

વार्षिक લવाजમ રૂ. ૧૫૦/-

વર્ષ : ૪૧મુન્  
એપ્રિલ - ૨૦૧૬  
અંક : ૪૫૫

મંગલ મંદિર @ એપ્રિલ-૨૦૧૬ @ ૧  
(કુલ પાણા : ૧૦૦)



# મંગલ મંદિર

શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદનું માસિક મુખ્યપત્ર



કોલોઝીયામ  
રોમ - ઈટાલી

: મુખ્ય કાર્યક્રમ :

શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ

માતુશ્રી સાકરભાઈ રવજી મોરારજી લાલન (કોડાય-સુધીમવાળા)

શ્રી કચ્છી જૈન ભવન

૪૩-૪૪, બાહ્યા મિત્રમંડળ સોસાયટી, પાલડી, એલિસબ્લીજ, અમદાવાદ-૩૮૦ ૦૦૬


ફોન : (૦૭૯) ૨૬૫૭ ૮૮૯૨, ૨૬૫૮ ૧૫૦૧, ૨૬૫૭ ૯૪૬૯ ફેક્સ : (૦૭૯) ૨૬૫૮ ૨૦૬૦

Email : [kutchijainamd@gmail.com](mailto:kutchijainamd@gmail.com) • Website : [www.kutchijainahd.org](http://www.kutchijainahd.org)

## ‘નવનીત’નાં જનરલ નોલેજ માટેનાં શ્રેષ્ઠ પ્રકાશનો

શૈક્ષણિક, વૈજ્ઞાનિક, વ્યાપારિક, રાજકીય, માનવીય, શારીરિક, માનસિક, બૌધ્ધિક, વ્યાવસાયિક, સ્વાસ્થ્યલક્ષી, વાસ્તુલક્ષી, ખેચર-ભૂયાર-જળચર, પણુ-પંખી-જીવ-જંતુ-કીટાશુ, વાનરપતિક, જોવિક, ભૌગોલિક, ખગોલીય, બહુાંડીય / ધૈનિક - તમામ વિષયો માટે ‘ગાગારમાં સાગાર’ સમાં ને જ્ઞાનના ખજાના જેવાં આ પ્રકાશનો દરેક ઘરમાં અવસ્થા હોવાં જ જોઈએ. આજે જ વસાવી લેશો. આભાલ-વૃદ્ધ સૌ માટે આ પ્રકાશનો ખૂબ જ ઉપયોગી નીવડથો!

દરેક બુક્સેલરને ત્યાં મળે છે.



**NAVNEET EDUCATION LIMITED**


**Correspondence Address :** Navneet House, Gurukul Road, Memnagar, Ahmedabad – 380 052, India.  
**Phone :** (079) 6630 5000 • 6630 5001, 2745 1000 • **Fax :** (079) 6630 5011, 2748 8000  
**e-mail :** navneet.ahd@Navneet.com • **Website :** www.navneet.com

## Available on HIRE

- Gas Engine Driven Generators  
Range : 50 KVA to 10 Mega Watts
- Gas Engine Driven Gas Compressors  
Range : 10 HP to 8000 HP
- Oil & Gas Processing Equipments Readily Available
- Work Over Rig 100 Ton, 50 Ton & 30 Ton Capacity
- 120 kg/cm<sup>2</sup> Air Compressors

## We Provide

- Complete equipment Readily Available
- Spare Parts
- Operation & Maintenance
- Engineering Consultancy



**Corporate Office :**

### Deep Industries Limited

6th Floor, N.G. Tower, Opp. Fun Republic Cinema,  
S.G. Highway, Ahmedabad - 380 015.  
Tel # 91-79-26862076/78  
Fax # 91-79-26862077

**Registered Office :**

### Deep Industries Limited

Opp. Suryanarayan Bunglows,  
State Highway, Motera,  
Dist. Gandhinagar.  
Phone # 91-79-27571128  
Fax # 91-79-27502464  
Email [info@deepindustries.com](mailto:info@deepindustries.com)



## ઘેર ઘેર વસાવવા જેવું વૈવિધ્યસભર બાળસાહિત્ય

### બાળકોને વારંવાર વાંચવી ગમે તેવી બાળકથાઓ

| રમણાલાલ સોની                        | યશવન્ત મહેતા                 | મૂળશંકર મો. ભણુ                    |
|-------------------------------------|------------------------------|------------------------------------|
| બાદશાહ અને જિરબલ પુ. ૫              | પદ્ધિત સરસારામાંં પરાકમો ૧-૫ | ગગનરાજ (જુલેવર્નની પ્રવાસકથા)      |
| ગલબા શિયાળનાં પરાકમો                | મોટા જાડાનાં મીઠાં ફળી ૧-૫   | ચંદ્રલોકમાં (જુલેવર્નની પ્રવાસકથા) |
| વીર વિકમની વાતો (પુ. ૫)             | બાલરંજન વાર્તામાણા : પુ. ૫   | નાનસેન (જુલેવર્નની પ્રવાસકથા)      |
| ભૂરિયો ભોટ                          | વાર્તાકિલ્લોલ ભા. ૧થી ૪)     | કનૈયાલાલ જોશી                      |
| <b>નાનાભાઈ ભણુ</b>                  | ઉદ્યમપ્રેરણાની કથાઓ          | શિશુ અભિવાદન ગ્રંથાવળી પુ. ૫       |
| શ્રીમદ્ લોકભાગવત ભા. ૧-૨            | <b>મધુસૂદન પારેખ</b>         | ગુજરાત ઈતિહાસ કથામાણા પુ. ૧૨       |
| લોકરામાયણ પુ. ૬                     | પ્રિયદર્શિનું પંચતંત્ર       | <b>બાવેશ પંડ્યા</b>                |
| હિન્દુ ધર્મની આખ્યાયિકાઓ            | <b>ગિજુભાઈ બધેકા</b>         | દાદાનો ડંગોરો                      |
| લોકભારત પુ. ૫                       | બાળવાર્તાઓ - ૧થી ૫           | વારતા રે વારતા                     |
| <b>જયભિષ્ણુ</b>                     | <b>રમણાલાલ ના. શાહ</b>       | <b>ઊરા પિનાકીન ભણુ</b>             |
| દીવા શ્રેષ્ઠી : ભાગ ૧થી ૫           | દેશદેશની અદ્ભુત વાતો (પુ. ૫) | મંકોડાનો સાઝી                      |
| કૂલપરી શ્રેષ્ઠી : ભાગ ૧થી ૫         | <b>સુભદ્રા ગાંધી</b>         | દ્રાર્ઢ-દ્રાર્ઢ દાખેલી પાર્ટ       |
| <b>ધૂમકેતુ</b>                      | ચંબળના કોતરોમાં (ઠિનામી)     | લાંબી પુંછિનો વટ                   |
| ઉપનિષદ્ધકથાઓ ૧-૪                    | આજના યુગનો ભસ્માસુર (ઠિનામી) | હાફ્થી... હાફ્થી ને મજા...મજા      |
| લોકસંસ્કાર દીપાવલિ શ્રેષ્ઠી-૧ પુ. ૫ | <b>હંસાખણેન પટેલ</b>         | હું ફંકો ઝોજદાર                    |
| દ્યુવ ભણુ                           | દાદીમાની ડાયરી               | 40                                 |
| મનુભાઈ પી. પટેલ                     | બાળગીતો અને જોડકણાં          | સંપા. જ્યંત શુક્લ                  |
| જ્યંત સી. ગાંધી                     | પરસુખભંજક પણ્ણુડો            | યશવંત મહેતા                        |

#### મસ્તન-મજાનાં બાળકાંયો

|                  |                 |    |                     |                   |
|------------------|-----------------|----|---------------------|-------------------|
| ગાય તેનાં ગીત    | ધૂવ ભણુ         | 80 | બાળગીતો અને જોડકણાં | સંપા. જ્યંત શુક્લ |
| ચોકલેટનો બંગલો   | મનુભાઈ પી. પટેલ | 40 | પરસુખભંજક પણ્ણુડો   | યશવંત મહેતા       |
| કૂલવાટિકાનો માળી | જ્યંત સી. ગાંધી | 80 |                     |                   |

#### જ્ઞાન-ગમ્ભીર પ્રવૃત્તિઓ વિશેનાં રસપ્રદ પુસ્તકો

| FUN WITH LETTERS AND WORDS   | નુસરત કાદરી         | 70  | FUN WITH WORDS AND SENTENCES   | નુસરત કાદરી         | 75  |
|--|---------------------|-----|--------------------------------|---------------------|-----|
| અંકડાની કરામત  | વર્સંતલાલ દોશી      | 60  | ગમતું ગણિત                     | કાન્ચિતલાલ જે. પટેલ | 100 |
| ગણિતગુંજન  | કાન્ચિતલાલ જે. પટેલ | 70  | ગણિતની મજા                     | સંજ્ય પટેલ          | 65  |
| ગણિતવિદાર  | બંસીધર શુક્લ        | 175 | ગણિતના જાહુપ્રયોગો             | ઇન્જિનીઝર્ન ડૉ.કેટર | 100 |
| વૈદિક ગણિત   | ડૉ. ડિવાસ પંડ્યા    | 50  | કબૂતરખાનાનો સિદ્ધાંત (ગણિતગમત) | આઈ. એચ. શેઠ         | 40  |
| દીવાસળીની રમતો   | વર્સંતભાઈ દોશી      | 50  | જિશાસા અને કૈતુક ૧-૫           | હરસુખ થાનકી         | 200 |
| શાનગમત પુસ્તકમાણા (પુ. ૫)  | યશવન્ત મહેતા        | 300 |                                |                     |     |
| નવી. રમતો. ₹ ૬૦ + નિરાંતની રેણૂએ. ₹ ૬૦ + જાતે બનાવીએ. ₹ ૬૦ + બનો જાહુગર. ₹ ૬૦ + ક્રિકેટ-ટાઈમ. ₹ ૬૦ |                     |     |                                |                     |     |

ગુજરાતી સાહિત્યરસિકો માટે અમદાવાદમાં ગ્રંથતીર્થ સમા અમારા ત્રણ શો-રિમ

### ગૂર્જર સાહિત્યભવન

રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ - ૩૮૦ ૦૦૧  
ફોન : ૦૭૯-૨૨૧૪૪૬૬૩. e-mail : goorjar@yahoo.com

### ગૂર્જર સાહિત્ય પ્રકાશન

102, લેન્ડમાર્ક બિલ્ડિંગ, યાઈટેનિયમ સિટીસેન્ટર પાસે,  
સીમા હોલની સામે, ૧૦૦ ફૂટ રોડ, પ્રષ્ટલાંદનગર, અમદાવાદ-૧૫  
ફોન : ૨૬૯૩૪૩૪૦, મો. ૯૮૨૫૨૬૮૭૫૯  
ઈમેલ : gurjarprakashan@gmail.com



ગૂર્જર  
સાહિત્ય  
કાર્યાલય

છેલ્લા ૪૦ વર્ષથી દર મહિનાની પ તારીખે  
નિયમિતપણે પોસ્ટ કરવામાં આવતું  
“શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ”નું

મુખ્યપત્ર

**“મંગલ મંદિર”****મુખ્ય કાર્યાલય**

**શ્રી કચ્છી જૈન ભવન,**  
૪૩-૪૪, શ્રી પ્રાણા મિત્રમંડળ સોસાયટી,  
પાલડી, એલિસાબિઝ,  
અમદાવાદ-૩૮૦ ૦૦૬.

ફોન : (૦૯૮) ૨૬૫૭૮૮૮૨, ૨૬૫૮૧૫૦૧

ફેક્સ : (૦૯૮) ૨૬૫૮૦૮૦૦

ઈ-મેલ : kutchijainam@gmail.com

વેબ-સાઇટ : www.kutchijainahd.org

**તંત્રી**

પ્રતાપ નારાણજી દંડ

(મો. ૮૪૨૬૭ ૨૫૬૧૮)

અંકુમાં પ્રસિધ્ય થયેલ લેખો તથા અન્ય વિભાગની માહિતીઓ સાથે તંત્રીમંડળ સહમત છે તેમ માની લેટું જરૂરી નથી. રજૂ થયેલ વિચારો જેતે વાક્તિના હોય છે, જેની નંદ્ય લેવા વિનંતિ.

**લેખકોને નામ વિનંતી**

‘મંગલ મંદિર’માં પ્રગટ કરવા માટે વિપુલ પ્રમાણમાં લેખ સામગ્રી અમને મળતી રહે છે અને એટેલ સ્વીકૃત કૃતિઓને પ્રગટ કરવાનું પણ સ્વાભાવિક રીતે વિનંતિબાય. મંગલ મંદિરના ધોરણને ધ્યાનમાં લઈ, પોતાની રચના મોકલતી વખતે લેખક સ્વવિવેક દાખવે તેવી વિનંતી છે.

એક સાથે એકથી વધુ કૃતિઓ ન મોકલવા વિનંતિ.

ભાગ્યાદોષ અને લાંબા લેખો અસ્વીકાર્ય બનશે તેની નંદ્ય લેવા વિનંતી. લેખમાં એકની એક વાતનું પુનરાવર્તન (રિપોટેશન) ટાપું જરૂરી છે. કૃતિની હસ્તપ્રત સ્વર્ણ અને સુવાચ્ય હોવી જોઈએ. આશા છે કે, આ બાબતમાં લેખક મિત્રોનો સહકાર અમને મળી રહેશે.

— મુખ્યમંડળી

**અનુક્રમણિકા****તંત્રી લેખ :**

- મહાન વિભૂતિઓની જીવનશૈલી સામાન્ય માનવી માટે દીવાદાંડી જેવી ..... પ્રતાપ નારાણજી દંડ ..... ૭

**લેખ વિભાગ****કચ્છ વિશેષ**

- સુંદરજી બેટાઈનું કાવ્ય : પાંચ વતનજી ગાલ્યું ..... નટવર આહિલપરા ..... ૮
- કારાણીબાપાજી તિથિ... ઈતરે... “ડાડાજો ડી...!!!” ..... જગદીશ ચં. છાયા ‘શ્રેયસ’ ..... ૯
- ચારણી સાહિત્યકાર વજાભગતની શતાબ્દી ..... ભરત ‘કુમાર’ પ્રા. ટાકર ..... ૧૧
- કચ્છના નારીરતનો : મીનલંઠેવી ..... માર્કડરાય મહેતા ..... ૧૩

**આરોગ્ય**

- આખા દિવસમાં કયારે ચાલવું સારું? ..... જનક નાથક ..... ૧૭
- ૧૦૦ વર્ષનું આયુષ્ય મેળવવા ૫૦ નિયમોનું પાલન કરો ..... પૈધરાજ ડૉ. જશવંતસિંહજી રાણો ..... ૧૮
- આધાર વિજ્ઞાન ..... ડૉ. રમેશ આઈ. કાપડિયા ..... ૨૧

**સમાજ ચિંતન**

- માતૃત્વ ..... હરીશ નાથક ..... ૨૫
- ‘જે દેશમાં બંદૂકની બેરેલથી ચર્ચા બંધુ કરાવવામાં આવે છે તે દેશનું ભાવિ અંધકારમય છે’ ..... લૉર્ડ બીજુ પારેખ અને અનુજ કુમાર ..... ૨૬
- શું ગાંધીજી વાણિયા હતા? ..... જિતેન્દ્ર દવે ..... ૨૮
- દીનતા શા માટે? ..... ડૉ. પ્રકાશ ગજજર ..... ૩૨
- આમાર લષ્ણ-લુહાન બાંગલા ..... સંજ્ય ગોસાઈ ..... ૩૬
- અંતર પણ જરૂરી ..... સ્વ. જયવદન પટેલ ..... ૩૭
- મને ના જાણતું કોઈ ..... કેશુભાઈ દેસાઈ ..... ૩૮
- છોકરાંને ખાતર ..... સોમાભાઈ પટેલ ..... ૪૨
- માણસ : વિચાર કરનારું પ્રાણી ..... રતિલાલ ‘અનિલ’ ..... ૪૫
- ભારત સરકારે જૈનોને લઘુમતી કોમ જાહેર કરવાથી થનારા વિશેષ લાભો ..... સંકલન : દિનેશચંદ્ર જે. શાહ ..... ૪૬
- સંબંધોના સથવારે : સંશેય ..... ઇલા. કે. શાહ ..... ૪૮
- ગુજરાતનું વિકાસલક્ષી બજેટ ..... ૪૯

શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદના  
“પદાધિકારીશ્રીઓ”

#### મેળજિંગ ટ્રસ્ટી

શ્રી પ્રતાપ નારાણજી દંડ  
ઘર : ૦૭૯- ૨૬૪૦૫૦૪૭ મો. ૯૪૨૬૭ ૨૫૬૧૮

#### ઉપમુખ-૧

શ્રી મનુભાઈ ગોવિંદલાલ શાહ  
ઘર : ૨૬૪૪ ફ્રેન્ડ્સ, ઓ. ૨૬૪૦ ૧૧૫૦  
મો. ૯૮૨૫૦ ૩૧૫૨૮

#### ઉપમુખ-૨

શ્રી શાંતિલાલ મુળજી સાવલા  
ઘર : (૦૨૭૭) ૨૩૪૪૫૫ મો. ૯૮૨૫૦ ૪૮૬૪૫

#### માનદ મંગી

શ્રી કાંતિલાલ રામજી શાહ  
ઘર : ૨૬૪૨૩૮૫૪, ઓ. : ૨૪૮૪૪૫૬/૨૪૮૩૬૮૮૯  
મો. ૯૩૮૦ ૦૧૧૪૦

#### સહમંગી

શ્રી હસમુખ બાલુભાઈ શાહ (ખાડવાલા)  
ઘર : ૨૬૬૦૩૪૮૮, ઓ. : ૨૬૬૦૫૪૫૩  
મો. ૯૮૨૫૦ ૪૦૬૬૬

#### ખજનચી

શ્રી ચંદ્રકાંત દામજી શાહ  
ઘર : ૨૬૪૦૫૨૪૫

#### સહ ખજનચી

શ્રી રમણિકલાલ કુંવરજી ગોસર  
ઘર : ૨૬૬૫૦૨૮૮, મો. ૯૪૨૮૩ ૫૧૩૭૦

#### શ્રી કચ્છી વિશ્રામ ગૃહનંસરનામું :

શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ સંચાલિત

શ્રી ખનિજ વિકાસ નિગમ લિ. માયોજિત  
શ્રી કચ્છી વિશ્રામ ગૃહ

અરિહંતનગર દેરાસરની સામે,  
ગાંધી વિદાલયની ગલીમાં, રચના રક્ષણની પાછળા,  
રાજ્યથાન હોસ્પિટલ પાસે, શાહીબાગ,  
અમદાવાદ-૩૮૦ ૦૦૪. ફોન : ૦૭૯-૨૨૮૮૫૪૭

#### સેવા ભવનનંસરનામું :

શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ સંચાલિત  
માતુશ્રી કંકુલાલ કાળજીમાઈ રવજી (નાની ખાખરવાલા) સેવા  
ભવન, એસ. ટી સ્ટેન્ડ પાસે,  
સાટકર ગેટ હાઉસની સામે, રૂગનાથપુરા,  
અમદાવાદ-૩૮૦ ૦૨૨. ફોન : ૦૭૯-૨૪૪૬૧૨૭૦

‘મંગલ મંદિર’ના અંકો સમાજની વેબસાઈટ  
[www.kutchhijainahd.org](http://www.kutchhijainahd.org)

ઉપર... ઉપરાઠા...

[www.hellokutchis.com](http://www.hellokutchis.com)

ઉપર વાંચી શકાય છે.

#### **ધર્મ ચિંતન**

- વાત્સલ્યનું સુખ ..... સ્વામી સચિદાનંદ .... ૫૧
- આગમ અને આત્મા ..... નમ્ર મુનિજી .... ૫૩
- શિક્ષાપત્રીના અંશો ..... ભગવાન શ્રી સ્વામિનારાયણ • અનુ. ડૉ. જગદીશ ગિવેરી .... ૫૭

#### **વ્યક્તિ વિશેષ**

- ડૉ. બાબાસાહેબ આંબેડકરની સફળતાનું રહસ્ય ..... ગુલાબચંદ પટેલ .... ૫૮
- શિષ્ટ સાહિત્યને પોથાતી કિંમતમાં, સામાન્ય લોકોમાં હદયસ્થ કરતું  
બુક મેનેજમેન્ટ અને તેના પુરસ્કર્તા : મહેન્દ્ર મેધાશી ..... ભદ્રાય વચ્છરાજની .... ૬૧
- નીરજી : વીરાંગનાને અશ્વભીની શ્રદ્ધાજલિ ..... ૬૩

#### **યાદગાર કાચા**

- ગાંધીજીએ બનારસ હિંદુ યુનિવર્સિટીમાં આપેલું ભાષણ ..... મો.ક. ગાંધી .... ૬૪

#### **ઇતિહાસ**

- શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદનો ઈતિહાસ  
(પ્રકરણ-૪૭). ..... દિનેશચંદ્ર જગજુવન શાહ .... ૬૮

#### **હાસ્યાની કાચોમાં**

- અમારા જમાનામાં તો. ..... ડૉ. નલિની ગણાગ્રા .... ૭૧
- શ્રીમતીજી સર્વિસે લાગ્યાં ..... પલ્લવી જિતેન્દ્ર મિશ્રી .... ૭૩
- કોસ કનેક્શન ફોન પર! ..... ચિપ્રેસેન શાહ .... ૭૫
- બાલું જયું ગાલિયું ..... સંકલન : ગુલાબચંદ ધારશી રંભિયા .... ૭૭

#### **નિયમિત વિભાગો**

- આંજો કાગર ..... ૭૮
- અન્ય સંસ્થાઓના સમાચાર ..... ૮૦
- જાણવા જેવું ..... સંકલન : રજનીકાંત પારેખ .... ૮૨
- Nano Nine શબ્દ ૨મત-૧૧૫ ..... સંકલન : રજનીકાંત પારેખ .... ૮૩
- Nano Nine Sudoku (કમાંક : ૧૦૭૨) ..... સંકલન : રજનીકાંત પારેખ .... ૮૫
- વલોવતન ..... સંકલન : દિનેશચંદ્ર જગજુવન શાહ .... ૮૬
- સમાજ દર્શા ..... ૮૮
- સંસ્થા સમાચાર ..... ૯૦
- શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદનો માસિક અહેવાલ ..... ૯૪
- ઉડતી નજ્રે ..... ૯૬

## તંત્રી લેખ

### મહાન વિભૂતિઓની જીવનશૈલી સામાન્ય માનવી માટે દીવાદાંડી જેવી

- પ્રતાપ નારાણાજી દા


આ મહિનામાં એકીસાથે ગ્રાણ ગ્રાણ મહાન વિભૂતિઓની જન્મતિથિ આવે છે. પોતાના જીવનકાર્યથી જ 'ભગવાન'નું બિરુદ્ધ પામેલા પૂર્ણ પુરુષોત્તમ રામચંદ્રજી, સેવક સ્વરૂપે ભગવાનની કોટિએ પહોંચેલા પવનપુત્ર હનુમાનજી અને ચોવીસમા તીર્થકર ભગવાન મહાવીર - આ ત્રિપુરીનો જન્મ ચૈત્ર માસના શુક્� પક્ષમાં થયો છે, તે પણ થોડા - થોડા દિવસોના અંતરે! અલબત્ત, ભગવાન રામચંદ્ર ત્રેતાયુગના અવિજ્ઞાતા દેવ છે, અને મહાવીર કલિકાળના, પંચમયુગના પરમાત્મા છે. હનુમાનને તો અમરત્વનું વરદાન છે. પવનપુત્ર છે એટલે જ્યાં અને જ્યારે પોકારો કે તાબડતોબ હાજર! યોગાનુયોગ ભગવાન સ્વામિનારાયણનો જન્મ પણ રામ નવમીના દિવસે જ થયેલો છે. સમસ્ત વિશ્વમાં સ્વામિનારાયણ સંપ્રદાય હિંદુ ધર્મના પર્યાય સમો બની રહેલ છે. ગયે મહિને શિવરાત્રી અને હોળી ધુળેટી જેવાં પર્વો ઊજવા પછી, વસંત ઋતુની પરાકાશ અને ગ્રીઝના પૂર્વાભાસ જેવા આ દિવસોમાં જ તેરમી એપ્રિલના દિવસે શીખોનું બૈસાખી પર્વ પણ આવે છે. બૈસાખી શાબ્દ વૈશાખ પરથી બન્યો છે એટલે સ્વાભાવિક રીતે જ આપણને એમાં અખાતીજના વૈશાખી પર્વનો ભાસ થાય. અખાતીજ એ વણજોયું મુહૂર્ત ગણાય છે, અને ખેડૂતો એમની નવી સીજનની શરૂઆત તે શુભ દિવસે શુક્લ જોઈને કરે છે. રવિ પાકમાં ચાલુ વર્ષે મહા મહિનાનું માવહું નહ્યું છે. પરંતુ આશા અમર છે. આ આશા પાછળ શ્રદ્ધાનું પીઠબળ પડેલું છે. શ્રદ્ધાનું એકસામટું ભાથું બંધાવતાં પર્વની પરંપરા એ ભારતીય સંસ્કૃતિની સાચી ઓળખ છે. ભગવાન રામનું જીવન હજારો વર્ષોથી માણસજીતને મૂઠી ઊંચેરા આદર્શો ચીધનારી દીવાદાંડી સમું બની રહ્યું છે. લાખોની સંખ્યામાં લોકો મોરારિબાપુ જેવા સંતોના શ્રીમુખે રામકથાનું રસપાન કરતા રહે છે. રામ એક આદર્શ રાજી તો છે જ; તદુપરાંત તેઓ આદર્શ પુત્ર, પતિ, ભાઈ અને પિતા પણ છે. રાજધર્મના પાલન ખાતર તેઓ અંગત સુખોની બલિ ચડાવી દે છે. આસુરી શક્તિઓ સામે યુદ્ધ કરીને તેઓ પ્રજાને નિર્ભય બનાવે છે. પવનસુત હનુમાન વાનર જાતિના અર્થાત્ પછાત સમાજના હોવા છતાં 'બુદ્ધિમતાં વરિષ્ઠમ્' છે. એમણો સેવાધર્મની અને ભક્તિની પરાકાશ બતાવી છે. રામ અને સીતા સિવાય એમને કશું જ ન ખપે. હનુમાનજી જીગંદર છે. એ શિવના ગણ છે - રુદ્રનો અગિયારમો અવતાર છે. સાત અમર વિભૂતિઓમાં હનુમાનજીનો સમાવેશ થાય છે. એમનું એક નામ 'મહાવીર' પણ છે. પટણમાં જે રેલવે સ્ટેશન સામે જગપ્રસિદ્ધ 'મહાવીર મંદિર' છે તે હનુમાનનું મંદિર છે. ચૈત્ર સુદ તેરસ મહાવીર જ્યંતી છે અને પૂનમ હનુમાન જ્યંતી ઉપરાંત શક્તિપૂજાનું પર્વ પણ છે. તે દિવસે અંબાજમાં ભવ્ય મેળો ભરાય છે.

મહાવીર ભગવાન જેન ધર્મના ચોવીસમા તીર્થકર છે. મનુષ્યાવતારમાં જ પરમાત્માપદ પામી શકાય છે, એવું પ્રતિપાદન કરીને જેન ધર્મ માનવજીતને ઉપકૃત કરી છે. તપ, ત્યાગ અને તિતિક્ષાનાં ત્રિવેણી પર્વ જેવું તથા અહિસા અને ક્ષમા જેવા સર્વકાલીન આદર્શોના પ્રતીક સમું ભગવાન મહાવીરનું જીવન સર્વ કાળમાં સર્વ જીવો માટે શાતાદાયક અને પ્રેરણારૂપ છે. શીખોના દસમા ગુરુ ગોવિંદસિંહે ધર્મના રક્ષણ માટે શાસ્ત્ર સાથે શાસ્ત્ર પણ ઉપાડ્યાં. એમણે એક તરફ ગુરુ તરીકે 'ગ્રંથ સાહેબ'ની સ્થાપના કરી અને બીજી તરફ 'પંજ ઘારે' - પાંચ પ્રિય શિષ્યોને તલવાર પકડાવી. સરહદ પર વસતી આ ખમીરવંતી શીખ કોમ ભારતીય જનસમુદ્દાયમાં નોખી જ તરી આવે છે. આટલાં વર્ષો પછી પણ એઝો ગુરુ ગોવિંદસિંહે ચીધેલાં પાંચ ઓળખ ચિહ્નો અકબંધ જાળવી મહાન આદર્શ રજૂ કર્યો છે. આ પાંચ નિશાનીઓ છે - કેશ, કંકણ, કાંસકો, કચ્છો અને કિરપાણ.

અને ૧૪ એપ્રિલ તો આપણા બંધારણ - ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરનું પ્રાગટ્ય પર્વ. એમની સવાસોમી જ્યંતીનું સમગ્ર વર્ષ દેશ આખામાં ભારે ઉલ્લાસપૂર્વક ઉજવાયું. 'ભારત રત્ન' સમ્માનને તમામ અર્થોમાં સાકાર કરનાર એ મહાન વિભૂતિને કોટિ કોટિ વંદન.

આપણે આપણા દેશમાં અવતરેલ આ વિભૂતિઓમાંથી પ્રેરણાનો પ્રસાદ પામીએ તે જરૂરી છે. ભગવાન રામનો કૌટુંબિક જીવનનો આદર્શ હોય કે ભગવાન મહાવીરનો વિશશાંતિ, અહિસા અને ક્ષમાનો આદર્શ હોય, હનુમાનજીનો સેવાધર્મ હોય કે ગુરુ ગોવિંદસિંહનો રાધ્રધર્મ - આ બધી બાબતોને આચરણમાં ઉતારવાનો યત્કિચિત્ત પ્રયાસ કરીશું તો આપણું જીવન વધુ અર્થસભર અને વધુ જીવવાલાયક બની રહેશે.

'મંગલ મંદિર'ના આ તંત્રી તરીકે હું આ પાવનપર્વોની સૌ વાચકોને અંતઃકરણપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું.



• નાટવર આહલપરા •

પાંજે વતનજી ગાલ્યું,

અનેરી પાંજે વતનજી ગાલ્યું.

કુંદળા દાદાજી જેવા એ કુંગરા,

ઉજરા દેખાવે ભૂંડા ને ભૂખરા;

બાળપણું ખૂંડી ત્યાં ગાલ્યું

અનેરી પાંજે વતનજી ગાલ્યું.

પાદરની દેરીએ ઝૂકેલાં કુંડમાં,

ભર્યો તળાવ, પેલા કૂવા ને કુંડમાં;

છોટપણું છંદમાં ઉછોળ્યું

અનેરી પાંજે વતનજી ગાલ્યું.

પેલી નિશાળ - જીમાં ખાધી'તી સોટિયું,

પેલી શેરી - જ્યાં હારીખાટી લખોટિયું.

કેમે ભૂલાય કાનગાલ્યું?

અનેરી પાંજે વતનજી ગાલ્યું.

બુઢાં મીઠીમા - એની મીઠી રે બોરડી,

ચોકી ઘડી - એની થડ માંછે ઓરડી!

દીધાં શાં ખાવાં? અમે ઝંઝેરી બોરડી;

બોર ભેળી ખાધી'તી ગાલ્યું.

અનેરી પાંજે વતનજી ગાલ્યું.

બાવા બજરંગીની ધંટા ગજાવતી,

ગોમી ગોરાણીની જીબને ચગાવતી,

ગોવા નાવીની છટાને છકાવતી,

રંગિલી રંજલી ગાલ્યું.

અનેરી પાંજે વતનજી ગાલ્યું.

છાલગળ્યાં વેલામાં, ચંચીએ ચીકણી,

તંતીલી અંબા, ને ગંગુ એ બીકણી,

શામુકાકાની એ ધમકીલી છીકણી,

જેવું બધુંય ગયું હાલ્યું.

અનેરી પાંજે વતનજી ગાલ્યું.

છોટી નિશાળેથી મોટીમાં ચાલ્યા,

પ...ર પ...ર અંગરેજ બોલ બેક જાલ્યા,

ભાઈ ભાઈ કહેવતા અકડાતા હાલ્યા;

મોટપણું ખોરન્તું ખાલ્યું.

અનેરી પાંજે વતનજી ગાલ્યું.

કચ્છની બોલીનો સરસ ઉપાડ ધરાવતું ગીતકાવ કવિ સુંદરજી ગોકળાસ બેટાઈએ લખ્યું છે. કવિનો જન્મ જામનગર જિલ્લાના બેટ દ્વારકામાં ઈ.સ. ૧૯૦૫માં થયો હતો અને મૃત્યુ ૧૯૮૮માં થયું હતું.

કચ્છની ભૂમિનાં, પોતાના વતનનાં બાળપણના ખટમીઠાં સ્મરણોને કવિએ ગીતમાં ચિગ્રાત્મક રીતે વ્યક્ત કર્યો છે. વતનનાં કુંગરા, તળાવ, કૂવા, શાળાના અનુભવો, સીમની રખડપણી અને તોફાન મસ્તીને તેમણે સરળ બાનીમાં રજૂ કર્યો છે. શૈશવકાળથી કેટલીક વ્યક્તિઓની સ્મૃતિમાં અંકિત થયેલી છબીઓને પણ આદેખી છે.

ગીત રચનામાં ડિશોરકાળની નિર્દોષતા અને સ્વાભાવિકતા સહજ રીતે પ્રગટી રહે છે. કચ્છી ભાષામાં પાંજે વતનજી અર્થાત્ પોતાના આપણા વતનની, વાલ્યું એટલે વહાલી, ગાલ્યુંનો અર્થ વાતો. જ્યારે કુંદળા એટલે મોટી ફાંદવાળા, છોટપણું એટલે કે બાળપણ, હારીખાટી લખોટિયું બરાબર કાચની ગોળીઓ હાર્યો અને જીતાં.

આવા બજરંગી, ગોમી ગોરાણી, ગોવા નાવી, ચંચી ચીકણી, તંતીલી અંબા ને ગંગી બીકણી, શામુકાકા વગેરે પાત્રોને કવિએ જીવંત બનાવ્યા છે.

જો કે આ કવિને મેં ૧૯૮૦થી ૧૯૮૮ સુધી વર્ગમાં ભાણાવી કચ્છની સુગંધને મનમાં ભરી હતી તે કેમ ભૂલાય?

‘શ્રી પવનતનય’, ૩, વિમલ નગર,  
યુનિવર્સિટી રોડ, રાજકોટ-૫. મો. ૯૯૭૪૦ ૦૬૦૪૨

**JAYANT STEELS**

179-A, Kandori Building, Opp. Sarvoday Nagar,  
Panjarapole Road, Bhuleshwar, Mumbai-400 004.  
Ph. : (022) 2242 2463 • 2242 7263

**જ્યાંત સ્ટીલ્સ**

૧૭૯/એ, પાંજરાપોલે રોડ, સર્વોદય નગરની સામે,  
મુંબઈ-૪૦૦ ૦૦૪. ★ ફોન : ૨૨૪૨૨૪૬૩ / ૭૨૬૩ / ૭૩૬૦  
સુંદર - સુધી રસોડાના રાયરચીલાંતું પ્રાસિનું પ્રેરણા સ્થાન

## કારાણીબાપાજુ તિથિ... એતરે... “ડાડાજો ડી...!!!”

● જગદીશ ચં. છાચા ‘શ્રેયસ’ ●

“કચ્છઢો ખેલો ખલકમે, અ મહાસાગર મેં મચ્છ,  
જિત હિકડો કચ્છી વસો, ઉતે ડીયાંડી કચ્છ.”

— દુલેરાય કારાણી

કચ્છના “મેઘાડી” દુલેરાય કારાણી... લોક સાહિત્યનો કળાયેલ મોરલો...!!

તા. ૨૪મી ફેબ્રુઆરી, ૧૯૮૮ રવિવારે પૂજ્ય કારાણીજીની ચિરવિદાયથી, કચ્છને કદી ના પૂરાય તેવી ખોટ પડી.

એમનો જન્મ દિન જ એમની પુણ્યતિથિ બની!!

એક પૂર્ણ વ્યક્તિત્વની અદભ કુદરતે વિદાય વેળાએ પણ સાચવી, પૂર્ણતા બક્ષી!!

દુલેરાય કારાણીજીની મહેચ્છા હતી... ‘કચ્છનાં ગામોના નામકરણ’ અંગે સંશોધન કરવાની. પણ ઉમરને લીધે એ અધૂરી રહી ગઈ.

એમણે ગામ નામકરણ અંગેના સંશોધન કાર્યમાં લોકોને સહકાર આપવાની અપીલ ‘કચ્છમિત્ર’, તા. ૪-૧૦-૧૯૭૮નાં ‘જ્ય કચ્છ’માં અને પછી અન્ય અખબારોમાં અખબારી યાદી દ્વારા કરી હતી.

અરે!

...કારાણીજીએ તો મને જ આપ્યો... ખો....!!

આ બાબતે ૫-૭ વર્ષ સુધી ખાસ પ્રગતિ નહીં થતાં મેં થોડો રસ દાખવતાં, એમણે, મને જ એ કાર્ય ઉપાડી લેવા પ્રેરણા, પ્રોત્સાહન અને આશીર્વાદ આપ્યા...

કારાણીજીએ મને જ ખો... આપતાં, પ્રથમ તો મેં મારી મર્યાદા દર્શાવી. કારાણીજી મક્કમ રહ્યા અને મને લખ્યું.... “મારો વારસો તમારે લેવાનો છે. તમે મારા ‘માનસ વારસદાર’ છો. મારા આશીર્વાદ છે.”

હું એમની આ આજ્ઞા અવગણી શકવા સક્ષમ ન હતો.

મેં પણ સૌ પ્રથમ અખબારી યાદી જ બહાર પાડી. પછી, લોક સહયોગ મેળવવા હેતુ પ્રયત્નો કર્યા.

‘કચ્છમિત્ર’, ‘પથિક’, ‘જ્ય કચ્છ’, ‘વલો કચ્છડો’, ‘સ્વબળ’, ‘કચ્છ રચના’, ‘ટાઈમ્સ ઓફ કચ્છ’, ‘ગુજરાત (માહિતી ખાતું)’, ‘કચ્છશુદ્ધિ’, ‘કચ્છ જ્યોતિ’, ‘કચ્છ સત્તા’, ‘કચ્છ શક્તિ વિશેષાંક’ વગેરે અનેક પત્રો - સામયિકોમાં આ વિષય પર લેખો લખ્યા. લોકોને એ દિશામાં વિચારતા કર્યાનો હેતુ સર્યો એનો સંતોષ છે.

### ‘મિશન-કાર્ય’નું મૂળ બાળપણમાં :

ગામ નામ પાછળ... ‘આદુ ખાઈને પડવા પાછળ’નું મૂળ શોધતાં બાળપણમાં સરી જવાયું. હા, કચ્છના લોક સાહિત્યના ભીખ પિતામહ દુલેરાય કારાણીજીની, આ વણખેડાયેલ દિશામાં ખેડાણ કરવાની અધૂરી રહી ગયેલી મહેચ્છા આગળ ધ્યાવવા એમણે મને ખો... આપ્યો. એટલું જ નહીં, મને એમનો ‘માનસ-વારસદાર’ બનાવ્યો...!

ઉંડા ઉત્તરતાં એનું વિચાર-બીજ બાળપણમાં ધરબાયેલું દેખાયું.

એ વખતે હું માંડ ૭-૮ વર્ષનો હોઈશ. મોટાં બેન વેકેશનમાં મને એમનાં ઘરે અમદાવાદ લઈ જતાં. અમે ટ્રેનમાં જતાં. ભુજથી બપોરે ઓકાદ વાગ્યે ઉપડતી ટ્રેન બીજા દિવસે મળસ્કે અમદાવાદ પહોંચતી.

‘ભુજથી અમદાવાદ વચ્ચે કયાં કયાં ગામો આવે?’ એમ બેનને મેં કુતૂહલવશ પૂછ્યું. બેને મને એક નોટ અને પેન્સિલ આપીને કહ્યું હતું, ‘આ લે... નોટ-પેન્સિલ. તું રસ્તામાં જે ગામ આવે એનું નામ લખ્યા કરજે.’

ખબર નહીં પણ મને આ વાત એકદમ ગમી ગઈ. મેં તો ટ્રેન ઊપડ્યા પછી પહેલું ગામ માધાપર આવ્યું ત્યારથી... ગામ નામની નોંધણી કરી શરૂ. રાત પડી ગઈ. બેને ઊંધી જવા કહ્યું પણ મને તો આ ‘કામ’માં એવો તો રસ પડી ગયો હતોકે બેનને મેં ‘નિંદર નથી આવતી’ એમ કહી, ઊંધવાની સવિનય સાફ ના પાડી દીધી! બેને બહુ સમજાવ્યો પણ હું મારા ‘મિશન-કાર્ય’માં મળ્યા રહ્યો!!

અને વર્ષો પછી કારાણીજીએ એ કાર્ય માટે નિમિત થવા મને પ્રેર્યો. કુદરતે જાણો કે નિવૃત્તિ પછી એ ‘બાકી’નું કાર્ય મારા માટે નક્કી રાખ્યું હતું! ભુજથી ઘનશ્યામસિહજ જોડેજાએ આખા કચ્છ જિલ્લાના તમામ સરપંચોના ફોન નંબર આપ્યા છે તો નલિયાના કપિલભાઈ જોશીએ આખા અબડાસા તાલુકાના સરપંચોના સંપર્ક નંબર આપ્યા છે.

આધુનિક ટેકનોલોજીનો સુંદર સદ્ધુપયોગ શક્ય બન્યો છે. એ સિવાય ‘ડોમેન્ટ’ દ્વારા ઘણા મિત્રો સહયોગ કરે છે.

રીચેશભાઈ, જ્યશ્રી પુત્ર છાયા, જગદીશભાઈ પટેલ (લુડવા, મુંબઈ), જગર રાજગોર, પીનાકીનભાઈ મેઘાણી, વીરેન્દ્રસિંહ પટ્ટિયાર, ભુવનેશભાઈ દવે, રામકુલ્ભાઈ કરપડા, ભવજીતભાઈ બક્ષી, વસંતભાઈ છાડવા (બાડા), રાજભા જાલા, પંડિત ડૉ. હિતેશભાઈ મોઢા વગેરે અને ખાસ તો જીતુભાઈ

ઠકરાર જેવા લેખકો વિદ્વત્તાસભર અભ્યાસપૂર્ણ લેખો સતત લખે છે! અમે આ એક સમાન વિષય પર લખીએ છીએ.

અંજારના લક્કડી રાજસિંહે કચ્છનાં અનેક ગામોનાં નામકરણ વિષે લખ્યું છે. દલપતભાઈ દાઢીધરિયા પણ રસાનું છે.

મેઘાણીજી, કારાણીજી જેવા લોક સાહિત્યકારોએ પાળિયાને હંદોળીને એમને બોલતા કરવાનું ‘ધૂળ ધોયા’ કાર્ય કર્યું છે. કહેવાય છે કે પાળિયાને વાચા ફૂટી હોય એમ, એમની સમક્ષ પાળિયા સ્વયં જ્ઞાણો કે પોતાની ગાથા બોલવા લાગતા! મને લાગે છે કે ગામ નામો પણ એ જ રીતે પોતાની ગાથા ગાવા લાઈનમાં ઊભા છે. આપણો એમને સાંભળવા કર્ણ દશ્ટિ કેળવવી પડશે.

દરેક ગામ પોતાનો આગવો ઈતિહાસ, વિશેષતાઓ ધરાવે છે. ગામનું નામ સમાવિષ્ટ હોય એવી કહેવતો લોકોક્રિતાઓ અસંખ્ય છે. ગામ વિષે લોકકથાઓ, દંત કથાઓ, લોકોક્રિતાઓ, કહેવતો દ્વારા ‘ગામ નામકરણની ગાથા’ લોકમુખે રમે છે. ચાલો, આ વિશેષ સંશોધન કાર્યને ‘યજ્ઞકાર્ય’ સમજી એમાં આદૂત્ય આપવાનો શિવ સંકલ્પ કરીએ. કાળના ગર્ભમાં આવી અમૃત્ય વિગતો લુંમ થાય એ પહેલાં એને સાચવી લઈએ. અમૃત્ય હસ્તપ્રતો, ફોટોગ્રાફસ, સાહિત્ય સામગ્રી, જૂની ડાયરીઓની નોંધો, વડીલોની વાતોમાં સચવાઈ રહેલ અમૃત્ય વારસો જાળવી લઈએ. આ યજ્ઞ કાર્યમાં રસાજ્ઞુઓ, તજજ્ઞો સહિત સૌના અવિરત સહકાર અને માર્ગદર્શનની અપેક્ષા છે. એક સમયે ‘કુરો કુજાડો’ કહેવાતી કચ્છીનું મહેણું કચ્છી સાહિત્યકારોએ ભાંગ્યું.

કારાણીજીએ તો લખ્યું,

‘કુરો કુજાડો’ કચ્છી, તું પ થી તૈયાર  
કચ્છી પાણીવારી વીર વાણીકે તા  
‘કારાણી’ ચેં મિણીનું વડેરી મહારાણી કરે વ્યારીયાં...!!

કચ્છીના વિકાસની દિશામાં પ્રયત્નો સતત થાય છે. પણ બીજી દિશામાં ગુજરાતના એક પ્રય્યાત લેખકના કેટલાક વાક્યો આપણને વિચારતા કરી દે છે.

તેઓ લખે છે, ‘કચ્છની જનભાષા કચ્છી છે. એ ગુજરાતીની નહીં સિંધીની શાખા છે.’

જો કે અત્યારે કચ્છમાં શિક્ષણ, સંસ્કાર અને રાજ્યની ભાષા તરીકે સ્વીકારાયેલી ગુજરાતી... જડપથી કચ્છીને ખસેડી રહી છે!!

‘કચ્છીને ખસેડી રહી છે’ એટલે શું?

મારી આ વથા માંડવીની ‘જ્યંત જ્યોત’ સંસ્થામાં, “કચ્છના મેઘાણી દુલેરાય કારાણી અને મારા સંસ્મરણો” એ વિષેમાં યોજાયેલ મારા વક્તવ્યમાં પણ મેં ઠાલવી હતી.

## ● દાદા-પોત્રા જેવો સંબંધ :

કારાણીજી સાથે મારા દાદા-પોત્ર જેવા મીઠા સંબંધો!!!

તેઓ મને ‘માનસ વારસદાર’ કહેતા એ એમની આત્મીયતા જ હતી!

કારાણીજી વિશે લખવું એટલે મનમાં થાય કે, “લ્હાલાજી તારી કલમ વખાણું કે તારી લાગણી વખાણું.” એમના ૭૦થી વધુ પુસ્તકો જ એમના સાચા વારસદારો છે. મારા હદ્યને વિશેષ સ્પર્શી ગયું છે “સોનલ બાવની.” ધર્મપત્તીના વિધોગમાં હદ્યમાંથી જ પ્રગટેલી એ ઉર્મિઓ છે... એ જ કારણ... એમણે પાંચ બાવની લખી છે. ગાંધી, દયાનંદ, કલ્યાણ, સોનલ અને મહાવીર બાવની.

ભુજના ટાઉન હોલને ‘દુલેરાય કારાણી’નું નામ આપવા થયેલ સૂચન સમયસરનું અને ઉત્તમ છે. કાંતિવીર શ્યામજી કૃષ્ણવર્મની ગતિમાં વિલીન થાય એ પહેલાં પ્રજાએ જાગૃતિ દાખવી અને મોટી સાહેબે અંગત રસ લીધો, તો પ્રયત્નો રંગ લાયા. એ જ રીતે કારાણીની પુણ્ય સ્મૃતિ સચવાય... એ માટે આશા રાખીએ. આવો જ કોઈ ચમત્કાર થાય. કચ્છના મહાન લોક સાહિત્યકાર દુલેરાય કારાણીની જન્મ - પુણ્ય તિથિ... તા. ૨૬મી ફેબ્રુઆરી. પિતૃભાષા... બાબાણી બોલી ‘કચ્છી ભાષા દિન’ તરીકે ઉજવવો જોઈએ એવું નન્દ સૂચન છે. જેમ કચ્છ માટે કહેવાય છે... ‘ભૂકુંપ પહેલાનું કચ્છ અને ભૂકુંપ પદ્ધીનું કચ્છ’ એમ કચ્છી ભાષા માટે કહેવું જ પડે... ‘કારાણીજીની પહેલાની અને કારાણીજીની પદીની ભાષા સમૃદ્ધિ.’

પહેલા મેઘાણીજી જન્મ્યા માટે દુલેરાય કારાણીજીને કચ્છના ‘મેઘાણી’નું બિરૂદ મળ્યું. પણ જો દુલેરાય કારાણી એમનાથી પહેલા જન્મ્યા હોત તો... કદાચ, મેઘાણીજીને ‘સૌરાષ્ટ્રના કારાણી’નું બિરૂદ મળ્યું હોત!!!

કારાણીજીને જન્મનૂંપૂર્વક યાદ કરવાનું પ્રયોજન આ રહ્યું.

તાજેતરમાં કચ્છની એક સ્થાનિક ન્યુઝ ચેનલે મારી એક કોલમ અંગે મુલાકાત લીધી. ત્યારે મુલાકાત લેનાર યુવતીને મેં કારાણીજી વિશે વાત કરી ત્યારે એ હકીકત બહાર આવી કે એ યુવતી... કચ્છના લોકસાહિત્યના આ ભીખ પિતામહનું નામ સુદ્ધાં જાણતી ન હતી!

કચ્છી ‘બાબાણી’ બોલીની અસલી તાકાત એમની રચનાઓ થકી કારાણીજીએ સુપેરે દર્શાવી છે. બણુકી ‘કચ્છી ભાષા’નું આ ‘શક્તિ પ્રદર્શન’...

“નુક જેડી નક્કર, સક્કર જેડી શીરી વારી,  
અક્કડ અનોખી અતિ ગતિ રામ બાણજી  
કુછી મેં કડક કચ્છી પાણીજી કડાકે વારી,  
વિજ જે વરાક વારી, જોય જિન-ધાનજી,  
તાજ ઘોડો છૂટે, તૂટે તોપ જો ગલોલો તેડી,  
‘કારાણી’ ચેં ચોટ કચ્છી વાણી જ કમાનજી!

“મુંજ માતૃભૂમિ કે નમન’ કચ્છનું “રાષ્ટ્રગીત” ગણાય છે, તો આ રચનાને કચ્છનું “વંદે માતરમ્” કહી શકાય!

## ચારણી સાહિત્યકાર વજાભગતની શતાબ્દી

● ભરત'કુમાર' પ્રા. ઠાકર ●

જન્મ : ઉજ મે, ૧૮૯૬

નિધન : ૨૭મી જાન્યુઆરી, ૧૯૮૮

વિદ્વિતા અને શૌર્ય માટે પંકાયેલી ચારણ જ્ઞાતિમાં જે કેટલાક સંતો અને શૂરવીરો થઈ ગયા તેમાં કચ્છ જિલ્લામાં માંડવી પાસે આવેલા કાઠડા ગામના સાધુચરિત વજાભગત (૧૯૧૬-૮૮) ની સેવાસુવાસ આ સમાજમાં અને આ પંથકમાં કાયમીપણે અંકિત થઈ ગઈ છે. આ સ્થળ લોકોમાં 'વજાભગતની ઝૂપડી' કે 'રામકૃષ્ણ કુટિર' તરીકે વિશેષ જાણીતું છે. આ વર્ષ તારીખની દિનિએ ઉજ મે, ૨૦૧૬ અને તિથિની દિનિએ વૈશાખ સુદ બીજ (૮-૫) ના આવતી ૧૦૦મી જન્મજયંતી પ્રસંગે સંતનું સ્મરણ અને એમની કુટિરનો પરિચય કરાયો છે.

### ● શિક્ષણ, સંસ્કાર, સત્તસંગ :

ચારણી સમાજમાં 'વજાભગત'ના દુલારા નામે જાણીતા થયેલા આ અલખના આરાધકનું પૂરું અને મૂળ નામ વરજાંગભાઈ ગોપાલ કાનાણી હતું. પિતા ગોપાલભાઈ ભીમા અને માતા મેઘભાઈને ત્યાં એક સૈકા પહેલાં સંવત ૧૯૭૨ના વૈશાખ સુદ બીજ અને તા. ઉજ મે, ૧૯૧૬ ના સંતહદદ્યી વજાભગતનો જન્મ થયો હતો. જીવનના ઉષાકાળમાં જ સાધુસંતોના સંગ અને સદ્ગુરુંથોના સેવન થકી એમના ભક્ત હૃદયમાં પરિવર્તન આવતું ગયું.

આની સાથે એમનું મૂળ 'કૃષિકર્મ' તો ચાલુ જ હતું. ચૌદ વર્ષના ગૃહસંસાર બાદ પણીનું અવસાન થતાં વૈરાગ્યમાવ વિશેષ પ્રબળ થયો. લોકોને મદદરૂપ થવાની ભાવના અને સંત સમાગમની રૂચિ વધી. દરિયાડિનારે ગંગાનાળ પાસે પણકુટિર બાંધી એકાતમાં ચિંતન-મનન સાથે એકાશ્રતા કેળવતા ગયા.

એક વર્ષની સાધના બાદ તેઓ વાડીએ આવ્યા અને તેના એક છેતે ઝૂપડી બાંધી નામ આપ્યું 'રામકૃષ્ણ કુટિર'. એમણે કોઈ શાળેય શિક્ષણ લીધું ન હતું. પણ માંડવીના અમૃતલાલ ડી. ધોળકિયા, નાનાલાલભાઈ વૈનુંદરાય વોરા (૧૮૮૭ - ૧૯૭૦) અને સ્વામી સુખાત્માનંદજી (૧૮૭૮ - ૧૯૫૭) પાસેથી સંસ્કૃત ભાષા, વિવિધ શાસ્ત્રો અને વ્યાકરણનો અભ્યાસ કરેલો.

### ● વૈરાગ્યાંશ અને ગાંધીરંગ :

નાના કાકાના સાન્નિધ્યમાં રામકૃષ્ણ પરમહંસ (૧૮૩૬ - ૧૮૮૬) ને પોતાના આધ્યાત્મિક ગુરુ માન્યા હતા. તો, હિંગરિયા (તા. અબડાસા) ના સંત હરિસાહેબ (૧૮૩૦ - ૧૯૩૨) ની કંઈ બાંધી એમના પહૃશિષ્ય દ્યારામજી મહારાજના શિષ્ય બન્યા હતા.

હરિસાહેબના લાંબા ભજનની આ પંક્તિમાં એમને ખૂબ પ્રીતિ અને શ્રદ્ધા હતી... જોગીરે જે જોગ મેં, વડો પંથ વેરાગ જો-

ઝરપરાના થાર્યાભગત (૧૯૦૬-૬૮), મોટા લાયજના પાલુભગત (૧૯૧૦ - ૭૪) અને કાઠડાના લાદ્યભાઈમા (૧૯૩૨ - ૮૮)... આ ગ્રાણે એમના સમકાલીન સત્તસંગીઓ અને સહપંથીઓ હતા. આ પંથકના આવા અનેક સંતો અને ભક્તો સંગાથે એમના સત્તસંગ - ગોષિ થતા રહેતા. એમને ગાંધી વિચારધારાનો રંગ પણ લાગ્યો હતો. માનવસેવાના તેઓ ખાસ હિમાયતી રહ્યા. તેમને મન 'માનવર્ધમ' એ જ સાચો ધર્મ! તેઓ દરેક પંથ-સંપ્રદાયના કાર્યક્રમોમાં જતા. એટલું જ નહિ, દરેક ધર્મનાં પુસ્તકો તે વાંચતા.

### ● અભ્યાસ અને અવગાહન :

ભારતના જુદા જુદા સમાજ સુધારક સંતોને એમણે ખૂબ વાંચ્યા અને પચાવ્યા.

તો, વિવિધ પ્રાચીન ભક્તકવિઓનાં કચ્છી, ગુજરાતી, હિંદી, સંસ્કૃત, બ્રજ, ચારણી ભાષાનાં સેંકડો કાવ્યો, ભજનો, સાખીઓ, પદો, ચોપાઈઓ એમને કંઠસ્થ હતાં! એમણે પોતે પણ ઘણાં કચ્છી કાવ્યો રચ્યાં છે. તો, ચારણી ભક્તકવિ થાર્યાભગતનો પદસંગ્રહ 'પરમાત્મા પદાવલી' (૧૯૫૮) તથા ભગવદ્ ગીતાનો સરળ કચ્છી ભાષામાં અનુવાદ (૧૯૭૮) જેવાં પુસ્તકો પણ એમણે આખ્યાં છે.

જીવનમાં સાચી સાધુતાના દર્શન કરાવનાર ભગતજી અનેક રીતે અજોડ હતા. ચારે વેદોનો સંપૂર્ણ અભ્યાસ કરનાર ચારણોમાં તેઓ કદાચ પહેલા હશે. સંસ્કૃતમાં તો એમણે ઊંચી લગની દાખવી હતી. શાસ્ત્રોના ઊંદાણમાં ઉત્તરી તેની માર્મિકતા સ્પષ્ટ કરવા પ્રયત્ન કરતા.

### ● પ્રવૃત્તિ અને સ્મૃતિ :

તેઓ એક સાચા ધર્મપ્રેમી અને સમાજસેવી હતા. પરચા અને ચ્યામતકારોમાં બિલકુલ શ્રદ્ધા નહિ. હંમેશાં પોતાની કુટિરમાં ભજનકીર્તન, પૂજાપાઠ, સાધના, સત્તસંગમાં લીન રહેતા. સાથે વાડીનું કામ કરી સાચું સ્વાશ્રયી જીવન ગાળતા. વજાભગત અને એમની કુટિર સાથે કચ્છના ઘણા સમકાલીન લેખકો-સાહિત્યકારો, સાધુસંતો, રાજકીય-સામાજિક આગેવાનોનો સ્નેહ-સંપર્ક અને આવાગમન રહ્યા કરતું.

જીતિ ઉત્કર્ષમાં પણ એમનું યંત્કચિત્ત યોગદાન રહ્યું છે. મફાડ (જિ. જૂનાગઢ) વાળા આઈ સોનલભા (૧૯૨૩ - ૭૪) ના કચ્છ-પ્રવાસો, માંડવીમાં ચારણ બોર્ડિંગની સ્થાપના, અભિલ કચ્છ ચારણ સભા તથા કાઠડા ગ્રામવિકસનમાં એમનો સક્રિય સહકાર સંપર્ક્યો હતો. માનવ અને મુંગા જીવો માટે કંઈક કરી છૂટવાની

ભાવનાવાળા વજાભગતનું સંવત ૨૦૪૫ના પોષ વદ પાંચમ (તા. ૨૭મી જાન્યુઆરી, ૧૯૮૮) અને શુક્રવારે ૭૩ વર્ષની વયે નિધન થયું.

આ સંતે આજીવન આદરેલી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ રહે તે માટે એમની યાદગીરીમાં ‘વજાભગત સ્મૃતિ ટ્રસ્ટ’ ની રચના કરવામાં આવી છે. કન્યા કેળવણી, નબળી આર્થિક સ્થિતિવાળા વિદ્યાર્થીઓને સહાય અને સંસ્કૃત પ્રચારાર્થે ચર્ચાસભા-સેમિનારોનું આયોજન વગેરે તેના મુખ્ય હેતુઓ છે. અત્યારે ભીમશીભાઈ કાકુભાઈ બારોટ આ ટ્રસ્ટના પ્રમુખ છે, જ્યારે વીરમભાઈ દેવાયત ગઢવી કુટિરનું સંચાલન અને સેવાપૂજા સંભાળી રહ્યા છે.

### ● રામકૃષ્ણ કુટિરનાં દર્શન :

માંડવી-નાલિયા ધોરીમાર્ગ પર માંડવીથી ૮ અને કાઠડાથી ૨ કિલોમીટરના અંતરે વાડી વિસ્તારના હરિયાળા વાતાવરણમાં આ સંકુલ આવેલું છે. વજાભગતે આ પરિસરમાં અનેક વૃક્ષોનું વાવેતર કરેલું, જે હવે નંદનવન સમું ભાસે છે. ૨૮ ગુંડા (લગભગ પોણો એકર) માં પથરાયેલ સમગ્ર કુટિર - સંકુલના ઉત્તર ભાગમાં ગ્રણેય સ્મારકો (ખંડ, મંદિર, પ્રતિમા) આવેલાં છે.

વજાભાપુએ પોતાની હ્યાતીમાં અહીં ‘રામકૃષ્ણ કુટિર’ બનાવી હતી. આ સ્થાન ઘરમંદિર જેવું અને મહુલી આડારનું છે, જેના બાર ફૂટ લાંબા-પહોળા ખંડમાં પ્રવેશતાં સામે જ ત્રિમૂર્તિ અને સમાધિના દર્શન થાય છે. તેમાં વચ્ચેની પીઠિકા પર રામકૃષ્ણદેવ (૧૮૩૬ - ૮૬), શારદામહિદેવી (૧૮૫૩-૧૯૨૦) અને વિવેકાનંદજી (૧૮૬૩ - ૧૯૦૨) ની આસનસ્થ પ્રતિમાઓ સ્થાપિત છે. તેની આજુભાજુ વજાભગત તથા નાનાકડાનાં પગલાં અને તેઓની તસવીરો જોવા મળે છે.

એમના આધ્યાત્મિક સહપંથી પાલુભગતનો મૂળ ‘રામસાગર’ (તંબૂર) અહીં ભગતની સમાધિની બાજુમાં

રાખવામાં આવ્યો છે, જે આ બંને સંતોનો આત્મીય સંબંધ બતાવે છે. તો, બીજા શિક્ષણગુરુ અમૃતલાલ ધોળકિયાની છબી પણ અહીં મૂકવામાં આવી છે.

### ● પ્રતિમા, સદન, પુસ્તકાલય :

કુટિરના દક્ષિણ દ્વાર સામે અને સંકુલની મધ્યમાં ૧.૫૭ મીટર (૬૨ ઈંચ) ઊંચા સ્તંભ પર સ્વામી વિવેકાનંદની અર્ધપ્રતિમાનું સ્થાપન થયું છે, જે મૂળે મંજલ-મંગવાળા (તા. નખગાણા) ના વતની અને ધંધાર્થે મુંબઈ સ્થાયી થયેલા ગાંધી વિચારસરણી ધરાવતા મણિલાલ ગોવિંદજ કેસરિયા (૧૯૧૦-૮૭) તરફથી ૧૯૬૩ માં સ્થાપિત થઈ છે.

સંકુલના વાયવ્ય કોણે ‘રામકૃષ્ણ સત્સંગ સદન’ આવેલ છે, જે હવે ભગતબાપુનો ‘સ્મૃતિ ખંડ’ પણ બન્યો છે. નાનાલાલભાઈ વોરાની પ્રેરણાથી તૈયાર થયેલ આ સત્સંગ સભાખંડનું ઉદ્ઘાટન ૧૯૬૮માં થયું છે. વજાભગતે વપરાશમાં લીધેલ ચીજવસ્તુઓ (ઢોલિયો, પેટીપટારા, પુસ્તકોના કબાટો, સંગીતના સાધનો વગેરે) કાયમી યાદગીરીરૂપે અહીં સાચવી રખાયેલ છે.

વજાભગતનો પુસ્તક-સંગ્રહ પણ અજોડ છે! ભગતજીને ધાર્મિક, આધ્યાત્મિક અને દાર્શનિક પુસ્તક-વાચનમાં ખાસ રૂચિ હતી. તેની સાક્ષી આપતાં અને ભારતીય સંસ્કૃતના અમૂલ્ય ખજાના જેવા સેકડો સંસ્કૃત, હિંદી, ગુજરાતી ગ્રંથો અહીં સચ્ચાયેલા છે. તેમાં સંસ્કૃત ગ્રંથોનું પ્રમાણ વિશેષ છે. ધર્મ, અધ્યાત્મ, તત્વજ્ઞાન, સાહિત્ય, વૈદક, વ્યાકરણ, વિજ્ઞાન, ઈતિહાસ, વનસ્પતિ વગેરે વિવિધ વિષયો પરનાં પુસ્તકો અહીં જોવા મળે છે.

### ● ઉત્સવ અને ઉજવણી :

ભગતજીનાં આ બંને સ્મૃતિસ્થાનો (કુટિર અને સત્સંગ - ખંડ) માં ભારતની સનાતન સંસ્કૃતની આધ્યાત્મિક વિભૂતિઓ, ધર્મોપદેશકો અને પ્રસંગોની ઝાંખી કરાવતી સુંદર છબીઓ નિહાળવા મળે છે. આ છબીઓના સંગ્રહને વ્યવસ્થિત

રૂપ આપવામાં આવે તો કાયમી ધાર્મિક-આધ્યાત્મિક પ્રદર્શનનું રૂપ ધારણ કરી શકે.

આ ઉપરાંત ભગતે કાઠડાવાસીઓ માટે ગામની અંદર પણ ‘હરિસાહેબ રામકથા ભવન’ અને આવળમાં મંદિરનું નિર્માણ તથા અમુક ધર્મસ્થાનોનો જીર્ણોકાર પણ કરાવ્યો હતો. રામકૃષ્ણ કુટિરમાં દર પુનમે સંતવાળીનું આયોજન થાય છે, જેમાં આ પંથકના ભજનિકો પોતાની ભાવપ્રસાદી વિનામૂલ્યે રજૂ કરે છે. વજાભગતે સ્થાપેલી ભજન પરંપરાની આ પ્રવૃત્તિ છેલ્લા લગભગ છ દાયકાથી આ સ્થળે સતત ચાલુ રહી છે.

દર વર્ષે વજાભગતની પુણ્યતિથિ (પોષ વદ પાંચમ) પર ઉજવાતો ‘સત્સંગ સમારોહ’ આ સ્થળનો મુખ્ય ઉત્સવ છે. તે પ્રસંગે આ પંથકના હજારો ચારણ ભાવિકો એકઠા થાય છે અને પોતાના પૂર્વજ સંતને આદરાંજલિ આપે છે. આ પ્રસંગે ગીતા-રામાયણ પાઠ, સંતોની ધર્મસભા, સૌરાષ્ટ્ર-કચ્છના ભજનિકોની સંતવાળી અને કવિ મુશાયરો યોજાય છે. વિવિધ ધાર્મિક જગ્યાના સંતો વર્ષોથી નિયમિત અહીં પથારે છે અને ઉપદેશવાળી પીરસે છે.

### ● સંકુલમાં નૂતન સુધારા-વધારા :

જાણીતા તાર-શરણાઈ વાદક પંડિત વિનાયકરાય નાનાલાલ વોરા (૧૯૨૯-૨૦૦૬) એ પણ અહીં વજાભગતના સાન્નિધ્યમાં સંગીતની આરાધના કરી હતી. આ અનુબંધને હવે વોરા પરિવારની ત્રીજ પેઢીએ પણ આગળ વધાર્યો છે. નાનાલાલ વોરાના પૌત્રો અને વિનાયક વોરાના પુત્રો પૈકી ફિલ્મસર્જક નીરજ વોરા અને સંગીતકાર ઉત્તંક વોરા દ્વારા પિતાની સ્મૃતિમાં અહીં છ લાખના ખર્ચે ‘વિનાયક વોરા સ્મારક સંગીત-સત્સંગ સભાગાર’ નું ૨૦૦૮માં નિર્માણ કરાયું છે.

ચારણોના ઈષ્ટદદેવી આઈ સોનલમાતાનાં મંદિરો કચ્છ જિલ્લામાં ૧૯૭૮ માં જરપરા (તા. મુંદ્રા), ૨૦૦૩ માં આટિપુર (અનુસંધાન : જુઓ પાના નં.-૩૧ ઉપર)



## કચ્છનાં નારીરત્નો : મીનલદેવી

• માર્કડરાય મહેતા •

એક અંગેજ કવિએ કહ્યું છે કે, “દરેક મહાપુરુષની પાછળ કોઈ સ્ત્રીનો હાથ હોય છે.” આપણા કચ્છમાં ૧૮મી સદીમાં બે મહાપુરુષો થઈ ગયા. જમાદાર ફટેહમામદ અને સુંદરજી સોદાગર. આ સુંદરજી સોદાગર વિષે આજની આપણી વાર્તા લખાયેલી છે.

નાનપણથી જ સુંધો (સુંદરજી) ઘણો જ તોફાની તેમજ રખ્યું હતો. તેના પિતા ગુણિયાળી ગામમાં રંગાટનું કામ કરતા. તેમને ચાર પુત્રો હતા. જ્યારે તેમણે જાણ્યું કે, આ મારા પુત્રો મારા કદ્યામાં નહીં રહે એટલે તેમણે પોતાની મિલકતના ચાર ભાગ પાડી ચારેયને વહેંચી આપી.

સુંધો જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ કુછદે ચડવા લાગ્યો અને ધીમે ધીમે તે મોટો જુગારી બની ગયો. પોતાના પિતાએ આપેલી બધી મિલકત જુગારમાં હારી ગયો તો પણ તેણે જુગાર ન છોડ્યો અને પત્નીનાં ઘરેણાં છીનવી જુગાર રમવા પહોંચી ગયો.

જુગારમાં પત્નીનાં ઘરેણાં પણ હારી ગયેલો સુંધો જ્યારે ઘરે આવ્યો ત્યારે રાત્રિના બાર વાગી ગયા હતા. તેની પત્ની તેની રાહ જોતી બેઠી હતી અને ખાટલાની આડશે જોલાં ખાતી હતી. કમાડ ખખડ્યું અને તે સફાળી બેઠી થઈ ગઈ અને તરત જ બારણું ઉધાર્યું. જોયું તો પોતાના પતિનું વદન તદ્દન નિસ્સેજ થઈ ગયેલું. ‘નક્કી હારી આવ્યા હશે.’ તેણીએ વિચાર્યુ પણ મોં પર હાસ્ય લાવી તેણી બોલી, ‘તમે તે કેવા છો. તમને તો ભૂખ પણ નથી લાગતી. હાલો હવે થાળી પીરસું છું.’ આવા વહાલભર્યા શબ્દોથી સુંધો બેબાકળો બની ગયો તે ગુપ્યુપ રસોડા તરફ દોરાયો. પત્નીએ સફરો પાથર્યો. દીચણિયું આચ્યું અને પાણીનો લોટો ભરીને પાસે મૂક્યો અને પછી ખીચડી, રોટલો અને વાટકામાં

કઢી પીરસી લાવી. કુંગળીના બે દઢા પણ મૂક્યા, મરચાનું અથાણું પણ વાટકીમાં લાવી અને વીજણો લઈ પતિ પાસે બેઠી.

સુંધો તો આ નિર્દોષ, વહાલસોયી નમણી નારીને જોઈ જ રહ્યો. પત્નીએ છણાકો કર્યો, “હવે મારી સામે શું જુઓ છો? હું તો એ જ છું. હવે હાથ હલાવો.” એટલે સુંધો ગુપ્યુપ ખાવા લાગ્યો. પણ આજે તેને ભાવતું ન હતું. છતાં એ એને બતાવવું ન હતું. નહિતર આ નારીને દુઃખ થશે એટલે સુંધો બધું જાપટી ગયો. હાથ ધોયા અને આંગણામાં પડેલા ખાટલા પર લંબાવું. આ સુંધો, જેની ગામમાં રાડ પડતી. કોઈ તોફાન તેણે બાકી રાખ્યું ન હતું. જુગારનો તો તે અર્દગ ખેલાડી હતો. ગધેડા સવારી તેનો અજબનો શોખ હતો. વાડીઓમાંથી કેરી, ગાજર, જામફળ ચોરીને ખાઈ જવાં એ તો તેનો મામૂલી ધંધો હતો. ગામમાં બધા એનાથી બીતા પણ એ જ સુંધો તેની પત્ની પાસે નરમ ધેંસ જેવો બની જતો. આજે પણ તેણે ગુપ્યુપ ખાઈ લિધું હતું.

રાત ઘણી વીતી ગઈ હતી. પરંતુ તેને ઊંઘ આવતી ન હતી. પોતાની વાત જો પત્નીને કહી નાખે તો જ તેનું દિલ હળવું થાય એટલે જેવી તેની પત્ની પાંગતીએ બેસી તેના પગ ચાંપવા લાગી એટલે સફાળો બેઠો થઈ ગયો અને બોલ્યો, “મીનલ, હું તને કાંઈપણ સુખ આપી શકતો નથી. મને લાગે છે કે મારે મરી જવું જોઈએ.” તેની પત્ની તેના મોઢા પર હાથ રાખી કહે, “આવું શું બોલો છો? જો તમારા જેવો બહાદુર માણસ આવું બોલશે તો મારું શું? હું પછી કેમ જવીશ? ના ના તમારી શક્તિ હું જાણું છું, તમને એની ખબર નથી.” સુંધાએ જવાબ આપ્યો, “હું કેવો જુગારી બની બેઠો છું, તને ખબર છે. મેં મારા બાપની મિલકત અને તારાં ઘરેણાં પણ

જુગારમાં ગુમાવ્યાં. હવે આપણું ઘર કેમ ચાલશે?” મીનલ હસી પરી, “તમે આવી નામર્દ જેવી શું વાતો કરો છો. તમે તો જ્યાં લાત મારશો ને તો પાતાળમાંથી પાણી નીકળશે અને તમને ખબર છે મારી પાસે જે કસબ છે તે આપણું ગુજરાન ચલાવવા પૂરતું છે.” સુંધો કહે, “ના ના તું કમાય ને હું ખાઉં.” મીનલ કહે, “એમાં શું કાં તો તમે કમાઓ. કાં તો હું કમાઉં. લ્યો હવે રાત ઘણી ગઈ છે. છાનામાના સૂર્ય જાવ. સવારે હું તમને એક સરસ વાત કહીશ.” અને ખરેખર સુંધો થોડી જ વારમાં નસકોરાં બોલાવવા લાગ્યો.

સવારે જ્યારે સુંધો ઊઠ્યો ત્યારે તદ્દન શાંત હતો. તેનું મન ખુશીમાં હતું. ઊઠીને દાતણ-પાણી કરી સવારનો નાસ્તો કરવા બેઠો ત્યારે નાસ્તો કરતાં કરતાં તેણે મીનલને પૂછ્યું, “તું જે સરસ વાત કહેવાની હતી તે કહી દે.” મીનલનું મન અતિશય આનંદિત થઈ ગયું પણ બહારથી ગંભીરતા બતાવી બોલી, “જુઓ આજે તમારે હું કહું તેમ કરવાનું છે. કરશો ને?” સુંધો કહે, “હા હા મને કબૂલ છે. તું જેમ કહીશ તેમ જ કરીશ.” મીનલ કહે, “જુઓ બરાબર બાર વાગે તમારે ભાડિયા મહાદેવ જવાનું છે. ત્યાં જઈ મહાદેવ પાસે કરગરજો અને મારે શું કરવું એમ વારંવાર પૂછજો. એટલે મને ખાતરી છે કે તમને જવાબ મળશે.”

બપોરના બાર વાગે સુંધો ભાડિયા મહાદેવ પહોંચી ગયો. મંદિર સુમસામ હતું. પૂજારી પણ પૂજા કરી ચાલ્યો ગયો હતો. એટલે બિલકુલ એકાંત હતું. સુંધો બારણું ઉધાડી અને ગર્ભગૃહમાં પહોંચ્યો અને કપડા ઉતારી હાથ-પગ ધોઈ મનને પવિત્ર કરી મહાદેવના લિંગ પાસે બેઠો અને મનમાં “શિવાય નમઃ” નો પાઠ શરૂ કર્યો. થોડી વારમાં મંત્રનું રટણ ચાલુ હતું ત્યાં તેને સમાપ્તિ લાગી ગઈ અને સમાપ્તિમાં તેણે

પોતાની સમક્ષ મહાદેવ, શિવ ભગવાનને ઉભેલા જોયા. એટલે તે તેમને પગે પડ્યો અને કરગરવા લાગ્યો, “હું શું કરું?” મહાદેવ પ્રસન્ન મુદ્રાથી બોલ્યા, “બેટા, તું પશ્ચિમમાં જા.” એમ કહી અદશ્ય થઈ ગયા. આ બધું સમાધિમાં જ સુંધાએ અનુભવ્યું. ઘોડી વારમાં એની સમાધિ તૂટી અને તે જાગૃત થઈ ગયો. હવે મારે શું કરવું? મહાદેવ તો “તું પશ્ચિમમાં જા” એટલો જ આદેશ આપી ચાલ્યા ગયા. બપોરના બે વાગી ગયા હતા. ખૂબ્યોતરસ્યો સુંધો ઘેર આવ્યો. આજે તેની મુખમુદ્રા જોઈ મીનલ મનમાં ને મનમાં ખૂબ ખુશ થઈ અને પોતાના પતિને હાથમોહું ઘોવડાવી પાટલા પર બેસાડી, થાળીમાં તૈયાર કરેલી આરતી લઈ આવી. પોતાના પતિની પૂજા કરવા લાગી. સુંધો કહે, “આ શું કરશ? મારી તે કંઈ પૂજા હોય?” પરંતુ મીનલ તો આરતી ઉત્તારવામાં મશગૂલ હતી. તેથી કંઈ બોલી નહીં. આરતી પૂરી કરી તેણીએ કહ્યું, “આજે તમારા મોં પર જે પ્રસંગતા છે તેથી મને લાગે છે કે મહાદેવ તમારા પર પ્રસન્ન થયા છે.”

સુંધો કહે, “ખરી વાત છે. મને તો મહાદેવજીએ સાક્ષાત્ દર્શન આપ્યાં અને કહ્યું, “બેટા પશ્ચિમમાં જા.” મીનલ કહે, “તમે કેટલા બધા નસીબદાર છો. સાક્ષાત્ ભગવાને તમને દર્શન આપ્યાં. જુઓ આપણા ગામની પશ્ચિમમાં તો માંડવી છે. આજે સાંજે જ તમે માંડવી જાઓ.” સુંધો ખાઈ-પી ઘોડો આરામ કરી માંડવી જવા રવાનો થયો.

સુંધો જ્યારે માંડવી પહોંચ્યો ત્યારે હજુ અંધારું થયું ન હતું. જેવો તે ગામની બજાર પાસે પહોંચ્યો કે લોકો દોડતા દોડતા “ભાગજો, ભાગજો, નગરશેઠની ઘોડી ભડકીને ભાગી છે. વચ્ચે કોઈ આવતા નહીં. નહીં તો કચડાઈ જશો.” એવી બુમો પડતી હતી. સુંધો સાવધ થઈ ગયો. સામેથી દોડતી આવતી ઘોડીને તેણે જોઈ પરંતુ તે નાઠો નહીં, સામો ઊભો રહ્યો. એટલે ઘોડી જરા અટકી. જેવી ઘોડી ઊભી રહી કે તરત જ સુંધો ઠેક મારી ઘોડી પર ચડી બેઠો. ભડકેલી ઘોડી વધુ ભડકી. પોતા પર સવારી

કરતા માણસને નીચે પાડવા તેણીએ જુદા જુદા ઉપાયો કર્યા. જો કે સુંધો અગાઉ ક્યારે પણ ઘોડી પર ચચ્યો ન હતો. પણ ગઢેડા સવારીનો તેને ઘણો શોખ હતો. માટે તે આવડતનો લાભ લઈ સુંધો ઘોડીની ગરદન પકડી બે પગની આંટી મારી ઘોડીની પીઠ પર સૂર્ય ગયો. ઘોડીએ તેને નીચે પાડવા ખૂબ પ્રયત્નો કર્યા પરંતુ સુંધો તો જડની જેમ તેને વળગી રહ્યો હતો. એટલે ખૂબ પ્રયત્નો કર્યા પછી ઘોડી થાકી. આ તકનો લાભ થઈ સુંધાએ તેને પગથી એડી મારી દોડાવી. ઘોડી પણ ચાર પગે દોડવા લાગી. બેએક માઈલનો પંથ કાપી નાખ્યો. હવે ઘોડીને હાંફ ચડી હતી એટલે સુંધાએ તેને વાળી અને માંડવી તરફ હાંકી. જેવી ઘોડી માંડવી શહેરમાં દાખલ થઈ લોકોએ સુંધાને ઘોડી પર બેઠેલો જોયો તેઓ આશ્રય પામ્યા કારણ કે ઘોડી શાંત રીતે પોતાની મક્કમ ચાલમાં નગરશેઠના ઘર ભણી જતી હતી.

લોકો અંદરોઅંદર કહેવા લાગ્યા. “છોકરો તો મુશસ છે. જુઓ એણે ઘોડીને કેવી કબજે કરી લીધી છે.” નગરશેઠના ઘર પાસે જેવી ઘોડી આવી કે નગરશેઠના માણસો બહાર નીકળી આવ્યા. ઘોડી નગરશેઠને ખૂબ વહાલી હતી. એટલે નગરશેઠ પોતે પણ ઘરની બહાર આવ્યા અને જોયું તો સુંધો ઘોડી પર સવાર થઈને ઘર પાસે આવી પહોંચ્યો અને હળવેકથી નીચે ઉતર્યો અને નગરશેઠને પ્રણામ કરી કહે, “શેઠ, લ્યો આ તમારી ઘોડી ભારે તીખી છે. પણ છે સોનાની.”

નગરશેઠ હસ્યા, સુંધાને શાબાશી આપી અને કહ્યું, “વાહ રે જુવાન વાહ.” અને કહ્યું, “તેં તો મારી ઘોડીને એવી વશ કરી લીધી છે કે જાણે તારી પોતાની ન હોય!” અને પૂછ્યું, “જુવાન તારું નામ શું? અને ક્યાંથી આવ્યો છે?” સુંધાએ જવાબ દીધો. “હું શિવજ બ્રહ્મક્ષત્રિય ગુંદિયાળીવાળાનો દીકરો છું. મારું નામ સુંદરજી.” પોતાની ઘોડીને સુંધારનાર યુવાન તરફ શેઠ ખુશ થઈ ગયા હતા. એટલે તેને ઘરમાં લઈ ગયા. નાસ્તો

કરાવ્યો અને પૂછ્યું, “શું કરશ? તારો બાપ તો રંગાટનું કામ કરે છે નહીં! તો તું પણ એ જ કરતો હોઈશ. તો આ ઘોડે સવારી ક્યાંથી આવી?”

સુંધો કહે, “શેઠ હું તો ધંધો શોધવા નીકળ્યો છું. મારે તો આ માંડવી શહેરમાં ક્યાંય નોકરી શોખી લેવી છે.” શેઠ કહે, “અરે વાહ! મારી પાસે પાંચ-સાત ઘોડાઓ છે. એનો રખેવાળ ગઈ કાલે જ ચાલ્યો ગયો. તો તું જ એ કામ સંભાળી લે. તું માંગીશ તે પગાર આપીશ.” સુંધો ખુશખુશ થઈ ગયો.” કહે “શેઠ તમારી મોટી મહેરબાની. કાલ સવારથી હું તમારો નોકર અને તમે મારા શેઠ. લ્યો ત્યારે રામ રામ.” એમ કહી સુંધો પાતાના ગામ ગુંદિયાળી તરફ રવાનો થયો.

હવે સુંધો દરરોજ નિયમિત સવારે માંડવી પહોંચી જતો અને શેઠને મળી ઘોડાઓને સંભાળવાનું કામ કર્યા કરતો. બાપોરના સમયે એક ઘરડા સાઈસ (ઘોડાઓનો રખેવાળ) પાસે પહોંચી જતો અને તેની પાસેથી ઘોડા સંબંધી કેટલું જ્ઞાન પ્રશ્નો પૂછી પૂછીને માહિતી મેળવતો. ઘોડાનાં લક્ષણો, તેના પ્રકારો, તેની ઓળખ કેવી રીતે મેળવવી, સારા ઘોડાનાં લક્ષણો તેમની પાસેથી નમ્રતા ભાવે મેળવતો. શેઠ પાસે પાંચ ઘોડા હતા. પણ સુંધાએ તે ઘરડા સાઈસની શિખામણથી બાજુમાંથી બીજા ચાર પાંચ જાતવાન ઘોડા ખરીદ્યા. આમ દરરોજ ઘોડાઓની દેખભાણ કરતાં કરતાં બે માસ વીતી ગયા.

એક વાર તે શિરામણ કરતો હતો ત્યારે તેની પત્ની મીનલે કહ્યું, “મને થાય છે કે તમે હવે ઘોડાનો વેપાર કરો તો કેમ?” સુંધાને હવે બધા સુંદરજી કહેતા. તેણે પોતાની પત્નીને જવાબ આપ્યો, “હું પણ તે જ વિચાર કરું છું. તેં હવે મને પ્રેરણા આપી છે. તેથી હું આજે જ શેઠ પાસે વાત કરીશ.”

પેઢી ઉપરથી ઘેર જતાં શેઠ દરરોજ એક વાર સુંદરજી પાસે આવતા અને ઘોડાઓને લગતી વાતો કરતા. તેમને સુંદરજી તરફ સ્નેહભાવ ઉત્પન્ન થયો હતો.

તેથી આજે તેમણે જ સુંદરજીને કહ્યું, “ભાઈ, સુંદરજી તને બે મહિના થઈ ગયા. તારા કામથી હું ખુશ છું. પણ મને લાગે છે કે તારે હજુ ખૂબ આગળ વધવાનું છે. માટે તું હવે ઘોડાનો વેપાર કરવા માંડ.” સુંદરજીએ જવાબ આપ્યો. “તમારી મારા ઉપર ખૂબ રહેમનજર છે. પણ વેપાર કરવા માટે તો મૂડી જોઈએ ને?” શેઠ કહ્યું, “સુંદરજી, તું મારા દીકરા જેવો છે. માટે તને જેટલી મૂડી જોઈએ એટલી મારા પાસેથી લઈ જશે.” બનવા જોગ છે કે, તે જ દિવસે એક મોટા જાગીરદાર ઘોડાની ખરીદી માટે માંડવી આવ્યો અને શેઠ પાસે સારા ઘોડા છે એવી વાત સાંભળી એટલે ઘોડા જોવા શેરના ઘોડારમાં આવ્યા અને સુંદરજી સાથે ઘોડા સંબંધી વાતો પૂછ્યી. તેણે ઘોડા જોયા અને ખુશ થઈ ગયો. તે કહે, “બોલો આ દસે ઘોડા હું ખરીદી લઉં. કેટલા પૈસા લેશો?” સુંદરજીએ જરા પણ વિચાર કર્યા વગર કહી દીધું. “આ એક ઘોડાના ત્રણ સો રૂપિયા પડશે. પેલો જાગીરદાર કહે. “રૂપિયામાં હું ન સમજું, જો તમારે આપવા હોય, તો હું દસ ઘોડાની દસહજાર કોરી આપીશ.” સુધારે કહ્યું, “ચાલો મારા શેઠ પાસે,” બશે શેઠ પાસે ગયા અને ઘોડાના સોદાની વાત કહી. શેઠ કહે, “આ મારો સુંદરજી કહે તે મારે કબૂલ.”

આમ સોદો થઈ ગયો. પેલો જાગીરદાર કહી ગયો કે, “અદવાયિમાં મારો કામદાર દસ હજાર કોરી આપી જશે અને દસે ઘોડા લઈ જશે.” સાંજે જ્યારે સુંદરજી ઘેર જતો હતો ત્યારે શેઠ પાસે ગયો. શેઠ કહ્યું, “સુંદરજી, તારો વેપાર તો શરૂ થઈ ગયો. આપણાને ઘોડા દીઠ પાંચસો કોરીનો નફો થયો. એટલે તેમાંથી અડધી તારી અને અડધી મારી.” આમ ખુશ થતો થતો સુંદરજી ઘેર ગયો. તેની પત્ની જેવો તે ઘેર પહોંચ્યો કે તરત જ ખુશ થઈ બોલી, “આવો સુંદરજી સોદાગર.” આજથી તમે એ જ નામે ઓળખાશો. સુંદરજીને નવાઈ લાગી કે મારી પત્ની કોઈ જાહુગર કે કોઈ દેવી અંશ છે કે તેને આ બધી બખર કેમ પડી? તે

તરત જ બોલ્યો “દેવી, એ બધો તમારો પ્રતાપ છે.” તેની પત્ની હસીને બોલી, “ના રે ના એ તો તમારા પુરુષાર્થનું પરિણામ છે.” તે રાત્રે તેની પત્નીએ સુંદરજીને કંસાર જમાડ્યો અને બશે મોડી રાત સુધી ભાવિ જિંદગી વિશે વાતો કરતાં કરતાં સૂર્ય ગયા.

સુંદરજી હવે કચ્છને ગામે ગામ સારા જાતવાન ઘોડાઓ જોવા તેમજ ખરીદવા ફરવા લાગ્યો. તેણે પોતાના શેઠ પાસેથી એક લાખ કોરી ઉધાર લીધી અને જેટલા બને એટલા વધારે ઘોડા ખરીદતો ગયો. તેમ તેમ તે ઘોડાઓ વેચવા પણ લાગ્યો અને સમગ્ર કચ્છમાં “સુંદરજી સોદાગર” તરીકે પ્રાય્યાત થઈ ગયો.

એક વાર તે પોતાને ગામ રાત્રે વાળું કરતો હતો ત્યારે માંડવીથી તેનો દોસ્તાર તેને ઘેર આવી ચક્કો. ખૂબ વાતો ચાલી તેમાં તેના દોસ્તારે બે અંગ્રેજો કચ્છમાં પરવાના વગર ફરતા હતા. તેને ભુજના પોલીસ અધિકારીએ જેલમાં પૂરી મૂક્યા છે. આવા સમાચાર તે મિત્રો સુંદરજીને આપ્યા. મિત્ર તો મોડી રાત્રે માંડવી ચાલ્યો ગયો. તેની પત્નીએ આ અંગ્રેજોની વાત સાંભળી હતી. તેથી તેણીએ સુંદરજીને કહ્યું, “તમે ભુજ જાઓ અને તે અંગ્રેજોને બની શકે તો ઘોડાવી આવો.” પહેલાં તો સુંદરજીએ આનાકાની કરી અને કહ્યું, “આવાં નકામાં કામો કરું તો મારો વેપાર અટકી પડે. પણ આખરે તે સહમત થયો.

બીજે દિવસે પોતાની ખાસ ઘોડી પર સવાર થઈ માંડવી ગયો. પોતાના શેઠને આ અંગ્રેજોની વાત કરી અને પોતે તેમને ઘોડાવા ભુજ જવા ઈચ્છે છે એવું જણાવ્યું. શેઠ ન હા પાડી અને ન વિરોધ કર્યો. કહે, “જેવી તારી મરજી.” પણ સુંદરજી તો તે જ દિવસે ભુજ પહોંચ્યો અને એકાદ વકીલને લઈ ન્યાયાધીશ પાસે અંગ્રેજોનો પોતે જામીન બની ઘોડાવા અરજી કરી. વકીલ હોંશિયાર હોઈ તેની રજૂઆત પરથી ન્યાયધીશે તે અંગ્રેજોને જામીન પર ઘોડ્યા. અંગ્રેજો જેલમાંથી છૂટ્યા ત્યારે તેમને ઘોડાવનાર આ સુંદરજી કોણ છે. તેઓ

સુંદરજીને મળ્યા અને ભાંગી તૂટી હિંદીમાં તેમનો આભાર માન્યો અને મુંબઈ આવવા આમંત્રાણ આપ્યું. પેલા અંગ્રેજોને સુંદરજીએ સમજાવ્યું કે આ વકીલ ઘણો જ હોંશિયાર છે. તેથી તમારો કેસ જલદીથી પૂરો થઈ જશે. આમ અંગ્રેજોને છોડાવી સુંદરજી પાછો માંડવી આવી ગયો.

ઓડા દિવસમાં તો સુંદરજી પાસે ઘણા ઘોડા થઈ ગયા. હવે તો તેમને રાખવાનું કોઈ ડેકાશું પણ ન હતું. ઘરાંકો પણ આવતા ન હતા. એટલે શેઠ સુંદરજીને મુંબઈ તરફ જવાની સલાહ આપી અને પોતાના એક પરિચિત વેપારી પર કાગળ લખી આપ્યો. સુંદરજી મુંબઈ પહોંચ્યો. ચાર પાંચ દિવસ ખૂબ રહ્યો. પેલા વેપારીએ પણ ખૂબ પ્રયત્નો કર્યા પણ ક્યાંય પત્તો ખાંધો નહીં. એક વાર સુંદરજી મુંબઈના કોટ વિસ્તારમાં ફરતો હતો ત્યાં સામેથી એક મોટર આવી અને તેની પાસે ઊભી રહી અને તેમાંથી બે અંગ્રેજો ઊતર્યા અને સુંદરજી પાસે જઈ બોલ્યા, “અરે સુંદરજી! દુમ ઈધર!” અને સુંદરજી સાથે હાથ મિલાવ્યા. સુંદરજીએ કહ્યું કે, “મારી પાસે જાતવાન ઘોડાઓ છે તે વેચવા મુંબઈ આવ્યો છે.” પેલા અંગ્રેજોએ પોતાને કેદમાંથી ઘોડાવનાર તરફ સ્નેહભાવે જોયું અને કહ્યું, “અમારી સાથે ચાલો.” અને એમ કહી મોટરમાં મોટા અંગ્રેજ સેનાપતિ પાસે લઈ ગયો અને સેનાપતિને વાત કરી કે આ માણસ પાસે કચ્છના સારામાં સારા ઘોડાઓ છે અને આપણે તે ખરીદી લેવા જોઈએ.”

ઘોડાઓની વાત સાંભળી તે ઘણો ખુશ થયો. તેણે પૂછ્યું, “કેટલા ઘોડાઓ છે?” સુંદરજી કહે “અત્યારે મારી પાસે ત્રીસ ઘોડાઓ છે અને તે બધા ખૂબ જાતવાન છે.” સેનાપતિ કહે, “હું દરેક ઘોડાના તમને પાંચસો રૂપિયા આપીશ અને મારા માણસો તારી સાથે કચ્છ આવશે. તેને તું ત્રીસ ઘોડા સંચી દેજો.” સેનાપતિએ તરત જ સુંદરજીને પંદર હજાર રૂપિયાની હુંડી લખી આપી અને કહ્યું કે તને હું બીજા પચાસ ઘોડા માટે પચીસ હજાર રૂપિયાની બીજી હુંડી લખી આપું છું : તે ઘોડા તારે

બે માસમાં અમને આપવા પડશે. આમ બે હુંગીઓ લઈ સુંદરજી ખુશ થતો થતો પેલા બે અંગ્રેજોનો ખૂબ ખૂબ આભાર માની કર્ય તરફ રવાનો થયો.

ભારતમાં તે વખતે અંગ્રેજો પોતાનું આધિપત્ય સ્થાપિત કરવા ભારતના ઘણા બધા રાજાઓ સાથે યુદ્ધ કરતા હતા અને તેમને હરાવીને તેમની પાસેથી તાબેદારી સ્વીકારવા ફરજ પાડતા હતા. એટલે જ્યારે યુદ્ધ થાય ત્યારે તે વખતે કોઈ મશીનો ન હતાં. ફક્ત ઘોડા જ લડાઈમાં કામ આવતા. એટલે અંગ્રેજો વારંવાર સુંદરજી પાસેથી ઘોડાઓ ખરીદવા લાગ્યા. એ જ રીતે મૈસુરના ટીપુ સુલતાને ઘોડાઓ પૂરા પાડવા ખૂબ આગ્રહ કર્યા. આમ સુંદરજીનો વેપાર દિવસે ખૂબ વિસ્તરવા લાગ્યો. તેમની નામના પણ ખૂબ વધી. અંગ્રેજોનો તો તે ખૂબ જ ભરોસાપાત્ર મિત્ર બની ગયો.

એક વાર કર્નિલ મોન્ટેભોન્ટ્રીએ સુંદરજી સોદાગરને ચારસો ઘોડા પૂરા પાડવા જણાવ્યું અને તે બદલ તેને મદ્રાસ બોલાવી એક લાખ રૂપિયા ખરીદી પેટે આયા. સુંદરજીએ એ લાખ રૂપિયાનાં મોતી મદ્રાસમાંથી જ ખરીદાં અને સુરત આવી બે લાખમાં વેચ્યા. આમ સુંદરજીની આવક લાખોમાં થવા લાગી. તેણે કર્ય, સિંધ, ગુજરાત તેમજ ભારતભરમાં પોતાની પેઢીઓ ખોલી અને લાખો રૂપિયાનો વેપાર કરવા લાગ્યો.

હવે સુંદરજી મોટા રાજાઓને પણ મદદ કરવા અવારનવાર ભારતભરમાં પ્રવાસ કરવા લાગ્યો અને અંગ્રેજોએ તેને પોતાના એજન્ટ (દલાલ) તરીકે નીચ્યો અને તેને માસિક પગાર પણ આપવાનું શરૂ કર્યું. આમ સુંદરજીએ કેટલાય રાજાઓ સાથે અંગ્રેજ સરકાર સાથે સંથિ કરાવી આપી. કેટલાય રાજાઓને અંગ્રેજો પાસેથી લશ્કરો લઈ આપી તેમના દુશ્મનોને

હરાવ્યા. વળી જ્યારે આ રાજાઓને અંગ્રેજોને પૈસા આપવા પડતા ત્યારે તેઓ સુંદરજી પાસેથી લાખો રૂપિયા ઉધાર લેતા અને પોતાના રાજ્યનો અમુક ભાગ સુંદરજીને ગિરવી આપતાં.

એક વાર સુંદરજી પોતાને ઘેર ગુંદિયાળી આવ્યો ત્યારે તેની પત્ની મીનલે તેની ખૂબ પ્રશંસા કરી અને તેને સલાહ આપી કે આપડી સમબૃદ્ધિમાંથી તમારા પિતા, ભાઈઓ, સગાસંબંધીઓને કંઈક ભાગ આપો. ગુંદિયાળી ગામમાં જ્યારે સુંદરજી સોદાગર આવતો ત્યારે કોઈ રાજા આવ્યો હોય તેવો દેખાવ થઈ જતો. ગામ બહાર તંબુઓ તણાતા અને તેમાં તેના નોકરો, સિપાહીઓ, આડતિયાઓ, વેપારીઓ અને કેટલીક વાર તો નાના નાના રાજાઓ, ગુંદિયાળી આવતા અને તેમની યોગ્ય સરભરા સુંદરજીના માણસો કરતા. તેમાં પોતાના ભાઈઓ અને સગાસંબંધીઓને તો તે કામમાં લગાડી દેતો.

એક વાર તેની પત્નીએ તેને કહ્યું કે જુઓ ઈશ્વરની મહેરબાનીથી આપણને રૂપિયા મળો છે. પરંતુ આપણે ફક્ત લેવાનું જ કરશું તો તે ઈશ્વરને નહીં ગમે માટે તે વાપરવાનું પણ ચાલુ રાખો. તેણે સુંદરજીને નારાયણ સરોવર યાત્રા કરવા લઈ ગઈ અને ત્યાં નારાયણ સરોવરનાં મંદિરો તથા કોટેશ્વર મંદિરનો જીર્ણોદ્વાર કરાવ્યો અને તેમાં હજારો રૂપિયા ખર્ચ્યા અને આઈ આશાપુરાના મંદિરનો માતાપાત્રાની મઠમાં પણ જીર્ણોદ્વાર કરાવ્યો. ત્યાં મોટા યજો કર્યા. હજારો બ્રાહ્મણોને ભોજન તેમજ દાન-દક્ષિણા આપ્યાં.

એક વાર તેણીના આગ્રહથી સુંદરજી કુભમેળામાં હરદ્વાર ગયો અને ત્યાં હજારો સાધુઓ, નાગા બાવાઓ, સંન્યાસીઓને પાંચ દિવસ સુધી જુદી જુદી મીઠાઈઓનાં ભોજન કરાવ્યાં અને દરેકને પુષ્ણ દાન આપ્યું. આવું

પાંચ દિવસનું જમણ અગાઉ કોઈએ કર્યું ન હતું. એટલે સુંદરજીનું નામ દાનવીર તરીકે આજા ભારતમાં ગ્રાન્યાત થઈ ગયું. આમ સુંદરજીએ પોતાની પત્નીની પ્રેરણાથી લાખો રૂપિયા ખર્ચ્યા. કર્યમાં ૧૮૬૮માં દુષ્કાળ પડ્યો અને તેમાં પણ લોકોને છૂટે હાથે અનાજ આપ્યું અને ઢોરો માટે ઘાસ પણ દૂરદૂરથી મંગાવી મફત આપ્યું.

એક વાર ઓચિતા તે બહાર હતો ત્યારે તેની પત્ની માંદી પડી. દાકતરો, વૈધોને તેડાવ્યા. ખૂબ સારવાર કરવામાં આવી. સુંદરજીને પણ સંદેશા મોકલવામાં આવ્યા. પરંતુ ઈશ્વરની ઈચ્છા કંઈક જુદી જ હતી. એટલે સુંદરજી આવે તે પહેલાં જ મીનલનું અવસાન થઈ ગયું. પોતાની વહાલી પત્નીનું અવસાન થતાં સુંદરજી બેબાકળો થઈ ગયો. તેને જીવનમાંથી રસ ઊરી ગયો. એમ કહેવાય છે કે પોતાની પત્ની પાછળ તેણે લાખો કોરી ખર્ચી તેનો શોક ઉતારવા કેટલાય રાજાઓ, જાગીરદારો, વેપારીઓ અને અંગ્રેજોના સેનાપતિઓ પણ ગુંદિયાળી આવ્યા. આટલી બધી જાહોજલાલી અને કીર્તિના શિખરે પહોંચેલા સુંદરજી પત્નીના શોકમાં ખાખડી ગયો અને તે ગ્રા ચાર માસમાં જ પત્ની પાછળ સ્વર્ગવાસી થઈ ગયો. સંવત ૧૮૭૮માં તેનું મૂત્યું થયું. તેની પાછળ કોઈ સંતાન ન હતું અને તેના ભાઈઓ તેમજ કુટુંબીઓમાં કોઈ તેજસ્વી પુરુષ નીકળ્યો નહીં એટલે સુંદરજીએ ગ્રામ કરેલી બધી સંપત્તિ વેડફાઈ ગઈ. આમ એક જુગારી, તોફાની છોકરો તેની પત્ની મીનલની પ્રેરણાથી મોટો સોદાગર બન્યો, લાખો કમાયો, ભારતભરમાં તેની નામના થઈ. તેણે લાખો રૂપિયા ખર્ચ્યા, મંદિરોના જીર્ણોદ્વાર કરાવ્યા અને દુષ્કાળ વખતે પણ ઘણો ખર્ચ કરી નામના મેળવી.

**સોઝન્ય : “કર્યાનાં નારીરત્નાં”**

## હરીભાઈ ભીખાઈ પેઇન્ટર

જૈન ધર્મના કેન્વાસ પેઇન્ટિંગ, ટીર્થપટ, માર્બલ કાર્વિંગ ટીર્થપટ - ટીર્થ રચના બનાવનાર

★ તળાવ એરીયા, પ્રાઈમરી સ્કુલ સામે, પાલીતાણા-૩૬૪ ૨૭૦. ★ ૧૩, બાલમંદિર શેન્ટર, તણેટી રોડ, પાલીતાણા.

Tel. : (02848) 252454 • Mo. 94262 46176, 99240 36761



## આખા દિવસમાં કયારે ચાલવું સારું?

• જનક નાયક •

આખા દિવસમાં કયારે ચાલવું સારું?

તડિકયાકલામ જેવો એક શબ્દ મોટેભાગે આપણે સૌ બોલતા હોઈએ છીએ - ‘સમય નથી.’ અલબજ, જ્યારે સમય નથી એવું કહી છીએ ત્યારે આપણે પોતે પણ જાણીએ છીએ કે આખા દિવસમાં સૌથી વધુ સમયનો બગાડ આપણે કરતા હોઈએ છીએ. જાગ્રત અવસ્થાના લગભગ સોણ કલાકમાં કેટલા કલાક આપણે કામ કરીએ છીએ એની એક ડાયરી બનાવવા જેવી છે. સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે દરરોજ ખૂબ કામ થાય છે. રોજના દસદસ કલાક કામ કરું છું એવું ઘણા અતિમાનપૂર્વક કહેતાં હોય છે. પરંતુ આખા દિવસનું નિરીક્ષણ કરવામાં આવે તો જણાશે કે આઠથી દસ કલાકમાં માંડ આપણે બે-અઢી કલાક ગંભીરતાપૂર્વક કામ કરતા હોઈશું. સમય વિશેનો પ્રશ્ન એ આત્મ-નિરીક્ષણનો પ્રશ્ન છે અને એક અઠવાડિયાની ડાયરીમાં નોંધ કરીને આપણે એનો જવાબ જાતને આપવાનો છે. ‘સવારે ઉઠાતું નથી.’ ‘કામ એટલું રહે છે કે રાતે મોડે સુધી જાગવું પડે છે.’ અને ‘આખો દિવસ ઓફિસમાંથી બહાર નીકળવાનો

સમય મળતો નથી.’ જેવાં બહાનાંઓ આપણે સતત કાઢતા રહીએ છીએ. ને શરીરને ટોટલ ફિટનેસ માટે જરૂરી વ્યાયામથી વંચિત રાખીએ છીએ.

સામાન્ય રીતે વહેલી સવારમાં ચાલવામાં આવે તો ઊગતા સૂર્યની અને પંખીના કલરવની હકારાતમક અસર આપણાં શરીર-મન પર પડે. સવારનું વાતાવરણ મહદેશે પ્રસંગતાસભર હોય છે. તેથી જ સવારે ઊઠીને એક-દોઢ કલાકની કસરત ચાલવાનું, યોગાસન, પ્રાણાયામ વગેરે કરાય તો આખો દિવસ સ્ફૂર્તિમાં ને તાજગીમાં પસાર થાય છે. એટલું જ નહિ પણ લાંબુ આયુષ્ય આપણા જીવનના ફિક્સ રિપોઝિટ વોલ્ટમાં આપણે જમા કરાવી દઈએ છીએ. સવારે ચાલવાનો સમય મળતો જ ન હોય તો સાંજે પણ ચાલવા જઈ શકાય. અથવા રાતે સૂતા પહેલાં ચાલવા જઈ શકાય. આખા દિવસમાં વધુમાં વધુ એક કલાક અથવા ઓછામાં ઓછાં પિસ્તાલીસ મિનિટ ચાલવું જરૂરી છે. ધારો કે તમે બહુ વસ્ત છો. આખો દિવસ તમને બહુ કામ રહે છે. તો તમે વીસ-વીસ મિનિટના ત્રણ ભાગ પારીને સવાર, બપોર

અને સાંજ પણ ચાલી શકો. એ રીતે આખા દિવસમાં એક કલાક ચાલવાનો સંકલ્પ પૂરો થવો જોઈએ.

નાનાં નાનાં કામો માટે થોડા થોડા અંતરે વાહનો ન વાપરતાં ચાલીને જવાનો દુરાગઢ રાખવો જરૂરી છે. આખા દિવસમાં જ્યારે પણ ઓફિસની બહાર નીકળતા હોઈએ તો ખૂબ લાંબે જવાનું હોય તો ટીક પણ ઓછા અંતરે જવાનું હોય તો વાહન ન વાપરતાં, ચાલવાનો આગઢ રાખવો જરૂરી છે. ટુંકમાં આખા દિવસમાં તમે વધુમાં વધુ ચાલો. જ્યારે પણ શક્ય હોય ત્યારે ચાલવાનો આગઢ રાખો. ને તમારી કુદરતી ચાલથી થોડું જરૂરી ચાલો. તે આખો દિવસ તમે સ્ફૂર્તિમાં, તાજગીમાં, તનાવમુક્ત રહી શકીએ છીએ. અને નકારાતમક વિચારોને સ્થાને હકારાતમક વિચારતા થઈ શકીએ છીએ.

તોજન્ય : “સુખી જીવન”

### ગીતાનાન

ભગવદ્ગીતા એ માનવ સમાજના ઉત્કર્ષ માટે જ્ઞાનનો એક મહાબંડાર છે. ગીતાએ એક જગ્યાએ કહ્યું છે કે ખરેખર આ સંસારમાં જ્ઞાનની સમાન પવિત્ર કરવાવાળું બીજું કશું નથી.

૨ છે જ્ઞાને સંદર્શં પવિત્રમિહ વિદ્યત! ગીતા ૪/૩૮

તેથી ભલેને જ્ઞાન ગમે તેટલું અલ્પ હોય, એનો પ્રકાશ સેંકડો વર્ષોથી સંચિત અંધકારને કશાભરમાં ભગાડી મૂકે છે. અંધકાર ગમે તેટલો સંગઠિત બનીને આવે જ્ઞાનની મીંબની જેટલા પ્રકાશને પણ તે હોલવવા સર્વાં ન બની શકે. ગીતા જ્ઞાનનો વિપુલ બંડાર છે. એમાં જેટલું ઉંચું ઉત્તરવામાં આવે, એટલા જ અધિક રત્નો પ્રાપ્ત થાય છે. એટલા માટે દરેક વ્યક્તિએ ગીતા વાંચવી જોઈએ. અને એ પણ કહીશ કે જે વ્યક્તિ એને જે સ્વરૂપે જોશે એને ગીતા એ સ્વરૂપે દેખાશે. ગીતા જેવી અમૃતદાયિની વાણી છોડીને અન્ય ધર્મશ્રંખોમાં પ્રકાશની શોધ કરવી એ આપણા જેવા સાધારણ બુદ્ધિજીવી લોકો માટે કષ્ટપ્રદ છે. એટલા માટે જ મહાભારતમાં મહર્ષિ વેદવ્યાસે કહ્યું છે કે - “ગીતા જે પદ્ધતાના ભગવાન વિષ્ણુના મુખારવિદ્ધી નીકળી છે એને છોડીને અન્યશાસ્ત્રોના વિસ્તારનો શો અર્થ છે?” એટલે દરેક વ્યક્તિએ ગીતામાં ઉડા ઉત્તરીને ગીતાજ્ઞાન મેળવવું જરૂરી છે. - પૂ. શ્રી. તનસિંહજી

## ૧૦૦ વર્ષનું આયુષ્ય મેળવવા પાયાના ૫૦ નિયમોનું પાલન કરો

● ડૉ. જશવંતસિંહજી રાઠોડ, આયુર્વેદિક નિષ્ણાત, ગાંધીનગર ●

સતત નીરોગી રહી, દીર્ઘયુથ થવું એ પણ એક સાધના છે, કળા છે. એ માટે પાયાના ૫૦ કાનૂનોનું પાલન કરવાનું છે જેને સંકેપમાં રજૂ કરવામાં આવે છે.

- (૧) સવારે વહેલાં બ્રાહ્મ મુહૂર્તમાં ઊઠો.
- (૨) ઊઠીને નરણાં કોઠે લોટો ભરીને પાણી ધીમે ધીમે પીઓ. શિયાળામાં થોડું ગરમ પાણી વાપરો.
- (૩) દાંત સાફ કરવા કોઈ સારો દંતમંજન કે લીમડાનું દાતણ વાપરો. ક્યારેક ક્યારેક સરસિયું, હળદર અને સિંધવ નમકની પેસ્ટ બનાવી દાંત અને પેઢા ઉપર સારી રીતે માલિશ કરો. તે સાથે આંખોને અવારનવાર પાણીની છાલક મારી સાફ કરતાં રહો.
- (૪) દરરોજ સવારે વહેલા ઊઠી, મળ સાફ થયા પછી નિયમિત રીતે યોગાસનો કરો. તે આપના આંતરિક અંગોને સ્વસ્થ રાખશે. તે સાથે દરરોજ સવારે યોગાસનો પછી વિવિધ જ્ઞાતના પ્રાણાયામ કરો. જેમાં ભસ્ત્રિકા, કપાલભાતિ અને અનુલોમ-વિલોમ મુખ્ય છે. તેનાથી સર્વે અંગો સ્વસ્થ થશે.
- (૫) નાહતી વખતે પગના તળિયામાં ઊપસેલા બિંદુઓવાળો પથર-ઠીકરું ઘસો જેથી પગના તળિયાના એક્યુપ્રેસરના પોર્ટના ચાર્જ થાય અને આરોગ્યનું નિયંત્રણ થવા પામે.
- (૬) અજ્ઞાન થાય તે માટે ભરપેટ જમ્બો નહિ. ખાવાપીવામાં નિયમન રાખો. દાખીને જમવાનું ટાળો.
- (૭) દરરોજ બને તેટલો પ્રવાહી ખોરાક લો. પાણી, છાશ, લસ્સી, મલાઈ વગરનું સેપરેટ દૂધ (સ્કીમ્ડ મિલ્ક), ગાજરનો રસ, ફળનો રસ, ભાજનો રસ, ગોળ અને લીંબુનું શરબત તેમજ ગરમ કે ઠંડા પાણીમાં મધ અને લીંબુ નાખેલું પીણું પીઓ.
- (૮) આરોગ્યને પોષક અને પથ્ય ખોરાક પસંદ કરો. તાજે અને રાંધેલો ખોરાક લેવાનું રાખો કારણ કે તે સુપાદ્ય હોય છે.
- (૯) ચરબીયુક્ત તેમજ તળેલો ભારે ખોરાક લેવાનું ટાળો. શાકભાજી સાથેનો સાદો આહાર પસંદ કરો. મીઠાઈનો જૂજ ઉપયોગ કરો.
- (૧૦) ભોજનમાં ૨૫ ટકા શાકભાજી અને ૨૫ ટકા ફળફળાદિનો સમાવેશ કરો. શાકભાજીનું કચુંબર કાચું-પાકું કરીને દહીં સાથે ખાઓ.
- (૧૧) ભોજન પહેલાં શક્ય હોય તો આદુનો રસ સિંધાલૂણ અને

લીંબુ નાખીને પીઓ. એ કૃધાપ્રદીપક છે. ભોજનમાં આદુની કાતરી કચુંબર સાથે ખાવી. દાળશાકમાં લીંબુ નીચોવો. અનુકૂળ આવતી હોય તો ભોજન બાદ છાશ પીવી અમૃતતુલ્ય છે.

- (૧૨) ભોજનમાં ચટાકેદાર મરીમસાલાનો ઉપયોગ બિનજરૂરી અને આરોગ્યને નુકસાનકારક છે. વધુ પડતું મરચું મોં અને હોજરીને બાળે છે. મીઠું અનાજ તેમજ શાકભાજની કુદરતી મીઠાશને હણો છે.
- (૧૩) કાચા, વગર રાંધેલા શાકભાજ ખાસ ખાવાનું રાખો. કાકીની, સૂવાની ભાજી, લૂણી, સરસવની ભાજી, મૂળા, મોગરી, બીટ, કાંદા, લીંબું લસણા, લીલા કાંદા વગેરે થોડા પ્રમાણમાં કાચાં લેવા. કઠોળ ભરડ્યા વિના પાણીમાં પલાળીને ફણગાવેલા અને કાચાં ખાવાથી જરૂરી વિટામિન-બી મળી રહે છે. ખાસ કરીને મગ, ચણા અને અડદ પલાળીને દરરોજ સવારના ચાવીને ખાવાથી બધાં જ વિટામિનોની ઊણપ પૂરી થાય છે. ફણગાવેલાં કાચાં કઠોળ બેનમૂન આરોગ્યપ્રદ ટોનિક છે.
- (૧૪) મોસમનાં ફળ ખાવાં આરોગ્યદાયક છે. કેરી, જાંબુ, પપૈયાં, બિજોદું, ખાટાં લીંબુ, મોસંબી, નારંગી, સફરજન, ટેટી, તડબૂચ વગેરે ફળો જે તે મોસમમાં સવારનાં લેવાં વધુ સારાં છે.
- (૧૫) ચુનાનો ક્ષાર (કેલ્બિયમ) બાળક અને કિશોરનાં હાડકાં અને શરીરના બંધારણ માટે જરૂરી છે. દૂધ, ફળ અને લીંબાં શાકભાજમાં એ પૂરતા પ્રમાણમાં મળી રહે છે. શરીરને જરૂરી ક્ષાર મળી રહે તે માટે દૂધ, ફળ અને શાકભાજનો ખોરાકમાં છુટથી ઉપયોગ કરો. મીઠામાંથી આવા ક્ષારો મળતા નથી. પરંતુ દૂધ અને ફળ સાથે ન લો. દૂધને મીઠાવાળા ખોરાકની સાથે પડા ન લો.
- (૧૬) ખોરાકમાં ખાંડનો ઉપયોગ ઓછામાં ઓછો કરો. ખાંડમાં કોઈ પોષક તત્ત્વો નથી. તેને બદલે મધ, દેશી ખાંડ, ગોળ, સૂકા મેવા, ખજૂર, ગલુકોજ, તાડનો ગોળ વગેરે વાપરી શકાય.
- (૧૭) જમતી વખતે નીચેનાં પાંચ સૂચનોનો અમલ કરો : (ક) પ્રથમ કોળિયા સાથે એક ચમચી હિંગાએક ચૂર્છ અથવા બે ચમચા આદુનો રસ લીંબુ અને મીઠું નાખીને લો. (ખ) લસણા, જીરું, અજમો, મેથી, લીડિપીપર, સૂંઠ, ગંઠોડાં, સિંધાલૂણ અને લીંબુની ચટણી લો. (ગ) મગનું ઓસામણ પીઓ. (ઘ) લસણાની પાંચ કળી ખાઓ, (ચ)

- ભોજનને અંતે લીલુનું શરબત અગર તાજી દહીની છાશ પીઓ.
- (૧૮) સવારના ચા-કોફીના ઉકાળા પીવાને બદલે ગરમ પાણીમાં ગોળ અને લીલુનો રસ નાખી પીઓ અથવા તુલસીનો ઉકાળો પીઓ.
- (૧૯) દસ્ત સાફ લાવવા માટેનાં આસનો અને કસરતો કરો. તમારા શરીરની પ્રકૃતિને જે કસરત અને આસનો માફક આવે તે દરરોજ કરતા હો. પ્રાણાયામ પણ નિયમિત રીતે કરો.
- (૨૦) કબજીયાત ભગડવા દરરોજ હરે ફાકો. ફળ પાકીને ખરી પડે તેટલી આસાનીથી મળ ખરી પડે તેવું આપોજન કરો.
- (૨૧) સવારમાં ઊઠાતાંની સાથે જ નિયત સમયે જાજુ જવાની ટેવ પાડો. નિયમિત પેટ સાફ તો રોગ સાફ. યાદ રાખો કે ૮૦ ટકા રોગો પેટની ખરાબીમાંથી શરૂ થાય છે.
- (૨૨) આપણે સ્વાદ માટે જેટલું ખાઈએ છીએ તેટલું આપણા શરીરમાં દશ્ય કે અદ્રશ્ય રીતે ફૂટી નીકળે છે. તેટલે દરજજે આપણે આપણું આરોગ્ય ગુમાવીએ છીએ અને તેટલે દરજજે આપણે હૃદ્દિ થઈએ છીએ. તેથી સ્વાદ માટે નહિ પણ પોખરણ પૂરતું ખાવાનું રાખો.
- (૨૩) ઓછું ખાવાથી શરીરમાં સ્કુર્ટ અને કામ કરવાની ધગશ રહે છે. ભારે શારીરિક શ્રમ ઉઠાવવો હોય ત્યારે તેમજ ભારે માનસિક કામગીરી બજીવવાની હોય તે સમયે પેટને ઊણું રાખો.
- (૨૪) સવારે નાસ્તો કરવો બિનજરૂરી છે. હોજરીમાં પડેલા આમને પચવા માટે સવારે ચાર કલાકનો સમય આપવાની જરૂર છે. ભોજન માત્ર બે વખત કરવું બપોરે અને સાંજે. દરરોજનું કામ પતાવીને ભોજન લેવાનું રાખો. ભોજન બાદ થોડો આરામ કરો.
- (૨૫) ભોજન સમારંભોમાં લોકો દૂધમાં ઘણાં બધાં ફળોના ટુકડા નાખીને બનાવેલો હુટ સલાહ ખાય છે તેમજ વા-સંખ્યાની તકલીફ વાળા શીખંડ, ખમણ, દહીવડા, રાયતાં વગેરે ખાય છે. આનાથી ભયંકર કુપથ થાય છે.
- (૨૬) યથાશક્તિ આસનો કરવાથી શક્તિ જળવાઈ રહે છે. શીખસન અને સર્વાંગસન કરવાથી શરીરના સઘળા અવયવોને રૂધિરાભિસરણનો વેગ મળવાથી તંદુરસ્તી જળવાઈ રહે છે.
- (૨૭) ચાલવાની તેમજ દોડવાની કસરતો સાદી અને નિર્દોષ કસરતો છે. શક્તિ પ્રમાણે ચાલવાનું તેમજ દોડવાનું રાખો. દરરોજ ૩૦-૪૦ મિનિટ દોડવાથી મેદ વધતો નથી. પેટની ફાંદ ઉત્તરે છે, વજન ઓછું થાય છે તેમજ કટિપ્રદેશના અવયવોને હલનયલનની જોરદાર કસરત મળતાં યકૃત અને જઠર શક્તિશાળી બને છે. દોડનારાને હદ્દયરોગ, મીઠા પેશાબ, લોહીનું ઊંચું દબાણ કે સંખ્યિવા જેવા રોગો થતા નથી. જ્યારે થાકેલો હો, વધુ કામથી કંટાળી ગયા હો ત્યારે કસરત ન કરતાં માત્ર આરામ કરો. તંદુરસ્તી મેળવવા બીમાર વ્યક્તિએ પૂરતો આરામ કરવાની જરૂર છે. કસરત એ બીમારીનો ઈલાજ નથી. બીમારીનું કારણ શોધી કાઢી તેનો ઈલાજ કરો. તમે તમારી જાતના દાક્તર બનો અને નીરોગી રહો.
- (૨૮) નાકથી શાસ લો. નાકમાં વાળનાં ગુંચણા આવેલા છે તેમાંથી ગળાઈને, જરૂરી ગરમી પ્રાપ્ત કરીને, ચોખ્ખી હવા ફેફસામાં પ્રવેશ કરે છે. જેથી ચેપી રોગ થતા નથી. દમ અને ક્ષયના દર્દને નાકથી જ શાસ લેવો. ફરવા જાઓ ત્યારે ચાલતાં-ચાલતાં વાતો કરવી નહિ. મોહું બંધ રાખવું. જેથી ફેફસામાં હવાનાં જંતુ પ્રવેશી શકે નહિ.
- (૨૯) છાતી આગળ પડતી રાખીને અને દણિને દૂર રાખીને ટંડાર ચાલવું. દૂરના ટાવર, થાંબલા, ઝાડ, વનરાજ તરફ દણિ રાખીને ચાલવું.
- (૩૦) ખેડૂતની માફક ૮ થી ૧૦ કલાક શ્રમ - મહેનત કરો. તમારું જીવન શ્રમયુક્ત બનાવો. તેવું કામ ન હોય તો ખુલ્લી હવામાં દરરોજ કિકેટ, હુતુતુતુ, ખોખો, કબડી, વોલીબોલ, ફૂટબોલ, ટેનિસ, બેડમિન્ટન, પોલો, હોકી જેવી રમતો રમવાનો મહાવરો રાખો. નિયમિત યોગાસનો, કસરત, વ્યાયામ કરનાર વૃદ્ધ હોય તો ફરી યુવાન બની શકે છે. તે કાયાકલ્પનો ક્રીમિયો તેમજ દીઘાયું અને નીરોગિતાની અદ્ભુત જરીબુઝી છે. વૃદ્ધાવસ્થા રોકવાનો અને ફરીથી યૌવન પ્રાપ્ત કરવાનો જો કોઈ રામબાળ અદ્ભુત ઈલાજ હોય તો આ જ છે. તમે નિવૃત્ત થયા હો, કંઈ જ કામ ન કરતા હો અને આખો દિવસ બેસી રહેવાનું હોય તો જીલ્લતી ખુરશી (રોકિંગ ચેર) વાપરો. ખુરશી આગળ પાછળ હાલવાથી રૂધિરાભિસરણને સહાય મળો છે.
- (૩૧) માથામાં તેલ નાખતી વખતે માથાના બધા અવયવોને ખૂબ ટપારો. દરરોજ કાન, નાક, આંખ, ગરદન તથા હડપચીને મસાજ, સાધારણ ટપારવાની, થાબડવાની કિયા કરો. આમ કરવાથી રૂધિરાભિસરણને વેગ મળશે, આંખે મોતિયા આવશે નહિ, સ્મરણશક્તિ તેજ રહેશે તેમજ ઉંમર વધવા સાથે કાનની બહેરાશ આવશે નહિ.
- (૩૨) આંખ ઉપર ઠુંકું પાણી છાંટા રહો. દરરોજ દાતણ કરતાં, સ્નાન કરતાં, ભોજન પહેલાં હાથ, પગ, મોં વગેરે ધોતાં આંખે ઠુંકું પાણી છાંટો. રાત્રે પણ સૂતાં પહેલાં મોં સાફ કરીને આંખે ઠુંકું પાણી છાંટો. જરૂર ન હોય ત્યારે આંખો ખુલ્લી રાખો નહિ. જોવાના કામ પૂરતી જ તે ખુલ્લી રાખો, અન્ય સમયમાં તે બંધ રાખો. ખાતાં, પીતાં, ભોજન બાદ આરામ કરતાં, બસમાં કે ટ્રેનમાં બેઠાં, બેઠાં, વાતો કરતાં, આંખો સહજભાવથી બંધ રાખવા કોશિશ કરો. કેમકે બંધ આંખો શક્તિપ્રદાતા છે.
- (૩૩) બહુ કામ, મહેનત અને મજૂરી કરવાથી માણસ થાકી

- જાય છે, લોથપોથ થઈ જાય છે, પરંતુ મરતો નથી. તે મરે છે ચિંતા, ભય અને ઉદ્દેગથી.
- (૩૪) નિવૃત્ત થયા પણી એક એવો શોખ કેળવવો કે જે તમને સદા પ્રવૃત્તિમય રાખે.
- (૩૫) દરરોજ એકાંતમાં ધ્યાન, ધારણા, સમાધિમાં બેસો. એક કલાક સેવા-પૂજા કરો. આંખો બંધ રાખી તમારા ઈષ્ટદેવનું ધ્યાન કરો.
- (૩૬) ફિકરની ફાડી કરી શાંત અને પ્રહૃતિ ચિત્તે ભોજન કરો. આનંદપ્રમોદ કરતાં બાળકો સાથે ગમ્મત મસ્તી કરતાં કરતાં ભોજન કરો. કલેશમય વાતાવરણમાં ભારેખમ થઈ ભોજન કરવાથી પાચનશક્તિને હાનિ પહોંચે છે.
- (૩૭) અતિ સર્વત્ર વર્જયેત! કોઈનો અતિરેક કરવો નહિ. વધુ પડતો આહાર, ભય, નિદ્રા અને મૈથુન, વધુ પડતી વાતચીત, વધુ પડતા ઉપવાસ, વધુ પડતી કસરત વગેરે કરવાં નહિ તેમજ વધુ પડતો કાર્યભાર ઉઠાવવો નહિ. શરીરની શક્તિ અને અનુકૂળતા મુજબ શ્રમ કરો.
- (૩૮) શોક, ભારે ચિંતા, ઉદ્દેગ, ભય અને કોધ મનુષ્યના મહાન જીવલેણ શત્રુઓ છે. આયુષ્યને ટૂંકાવવામાં આ બધી બાબતો યમનું કામ કરે છે. કોધથી મૃત્યુ થયાના અનેક દાખલાઓ જોવા મળે છે.
- (૩૯) મન મૂકીને હસવું એ જીવનનું સૌભાગ્ય છે. એટલું હસો કે શરીરના અણુએ અણુ કંપી ઉઠે. જોરદાર હાસ્યથી રક્તભિસરણમાં પૂર આવે છે અને મોં લાલઘૂમ થઈ જાય છે. રોગ દૂર કરવામાં અને શરીરનું બંધારણ ઘડવામાં હાસ્ય સમાન બીજી કોઈ દવા નથી. તે કુદરતની મૂલ્ય વિનાની સાદી અને સરળ દવા છે.
- (૪૦) દરેક બાબતમાં અસંતોષ પ્રગટ કરવાથી કોઈ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. તમારાં દુઃખો, તમારી મુશ્કેલીઓ સવારના પ્રાર્થના સમયે માત્ર ભગવાન પાસે રજૂ કરો. અન્યને કદ્યા કરવાથી માત્ર નિરાશા અને હતાશા જ મળશે. સંસારને સુંદર જોવાનો દાખિલો કેળવો.
- (૪૧) સ્વર્ગ અને નરક આ સંસારમાં જ છે. સ્વર્ગનું અલગ અસ્તિત્વ ક્યાંય નથી. પ્રસન્ન ચિત્ત એ જ સ્વર્ગ છે. શોક, ભય, ઉદ્દેગ અને કોધથી ધેરાયેલા લોકો આ દુનિયામાં નરક ભોગવે છે.
- (૪૨) ખરું આરોગ્ય મેળવવા સારુ આપણે સ્વાદેન્દ્રિય જીબને જીતવી જ જોઈએ. જો તેમ કરીએ તો બીજી વિષયેન્દ્રિયો પોતાની મેળે વશ રહે છે. જેણે ઈન્દ્રિયોને વશ રાખી છે તે જગતને વશ કરે છે.
- (૪૩) વૃદ્ધાવસ્થામાં નીચેના નિયમોનું પાલન કરો : (ક) બ્રાહ્મમુહૂર્તમાં ઉઠવાનું રાખો. (ખ) સવારે નાસ્તો કરશો નહિ. બપોરના ભોજનમાં મિતાહારી બનજો. રાતના ભોજનમાં પ્રવાહી અને હલકો આહાર પસંદ કરવો. (ગ)

દરરોજ બે વખત જજરૂ જવાની ટેવ પાડો. (ઘ) કબજિયાત ઉપર વિજય મેળવવા હરે ફાકો. (ડ) મરચાં, મીઠા, મસાલા વિનાનો સાદો, સુપાચ, સમતોલ અને પથ્ય આહાર પસંદ કરજો. (ચ) અઠવાડિયામાં બે ત્રણ દિવસ હલકા હાથે તેલ-માલિશ કરવાનું રાખો. (ઇ) વૃદ્ધાવસ્થામાં સંતોષી, સંયમી અને સ્થિતપ્રશ્ન બની પ્રવૃત્તિમય જીવન ગાળો. (જ) પરોપકારના સેવાના કાર્યમાં રચ્યાપચ્યા રહો. સદા કાર્યરત રહો. (ઝ) માફક આવે તેવી કસરત કરતા રહો. શક્તિ પ્રમાણે ફરવાનું રાખો. ઉંમર વધવાની સાથે ઓછા ખોરાકનું સંયમિત ભોજન નક્કી કરો તો દીર્ઘ આરોગ્ય ભોગવશો. યાદ રાખો કે વ્યાપિરહિત વૃદ્ધત્વ એ મનુષ્યમાત્રનો જન્મસિદ્ધ હક્ક છે.

- (૪૪) તાવ અને શરદી જેવા સામાન્ય રોગોનો શાંતિથી સામનો કરો. ગલ્બરાટ ફેલાવવો નહિ, બેબાકળા થશો નહિ, દાક્તર પાસે દોડી જશો નહિ, શાંતિથી આત્મખોજ કરી રોગનું કારણ શોધી કાઢો. પ્રથમ ભારે આહાર બંધ કરો. ઉપવાસ કરો અથવા માત્ર ગરમ પાણી અને પ્રવાહી ખોરાક ઉપર રહો. પેટના આમને સાફ થવા દો. દાક્તર તમને દવાને જપાટે ચડાવી દઈ, કંઈનું કંઈ વેતરી નાખી તમને દુઃખના ડુંગરમાં ધૂકેલી ન હે તેનું ધ્યાન રાખો.
- (૪૫) જો દવાઓ રોગ મટાડતી હોય તો નિષ્ણાત ડેક્ટરો કીમતી દવાઓ આપતા હોવા છીતાં દરદી શા માટે મરી જાય છે? કોઈ દવા રોગ મટાડી શકતી નથી. દવા તરફ આંધળી દોટે તો દાટ વાળ્યો છે. દવાથી રોગ મટે કે ન મટે પરંતુ તે નવા રોગનાં મૂળ નાખતી જાય છે. દવાનો ત્યાગ કરો.
- (૪૬) આરોગ્ય અંગેના પુસ્તકો ધરમાં વસાવો. તેમને વારંવાર વાંચો. કુદરતના કાનૂનોનો અભ્યાસ કરી તેઓ અમલ કરો. આરોગ્યના નિયમોનું પાલન કરો.
- (૪૭) જરૂર પડ્યે આયુર્વેદિક અને નેચરોપેથિક સારવાર લો. એલોપેથિક ઉપયાર શક્ય તેટલા ટાળો.
- (૪૮) હંમેશાં હકારાત્મક વિચારો કરો. કદી નકારાત્મક વિચારો મનમાં લાવશો નહિ.
- (૪૯) પોતાના સમાજ અને રાષ્ટ્ર માટે કોઈ વિધેયાત્મક પ્રવૃત્તિ નિયમિત રીતે કરો. તેનાથી આત્મસંતોષ મળશે. પ્રવૃત્તિમય રહી શકશો અને શરીર સારું રહેશે.
- (૫૦) ઉપરના નિયમોનું પાલન કરવાનો સંકલ્પ કરો. અને નિયમિત રીતે તેનો અમલ કરો.
- ઉપરના પાયાના ૫૦ નિયમોનું જે કોઈ પાલન કરે છે તે સદા નિરોગી રહે છે અને ૧૦૦ વર્ષથી પણ વધુ જીવે છે. શું આપ નિરોગી રહેવા માંગો છો તો તેનો અમલ આજથી જ શરૂ કરો. આપ અવશ્ય સ્વસ્થ રહી શકશો અને આપના પરિવારને પણ શાંતિ અને સુખ આપી શકશો.

(સૌજન્ય : 'પંગુમિત્ર')

## આહારવિજ્ઞાન

● ડૉ. રમેશ આઈ. કાપડિયા ●

### ● કાર્બોહાઇડ્રેટ :

કાર્બોહાઇડ્રેટના પ્રકાર બે છે : જટિલ (કોમ્પ્લેક્સ) કાર્બોહાઇડ્રેટ અને સાદો (સિમ્પલ) કાર્બોહાઇડ્રેટ. જટિલ કાર્બોહાઇડ્રેટમાં કેલરી ઓછી અને રેખા વધુ હોય છે. જટિલ કાર્બોહાઇડ્રેટવાળો ખોરાક ખાવાથી પેટ ભરાયાનો સંતોષ જલદી થાય છે. તે ધીમે ધીમે લોહીમાં ભણે છે. તેથી લોહીમાં શર્કરાનું પ્રમાણ એકસરખું જગ્ઘવાઈ રહે છે. તે અનાજ, કઠોળ, તાજાં શક્કાજી અને ફળોમાં હોય છે.

કાર્બોહાઇડ્રેટવાળા દરેક પદાર્થમાં જટિલ કાર્બોહાઇડ્રેટ અને સાદો કાર્બોહાઇડ્રેટ બંને હોય છે. પણ તેમનું પ્રમાણ વધતું ઓછું હોય છે. અનાજ, કઠોળ, શક્કાજી અને ફળોમાં રહેલ કાર્બોહાઇડ્રેટ ફક્ત જટિલ સ્વરૂપે જ નથી. તેમાં સાદો કાર્બોહાઇડ્રેટ પણ થોડા પ્રમાણમાં હોય છે. કંદમૂળ જેવાં કે બટાટા, શક્કરિયાં, ગાજર, રતાળુમાં સાદા કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ વધુ હોય છે. પાંડાંવાળાં શક્કાજીમાં જટિલ કાર્બોહાઇડ્રેટ વિશેષ અને સાદો કાર્બોહાઇડ્રેટ જૂજ માત્રામાં હોય છે.

ખાંડ, ગોળ, મધ, ગ્લુકોઝ અને મદિરા સાદા કાર્બોહાઇડ્રેટ છે. તે લોહીમાં જલદીથી ભળી જતાં લોહીમાં શર્કરાનું પ્રમાણ જડપથી વધે છે. પરિણામે ઈન્સ્યુલિનનો ખાવ વધે છે. જેનાથી લોહીમાં રહેલ શર્કરાની માત્રા ક્યારેક વધુ પડતી ઘટી જાય છે. લોહીમાં શર્કરાનું પ્રમાણ વધુ પડતું ઘટે ત્યારે ગંભીર સ્વરૂપે તનાવ, ડિપ્રેશન, લાગાણીની અસ્થિરતા, ચિંતા, ઉશ્કેરાટ અને ગળ્યું ખાવાની તીવ્ર ઈચ્છા થાય છે. સાદો કાર્બોહાઇડ્રેટ વધુ પ્રમાણમાં ખાવ છતાં સંતોષની લાગાણી અનુભવાતી નથી. ઈન્સ્યુલિનના વધુ પડતા ખાવથી ચરબી વધુ જમા થાય છે, લોહીમાં કોલેસ્ટરોલ વધે છે. લોહીમાં થતી શર્કરાની વધુ પડતી વધધટ શરીર ખમી શકતું નથી. પરિણામે થાક, માનસિક અસ્વસ્થતા અને એકાગ્રતાનો અભાવ વર્તાય છે.

મદિરા સાદો કાર્બોહાઇડ્રેટ હોવા ઉપરાંત ચરબીનું દહન કરવાની શક્તિને મંદ કરે છે. માત્ર ગ્રામ ઔસ દારુ શરીરની ચરબીનું દહન કરવાની શક્તિમાં ઉત્ત ટકા ઘટાડો કરે છે.

### ● પ્રોટીન :

પ્રોટીનના બે પ્રકાર છે : વનસ્પતિજ અને પ્રાણિજ. વનસ્પતિજ પ્રોટીન ખાસ કરીને અનાજ, દાળ અને કઠોળમાં હોય છે. પ્રાણિજ પ્રોટીન દૂધ, ઈડાં, માઇલી, ચિકન અને મટનમાંથી મળે છે. શક્કાજીરમાં મળી આવતાં પ્રોટીન પૂર્ણ પ્રોટીન નથી. તેમાં એક બે અગત્યના એમિનો એસિડ ખૂટતાં

હોય છે. શક્કાજીરમાં અનાજ અને દાળના સંયોજનથી પૂર્ણ પ્રોટીન મેળવી શકાય.

બાળકોના વિકાસ માટે પ્રોટીન જરૂરી છે. પુખ વધનાઓને કેટલીક જરૂરી શારીરિક કિયાઓ અને રોજિંદા ઘસારા માટે જ તે જરૂરી છે. અલગ-અલગ વનસ્પતિજ પ્રોટીનો ભેગાં કરીને ખૂટતાં એમિનો એસિડ મેળવી શકાય છે. દા.ત. એક ભાગ દાળ અને ગ્રામ ભાગ અનાજ. દાળ અને રોટલી સાથે ખાવાથી આ ખોટ પૂરી શકાય છે. તેવી જ રીતે ચરબી વગરનું થોડું દૂધ અથવા દહી ઉમેરવાથી પણ ખોટ પૂરી શકાય.

કઠોળમાં પ્રોટીન અને બીજાં પૌષ્ટિક ઘટકો સારી માત્રામાં હોય છે. તેમાં રેખા વધુ અને ચરબી ઓછી છે. તે પ્રાણિજ પ્રોટીનની સરખામણીએ ઘણું સસ્તું છે. તાજેતરના સંશોધનમાં જણાયું છે કે તે કોલેસ્ટરોલ પણ ઘટાડે છે.

અનાજ, કઠોળ, શક્કાજી અને ફળોના બનેલા સમતોલ આહારમાં શરીરને જરૂરી એવા બધા જ ઘટકો છે. કુલ કેલરીના માત્ર ૧૦ થી ૧૫ % વનસ્પતિજ પ્રોટીનથી પુખ વધના શરીરની પ્રોટીનની જરૂરિયાત પૂરી પાડે છે. દૂધની બનાવટોની જેમ પ્રાણિજ પ્રોટીન પણ ધમનીઓમાં ચરબી જામવાની પ્રક્રિયા (એથરોસ્ક્લેરોસિસ) ની વૃદ્ધિ કરે છે.

### ● ચરબી :

આપણા આહારમાં ચરબીનું પ્રમાણ કુલ કેલરીના ૩૦ થી ૪૦ ટકા હોય છે. ચરબીથી આહાર સ્વાદિષ્ટ બને છે. સામાન્ય માન્યતા એવી છે કે ચરબીથી ગ્રેજ અને બળ મળે છે. કેટલીક અગત્યની શારીરિક કિયાઓ માટે ખોરાકમાં થોડી ચરબીની જરૂર પડે છે. વધારાની ચરબીનો શરીર સંગ્રહ કરે છે જે ખોરાક લેવામાં ન આવે ત્યારે ખપ લાગે. વધારાની ચરબી આખા શરીરમાં જમા થાય છે પણ પેદ પર તે વધુ જામી જાય છે. શરીરમાં વધુ પડતી ચરબી જામવાથી સુસ્તી અનુભવાય છે અને બેઠાડું બની જવાય છે. તેનાથી વળી પાણું વજન વધે છે, જેનાથી અનેક મુશ્કેલીઓ સર્જય છે.

આહારની કુલ કેલરીમાં ૨૫-૩૦% જેટલી ચરબીનું પ્રમાણ ચરબી જામવા (એથરોસ્ક્લેરોસિસ) ની પ્રક્રિયાને ઘટાડવા માટે અસમર્થ છે. જ્યારે ૧૦% થી ઓછી ચરબીવાળા આહારથી તે શક્ય છે. એથરોસ્ક્લેરોસિસને હળવો કરવા અને કમશા: મટાડવા અંગેના બધા જ અભ્યાસો આહારમાં ઘણી ઓછી ચરબી લેવાની ડિમાયત કરે છે. હદ્યરોગ મટાડવા અને થતો રોકવા વધુમાં વધુ કેટલી ચરબી લઈ શકાય તે હજુ સંશોધનનો વિષય છે.

ઓછી ચરબીવાળો આહાર લઈને એથરોસ્ક્લોરોસિસ મટાડવા પોતે શક્તિમાન છે તેવો આત્મવિશ્વાસ દર્દીમાં જાગે તો તે આવો આહાર સહેલાઈથી અપનાવી શકે. આ માટે દર્દને ગ્રોત્સાહિત કરવાનું કામ નિષ્ઠાવાન ડોક્ટરોનું છે.

રાંધવામાં શાકભાજીની અંતર્ગત નૈસર્જિક સ્નિગ્ધતાનો કુશળતાપૂર્વક ઉપયોગ કરી વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ બનાવીએ તો જેઓ વધુ ચરબીવાળો ખોરાક લેવા ટેવાયેલા છે તેઓને પણ આવો સ્વાદિષ્ટ ઓછી ચરબીવાળો આહાર લેવાનું ગમે.

### ● રેસાયુક્ત આહાર :

રેસાયુક્ત આહારના ઘણા લાભો છે. તેમાં વિટામિનો અને ક્ષારો પણ સારા પ્રમાણમાં હોય છે. તે અનાજ અને કઠોળના ઉપરના પડમાંથી, શાકભાજી અને ફળોમાંથી મળે છે. રેસાવાળા આહારથી નીચેના ફાયદા થાય છે :

- ★ આહારનો જથ્થો વધે છે. ઓછા ખોરાકે પેટ ભરાઈને જમ્યાનો સંતોષ થાય છે તેથી વધુ પડતું ખવાઈ જતું નથી. આમ વજન નિયંત્રણમાં મદદ થાય છે.
- ★ તેનાથી કેલરી ઓછી લેવાય છે. તે લોહીમાં કોલેસ્ટરોલ તથા ટ્રાયગ્લિસરાઇડ્ઝ ઘટાડે છે.
- ★ તે કાર્બોહાઇડ્રેટની લોહીમાં ભળવાની પ્રક્રિયાને મંદ કરે છે, તેથી લોહીમાં શર્કરાનું પ્રમાણ સ્થિર રહે છે.
- ★ કબજિયાત મટાડે છે. ભગંદર હરસ તેમજ આંતરડાનું કેન્સર થતાં અટકાવે છે.

### ● મીહું (સોડિયમ કલોરાઇડ) :

મીહાથી શરીરમાં પાણીનો સંગ્રહ થાય છે. મીહું વધારે લેવામાં આવે ત્યારે મીહાની સાંક્રતા (Saturation) ઓછી કરવા શરીર વધુ પાણી સંઘરે છે. પરિણામે વધુ પડતું મીહું લેવાથી વજન ઘટાડવું મુશ્કેલ બને છે. એવું પણ જણાયું છે કે વધારે પડતા મીહાથી ધમનીઓની દીવાલ કઠણ બને છે.

હાઈ બ્લડપ્રેશર અને હૃદયરોગના દર્દીઓને મીહું ઘટાડવાથી ફાયદો થાય છે તે સર્વવિદિત હકીકત છે. ઉભામાં પેક કરેલા ખાદ્ય પદાર્થો, જુદી જુદી જાતના કેચઅપ, સોસ, સલાદને સ્વાદિષ્ટ બનાવનારા ટ્રેસિંગ, અથાણાં, પાપડ તેમ જ બ્રેડ અને બિસ્કિટની બિનબિન જાતોમાં મીહાનું પ્રમાણ ખાસું હોય છે. પાંડાંવાળાં શાકભાજીમાં કુદરતી મીહાનું પ્રમાણ વધુ હોવાથી તેને રાંધવામાં મીહું ઓછું હોય તો ચાલે.

પુષ્પ વયનાઓ રોજનું ૧૭૦૦ થી ૩૩૦૦ મિલિગ્રામ સોડિયમ (મીહું) લઈ શકે. તેથી વધુ સલાહ ભરેલું નથી. અમેરિકન હાર્ટ એસોસિયેશન આહારની દર ૧૦૦૦ કેલરીએ ૧૦૦૦ મિ.ગ્રા. પણ ૩૦૦૦ મિ.ગ્રા. થી વધુ મીહું ન લેવાની ભલામણ કરે છે. ઉષ્ણ પ્રદેશમાં રહેનારને પણ દરરોજ ૧૦૦૦

થી ૧૫૦૦ મિ.ગ્રા. મીહું સામાન્ય રીતે પૂરતું થઈ રહે છે. એક ચમચી મીહામાં ૨૦૦૦ મિ.ગ્રા. મીહું આવે છે.

કેટલાક મસાલા જેવા કે લીલાં મરચાં, કોથમીર, આદું, લીબુનો આહારમાં પ્રમાણસર ઉપયોગ કરી મીહાનો વપરાશ ઘટાડી શકાય. રસોઈમાં મીહું ઓછું વાપરવાથી આહારનો કુદરતી સ્વાદ અને સોડમ વધુ સારી રીતે માણી શકાય. અન્ય સ્વાદની જેમ મીહાનો સ્વાદ પણ કેળવેલો સ્વાદ છે.

### ● ફી રેડિકલ્સ :

શરીરમાં ચયાપચયની કિયા દરમિયાન ફી રેડિકલ્સ ઉત્પન્ન થાય છે. તે ઉત્પન્ન થવાનું પ્રમાણ આહારનો પ્રકાર, સૂર્યપ્રકાશ, એક્સ રે, સિગારેટનો ધુમાડો અને વાહનોના ધુમાડાથી પ્રદૂષિત વાતાવરણ પર આધારિત છે. જ્યારે લોહીમાં ફી રેડિકલ્સનું પ્રમાણ વધી જાય છે ત્યારે તે શરીરના કોષોને હાનિ પહોંચાડે છે. વૃદ્ધાવસ્થા જડપથી આવે છે, તેમજ હૃદયરોગ, કેન્સર, ફેફસાંના દર્દ, મોતિયાની શક્યતા વધે છે. તે રોગપ્રતિકાર શક્તિને પણ નભળી પાડે છે.

આહારની ચરબી ઓક્સિજનપૂર્વક (ઓક્સિસંટ) ગણાય છે. પ્રાણીજ ચરબી અને રેડ મીટમાં ઓક્સિજનપૂર્વક તત્ત્વાનું પ્રમાણ વિપુલ હોય છે. તે વધુ પડતાં ફી રેડિકલ્સ ઉત્પન્ન કરે છે. કાર્બોહાઇડ્રાટ્યુક્ત ઓછી ચરબીવાળા શાકાહારમાં ઓન્ટિઓક્સિસંટ વધુ પ્રમાણમાં હોય છે જે ફી રેડિકલ્સને દૂર કરવામાં મદદ કરે છે.

બીટા કેરોટીન જેમાંથી વિટામિન ‘એ’ બને છે. વિટામિન ‘સી’ અને ‘ઈ’ ઓન્ટિઓક્સિસંટ છે. તેનાથી ફી રેડિકલ્સ ઉત્પન્ન થવાનું પ્રમાણ ઘટે છે. આથી ચરબી જામવાની (એથરોસ્ક્લોરોસિસની) પ્રક્રિયા મંદ પડે છે.

### ● રાંધ્યા વિનાનો કુદરતી આહાર :

રાંધ્યા વગરનો કુદરતી આહાર ‘જીવંત આહાર’ તરીકે જાણીતો છે. જીવંત આહારને ‘મેકોબાયોટિક’ આહાર પણ કહે છે. તેમાં પૌષ્ટિક ઘટકો અને વિટામિનો પુષ્કળ પ્રમાણમાં હોય છે. લાંબી બીમારીથી પીડાતી વ્યક્તિને ક્યારેક આવો આહાર ખૂબ ઉપયોગી બને છે. જોકે સામાન્ય રીતે રાંધ્યા ખોરાકમાંથી શરીર જરૂરી પૌષ્ટિક ઘટકો સારી રીતે મેળવી લે છે. રોગ અટકાવવા અને તંદુરસ્તી જાળવવા રાંધ્યા વિનાના આહારની ભલામણમાં કેટલીક મર્યાદા છે. તે અનુકૂળ પડવો જોઈએ. આવો આહાર વર્ષ દરમિયાન સતત ભળી રહેવો જોઈએ. ખાસ કરીને ઉષ્ણ અને ભેજવાળી આબોહવામાં તેની આરોગ્યપ્રદાતા જાળવવી અધરી બને છે. નાના અને સંપત્તિ કુટુંબમાં આ શક્ય બની શકે. આમ છતાં આવો આહાર લેવાનું ચાલુ રાખવા માટે ખૂબ જ ઉમ્ભેગ અને ઉત્સાહની જરૂર પડે છે. વળી ઘરની બહાર જમતી વખતે રાંધ્યા વિનાના કુદરતી આહાર લેવામાં જાડા, કમળો,

ટાઈફોઇડ થવાનું જોખમ પણ રહેલું છે. આપણા રોજિંદા આહાર સાથે પ્રમાણસર સલાદ લેવાથી કુદરતી આહારનો લાભ લઈ શકાય.

### ● આદર્શ આહાર :

અમે સંપૂર્ણ શાકાહારની ભલામણ કરીએ છીએ. ચરબી વગરનું દૂધ પણ પ્રાણિજ પ્રોટીન ગણાય. એટલે તેનો વધુ પડતો વપરાશ પણ ટાળવો જરૂરી છે. આહાર જટિલ કાર્બોહાઇડ્રેટ, વનસ્પતિજ્ઞન્ય પ્રોટીન (અનાજ, કઠોળ) લીલાં શાકભાજી અને ફળોનો હોવો જોઈએ. સાદા (તૈયાર વિશુદ્ધ) કાર્બોહાઇડ્રેટ જેવાં કે ખાંડ, ગોળ, મધ્ય, શેરડીનો રસ, પોલિશ કરેલા ચોખા, ચોખાની બનાવટો (મમરા, પૌંઝા), ગલુકોજ વગરે ઓછા પ્રમાણમાં લેવાં જોઈએ. તે લોહીમાં ઝડપથી ભળવાથી ઇન્સ્યુલિનનો સ્વાવ વધે છે. ઇન્સ્યુલિનના સ્વાવના ઘણા ગેરફાયદા છે. તેનાથી કોલેસ્ટરોલનું ઉત્પાદન વધે છે, ચરબી જમા થાય છે. ધમનીઓની દીવાલના કોષો વૃદ્ધિ પામે છે. ઉપરાંત ભાવાત્મક તાણ વખતે બને છે તેમ સિમેયેટિક નર્વ્સ સિસ્ટમ ઉત્સેઝિત થાય છે, જેના પરિણામે ધમનીઓ સંકોચાય છે, પ્લેટલેટ્સ વધુ ચીકડા બને છે અને ધમનીઓ સાંકી થવાનું અને લોહી ગંધાઈ જવાનું વિશેષ બને છે.

જટિલ કાર્બોહાઇડ્રેટમાં રેસા વધુ હોય છે. તે લોહીમાં ધીમેથી ભણે છે. તેથી થોડું ખાવા છતાં પેટ ભર્યાનો સંતોષ અનુભવાય છે. લોહીમાં શર્કરાની વધ્યઘટ ઓછી થાય છે અને ઇન્સ્યુલિનનો સ્વાવ પણ સામાન્ય રહે છે.

શરીરમાં જરૂરી ફંટી એસિડનું સંયોજન કરવા આહારમાં માત્ર ૪થી ૬% ચરબીની જરૂર પડે છે. હદ્યરોગ મટાડવા માટેના આહારમાં માત્ર ૧૦% ચરબી પર્યાપ્ત છે. ૩૦% થી વધુ ચરબીયુક્ત આહારથી વજન વધે છે અને હદ્યરોગ તેમ જ અન્ય બીમારીઓ થાય છે. જો આહારમાં ચરબીનું પ્રમાણ ઘટાડીને ૧૦% થી ઓછું રાખવામાં આવે તો આહારની કેલરીઓ ગણવાની જરૂર નથી. તેમ છતાં જો સાદા કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ આહારમાં ઘણું વધારવામાં આવે તો લોહીમાં ચરબી અને ટ્રાયગ્લિસરાઇડ્સ વધી જાય છે અને તે એથરોસ્ક્લેરોસિસને ઘટાડવામાં સહાયક બનતાં નથી. માટે ભૂખ સંતોષાય એટલું જ ખાવું, ઠાંસીને કદી ન ખાવું.

### ● વારંવાર થોડું થોડું ખાવું :

સ્વાસ્થ્ય જાળવવા, ખાસ કરીને હદ્યરોગીઓ માટે કટકે-

કટકે થોડો થોડો આહાર લેવો હિતકારી છે. એકસાથે વધુ ખાવાથી લોહીમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ વધે છે. તેનાથી લોહીમાં શર્કરાના પ્રમાણમાં તીવ્ર વધ્યઘટ થાય છે. જ્યારે આહારને વધુ ટંકમાં વહેંચી નાખવાથી લોહીમાં શર્કરાનું પ્રમાણ વધ્યઘટ થયા વગર વધુ સ્થિર રહે છે.

ટોરોન્ટોની યુનિવર્સિટીના ૧૯૮૮માં પ્રગટ થયેલા અત્યાસમાં જ્ઞાનવા મળ્યું કે જેઓ દિવસમાં ગ્રાશ વખત જમતા હતા તેમના કરતાં જેઓ કટકે કટકે ખાતા હતા તેમના લોહીમાં કોલેસ્ટરોલનું પ્રમાણ ઓછું હતું.

જોકે માત્ર કટકે કટકે ખાવું પૂરતું નથી. શું ખાઓ છો તે પણ ઘણું અગત્યનું છે. તમારા આહારમાં વધુ પડતી ચરબી કે ખાંડ હશે તો લાભ થશે નહીં.

### ● ધ્યાનથી જમો :

આપણા પ્રવૃત્તિમય જીવનમાં એકસાથે ઘણાં કામ પતાવવાનાં હોય છે. શાંતિથી જમીએ તેવું ભાગ્યે જ બને છે. સવારનો નાસ્તો આપણે છાપું વાંચતાં ઝટપટ ગળે ઉતારી જઈએ છીએ, બપોરનું જમવાનું ટેલિફોન વચ્ચે પતાવીએ છીએ, ચાત્રિનું ભોજન ટીવી જોતાં કે વાતચીતમાં ગુંથાઈને કરીએ છીએ. પરિણામે કેટલું ખાંડું અને તેનો કેવો સ્વાદ હતો તેનો જ્યાલ રહેતો નથી. જમતી વખતે બીજું કાંઈ પણ કરીએ એટલે આપણું જ્યાન ખાવા ઉપર કેન્દ્રિત થતું નથી. પરિણામે આપણાને જમવાનો ખરો આનંદ મળતો નથી, વધારે પડતું ખવાઈ જાય છે અને ખોરાકનું સારી રીતે પાચન પણ થતું નથી. આપણે જ્યારે જ્યાનપૂર્વક જમીએ છીએ ત્યારે જમવાનો પૂરો આનંદ મળે છે અને કેટલું ખાંડું તેનો જ્યાલ રહે છે. વધારે પડતું ખવાઈ જતું નથી અને વજન કાબૂમાં રહે છે. જમતી વખતે જ્યાનથી જમવાથી જ્યાલ રહે છે કે વધુ ચરબીયાળા અને જટિલ કાર્બોહાઇડ્રેટવાળા આહારથી થોડું ખાવા છતાં સંતોષ થાય છે, શરીર હળવું લાગે છે અને સ્ફૂર્તિ અનુભવાય છે. આમ આપણે ખાવાની સાચી પસંદગી કરી શકીએ છીએ.

બધા ધર્મો અને સંસ્કૃતિમાં જમતાં પહેલાં પ્રાર્થના કરવાની પ્રથા છે. પ્રાર્થનાથી ચિત્ત શાંત થાય છે. જમવામાં જ્યાન પરોવાય છે. તે જમજાનો આનંદ વધારે છે એટલું જ નહીં પણ વજનને કાબૂમાં રાખવામાં સહાયભૂત થાય છે. જ્યારે આપણે એકચિને જમતા નથી ત્યારે આપણે માત્ર પેટ જ ભરતા નથી પણ અંદરનું ખાલીપણું પણ ભરીએ છીએ જે મેદવૃદ્ધિમાં પરિણામે છે.

**WE CARE.... સમસ્યાથી સફળતા સુધી**

**ભાગ્યદીપ**

- Kundali Making
- Match Making
- Navgrah Stones
- Natural Rudraksh

કુંડલી પરંચી જિંડગીના વિવિધ પ્રજ્ઞોત્તું  
સારી રીતે સમજણપૂર્વક છણાવત માટે  
કોણથી સંપર્ક સાધો....

**Manilal Morarji Maroo**

Mob. : 8080209775, 9323998861

**MAROO ASTRO & VASTU POINT**

23/A, Mishra House, 90 Ft. Road, Navghar Road, Mulund (E), Mumbai-400 081.

E-mail : marooastro@gmail.com Ph. : (Resi.) (022) 67997717

સ્વૂળતા ઘટાડવા માટે પરંપરાગત અભિગમ કરતાં નવા અભિગમથી વધુ સફળતા મળે છે તેની તુલના :

## ડાયટિંગ

### પરંપરાગત અભિગમ

૧. ઓછી કેલરી લેતાં આહારનું ગ્રમાણ પણ ઘટે છે.
૨. ભૂખ અને અસંતોષની લાગણી.
૩. અશક્તિ અને થાક વરતાય.
૪. આહારનું ગ્રમાણ ઓછું થવાથી શરીર યથાવતું સ્થિતિ રાખવા કેલરીના બળતણનો દર (B.M.R.) ઘટાડે છે. પરિણામે વજન ઘટવાનું મુશ્કેલ બને છે.
૫. ધાર્યા ગ્રમાણે વજન ન ઘટતાં ડાયેટિંગને વળગી રહેવાનો ઉત્સાહ રહેતો નથી અને ડાયેટિંગ છૂટી જાય છે.
૬. ડાયેટિંગ છૂટી જતાં, વજન ઝડપથી વધે છે કારણ કે આ ડાયેટિંગ દરમિયાન ચરબીના કોષો સંઘામાં ઓછા થયા હોતા નથી કેવળ કદમાં નાના બને છે.
૭. વારંવાર ડાયેટિંગ કરવાથી અને છોડી દેવાથી (યો-યો ડાયેટિંગ) વજનની વધઘટ થતાં હૃદયરોગની શક્યતા વધે છે. (ડૉ. બ્રાઉન નીલ)

### આહાર અને તંદુરસ્તી :

આહાર અને તંદુરસ્તી સંદર્ભે કેટલાક ઉપયોગી મુદ્દાઓ અહીં આપ્યા છે.

- ★ રોજ અડ્ધી કાચી કુંગળી ખાવાથી HDL કોલેસ્ટરોલ ૨૫% સુધી વધી શકે છે.
- ★ બે ચમચી વાટેલ લસણ LDL કોલેસ્ટરોલમાં ઘટાડો કરી શકે છે.
- ★ એક કપ કઠોળ (beans-legumes) કોલેસ્ટરોલ ૧૦% ઘટાડી શકે છે. તે લોહીમાં રહેલ હોમોસિસ્ટીન નામના એમાઈનો એસિડ ઘટાડવામાં મદદ કરે છે. હોમોસિસ્ટીન હાર્ટએટેક થવાના વલણમાં વધારો કરે છે.
- ★ ઓટ એકથી દોઢ કપ રાંધીને ખાવાથી LDL કોલેસ્ટરોલનું ગ્રમાણ ઘટે છે.
- ★ અખરોટમાં લિનોલિક એસિડ હોવાથી LDL કોલેસ્ટરોલ ૧૬% અને ટોટલ કોલેસ્ટરોલ ૧૨% ઘટાડી શકે છે.
- ★ બદામ રોજની પાંચ લેવાથી LDL કોલેસ્ટરોલ ઘટી શકે છે.

### નવો અભિગમ

૧. ફક્ત ચરબીમાંથી મળતી કેલરીનું જ ગ્રમાણ ઘટે છે, પરંતુ આહારનું ગ્રમાણ પૂરતું રહે છે.
૨. પૂરતું ખાધાનો સંતોષ : કારણ કે જટિલ કાર્બોહાઇટ અને પ્રોટીનવાળી ખાદ્ય વસ્તુ ભૂખ ગ્રમાણે ખાઈ શકાય.
૩. પૂરતા ગ્રમાણમાં આહાર લેવાથી સ્વૂર્તિ રહે.
૪. કાર્બોહાઇટમાંથી પૂરતી કેલરી મળવાથી કેલરીના બળતણનો દર વધે અને તે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. ઓછી ચરબીવાળો અને વધુ કાર્બોહાઇટવાળો ખોરાક થાઈરોઇડના ખાવની વૃદ્ધિ કરે છે, જે કેલરીના બળતણનો દર વધારે છે. સહેલાઈથી વજન ઘટતાં ઉત્સાહ જળવાઈ રહે છે.
૫. ડાયેટિંગ જવલ્યે જ છૂટે છે.
૬. કમશા: વજન ઘટે છે.
૭. આહારનો નવો અભિગમ ઉત્સાહપૂર્વક ચાલુ રહે છે. આમાં યો-યો ડાયેટિંગ થતું નથી.

તેમાં લિનોલિક એસિડ અને એન્ટિઓક્સિડન્ટ તત્ત્વો છે.

★ દહી - ચરબીરહિત અથવા ઓછી ચરબીવાળું. તેમાં કેલિશયમ અને પોટેશિયમનું ગ્રમાણ દૂધ કરતાં ૫૦% વધારે છે.

### કેટલાક સૂચનો :

- ★ કુટુંબના દરેક સભ્ય તંદુરસ્ત આહારપ્રણાલી અપનાવે એ અગત્યનું છે.
- ★ ભોજનને સ્વાદિષ્ટ બનાવવાથી આહારની ટેવો બદલવામાં તકલીફ પડતી નથી.
- ★ તળેલા પદાર્થોને બદલે કાચા, બાંદેલા, વરાળથી રાંધેલા, શેકેલા પદાર્થો શક્ય હોય ત્યાં અપનાવવા જોઈએ.
- ★ બજારમાં મળતા કેટલાક તૈયાર ખાદ્યપદાર્થો ચરબીનું હાનિકારક ગ્રમાણ ધરાવતાં હોય છે.
- ★ રાંધવાનાં વાસણો નોનસ્ટિક વાપરવાથી તેલ-ધીના વપરાશમાં ઘટાડો થઈ શકે.
- ★ તમે શું રાંધો છો તેટલું જ અગત્યનું તમે કેવી રીતે રાંધો છો તે પણ છે.

સૌજન્ય : "હૃદયરોગ અને આહાર"



## માતૃત્વ

• હરીશ નાયક •

### આપણે નારાજ, પણ મા તો રાજુ જ.

હું બગડેલો છોકરો હતો.

પિતા હતા નહિ. મને જોઈતી વસ્તુ મળતી નહિ. ગરીબાઈથી ગ્રાસી જઈએ એમાં બધો જ વાંક મને માતાનો દેખાતો. હું ચિંડાઈ જઈને માતાને કહેતો : ‘બીજી બધી માતા તેમનાં બાળકોને બધું લાવી દે છે. તું શા માટે મારે માટે કંઈ લાવી દેતી નથી?’

મા કહેતી : ‘બીજી માતાઓ લાવી દેતી હશે. મને ખબર નથી કે એ માતાઓ ક્યાંથી લાવતી હશે. પણ હું નથી લાવી શકતી એ હકીકત છે, ‘બેટા! પણ હું મા છું. હંમેશાં એવી ઈચ્છા રહે છે કે જે કંઈ મળે તે તને આપું. તારા માટે સંઘરું. તારા માટે રહેવા દઉં.’

માની આવી વાતથી મને સંતોષ થતો નથી. હું મા પર ગુસ્સે થઈ જતો, ત્યારે માએ એકવાર મજાકમાં કહ્યું : ‘બધું માએ જ કરવાનું? શું બેટાઓ મા માટે કંઈ કરતા નથી? જો, દુનિયાભરના બેટાઓ મા માટે શું કરે છે? તેઓ પોતાની માને બધું જ લાવી દે છે - બધું જ.’

હું ધરમાંથી નાસી ગયો.

મા રડી નહિ. જ્યારે સમાચાર મળ્યા ત્યારે તે બોલી ઊઠી : ‘મારો પુત્ર ક્યાંય જશે નહિ. એ તો મારે માટે બધું લાવવા ગયો છે.’

વાત સાચી હતી. હું રાણીગંજની પારંશાળામાં દાખલ થઈ ગયો હતો. ખૂબ ભણ્યો. ત્યાંથી લશ્કરમાં ભરતી થઈ ગયો. મા રડી નહિ.

મેં માને પૂછ્યું : ‘મા! હું લશ્કરમાં જાઉ છું, અને તને કંઈ જ થતું નથી?’

મા કહે : ‘ના, બેટા! તું તો મા માટે આ બધું કરે છે. મા માટે બધું લેવા જાય છે. એમાં વળી રડવાનું શું?’

આંખમાં આંસુ સાથે પણ તે હસતી રહી અને મેં પ્રતિજ્ઞા કરી : ‘સાચું છે મા. હું મા માટે બધું કરીશ, બધું લાવીશ. તું જોઈ રહેજો.’

ત્યારથી હું માનો લાડલો પુત્ર બની રહ્યો.

કેવી હોય છે, માની મમતા! આપણે નારાજ પણ એ તો રાજુની રાજુ જ.

### પુસ્તકો અને પગરખાં વર્ચ્યોનો બેદ

વૈભવ હતો પણ મા મને મધ્યમ વર્જની જેમ જ જીવતાં શીખવતી.

એકવાર મને મન થયું કે હું લાઈટના થાંભલે જઈને વાંચું, મેં માની પરવાનગી માગી.

મા કહે : ‘જરૂર વાંચી આવ, એથી તને ધરમાં વાંચવામાં કેટલી સગવડ મળે છે એનો જ્યાલ આવશે.’

ધરમાં પાછા ફરીને મેં જેયું તો ટેબલ લેમ્પનો પ્રકાશ વધુ ઊજાનો અને નજીક હતો. ટેબલ ઉપર બેસીને વાંચવામાં વધુ અનુકૂળતા હતી.

અમારા ધરમાં એક દાદર હતો. મને દાદરનાં પગથિયાં પર બેસીને વાંચવાની આદત હતી. હું ઉપરનાં પગથિયાં ઉપર ચોપડાં મૂકતો. નીચેનાં પગથિયાં પર પગરખાં.

એક વખત શાળાએથી પાછો ફર્યો તો દાદર સાફ હતો. મા કહે : ‘પગરખાં નીચે અને પુસ્તકો મેં કબાટમાં મૂકી દીધાં છે. દાદર ઉપર ચઢવા માટે છે. જો વચ્ચે અંતરાયો રાખશે તો સરળતાથી તું ઉપર નહિ ચઢી શકે, અને વિદ્યાને ઢોકરે મારીને શું તું ઉપર ચઢી શકશે? એ સંજોગોમાં પુસ્તકો અનુ પગરખાં એક નહિ થઈ જાય શું?’

માના એ બોધ પછી મારો પુસ્તકો પ્રત્યેનો પૂજ્યભાવ જાગ્યો અને હું તેની કાળજી કરવા લાગ્યો.

‘મા મને ‘શ્યામની મા’ નામનું પુસ્તક વાંચી સંભળાવતી હતી. સાને ગુરુજીનું લખેલું એ અદ્ભુત પુસ્તક છે. મા જ્યારે એ પુસ્તક વાંચતી ત્યારે મને લાગતું કે હું જ શ્યામ છું અને પુસ્તકમાંની મા મારી જ મા છે.’ મોતીલાલ નહેરુ અને સર તેજબહાદુર સમુના જમાનાના જાણીતા દેશનેતા અને રાષ્ટ્રભક્ત શ્રી જ્યકર કહે છે!

### બા એટલે બાળકની બારી

ગીતાંજલિની અવિરત ધારા દ્વારા નોબલ પારિતોષિક મેળવનાર પ્રખર સાહિત્યકાર ઠકુર રવીન્દ્રનાથ અથવા ટાગોરના નામથી જ દુનિયા ભારતને ઓળખે છે. ભારતીય ‘ગુરુદેવ’ તથા ઋષિજન જેવા ટાગોરની આ રહી માતૃ-વંદના. ધરમાં બધાં વહાલ કરતાં. પણ મા મને બારીએ લઈને ઊભી રહેતી. એ વાત જ નિરાણી.

(અનુસંધાન : જુઓ પાના નં.-૩૪ ઉપર)

## ‘જે દેશમાં બંદૂકની જોરેલથી ચર્ચા બંધ કરાવવામાં આવે છે, તે દેશનું ભાવિ અંધકારમય છે.’

• લૉડ બીજુ પારેખ અને અનુજ કુમાર •

ભારતનો એક દેશ તરીકે ‘જોરે ચર્ચા’ (પબ્લિક ટિબ્લેટ્સ) નો ગૌરવમય, ભવ્ય વારસો હતો. આધુનિક ભારતમાં કેમ જ્ઞાન આધ્યારિત વિચારભેદ, મતભેદ (વાંદિસ ઓફ ડિસેન્ટ) માટેની જોરચર્ચાની જગ્યા, અવકાશ (સ્પેસ) જ્ઞતા સંકોચાતા જાપ છે?

આશરે એક દાયક પહેલા નોબેલ પ્રાઇઝ વિજેતા અમત્ય સેને ‘ધી આંગ્યુમેન્ટટિવ ઇન્સિયન’ નામના પોતાના જગપસિક પુસ્તકમાં લઘું હતું કે દેશની ધર્મનિરપેક્ષ (સેક્યુલર ડેમોકર્સી) લોકશાહીને બચાવવા માટે જુદા જુદા વિચારો ઉપરનો બોંદ્રિક વિવાદ ખૂબ જ અનિવાર્ય છે. આ મુદ્દે પ્રો. સેને ખૂબ જ મુશ્કેલ અને જટિલ પ્રવાહોને સાવિસ્તાર વૃત્તાંત સાથે અસરકારક રીતે પોતાના પુસ્તકમાં રજૂ કર્યા હતા.

શું આજે આ ભારતીય ખોવાઈ ગયેલો હેખાય છે? હા, કદાચ તે પહેલાં જેવો પોતાના વિચારો વ્યક્ત કરવામાં અસરકારક નહીં હોય! પરંતુ હું આજું છું કે હજુ તે આ મુદ્દે સક્રિય છે અને ભારતદેશની આ પ્રશાલિકાને જીવંત રાખવા તે પોતાનાથી જે યથાર્થ છે, તે કરી રહ્યો છે. સને ૨૦૦૫માં દેશના વડાપ્રધાન તરીકે એક શીખ ચૂંટાઈ આવ્યા હતા અને તે સમયે દેશના રાષ્ટ્રપ્રમુખ મુસ્લિમ હતા. તે સમયે નીતિશક્ષમારે બિહારની ચૂંટણીમાં લાલુપ્રસાદ યાદવને હરાવ્યા હતા (સને ૨૦૧૫ માં બંનેઓ ભેગા થઈને ભાજપને જબ્બરજસ્ત હાર પણ આપી છે.) તે સમયે અણ્ણબ ગોસ્વામી રાષ્ટ્રીય ટેલિવિઝનના પડદે એક અસરકારક પરિબળ તરીકે જીભરી આવ્યા ન હતા અને ઓસામા બિન લાદેન જીવિત હતો, પરંતુ ભારતીય સમાજને કોઈ બાબુ પરિબળનો ભય ન હતો. પણ સને ૨૦૧૫-૧૬ માં આ બધું બિલકુલ જુદું થઈ ગયું છે. વૈચારિક મતભેદ માટે રાષ્ટ્રીય કક્ષાએ જે ખુલ્લાપણાનો અવકાશ કે મોકણાશ હતી તે ખૂબ જ ઝડપથી સંકોચાઈ જવા માંડ્યા છે. બીજી બાજુએ ISIS જેવી ઈસ્લામિક ધર્માંધ સંસ્થાના ત્રાસવાદીઓ દેશની સરહદો પર ટકોરા મારી રહ્યા છે.

આવા સંઝોગોમાં ‘હિન્દુ’ દેનિકના પ્રતિનિધિ અનુજકુમાર ‘ઇબેટિંગ ઇન્સિયન’ ના લેખક પ્રો. ભીજુ પારેખના રાજકીય વિચારો સમજવાનો પ્રયત્ન કરે છે.

દિલ્હીની ડિસેન્બર માસની સવારની કડકડતી ઠંડીમાં તેમણે પ્રો. પારેખ સાથે ચર્ચા કરવા માંડી. આ પુસ્તક પ્રો. સેનના ‘ધી આંગ્યુમેન્ટટિવ ઇન્સિયન’ કરતાં ઘણી બધી દિલ્હીએ લિખે છે. સેનના મત પ્રમાણે બધા જ ભારતીયો એક સમૂહ તરીકે છૂટાના પાડી શકાય તેવા ‘હમોજિનાઈઝ’ છે. હું પ્રો. સેનના તે અભિપ્રાયથી બિલકુલ મુક્ત થઈ જવા માંગું છું (ગેટ અને ફોમ હિટ). હું દેશના પ્રજાજન ભારતીય વિશે ચર્ચા કરવા માંગતો નથી પણ ભારતની એક દેશ તરીકે ચર્ચા કરવા માંગું છું. પ્રો. સેનનું તારણ છે કે સમગ્ર ભારતીય પ્રણાલીઓ કે પરંપરાઓ મુક્ત મનથી છલોછલ વાદવિવાદના વારસાથી ભરેલી છે. આ સંદર્ભમાં મારો વિવાદનો મુદ્દો એ છે કે જ્યાં સુધી આપણી ચર્ચા ધાર્મિક અને જ્ઞાનમીમાંસા (ઇપિસ્ટોમોલોજિકલ) વિષયક

હશે ત્યાં સુધી આપણે બધા તે અંગેની ચર્ચાઓમાં મૌલિક, ધર્મભૂળથી સુધારાની તરફેણ કરનારા, કે હિમાયતી બની જઈએ છીએ, પણ જ્યારે આ દેશની દુખતી નસ જેવા સામાજિક ને રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરવાની હોય છે, ત્યારે ઉગ્ર, મૌલિક સુધારવાદીને બદલે ડરપોક તથા “જૈસે થે વાદી” બની જતા હોઈએ છીએ. આપણી ચર્ચામાં એવો પ્રશ્ન ક્યારેય પેદા થતો નથી કે શા માટે આપણામાંથી કેટલાક લોકો ગરીબ છે? શા માટે આપણામાંથી કેટલાક લોકો દલિત છે? પછી પ્રો. પારેખ, પોતાના સમર્થનાની દલીલમાં બાબાસાહેબ આંબેડકરના આ વાક્યનો સંદર્ભ આપે છે, “HOW COME NO HINDU FELT MORALLY ANGRY AND OUTRAGED AT THE PRACTICE OF UNTOUCHABILITY” શા માટે કેમ

કોઈ છિંદુને, પોતાના સમાજમાં પ્રવર્તમાન અધ્યત્પ્રથા સામે નૈતિક અને વાસ્તવિક રીતે આકોશ થતો નથી? શા માટે તે બધાને આ પ્રથા અમાનવીય અને ગૌરવહીન દેખાતી અને અનુભવાતી નથી? મેં મારા આ પુસ્તકમાં એ સાબિત કરવાની કોશિશ કરી છે કે આ દેશની એક પ્રણાલી ખૂબ જ પરિવર્તનશીલ અને મૂળભૂત રીતે કાંતિકારી દેખાય છે, જ્યારે તે જ દેશમાં બીજી સામાજિક કે રાજકીય પ્રણાલીઓ સામે રૂઢિચુસ્ત, અપરિવર્તનશીલ અને પ્રત્યાધાતી વલણો જોવા મળે છે.

અમત્ય સાથે પ્રો. ભીજુભાઈ એક બીજા મુદ્દા પર પણ સંમત નથી. ‘ભારતમાં મુક્ત વાદવિવાદની પરંપરા છે.’ વિશ્વા કોઈ દેશમાં અસ્તિત્વ ના ધરાવતી હોય તેવી અગત્યની જાહેર વાદવિવાદની પ્રથા (ટ્રેડિશન ઓફ પબ્લિક ડિબેટ) આપણા

દેશમાં છે. આપણે ત્યાં જાહેરમંચ (પબ્લિક સ્પેક્ટક્લલ) ઉપરથી હજારો લોકો સામે બે કે તેથી વધારે વ્યક્તિઓ સમાજને સ્પર્શતા પ્રશ્નો અંગે બિલકુલ શાંતિપૂર્ણ રીતે ચર્ચા કરે એ પ્રગાલી છે. તેઓનો અભિગમ ભારતની આ વિશિષ્ટ ચર્ચાપ્રશ્નાલી વિચારને સમજાવવાનો છે. તમે કલ્યાના કરી શકો છો ખરા કે પ્રિસ્ટી પાદરીઓ અને હિંદુ પંડિતો સાથે એક મંચ પરથી ચર્ચા થઈ શકે? આ ચર્ચા તે જમાનામાં બનારસના મહારાજાના પ્રમુખપણામાં બનારસ મુકામે (કાશીમાં) યોજાઈ હતી. મહારાજાએ આ ચર્ચામાં પ્રથમ પ્રશ્ન પ્રિસ્ટી ધર્મગુરુઓને પૂછવાનો કહ્યો હતો. “The Maharaja asks the missionaries to fire the first question” અને તે ચર્ચા વિના વિઘ્ને ત્રણ અઠવાડિયાં સુધી ચાલી હતી.

ગમે તે કારણોસર આવી જાહેર ચર્ચાઓનાં સદ્ગુણો અને ફળ સામાન્ય પ્રજાજનોના બૌદ્ધિક સ્તરો સુધી જમણ (પરકોલેટ) થઈને પહોંચ્યા નથી. આ દેશમાં જ્યારે ગાંધીજી રાષ્ટ્રીય સ્તર પર કેન્દ્રસ્થાને હતા ત્યારે તેઓએ આવા પ્રજાલક્ષી જાહેર પ્રશ્નો ઉપર ચર્ચાઓ કરી હતી. પોતાની દણિએ જાહેર હિતમાં હાનિકારક માન્યતાઓને પડકારી હતી અને પોતાના અભિપ્રાય મુજબના લભ્યપ્રચારનાં સંસાધનોનો ઉપયોગ કરીને કેળવણી આપીને પ્રજામત તૈયાર કર્યો હતો. પ્રો. પારેબે જે પાંચ રાષ્ટ્રીય ચર્ચાઓમાં ગાંધીજી કેન્દ્રસ્થાને હતા, તેની યાદી જણાવી હતી : (૧) ગાંધીજી અને સાવરકર, (૨) ગાંધીજી અને આધુનિક વિચારના સમર્થકો (મોડર્નિસ્ટ), (૩) ગાંધીજી અને હિસાંથી કંતિ કરીને બ્રિટિશ હક્કુમતને ઉથલાવનારાઓ, (૪) ગાંધીજી અને ટાગોર, (૫) ગાંધીજી અને બાબાસાહેબ આંબેડકર. આ બધા ગાંધીજી સામેના વિચારો ભવે જુદી-જુદી વ્યક્તિઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા, તેમ છતાં તે દરેક વિચારની પાછળ લોકમાન્યતાઓનું પીઠબળ હતું.

ગાંધીજી અને ટાગોર વચ્ચેની ડિબેટનો મુદ્દો વિદેશી કાપડની હોળી કરવા વિશેનો હતો. લોકો આ ચર્ચામાં કોણ જતશે, તેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોતા હતા. કોણ નવી દલીલ લઈને આવશે, તેની ખૂબ જ હૃતેજારી પ્રજામાં હતી.

ટાગોરે ગાંધીજીને કહ્યું હતું કે તમે પરદેશી કાપડોની હોળી કરો છો. શું આવી સુંદર સાતીઓની હોળી કરવાની તમને ઠીક લાગે છે? તેને બદલે તે બધી સાતીઓ ગરીબોની અંદર વહેંચી આપોને.

ગાંધીજીએ જવાબ આપ્યો કે શું તમને આવી દલીલ વાજબી લાગે છે? તમને માહિતી છે ખરી કે આવી સાતીઓની દેખરેખ રાખવાં માટેનાં સાધનો તે બધી ગરીબ સ્ત્રીઓ પાસે છે? ખરેખર તો આવી સાતી તે ગરીબોને આપવી તે જ ગરીબોનાં અપમાન સમાન છે.

આવી ચચ્ચાએ આજાઈના સંગ્રહમનો પ્રજામત ઘરીને લોકોને સર્વસ્વનો ત્યાગ આપવા તૈયાર કરી હતી. આજાઈ પછી દેશની સંસદના ડિબેટે સરકારી અને સામાન્ય સ્વરૂપ ધારણ કરી લીધું છે, જેનાથી સામાજિક, રાજકીય અને આર્થિક મુદ્દાઓ પર પ્રજામત ઘડાતો અને વિકસતો બંધ થઈ ગયો છે. સંસદીય ચર્ચાઓનો સ્તર ક્રમશઃ જડપથી ઉત્તરતો જાય છે. (વધારે દુઃખદ બાબત તો એ છે કે રાજ્યના મુખ્ય પ્રધાન કે દેશના વડાપ્રધાન ચાલુ વિધાનસભાએ કે ચાલુ સંસદે સમજપૂર્વક ગેરહાજર રહીને આ બંને સંસ્થાઓની ગરિમાને હાનિ પહોંચાડે છે. આવી સંસ્થાઓની પ્રસ્તુતાઓને અપ્રસ્તુત બનાવે છે-ભાવાનુવાદક) સને ૧૯૭૦ પછી આપણા આ મહામૂલા વાદવિવાદ-સંવાદ દ્વારા લોકશિક્ષણનો વારસો જડપથી ઘસાતો ગયો. લોકચર્ચ માટે આપણી સમક્ષ પ્રજા તરીકે રાષ્ટ્રવ્યાપી મોટી ચર્ચાના મુદ્દાઓ હોવા જોઈએ. જે મુદ્દાઓ ઉપર મહત્વના પ્રામાણિક અને સૈદ્ધાંતિક મતભેદો હોવા જરૂરી છે. આવા જાહેર મુદ્દાઓને પ્રજા સમક્ષ જ્ઞાન આધ્યારિત રજૂ કરનારા

શક્તિશાળી સાક્ષરો હોવા જોઈએ, જે આવા મુદ્દાઓને લોકભોગ્ય ભાષાઓમાં સહેલાં અને યાદગાર સૂત્રો બનાવીને દેશની પ્રજા સમક્ષ પ્રજામત ડેણવવા મૂકી શકે. આ બધાં હકારાતમક ડિબેટ્સનાં પરિબળો સખત પ્રમાણમાં રાષ્ટ્રીય અને સ્થાનિક કક્ષાએ ઘટી ગયાં છે. નરેન્દ્ર મોદી જેવા કુશળ વક્તાઓ છે, પણ જ્ઞાન આધ્યારિત વાસ્તવિક વાદવિવાદ કરનારા જૂજ હશે. મોદી મોટી જનમેદની સમક્ષ લોકરંજક આવેશયુક્ત ભાષણ કરી શકે છે, પણ શું તે સામસામા બેસીને ઠેચિતે જ્ઞાનઆધ્યારિત વાદવિવાદ કે ચર્ચા કરી શકે? (“There are orators like Narendra Modi but very few debaters. He can harangue a crowd, but can be debate?” he muses.)

હવે આ એવો સમય પેદા થઈ ગયો, જે સમયે હિંદુત્વ આધ્યારિત ઓળખે પોતાનું રાષ્ટ્રવ્યાપી કાઢું કાઢવાની પ્રક્રિયાને ગતિશીલ બનાવી. નિરીક્ષક મો. પારેખના મંત્ર્ય પ્રમાણે તે માટે કેટલાક અંશો જવાહરલાલ નેહરુ જવાબદાર હતા. “નેહરુએ કહ્યું હતું કે ભારતે વૈશ્વિક કે અન્ય કક્ષાએ પોતાની છાપ પેદા કરવી હશે, તો તેણે તેના ભૂતકાળ સાથે જોડાયેલા નાભિ-નાતાનો સંબંધ કાપી નાંખવો પડશે.”

ભૂતકાળે તો આપણને મારી નાંખ્યા છે. બ્રિટનના એક સમયના વડાપ્રધાન શ્રીમતી થેયરની માઝક નેહરુજીએ દેશને વૈચારિક રીતે એવો ‘હાઈજેક’ કરી લીધો હતો કે જ્ઞાને દેશ સમક્ષ નેહરુજીના બૌદ્ધિક તારણ સિવાય બીજો કોઈ સુલભ વિકલ્પ ઉપલબ્ધ જ નથી. નેહરુજીના અવસાનનાં ૨૦ વર્ષ પસાર થઈ ગયા પછી આપણી પાસે સૂત્ર આવ્યું કે “ગર્વસે કહો હમ હિંદુ હું.” આ સંદર્ભમાં મને વિચાર આવે છે કે જે દેશની ૮૫ ટકા પ્રજા હિંદુ છે, તેને એમ ઠસાવવાની કોશિશ કરવામાં આવે કે તને હિંદુ હોવાનું ગૌરવ હોવું જોઈએ, તે સ્થિતિ બહુમતી પ્રજા માટે દયનીય કહેવાય, કરણ કે નેહરુજીના જમાનામાં સાચી કે

ખોટી રીતે એવી છાપ પેદા કરવામાં આવી કે હિંદુઓને બહુમતી પ્રજા તરીકે પોતાના અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા છે.

અસહિષ્ણુતાનાં મુદ્દાના સંદર્ભમાં ચર્ચા કરતાં ગ્રો. પારેખનું મંતવ્ય છે કે જો આપણે આપણી રાખ્યીય ઓળખનાં પ્રતીકો અથવા સંકેત ચિહ્નો (ધી સિભોલ્સ ઓફ અવર નેશનલ આઈન્સ્ટિટ્યુટ) તરફ એક નજર નાંખીશું, તો ખબર પડશે કે તે બધામાંથી ૮૦ થી ૯૦ ટકા પ્રતીકો હિંદુ અથવા બૌદ્ધ છે. “શું તે દેશના હિંદુ ચહેરાની ઓળખ નથી, તો બીજું શું છે?” આમ, દેશની પ્રતિકાત્મક ઓળખ હિંદુ કે બૌદ્ધર્મ આધારિત બનાવ્યા પછી નેહરુજીનું કહેતું હતું કે અમે દેશની લઘુમતીમાં જ્યાં સુધી તે સુધારા માટે તૈયાર ન હોય ત્યાં સુધી તેને અડકિશું નહીં કે તેમાં કોઈ ફેરફાર સૂચવીશું નહીં. પરંતુ તે હિંદુ બહુમતીના સંદર્ભમાં ફેરફાર માટે હિંદુકોડ બિલ લઈને આવ્યા. તેથી કેટલાક હિંદુ આગેવાનોએ અનુભવ્યું કે પંડિતજીના ભારતમાં હિંદુઓ માટે કોઈ મહત્વનું સ્થાન કે ભૂમિકા નથી. ખરેખર તો તે બધા નેહરુજીને સમજ્યા નહીં અથવા જે નેહરુજી કરવા માંગતા હતા, તે અંગે આ બધા હિંદુ અગ્રાહીઓનાં મનમાં મોટી ગેરસમજ પેદા થઈ. નેહરુજીના પક્ષે એ સમજવાની જરૂર હતી કે છેલ્લાં બે હજાર વર્ષ કરતાં વધારે સમયથી હિંદુઓ આ દેશમાં બહુમતી પ્રજા હોવા છતાં ગૌરવહીન (હ્યુમિલિયેટેડ) દર્શામાં જીવતી આવી છે. તેને બદલે હિંદુઓને કોમવાદી તરીકે ઓળખાવ્યા.

મારા મત મુજબ “ગર્વસે કહો હમ હિંદુ હૈ” સૂત્રની પાછળનો આ પૂર્વપિર સંદર્ભ છે. પણ તેઓનું સ્પષ્ટ મંતવ્ય છે કે આવા હિંદુઓની ગૌરવહીનતાનો ભારપૂરક કે નિશ્ચયપૂર્વકનો જ્યાલ બિલકુલ ગેરસમજ પર આધારિત છે. ગણપતિનો દાખલો આપીને એમ સાબિત કરવા કોશિશ કરવી કે અમારે ત્યાં પ્રાચીનકાળમાં ખાસ્ટિક સર્જરીનું વિજ્ઞાન વિકસેલું હતું તે બિલકુલ વિવેકહીન હકીકત (ઓફ્સર્ડ) છે. હિંદુઓના માનબિંદુની જ્યાલ આ રસ્તા

ઉપર દોડશે, તો ટૂંક સમયમાં જ તે બેઅબરુ થઈ જશે. હું એ વાત સમજી શકું હું કે જો તે બધા એમ કહેતા હોય કે ભારતની એક દેશ તરીકેના ભૂતકાળની નોંધ લેવાવી જોઈએ અથવા રામાયણ અને મહાભારત તે ફક્ત હિંદુગ્રંથો નથી, પણ સમગ્ર ભારતીયોના ગ્રંથો છે તે બધાની આવી આકંક્ષાઓને હું સમજી શકું હું. તેના પર ચર્ચા કે વાદવિવાદ પણ થઈ શકે? પણ તેનાથી આગળ વધીને આ બધા કહે કે કોઈએ ગાયનું માંસ ન જ ખાવું જોઈએ, તે દલીલ અથવા હકીકત વિચારહીનતાની પરાકાઢા ગણાય.

ઈસ્લામ અંગે ગ્રો. પારેખના વિચારો જાગ્રતાના પહેલાં આપણે એ જાગ્રવાની જરૂર છે કે તેઓએ બ્રિટનમાં બહુસંસ્કૃતિવાદ અને જાતીય સમાનતાના મુદ્દે (માલ્ટિકલ્યરાઇઝમ એન્ડ રેસિયલ ઈન્ડિકવાલિટી) ઘણાં કમિશનોના પ્રમુખ તરીકે કામ કર્યું છે. તેઓનું મંતવ્ય છે કે ઈસ્લામમાં હિંદુર્મની માફક જાહેર ચર્ચા કરાવાની કોઈ પ્રણાલીઓ નથી અને વિકસી પણ ન હતી. તેઓએ પોતાના આ પુસ્તકમાં ગાંધીજી અને બિનલાદેન વચ્ચે કાલ્પનિક સંવાદ ઉભો કર્યો છે, જેમાં ગ્રો. પારેખે બિનલાદેનને ભારતદેશની આજાદીની જ્યાલવળમાં ગાંધીજીના અંતિમવાદી મિત્રો (!) તરીકે સરખામણી કરી હતી. જાહેર સંવાદ કે વાદવિવાદને ઈસ્લામમાં ‘ઈત્તિહાસ’ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ તે માટેનાં બારણાં બંધ કરી દેવામાં આવ્યાં છે. ઘણા આ મુદ્દે એમ દલીલ કરે છે કે ઈસ્લામમાં બૌદ્ધિક વાદવિવાદને સ્થાન છે પણ કોઈ સ્પષ્ટ રીતે જવાબ આપતું નથી કે વાદ-વિવાદનું કેટલું મહત્વ ઈસ્લામમાં છે. ધાર્મિક પુસ્તકો તમને તમારો રસ્તો બતાવશે, પણ તેમના લખાણોથી આગળ જતા ચોક્કસ અટકાવશે.

ગ્રો. પારેખે હંગેન્ડ અને ભારતની વાદ વિવાદની વિકસેલ પ્રથાની સરખામણી કરતાં જાણવ્યું કે આપણા દેશના જે-તે સમયના નેતાઓએ આ સંવાદને કોમવાદી

દિશામાં લઈ જવા માટે જવાબદાર ઠેરવ્યા છે. હંગેન્ડમાં વાદ વિવાદમાં કે ચર્ચામાં તમને સપાટી ઉપર મતભેદ દેખાય, પણ દેશને કઈ દિશામાં લઈ જવો છે તે મુદ્દે બધાની સહમતી હોય. તેથી ચર્ચા કરનારાઓ પોતાના આંતરિક મતમતાંતરોને દેશનું પાયાનું માળખું તૂટી જાય ત્યાં સુધી ન લઈ જાય, આપણે એવી સહસંમતિ વિકસાવવાની પ્રક્રિયાની તૈયાર કરી રહ્યા છે, પણ કરી નથી.

અંતમાં પારેખસાહેબની ચિંતા છે કે મતભેદ, અસંમતિ, સહિષ્ણુતા, વિવેક, વિનયસૌજન્ય એક પ્રકારની ગૃહસ્થાઈ (સિવિલિટી) જાણે ભારતીય સમાજમાંથી કમશા: લુમ થતી હોય તેમ દેખાય છે. તેની નિશાનીઓ તો રોજબરોજના નાગરિક જીવનમાં દેખાય છે. સવા અબજની વસ્તીવાળા દેશમાં બે-ત્રાણ બનાવો કાંઈ મોટી ચીજ નથી, પરંતુ આ બધા બનાવો દેશ જે હિંદુ માનસિકતામાં વલોવાઈ રહ્યો છે, તેના વજૂદવાળા, નજરાંદાજ ન થઈ શકે તેવાં પ્રતિકો કે ચિહ્નો છે. કેટલીક વસ્તુઓની કે વિષયોની આ દેશમાં ચર્ચા જ ન થઈ શકે! આવાં વલણોની શક્તિઓમાં સતત વધારો મને ખૂબ જ ચિંતા ઉપજાવે છે. જે રીતે પેલા ત્રાણ રેશનાલિસ્ટોના ખૂનીઓએ બંદુકની બૂલેટથી તે બધાની ચર્ચાઓ કાયમ માટે બંધ કરાવી દીધી, તે ખૂબ જ દુઃખ અને આધાતજનક છે.

### ● જાહેરચર્ચાનું નવું સ્થળ :

આ દિવસોમાં જાહેરચર્ચાઓ અને વાદ-વિવાદનું સ્થળ બદલાઈનો ટેલિવિઝનો સ્ટુડિયો બની ગયું છે. જ્યારે ટીવી-એન્કર પોતે જ ચર્ચાની શરૂઆત કરનારો હોય, ત્યારે કિકેટની રમતમાં અમ્યાયર પોતે ખેલાડી બની જાય તેવી સ્થિતિ પેદા થાય છે. આ સંદર્ભમાં લોકસભા અને રાજ્યસભાનાં ટીવી-ટિબેટ્સ જુદાં તરી આવે છે. (રજૂ. બીપીન શ્રોદ્ધ)

Email : [prosparekh@gmail.com](mailto:prosparekh@gmail.com)

(સોઝન્ય : નિરીક્ષક)

## શું ગાંધીજી વાણિયા હતા?

● કિતેન્દ્ર દવે ●

હાજી, ગાંધીજી વાણિયા હતા. ગાંધીજના પિતા કરમચંદ ગાંધી અને માતા પૂતળીબાઈ મોઢ વણિક જ્ઞાતિનાં હતાં. મોઢ વણિક કુટુંબમાં જન્મ્યા તેથી વૈષ્ણવકુળના સંસ્કાર પામ્યા હતા. બાળપણમાં ગાંધીજને હવેલીએ જવાનું વારંવાર થતું.

ગાંધીજની કિશોરાવસ્થા દરમિયાન એમના પિતાશી માંદા હતા ત્યારે કેટલોક વખત તેઓ પોરબંદર રહ્યા હતા. ત્યાં રામજીના મંદિરમાં રોજ રાત્રે રામાયણ સાંભળવા ગાંધીજી જતા. તેર વર્ષની ઉમરના ગાંધીજને રામાયણ સાંભળવું ગમતું. પછી રાજકોટ રહેવા જતાં ગાંધીજને અનાયાસે સર્વ સંપ્રદાયો વિશે સમાનભાવ રાખવાની તાલીમ તેમના ઘરે મળી. તેનું કારડા એ હતું કે માતાપિતા હવેલીએ જાય, શિવાલયમાંય જાય અને રામમંદિરે પણ જાય. સંતાનોને સાથે લેતાં જાય અથવા મોકલતાં.

પિતાજી પાસે જેન ધર્મચાર્યો પણ આવતા. પિતાજી તેમને વહોરાવે. ધર્મચાર્યો પિતાજી સાથે ધર્મની તેમ જ વ્યવહારની વાતો કરે. પિતાજને મુસલમાન અને પારસી મિત્રો હતા. તેઓ તેમના ધર્મની વાતો કરે. પિતાજી તેમની વાતો માનપૂર્વક અને રસબેર સાંભળે. આવા વાર્તાલાપો વખતે ઘણી વેળા કિશોર ગાંધી હાજર જ હોય. એ વાર્તાલાપોની અસર ગાંધીજી ઉપર એ પડી કે સર્વ ધર્મો પ્રત્યે એમનામાં સમાનભાવ પેદા થયો.

ગાંધીજી દસેક વર્ષના હતા ત્યારે જનોઈ પહેરાવવામાં આવી હતી. પણ એ તૂટી ગયા પછી બીજી પહેરી ન હતી. જોકે વૈષ્ણવ હોવાથી ગાંધીજી કંઈ પહેરતા. શિખા તો વડીલો રખાવતા પણ વિલાયત ગયા પછી શિખા કપાવી હતી.

ગાંધીજને પોતાને વાણિયા કહેવડાવવાનું ગમતું. તા. ૧૮મી માર્ચ, ૧૯૨૨ ના રોજ શનિવારે, અમદાવાદમાં ૪૪ મિ. બ્રૂમફિલ્ડની કોર્ટમાં ગાંધીજી અને તેમના સાથી શંકરલાલ બેંકર વિરુદ્ધ ચાલેલા ‘દેશદ્રોહ’ ના કેસમાં ગાંધીજને છ વર્ષની આસાન કેદની સજી ફરમાવવામાં આવી હતી. ગાંધીજને યરવડા જેલમાં લઈ જવાયા. હેંડમાં ગાંધીજનો આ પહેલો કારાવાસ હતો. આ પ્રસંગે આરોપીના સ્ટેટેમેન્ટમાં ગાંધીજાએ પોતાના વિશે માહિતી આપતા લખી જણાયું હતું :

**જ્ઞાતિ :** હિન્દુ વાણિયા

**ધંધો :** ખેડૂત અને વણકર

**રહેવાસી :** આશ્રમ, સાબરમતી

**બીજો પ્રસંગ જોઈએ,** “મહાદેવભાઈની ડાયરી” પુસ્તક બીજું (ગાંધીજી સાથે યરવડા જેલમાં) ગાંધીજી અને વલ્લભભાઈની વાતચીતનો ઉલ્લેખ કરતાં મહાદેવભાઈ નોંધે છે કે, ગાંધીજી સૂતાં

સૂતાં કહે છે, “વલ્લભભાઈ, તમને એક ગમતની વાત કરવાની રહી ગઈ. પેલો વિલિંગન, જ્યકર-સમુને કહે, “Irwin foolishly yielded to that villain of bania, not I. (ઇર્વિન મૂર્ખો તે પેલા બદમાશ વાણિયાને નમ્યો, હું એમ ન કરું)

વણિક વિશેનો શામળનો છખ્યો ગાંધીજને ગમતો. શામળે તેના એ છખ્યામાં વણિકના સ્વાત્માવિક ગુણધર્મ ગણાવ્યા છે.

વણિક તોહનું નામ, જે જૂહું નવ બોલે,  
વણિક તોહનું નામ, તોલ ઓછું નવ તોલે.  
વણિક તોહનું નામ, જે કાઈ બોલ્યું પાળે,  
વણિક તોહનું નામ, વ્યાજ સહિત ધન વાળે.  
વણિક માંદા ગુણ વીસ, રીસ ચડે નહીં અંગે,  
ચોરી ચાડી (જર) જૂઠ, અહંકાર આવે નહીં સંગે.  
અધર્મ, અન્યાય, અભિમાન ગાનાતાન તો ન ગણે.  
નિંદા, નીચ સ્વભાવ, ભૂંદું કોઈનું ન ભણે,  
ગાળો કોઈ એક દે ઘણી, પાછી વાળી નવ આણિયો,  
પૂઠ નવ બોલે પારકી, વહેવાર પાળે તે વાણિયો.

“હેંડ છોડો” ચળવળ દરમિયાન, મુંબઈમાં ઉમી ઓગસ્ટ, ૧૯૪૨ ના રોજ મહાસમિતિની બેઠકમાં ગાંધીજાએ પોતાના મહત્વના ભાષણમાં કહ્યું હતું, “...આપણે લડીને જ સ્વરાજ લઈશું. એ આકાશમાંથી પડવાનું નથી. આપણે પૂરતા ભોગ આપ્યા હશે અને આપણી તાકાત સાબિત કરી આપી હશે તો અંગ્રેજોને સ્વરાજ આપવું જ પડવાનું એ હું ઘણી સારી રીતે જાણું છુ... એવા લોકો છે જે મને શેખચલ્લી કહેશે. પણ હું તમને કહું છું કે, હું એક સાચો વાણિયો છું અને મારો ધંધો સ્વરાજ મેળવવાનો છે. એક વહેવારુ વાણિયા તરીકે તમારી આગળ બોલતાં હું તમને કહું છું કે જો તમે (અહિંસક આચરણની) પૂરેપૂરી કિંમત ચૂકવવા માગતા હો તો જ આ ઠરાવ પસાર કરજો. નહિં તો પસાર ન કરજો.”

આદરણીય દુલા ભાયા કાગે તેમના દુહામાં ગાંધીજને વાણિયા તરીકે બિરદાવ્યા છે.

**વાણિયો ખરે વેર**

માતાજની નોબતું વાગે છે,  
આજે સૂતાં સૌ માનવી જાગે છે,  
લીલુડાં માથડાં માગે છે...  
ધાવ જીલે ધમસાણના રે,

એની આંખુમાં નાવ્યાં ઝેર,  
હુનિયા આખી ડોલવા લાગી,  
વાણિયો ખડે વેર.

મારા વાચક મિત્રો, કાગ સાહેબે એમના આ એક હુણમાં ગાંધીજીનો સત્ય, અહિસા અને પ્રેમનો સંદેશ કેટલો સુંદર રીતે ઉત્તાર્થે છે, ગાંધીજીની ‘વાણિયાળી’ નું આવું અદ્ભુત વર્ણન ભાગ્યે જ બીજા કોઈ કાવ્યમાં થયું હશે. કવિ કાગ આગળ લખે છે...

અંગ વેરાવે ને શિશ ખંડાવે,  
લુંટાવે ઘરબાર,  
વીર વેવાડુ વાણિયો નઈ દૈ  
નમતું એક તલભાર.

મિત્રો, આ વહેવારુ વાણિયાનો વટ તો જુઓ કે ગમે તેવી પરિસ્થિતિમાંય એક તલભાર નમતું જોખવા તૈયાર નથી! આપણને કહેવાનું મન થઈ જાય કે ગાંધીજી માત્ર વાણિયા નથી, એ તો ‘વહેવારુ વાણિયા’ છે.

મિત્રો, આપણા આ ‘વહેવારુ વાણિયા’ને ચકાસવામાં કોઈએ કચાશ રાખી ન હતી. ૪ સપ્ટેમ્બર, ૧૮૮૮ના રોજ ગાંધીજી બેરિસ્ટર થવા મુંબઈથી લંડન જવા નીકળ્યા તે પહેલાં એમના જ્ઞાતિબંધુઓએ ઊભી કરેલી કેટલીક અગવડતાઓ ગાંધીજીએ ભોગવવી પડી હતી. ગાંધીજી વિલાયત જઈ રહ્યા છે, એવી ખબર જ્ઞાતિજીનોએ જાણી. મોઢજ્ઞાતિની કોઈ પણ વ્યક્તિ દરિયો ઓળંગીને પરદેશ જાય તે જ્ઞાતિજીને પસંદ ન હતું. જ્ઞાતિમાં ખળભળાટ ઉઠ્યો. નાત બોલાવવામાં આવી. કોઈ મોઢ વાણિયો હજુ સુધી વિલાયત નહોતો ગયો અને જો મોહનદાસ જવા હશ્ચતા હોય તો નાતમાં એમની હાજરી લેવાવી જોઈએ. આથી નાતની વાડીમાં હાજર રહેવાનું ગાંધીજીને ફરમાવવામાં આવ્યું.

(ગાંધીજીએ તે સંઝોગોનું વર્ણન તેમની આત્મકથામાં કર્યું છે. ઉપરાં વિદ્યાભ્યાસને માટે ઈંગ્લેન્ડ જવા ઈચ્છા હિન્દુઓની સામે કેવી મુશ્કેલીઓ ઊભી થાય છે તેનો અંગ્રેજોને ચોક્કસ ઘ્યાલ મળે અને તે મુશ્કેલીઓ કેવી રીતે પાર કરી શકાય તે એવા હિન્દુઓને બતાવવા માટે ‘ધી વેજિટેરિયન’ ના પ્રતિનિધિએ ગાંધીજીને થોડા સવાલ પૂછ્યા હતા અને ગાંધીજીએ જવાબ આપ્યા હતા. પ્રસ્તુત છે ગાંધીજીએ આ સંદર્ભે આપેલા જવાબના અંશ.)

...ન્યાતના સૌથી આગેવાન પટેલે મને (નીચેની મતલબના) આ શબ્દો કહી સંભળાવ્યા : “અમે તારા બાપના મિત્રો થઈએ તેથી અમને તારી સારુ લાગે છે. ન્યાતના આગેવાનો તરીકે અમારી કેટલી સત્તા છે તે તું જાણો છે. અમને પાકે પાયે ખબર મળી છે કે વિલાયતમાં તારે માંસ ખાવું પડ્યે ને દારુ પીવો પડ્યે, વળી, તારે દરિયો ઓળંગવો પડ્યે; આ બધું આપણી ન્યાતના રિવાજ અને નિયમથી વિરુદ્ધ છે તે તું જાણે

છે. તેથી તારા નિર્જયનો ફરી વિચાર કરવાની અમારી તને આજ્ઞા છે અને નહીં તો ભારેમાં ભારે સજા તારે ભોગવવી પડશે. આ બાબતમાં તારે શું કહેલું છે?”

મેં નીચેના શબ્દોમાં જવાબ આપ્યો, “તમારી ચેતવણી માટે તમારો આભાર માનું છું. મારો નિર્જય હું ફેરવી શકું એમ નથી તે સારુ દિલગીર છું...”

એટલે પટેલે ગુસ્સે થઈને કહ્યું, “બહુ સારું ત્યારે, તું તારા બાપનો દીકરો નથી.” પછી સભા તરફ વળીને તેમણે આગળ ચલાવ્યું. “આ છોકરાની બુદ્ધિ બહેર મારી ગઈ છે અને અમારી હરેકને આજ્ઞા છે કે કોઈએ એની સાથે કશો સંબંધ રાખવો નહીં. જે કોઈ તેને કોઈ પણ રીતનો ટેકો આપશે અગર તેને વિદાય આપવાને જરૂર તેને ન્યાત બહાર ગણવામાં આવશે, અને અલ્યા તું, તું ગમે ત્યારે પાછો આવશે તોપણ તને કદી ન્યાતમાં પાછો લેવામાં આવશે નહીં.”

ગાંધીજી અહીં ઉમેરે છે કે “...મારા ભાઈ સુધ્યાં થોડા ડરી ગયા પણ તે એક કષા પૂરતા...અને હકીકિતમાં તો તેમને ન્યાતબહાર પણ મૂકવામાં આવ્યા નથી...”

વિલાયત જવાના પ્રસંગે જ્ઞાતિજીનો ગાંધીજીની વિરુદ્ધ ગયા પણ ૧૯૧૫ ની સાલમાં દક્ષિણ આફિકાથી ગાંધીજી કાયમ માટે હિન્દુસ્તાન પાછા આવ્યા ત્યારે તેમના આ જ્ઞાતિજીનોએ તેમનું બહુમાન કરવામાંય કોઈ કચાશ રાખી ન હતી.

તા. ૮મી જાન્યુઆરી, ૧૯૧૫ના રોજ સવારે ૭.૩૦ વાગે આગબોટમાંથી ગાંધીજી મુંબઈના બંદરે ઉત્તર્ય અને બીજે જ દિવસે મોઢ કોમ તરફથી ગાંધીજીનો સત્કાર કરાયો, સ્થળ કોટમાં જીવણદાસ પીતાંબરદાસનો બંગલો. ગાંધીજીએ મોઢ બોર્ડિંગની મુલાકાત પણ લીધી. તા. ૧૪મી જાન્યુઆરીએ રાતે મોઢ જ્ઞાતિ તરફથી ભૂલેશ્વર ગુલાલવાડીમાં ગાંધીજીને માનપત્ર અપાયું હતું. તા. ૨૦મી જાન્યુઆરીએ ગાંધીજી રાજકોટ ગયા હતા ત્યારે બપોરે મોઢ પુરુષ વર્ગ તરફથી ગાંધીજીને માનપત્ર અપાયું હતું અને મોઢ સી વર્ગ તરફથી કસ્તૂરબાને પણ માનપત્ર અપાયું હતું.

ગાંધીજી પોતાને વાણિયો કહેવડાવતા પણ વાણિયો એટલે અમુક ન્યાત નહીં. ગાંધીજી એ સંખાનો સંકુચિત અર્થ કરતા ન હતા. એ બહુ વિશાળ અર્થમાં પોતાની જાતને વાણિયા તરીકે ઓળખાવતા. ૧૯૪૭ના ડિસેમ્બર મહિનામાં ગાંધીજીનો ઉતારો જ્યારે બિરલા હાઉસ, નવી દિલહિમાં હતો ત્યારે શંકર, રાવજ અને બીજી કાર્યકરો સાથે વાત કરતાં ગાંધીજીએ કહ્યું હતું, “...જો કે લોકો મારે મહાત્મા જેવાં વિશેષાંગો વાપરે છે, અને બીજી અનેક રીતે વખાણ કરે છે. હું એમાનું કશું જ માનતો નથી. એ માની લંઠિ તો મારી પડતી જ થાય. મને વિવાદમાં ઘણા વાણિયો કહે છે, વાત સાચી છે. વાણિયો જ છું અને રહીશ. વાણિયો એટલે અમુક ન્યાત નહીં. વાણિયો એટલે વેપારી

કે સોદાગર. હું અહિસાનો સોદાગર છું. જો મન પડે તો લો, નહીંતર નહીં.” (મનુભેન ગાંધી લિખિત ‘દિલ્હીમાં ગાંધીજી’ ભાગ બીજામાંથી સાભાર)

ગાંધીજી માત્ર વાણિયા ન હતા. બ્રાહ્મણ તરીકે સ્વેચ્છાએ અનેક ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો. કેટલાય ધર્મગુરુઓ સાથે ધર્મની ચચ્ચાઓ કરી હતી. વિવિધ ધર્મોના આચાર-વિચારનો તુલનાત્મક અભ્યાસ કર્યો હતો. ગીતા, રામાયણ, મહાભારત વગેરે ધર્મગ્રંથો વિશે પ્રવચનો આખ્યાં હતાં. ધર્મ લેખ લખ્યા હતા. સત્ય, બ્રહ્મચર્ય, અહિસા વગેરે ત્રતો જીવનમાં અપનાવ્યાં હતાં.

એટલે જ તો તા. ૧૫-૧૧-૧૯૨૦ ના રોજ અમદાવાદમાં ગુજરાત વિદ્યાપિઠની સ્થાપના કરી ત્યારે ગાંધીજીએ કહ્યું હતું, “મેં તો કેવળ મંત્ર આપ્યો છે, અને વણિકપુત્ર કરી શકતો હોય તો મેં ઋષિનું કાર્ય કર્યું છે.” ઈતિહાસ આ વાતની સાક્ષી પૂરશે કે ગાંધીજીએ શિક્ષણ ક્ષેત્રમાં પણ અનેરું યોગદાન આપ્યું છે. ધર્મગ્રંથોમાં બ્રાહ્મણનાં મુખ્ય છ કર્તવ્ય ગણાવ્યા છે, ભણવું-ભણાવવું, દાન લેવું અને દાન આપવું, યજ્ઞ કરવા અને યજ્ઞ કરાવવા. ગાંધીજીએ આ કર્તવ્યો સુપેરે પાર પાડ્યાં હતાં.

ક્ષત્રિય તરીકે ગાંધીજી વર્ષો સુધી અંગ્રેજોની સામે ચળવળ ચલાવતા રહ્યા. નિષ્ફળતા સતત મળી તેમ છિત્યાંય કયારેય પીછેહઠ ન કરી. એમના કોઈ કાર્યમાં નિર્ભળતા ન હતી. ક્ષમા એમનો ધર્મ હતો. બ્રિટિશ રાજ્ય સરકાર સામે વિદ્રોહની ભાવના બજાકટ શબ્દોમાં રજૂ કરતા. ઉગ્ર આંદોલનો ચલાવ્યા હતા.

“વૈશ્ય” તરીકે ગાંધીજીની કેટલાંય વર્ષોની અવિરામ નેતાગીરી દરમિયાન યોજાયેલી અનેક ચળવળમાં ખર્ચતા પૈસા જાહેર જનતા પાસેથી સ્વૈચ્છિક રીતે મેળવતા અને તેમાં એક એક પૈસાનો હિસાબ રહેતો. લોકો એમના દરેક આદેશને અનુસરવા તત્પર રહેતા. ઘર, પણી, કુટુંબ, માલમિલકત વગેરે બધું જ છોડી દઈને એમની ચળવળમાં લોકો સામેલ થતા. બજારમાં શાખ ધરાવતા મોટા વેપારીના જેવી એમની વહીવટ કુશળતા જોઈને લોકોને એ વૈશ્ય જ્ઞાય તો નવાઈ નહીં. અંગ્રેજ શાસનાધિકારીઓ અને મુત્સદીઓ સાથેની દીર્ઘ વાટાવાટ દરમિયાન જરૂરી હોય ત્યારે કુનેહપૂર્વક સંધિ કરી લેતા. હાથ ધરેલાં આંદોલનો મોકૂફ રાખવાનું સ્વીકારતા પણ હાથમાં લીધેલું કાર્ય અધૂરું મૂકતા નહીં. તક ઊભી થાય કે તરત એ ઝડપી લેતા અને મોકૂફ રાખેલું આંદોલન ફરી હાથમાં લેતાં એ અચકાતા નહીં. આ એમની વાણિયાગીરી નહીં તો બીજું શું હતું?

આપણી વર્ણવ્યવસ્થામાં “શૂદ્ર” એટલે સેવક. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય - આ ત્રણેય વર્ણની સેવા ‘શૂદ્ર’ કરતાં. ગાંધીજીની સેવાભાવના અનન્ય હતી. માંદાની સેવા કરવા એ હંમેશાં તત્પર રહેતા. દર્દની જાતે સારસંભાળ રાખતા. જરૂર પડે તો તારટપાલ દ્વારા માંદગી દૂર કરવાના અને તંદુરસ્ત રહેવાનાં સૂચનો આપતા. કોઈ જાતના આંદોલ વગર ગાંધીજી દર્દની સેવા કરતા. સેવા દરમિયાન દર્દની માનસિક અવસ્થાને

જરાય ઠેસ પહોંચે નહીં તેનીય કાળજી લેતા.

એક પ્રસંગ નોંધું છું. તા. ૧૩-૮-૧૯૨૫. સ્થળ : પુરુલિયા, ગાંધીજી રક્તપિત્તિયાઓના આશ્રમની મુલાકાતે ગયા હતા. ત્યાં એક દર્દના શરીરે હાથ ફેરવી માયા બતાવી. ચેપ ન લાગે તેથી ગાંધીજીના હાથ ધોવા માટે ડોક્ટરે દવાવાળા પાણીનો વાટકો ગાંધીજી સામે ધર્યો. વાટકો પાછો ડેલતાં ગાંધીજીએ ધીરા અવાજે કહ્યું, “આમના દેખતાં ધોઉં તો એમને ઓછું આવે. પછી ધોઈશ.”

દવાવાળા પાણીથી હાથ ધોવાના તો હતા જ પણ જો તે જ વખતે દર્દની સામે જ હાથ ધુએ તો દર્દને કેવું લાગે? તેની ચિંતા પણ ગાંધીજીને થઈ. આટલી સૂક્ષ્મ સેવાભાવના ગાંધીજીમાં હતી.

ગાંધીજીએ હરિજનોની પણ ખૂબ સેવા કરી. હરિજનો એ સમયે અસ્પૃશ્ય ગણાતા. ગાંધીજી સ્પષ્ટપણે માનતા કે અસ્પૃશ્યતા એ હિંદુધર્મનું અંગ નથી પણ એમાં પેસી ગયેલો સરો છે. ઓણે ધર્મને બહાને લાખો કે કરોડો લોકોની સ્થિતિ ગુલામ જેવી કરી મૂકી છે. જાહેર સ્થળોએ જ્યાં બીજા હિંદુઓને છૂટથી જવાનો અવિકાર હોય ત્યાં અસ્પૃશ્યોને પણ એ અવિકાર મળગો જોઈએ. એ અવિકારથી એમને વંચિત રાખનાર અન્યાય કરે છે. જે હિંદુઓ એમનો આ અવિકાર માન્ય રાખે છે, તે અસ્પૃશ્યો પર મહેરભાની નથી કરતા, પણ માત્ર પોતાની ભૂલ સુધારે છે. ૧૯૭૨ની સાલમાં સપેભર મહિનામાં હરિજન પ્રશ્નને અંગે બાપુએ પૂનાની ચરવડા જેલમાં આમરણ ઉપવાસ કર્યા હતા.

ચારેય વર્ણનાં લક્ષણો ગાંધીજીના જીવનમાં અનેક રૂપે પ્રગટ્યાં છે. ગાંધીજી વાણિયા હતા, પણ એ માત્ર વાણિયા ન હતા, એ સિવાય પણ ગાંધીજી ઘણું બધું હતા.

મો. ૦૮૮૩૩૬૨૬૬૩૮

શોઝન્ય : ‘શાશ્વત ગાંધી’

## ચારણી સાહિત્યકાર વજભગતની શતાબ્દી

(અનુસંધાન : પાના નં.-૧૨ ઉપરથી ચાલુ)

(તા. ગાંધીધામ), ૨૦૦૭માં મોટા ભાડિયા (તા. માંડવી) અને ૨૦૧૦ માં મોટી ખાખર (તા. મુંદ્રા) ખાતે નિર્માણ પાય્યાં છે. તેમાં હવે કાઢડા (તા. માંડવી) નો પણ ઉમેરો થયો છે. અહીં ૨૦૦૮માં નિર્મિત ‘સોનલધામ’ ભારતમાં સૌથી મોટું સોનલમંદિર મનાય છે.

૨૦૧૪ માં ગુજરાતી ચલચિત્રોના અભિનેતા ઉપેન્દ્ર નિવેદી (૧૯૭૬-૨૦૧૫) માંડવીની મુલાકાતે આવેલા ત્યારે ભગતની જૂપડીએ પણ દર્શનાર્થે આવેલા અને વિનાયક વોરા સત્તસંગ ભવનમાં પંડિતજીની તાર-શરણાઈ પાસે બેસીને સ્વરંજલિ આપી હતી. ૨૦૧૬ માં વજભગતની ૨૭મી પુજ્યતિથિ પ્રસંગે એમની સાધનાકુટિર અને રામકૃષ્ણ મંદિરના જીર્ણોદ્વાર દેતું પાયાવિષી કરાઈ છે.

‘શિવમુ’, ૪૦/૬૮, વૃદ્ધાવનનગર,  
વૈશાળી સિનોમા રોડ, અંજર (ન્ય. ૫૨૭) ૩૭૦૭૧૦.

ફોન : (૦૮૮૩૬) ૨૪૦૭૩૮, મો. ૦૮૮૪૭૭ ૨૩૧૫૦

Email : bharat.thaker71@yahoo.com



## દીનતા શા માટે....?

● ડૉ. પ્રકાશ ગજજર ●

એક અંધ બિભારણ હતી. આંખોને અભાવે એ દુઃખી તો હતી જ, ઉપરાંત એના બંને હાથ કંડામાંથી કપાઈ ગયેલા. ભીખ માગવાનું એને ગમતું નહોતું, પણ બીજો કોઈ જ રસ્તો ન હોવાથી એણે એક નવી જ રીત અજમાવેલી. પોતાની પાસે એ બે ડબ્બા રાખતી. એકમાં પેન્સિલો મૂકીતી ને બીજામાં થોડા પૈસા પડ્યા હોય. ડબ્બા પાસેના એક નાના બોર્ડમાં લખેલું : ‘અંધ છું. મારા હાથ કપાઈ ગયા છે. આ પેન્સિલો ખરીદીને એ દ્વારા મદદ કરો.’

રોજ સવારે નિશ્ચિત સમયે એ જગાએ બેસવાનો એનો કમ હતો. આવીને હૂઠે હાથે ડબ્બા ને બોર્ડ ગોઠવીને એ આસાન વાળીને બેસી જતી. આંખોનાં અજવાળાં વિલાઈ ગયાં હતાં, એટલે નજર ગમે ત્યાં ફરવાનો કોઈ સવાલ નહોતો. આથી શાંતિથી એ ભગવાનનું નામ લેતી બેસી રહેતી. લોકો એની પેન્સિલો ખરીદતા ને કિંમત કરતાં થોડું પણ વધારે પરચૂરણ નાખીને જ જતા. પરિણામે એ બાઈનું પેટિયું નીકળી રહેતું.

એક વખત બે પ્રવાસી ત્યાં થઈને જતા હતા. ખરા બપોરનો સમય. ધોમ ધ્યતો હતો. રસ્તો જાણે ઉકળી રહ્યો હતો. અંધ બિભારણ આવા તાપ વચ્ચે પણ એ જ જગાએ બેઠી હતી. એક પ્રવાસીએ એક પેન્સિલ લીધી અને એક રૂપિયો ડબ્બામાં નાખ્યો. પણ એ અંદર ન પડતાં દડતો દડતો આઘે ગયો. બાઈએ અવાજ સાંભળ્યો એટલે એ સિક્કો શોધવા લાગી. હૂઠા હાથ લંબાવીને સિક્કો શોધતાં શોધતાં એણે કોણીના ભાર ઉપર શરીર લંબાવ્યું. હાથ વળી ગયો, એ ગબડી પડી. પેલા પ્રવાસીઓએ એને તરત જ ઊભી તો કરી, પણ એમને ખૂબ જ દુઃખ થયું. બે રૂપિયાની એક બીજી નોટ એના હાથમાં પકડાવીને એમણે ચાલવા માંડ્યું.

બીજો પ્રવાસી પહેલાને કહે : ‘બહુ લાચાર અને કમનસીબ બાઈ છે, નહિ?’

‘ના ભાઈ, હું લાચાર કે કમનસીબ નથી,’ બિભારણ બાઈએ પાછળથી જવાબ આપ્યો. ‘હું તો ખૂબ જ નસીબદાર છું. મને હંમેશાં આપના જેવા ઉદાર, પ્રેમાળ, સહાનુભૂતિવાળા અને ઉમદા સ્વભાવના સજજનોનો જ પરિયય થાય છે. મને કમનસીબી કે લાચારી સાલતી જ નથી.’

ભીખ માળીને જેને પોતાનું પૂરું કરવું પડતું હતું, અન્યની ઉદારતા ઉપર જ જેનું જીવન નિર્ભર હતું એવી આ બિભારણ બાઈ પણ જો પોતાને કમનસીબ અને લાચાર માનવાની ના પાડતી હતી તો, આપણે પોતાની જાતને દીન-હીન શા માટે માની લેવી જોઈએ?

દીનતા, આત્મપ્રતારણા, લાચારી, ઢીલાશ – આ બધા એવા રાહુ-કેતુ છે, જે આપણા વ્યક્તિત્વના સૂરજને સોણે કળાએ પ્રકાશવા દેતા જ નથી. એમની વિચિત્ર અને દુખદ છાયાઓ આપણા ઉપર પડ્યા જ કરે છે. આથી આપણે વારંવાર દીનતાનો અનુભવ કરવા લાગીએ છીએ. ‘હું હારી ગયો છું, થાકી ગયો છું, કોઈ ઉપાય નથી, હવે મારો કોઈ ઉગારો નથી, મારું શું થશે, ભગવાન બચાવે તો બચાય...’ આવા પ્રકારના તમામ નિરાશાસૂચક ઉદ્ગારો એ દીનતાની જ નિશાની છે. આવી દીનતાથી દુશ્મનો રાજી થાય છે, મિત્રોને રંજ થાય છે અને દુનિયાને નવો તમાશો નીરખવા મળે છે.

જો દીનતાથી આપણું કોઈ કલ્યાણ થતું હોય તો ટીક, પણ ખરેખર તો એ બધું વણસ્પાડી જ મૂકે છે. એનાથી દુઃખ વધારે સધન, ગહન અને મોટું બને છે, આરામ હરામ થાય છે, શક્તિ ક્ષીણ થવા માંડે છે ને હિંમતનો તો ખાતમો જ બોલી

જાય છે.

ક્રિમેન નામના જાણીતા મનોવૈજ્ઞાનિકે કહું છે કે એનાથી નિરાશ અને હતાશાના હલકા રોગ લાગુ પડે છે, એનાથી આપણી શ્રદ્ધા નાશ પામે છે અને કાર્યશક્તિ શૂન્ય બની જાય છે. દીનતા આપણી આંખ ઉપર એવા પાટા બાંધે છે કે નજર સામે આવી ઊભેલી તક પણ આપણને દેખાતી નથી. આપણા સ્વાસ્થ્ય ઉપર એની બહુ બૂરી અસરો પડે છે. દીનતા એવો ભયંકર દુશ્મન છે કે, જેનાથી સર્વદા ચેતતા રહેવું જોઈએ. એની સાથેના યુદ્ધમાં વિજેતા બનવાની કેટલીક યુક્તિ આ રહી :

### ● વધુ પડતી અપેક્ષા ન બતાવવી :

ખૂબ જ તેજસ્વી લાગતા એક સાધુ મહારાજ એક ગામને ચોરે આવીને બેઠા. નગરશેઠની નજર એમના ઉપર પડતાં જ એ પ્રભાવિત થઈ ગયા. ખૂબ પ્રેમથી સામૈયું કરી ઘેર તેરી લાવ્યા. એમનું વ્યક્તિત્વ એટલું પ્રભાવશાળી હતું કે જે આવે તે જૂકી જાય. વળી મહારાજ બોલતા નહોતા એટલે તો એમનું માન એકદમ વધી ગયું.

સાંજે સત્યનારાયણની કથા હતી. એક તો કથા ને મૌની સાધુ મહારાજનાં દર્શન - એમ બેવડો લાભ હોવાથી પાંચસો માણસોની સભા થઈ ગઈ હતી. શેઠ વ્યવસ્થા પણ સરસ કરેલી. તાબડતોબ મંડપ બંધાવી, વ્યાસપીઠ ઉપર સ્વામીજીને બિરાજમાન કર્યો હતા. દરમ્યાન કથા પૂરી ગઈ. આરતી પતી જતાં થાળની તૈયારીઓ થવા લાગી. મહાપ્રસાદની તાસ ભરીને એક ભાઈ થાઈ ધરાવવા જતા હતા ત્યાં જ મૌની સ્વામી બોલી ઉઠયા :

‘ઓ ભાઈ, મને પણ થોડો આપજો.’

‘પણ મહારાજ, હજુ થાળ ધરવાનો છે.’ એમની અધીરતા ન સમજતાં પેલાએ

કહું.

‘પણ થાળ જલદી ધરીને મને શીરો આપજો. મને શીરો... શીરો...’ સ્વામીજીના આ અવાજમાં અધીરતા અને લોહુપતા બેયનું મિશ્રણ હતું.

લોકોનું, નગરશેઠનું સાધુ તરફનું માન તરત જ ઉત્તરી ગયું. એમની દીનતાભરી વાડી સાંભળીને લોકોને એમની બજાવટી ગંભીરતા અને વાસ્તવિક હલકાઈનો જ્યાલ આવી ગયો.

જીવન એક એવી વિચિત્ર બાબત છે કે એમાં ચઢ-ઉત્તર તો થયા કરે. જગત પાસે વધારે આશા બતાવીએ તો જ દીન અને નિરાશ થવાનો પ્રસંગ આવે ને? શેક્સપિયર કહેતો કે ‘હજાર હજાર આધાતોના વારસ આપણે બનવાનું છે! આ ધરતી છે, સ્વર્ગ નથી; ને ધરતીને પોતાનાં અનેક વળગણો છે, મર્યાદાઓ છે.’ માટે ખોટી આશા રાખશો જ નહીં. પછી દીનતાને અવકાશ જ ક્યાંથી મળશે?

તમારા કરતાં ધ્યાં વધારે કમનસીબ માણસો હોય છે એ ભૂલશો નહિ

એક માણસને ખરે બપોરે ઓફિસમાં સંદેશો આપવા જવાનું થયું. અના પગમાં બૂટ કે ચંપલ નહીં હોવાથી પગનાં તળિયાં દાડી ગયાં. પોતાની ગરીબી ઉપર એને બહુ નફરત આવી ગઈ. પણ પગથિયાં ચઢતાં એણે જોયું તો એક માણસના બે પગ જ કપાઈ ગયા હતા. એણે મનોમન ભગવાનને પ્રાર્થના કરી કે, ‘હે નાથ! તારો આભાર માનું છું કે ભલે મને પગરખાં ન આખ્યાં, પણ મારા પગ તો સલામત રાખ્યા છે ને!’ આ સાથે જ એનો બધો વિષાદ અને દીનતા ઓગળી ગયાં.

એક અરબી કહેવત છે : ‘મારે પગરખાં નથી એ દુઃખ, કોઈના કપાયેલા પગ જોઉં છું ત્યારે, દુઃખ જ નથી લાગતું.’ કોઈ બાબત પરતે જ્યારે પણ દીનતા ને લાચારીનો અનુભવ થાય ત્યારે આ વાક્ય યાદ કરી લેવું. ગમે એવી લાચાર પરિસ્થિતિમાં પડ્યા હોઈએ તો પણ આપણને દીનતાના અનુભવમાંથી એ

ઉગારી લેશે. આપણા કરતાં વધુ લાચાર પરિસ્થિતિમાં પડેલા માણસોએ હિંમત જળવીને, મહેનત કરીને, કેવી સિદ્ધિઓ મેળવેલી એની પ્રેરણાને આપણા જીવનમાં ઉતારીએ તો?

### ● તમારી પારો શું છે તેની તત્ત્વશરી તપાસ કરો :

પેલી રાજકુમારીની વાતની ખબર છે ને કે જે નાની હતી ત્યારથી જ દુઃખમાં ઊદ્ઘરતી આવી હતી? રાજપાટ હારી ગયેલાં એનાં માતાપિતાથી એ બાળપણથી જ છૂટી પડી ગયેલી. ભીખ માગીને એ જેમેતેમ પૂરું કરતી. એક વખત એને મસોતાની જરૂર પડી. પોતે બાળપણથી સાથે વેંફારતી હતી તે ગોદીના એક ખૂંઝામાંથી એણે એક ટૂકડો ફાડ્યો તો અંદરથી એક હીરો નીકળી પડ્યો! એ વેચતાં મળેલા સવા લાખ રૂપિયામાંથી નવા જીવનની શરૂઆત કરી. વિશાળ લિક્ષુકગૃહ અને ઉદ્ઘોગશાળા બંધાવ્યા.

આટલી મૂડીવાળો હીરો એના ગાભામાં છુપાયેલો હતો છતાં એને ખબર ન પડેલી! એટલે એને ભીખ માગવી પડી! આપણી સ્થિતિ પણ આવી જ છે ને? આપણે પોતાની ભીતરમાં ઊતરીને શોધીએ કે આપણી પાસે શું છે.

વળી બહાર પણ ‘જે નથી’ એ માટે દુઃખી થવાને બદલે, ‘જે છે’ તેનો આનંદ માણતાં શીખવું જોઈએ. જે ખોવાઈ ગયું એનો રંજ કરવાને બદલે, જે છે તેનો આનંદ વ્યક્ત કરો. ભગવાને તમને આપેલી નાનામાં નાની આશિષ-ભેટનો પ્રેમથી સ્વીકાર કરો, એની એક સૂચિ બનાવો ને એ આશિષ માટે વારંવાર એનો આભાર માનો.

તમારું ઘર નાનું છે, એક કે બે ઓરડીમાં જ રહેવું પડે છે એનું દુઃખ થાય છે? તો યાદ કરો કે અસંખ્ય માણસો છાપરાંમાં રહે છે, ને બીજા અસંખ્યોને જૂપડીનો લાખ પણ નથી મળતો. ધરતીની પથારીને આભનું ઓઢણ કરીને એમને જિંદગી ખેંચવી પડે છે. તમને કોઈ

શારીરિક તકલીફ છે? તો ભયંકર રોગનો શિકાર થઈ પડેલા, અસંખ્ય પીડાતા ને અપંગ બની ચૂકેલા અસંખ્ય આજરોનો જ્યાલ કરો. તમને કમાણી ઓછી લાગે છે? તો બેકારોની શી હાલત હશે? તમને એમ નથી લાગતું કે એમની સરખામણીમાં તમે ઘણા નસીબદાર છો?

‘પરિસ્થિતિ વણસી છે. પણ આથી વધારે વણસી નથી એટલું સાંદું છે’ - આ વિચાર દ્વારા તમારા દુઃખને હટાવી શકશો. વિચારના ચકની દિશા સહેજ ફેરવવાથી તમને લાગશે કે તમે માનો છો એટલા બધા દીન થવાની તમારે જરૂર નથી.

### ● સબળ બનો; હિંમત રાખો. વળતાં લડી લો

શહીદ ભગતસંહને જ્યારે કેદમાં પૂરવામાં આવેલા ત્યારે અંગ્રેજના પીહુ જેવા ગદાર ભારતીય નેતાએ એમને કહેલું : “મારી ભૂલ થઈ ગઈ એમ કહી અંગ્રેજ સરકારની મારી માગો તો, તમને નિર્દોષ છોડાવી દઈ માનઅકરામ અપાવું.”

‘ટૂકડા થઈ જાઉં તો બહેતર, પણ હું વળીશ તો નહીં જ. ભલે ખતમ થઈ જાઉં, પણ અંગ્રેજ સરકાર પાસે દીન બનીને, ઘૂંટણિયે પડીને, જીવનની ભીખ તો કદી નહીં જ માગું. માભોમની સ્વતંત્રતા માટે પ્રગટેલા આ યજ્ઞમાં ભલે મારી આહૂતિ પણ અપાઈ જાય. હું ખતમ થઈ જઈશ પણ નમન મને સ્વીકાર્ય નથી.’ સિંહની ડણકે ભગતસિંહે જવાબ આયો ને થોડા જ દિવસમાં, હસ્તે મુખે, એ ફાંસીના તખા પર ચઢી ગયા.

આવા જ એક ખુમારીવાળા નરબંકાએ કહું છે કે, ‘અનેક ધાને કારણે મારું મસ્તક લોહીથી ખરડાયું છે, પણ હજ અણનમ જ છે.’ આપણે બરાબર આ દાખિકોણ અપનાવવાનો છે. ભલે શોણિતે ખરડાઈએ, પણ રહેવું તો અણનમ જ.

એક અંધ ભાઈની કોઈએ દ્યા ખાતાં એમણે તરત જ જવાબ આપી દીધેલો : ‘મારામાં જે ખરેખરો ‘હું’ બેઠેલો છે તેને તો અંધત્વ બિચારું સ્પર્શી પણ શક્યું નથી.’

હદ્યની આ વજ તાકાત તમારી અંદર પણ બેઠેલી છે જ. દીનતાના ઢીલા ને ગીલા ધાબળા નીચે એ ગરમાવાને તમે દટાઈ જવા ન દો. તો કિયાશીલ બનીને હુમેશ માટે તમને મદદ આપી શકે એટલી એની ગુંજાશ હોય છે. જીવનભર માનવમનનાં ગહનતમ રહસ્યોને પારખી આપનાર વિશ્વવિષ્યાત મનોવૈજ્ઞાનિક એડલર તો કહેતા કે, ‘માનવીની અંદર કોઈ પણ હાનિને લાભમાં પલટાવી દેનારી અંભ મનઃશક્તિ બેઠેલી છે! બસ, કામ છે એને જગાડવાનું.’

શું બન્યું એ વાત જ મહત્વની નથી. જે કાંઈ બન્યું એ તમે કેવી રીતે સ્વીકાર્યું, એ પડકારને તમે કેવી રીતે જીવ્યો એ જ અગત્યની વાત છે. વસ્તુ કે વિગત નહીં, એ વિશેનો તમારો અભિગમ જ મહત્વનો છે.

દીનતાને હટાવવાનો એક ઉત્તમ રસ્તો આ જ છે : ટ્રાફર ખડા થઈ જાઓ. પરિસ્થિતિના પડકારને જીલી લો. અકળાયા વગર એની સામે યુદ્ધ આદરો. વેદનાની પછેડી ઓઢીને સૂનમૂન બનીને બેસી ન રહેશો. ઊભા થાઓ, લડત આપો. કંઈક કરો. સમય તો પોતાનું કામ કર્યે જ જાય છે. પણ તમારે કર્મરત બની તમારો ફાળો પણ નોંધાવવો જોઈએ. સખત કામ કરો. મનને એમાં જોડેલું રાખો. નવી જવાબદારીઓ લો. જિબ્રાન કહેતો કે ‘પથરની ઠેસ વાગે તો તમે ઉપાડીને ફેંકો દો. પણ કોઈ ગ્રહ અફળાય તો શું કરશો?’ એની સાથે બાથ ભીડવા જાઓ તે ચાલશે? સામે ચાલીને મોતને નિમંત્રણ આપવું એ મૂખ્યી છે. ડરીએ નહીં એ કબૂલ, પણ અવિચારી સાહસ પણ ન જ કરીએ; કારણ કે, એવું સાહસ આપણાને હાંસીને પાત્ર બનાવી દે છે.

એક ચીની ચિંતક કહેતો : ‘બતકના પગ નાના છે ને બગલાના પગ મોટા છે તે છે. તેમાં હું શું કરી શકવાનો હતો?’ ટૂકમાં, જેમાં આપણાથી કાંઈ જ વળી શકે તેમ ન હોય તેની સાથે માથાં અફાળીને પરેશાન થવા કરતાં તેનો સ્વીકાર કરવામાં

વધારે શાંતિ રહેશે. એમ ન કરતાં ગણગણાટ કર્યા કરીએ તો દીનતા વધે છે. કાંઈ વળતું તો નથી જ, એટલે અસંતોષ વધે જ. જ્યારે અનિવાર્યને આનંદથી સ્વીકારી લઈએ તો એ યંત્રણાઓમાંથી બચી જવાય છે. પવન આવે ત્યારે ટહ્હાર ઊભા રહેવા મથતી આમલીઓ તૂટી પડે છે ને જૂડી જનારાં નેતર ટકી જાય છે અને પાછાં ઊભાં થઈ જાય છે.

### ● દીનતા એ પુષ્ટતાની કચાશની નિશાની છે. એમાંથી મુક્તા થાઓ.

વીસેક વર્ષની વયના એક યુવકે ગામના એક લોકપ્રિય પૂજારીને ખોળે માથું મૂકીને રડતાં રડતાં કહ્યું : ‘પણ હું હવે નાદાન નથી. હું પુષ્ટ થયો છું.’ આ વખતે એ પુષ્ટ આદમીનાં દૂસરાં તો ચાલુ જ હતાં!

આને તમે પુષ્ટ શી રીતે કહી શકશો? દર્દ, આંસુ, જલન, વેદના અને ઝેર એ આપણા સહુના અનુભવો છે. પણ એનાં પ્રદર્શન ન હોય, એની કોઈ જહેરાત ન શોભે. દર્દને દિલમાં જ દબાવી રાખો, આંસુને આંખની અંદર જ રોકો. જલનને અંતરમાં જ ભડભડવા દો. વેદનાને ભિતરમાં દફનાવો. ઝેરને અંદર જ પચાવી જાઓ. એમને બહાર બતાવીને દીન ના બનશો.

‘દીનતા અપુષ્ટતાની નિશાની છે, અને હું એટલો અપુષ્ટ નથી’ આ વિચારના એક જ ધક્કાથી તમે દીનતાની જૂંપીને પાયામાંથી ખોદી નાખી શકશો. તમારા આ સંકલ્પને મૃત્યુધંટ બનાવી દો. કારણ કે પછી દીનતા દ્વારા અપુષ્ટતાના આશ્રિત બનવાનું મન નહિં જ થાય.

દીનતા અંદર અનુભવનાર અને બહાર વ્યક્ત કરનાર પેલી લાકડીને બગડી ગયેલી એકમાત્ર દીકરી જેવો છે, માના ખોળામાં માથું મૂકીને રોયા કરે. આ તો બાલીશતા કહેવાય, કોઈ પણ હિસાબે એના ચક્કરમાંથી છૂટવું જોઈએ. જાતને વારંવાર કહો : ‘આપણે હવે નાના નથી!’

આપણે નાના નથી એ વાત એક બીજી રીતે પણ ધ્યાનમાં લેવા જેવી છે. આપણી છેલ્લી પણ સહેલેય ઉત્તરતી નહીં એવી આ યુક્તિ જોતાં એની ચર્ચા કરીએ :

### ● સર્વેશ્વરનું શરણું સ્વીકારો

કહે છે કે ચાતકને ગળે કાણું હોય છે એટલે જમીન ઉપરથી સીધું તો એ પાણી પી શકતું જ નથી. દંતકથા એવી છે કે આકાશમાંથી વરસાદ આવતો હોય ત્યારે ચાંચ ઊંચે રાખીને જ એ થોડાં ટીપાંથી પોતાની વરસભરની તરસ છિપાવી લે છે. એક સંસ્કૃત કવિએ કલ્પના કરી છે કે આવું ચાતક તરસથી પીડાઈને, દીન બનીને, ખાબોચિયા પાસે પાણીની માગણી કરે એ કેવું પતન કહેવાય! રાજનાય રાજ ગણાય એવા મેઘરાજને ધેર જેની સનાતન પરબ મંડાયેલી છે એવું ચાતક, એહું પાણી પીએ એ તો કળિયુગના આગમનની જ એંધાણી કહેવાય ને!

માણસ જેવા માણસ પણ, પોતે ભગવાનનો પુત્ર છે એ મહાન સત્ય ભૂલી જઈને, પોતાનું ખમીર અને ખુમારી ભૂલીને, સાવ સામાન્ય માણસ પાસે ખોળો પાથરી, દીનતાનાં વચન બોલે એ યોગ્ય કહેવાય?

ગાયત્રીના પ્રભર ઉપાસક શ્રી શ્રીરામ શર્માજી પાસે અમે એક વાર બેઠા હતા. ત્યાં એક મૂરખ માણસે આવીને એમને કહ્યું : ‘મને દીકરો થાય એવા આશીર્વાદ આપો તો હું તમને પચીસ રૂપિયા ભેટ ધરું.’

આચાર્યજી હસીને કહે : ‘દીકરો ક્યાંથી લાવી આપું?’

‘ગાયત્રી માતા પાસેથી.’

‘અને... બદલામાં તમે મને શું આપવાનું કહ્યું?’

‘પચીસ રૂપિયા.’

‘વાહ, હિસાબ સારો બેસતો થાય. માતાજી મને દીકરો આપે તે લઈને હું તમને આપું અને તમે મને પચીસ રૂપિયા આપો. બરાબર છે ને?’

‘હા.’

‘એ રૂપિયા પણ તમે માતાજી પાસેથી જ લાવવાના ને?’

‘હાસ્તો.’ પેલાએ તરત જ જવાબ આપ્યો.

‘તો ભલા માણસ, આમ ચાર ચોપડા ચીતરવાની જરૂર શી? તમે જાતે જ માતાજી પાસેથી દીકરો મેળવી લો ને મારે જોઈતા રૂપિયા હું પણ માતાજી પાસેથી મેળવી લઈશ. ઉબલ આપલે કરવાની જરૂર શી?’

જવાબ સાંભળી પેલાને લાગ્યું હશે કે વિદ્વાન ગણાતા આ સંતની સમજ ઓઈ છે, પણ મને તો એક પાઠ મળી ગયો. દીન બનીને કોઈની પાસે યાચના કરવી એના કરતાં ભગવાન પાસે જ ખડા શું કામ ન થઈ જવું! એ અનાથોનો નાથ, અસહાયનો સહારો, દૂષ્ટાનો તારણહાર, ચૌંદ ભુવનનો સ્વામી, દુનિયાનો પાલનહાર, આપણો સર્જનહાર, સર્વશક્તિનો સ્વામી, બ્રહ્માંડનું નિયંત્રણ કરનારો, કીરીના પગના જાંજરને પણ સાંભળનારો, પતંગિયાની પાંખના ટપકાને માથે બીજા રંગનું ટપકું મૂકનારો - એવા રાજાઓનાય રાજા પાસે જઈને આપણે દિલની વેદના શું કામ ના ઠાલવવી? દીન બનવું જ હોય તો એ દીનદયાળની પાસે બનીએ, દારિદ્રયાનાં રોદણાં રડવાં જ હોય તો દારિદ્રયબંજકને આંગણે જઈએ. પણ અધવચ્ચે પથ્રરહુદ્યી, મનના મેલા, સ્વાર્થના ભરેલા, મારીપગા માણસની પાસે ખોળો શું કામ પાથરીએ? દુઃખનું શું કામ રડીએ? નિર્જન વનવગે, અલી વાદળી! જળ શાં ઢોળવાં અમથાં? રણે રગડોળવાં અમથાં!

કેટલાય દીનજનોને એઝો ઉદ્ઘાર્યો. મગરના મુખમાંથી હાથીને બચાવ્યો, પાંચાળીનાં ચીર પૂર્યો, મીરાનાં જેરનાં અમૃત કરી દીધાં, અર્જુનનો રથ હાંક્યો. ધ્રુવના આયખાને ઉજજવળ કરી દીધું. અહો! આ દીન દ્યાળુએ ગણતાં થાકીએ એટલાં કામ કર્યા છે. એનો સહારો શા માટે ન લઈએ?

સુને રિ મેં ને, નિર્બલકો બલ રામ!

જેનું કોઈ નથી એનો સહારો મારો રામ છે. આપણા સહનો બેલી છે, પછી રડવું શું? રડવું શું?

ઉઠો મારા આતમદેવ! દીનતાને બંઘેરીને ફંગોળી નાખો. હતાશા હઠાવીને ઊભા થઈ જાઓ. ભગવાનનું શરણ સ્વીકારો, આત્મબળને જગાડો. જે શક્તિઓ અંદર સુષુપ્ત પડી છે એમને ઢંઢોળી કામે વળગાડો. એક એવું તેજ પેદા કરો, એક એવી તાકાત એને જોમ જાગવા દો અંદર કે દીનતા શિયાળની જેમ ભાગી જાય; તમારા જીવનના પટાંગણમાં એને પગ મૂકવાની જગા ન મળો. દીનહીન બની રહેવા તમે સર્જયા નહોતા. દુઃખ એવિ વિધાનની સાથે તમારે સ્વજ્ઞેય સંબંધ નહોતો. પરમ સચ્ચિદાનંદના કેન્દ્રમાંથી તમારું પ્રાગટ્ય થયું છે. અસીમ આત્મબળનો દરિયો તમારી અંદર ધૂઘવાટા મારી રહ્યો છે. પછી તમારે દીન બનીને બેસવાનું હોય જ શા માટે?

(‘શક્તિ દર્શનમ्’ માંથી સાભાર)

### માતૃત્વ

(અનુસંધાન : પાના નં.-૨૪ ઉપરથી ચાલુ)

બારીએથી ખસવાનું હું નામ લેતો નહીં, મા પણ ઉતાવળ કરતી નહીં.

બારીમાંથી ચકલીઓ, કબૂતર, કાગડા, કોયલ, મોર, પોપટ જેવાં બધાં જ પક્ષીઓની ઓળખાણ કરાવતી. પક્ષીઓ આવે અને આવતાં રહે, માટે મા જતજતનાં, તેમને ભાવતાં ચણ નાંખતી. જેવાં પક્ષીઓ આવે કે માની પાઠશાળા શરૂ.

કાગડા અને કોયલ વચ્ચેનો સૌપ્રથમ તફાવત માએ જ સમજાવ્યો હતો. પક્ષીઓ જ શા માટે, બકરી, શાન, ઘોડા, ગધેડા, ગાય, ભેંસ જેવાં પશુઓનો પરિચય પણ વિસ્તારથી મા કરાવતી. મને બાળપણમાં જ જાણવા મળ્યું હતું કે, ચકલી, કબૂતર, કાગડા, કોયલ, પોપટની જેમ પશુઓ ઊરી શકતાં નથી. બકરી ના ઊરી શકે. ગાય પણ નહીં. ઘોડો ઝડપથી ઢોરી શકે, ઊરી શકે નહીં.

વૃક્ષો, ફૂલજાડ, પાંદડાંઓ, ફળોની ઓળખાણ માએ નાનપણમાં જ કરાવી દીખેલી. બા બાળકની બારી છે. બાળક બાની નજરે જ દુનિયા જુઓ છે. એવું જુઓ છે અને સાંભળે છે કે જિંદગીભર યાદ રહી જાય.

મારી તથા માતાજીની આ બારી - રમત અમારી ખાસ કરીને મારી પ્રિય રમત હતી. બીજ ઘણી રમતો હતી પણ મને બારી - રમત સહુથી વધારે ગમતી.

બા અને બારીમાંથી કીણ મને વધારે ગમતું? એવું ના પૂછશો. ગમવામાં સરખામણી કરવી ઠીક નથી.

પછી તો હું મોટો થયો. એટલે કે, ઉમરમાં. અને મોટો થતો જ ગયો. ત્યારે પણ બારીએ ઊભા રહેવું મને ખૂબ જ ગમતું. કહી શકો કે, કલાકો સુધી હું બારીએ ઊભો રહેતો. દુનિયા નિહાળ્યા કરતો.

અને હા, ત્યારે મા મારી સાથે જ છે, એવો ભાસ થતો જ. ક્યારેક મા બારી સાથે બારીએ ઊભી છે અને એ રીતે હું વાત પણ કરી લેતો.

બારી બહાર આખું પથ્રવરણ ફેલાયેલું છે એનો પરિચય જ્યારે માતા કરાવે છે, ત્યારે કુદરત જીવતી થઈ જાય છે. એ વૃક્ષો, પક્ષીઓ, વાદળો, ચૂરજ, તડકો - છાંયો બધાં બાળકનાં રમકડાં બની જાય છે. બાળક જાતે જ એ રમકડાંઓમાંનું એક રમકડું બની જાય છે.

મારું નાનું મોટું, વ્યવહારું કે સાહિત્યનું જે કંઈ લેખન થયું એ બારીની નજીકથી જ થયું છે. બારીની નજીકથી, બાની નજીકથી.

મેં કહી મારી જતને એકાકી અનુભવી નથી. ક્યારેક તો એ સામૂહિક વાતાવરણ જ કવિતા ગાવા લાગતું. સંગીતની રચના એમ જ થઈ રહેતી. મેં ઘણી રચના ગાતાં ગાતાં કરી છે. ઘરમાં ઘણાં બધાં છે, પણ બાળકની બારી તો બા જ. મારી રચનાઓને એટલે જ મેં માતૃકથાઓ કહી છે.

(શ્રી હરીશ નાયક કૃત ‘મા! તુરુ સલામ’માંથી)



## આમાર હિંદુ-લૂહાન બાંગલા...

• સંજ્ય ગોસાઈ •

બાંગલાદેશમાં હિંદુ પૂજારીની સરેઆમ ગળું કાપી કરાયેલી હત્યા બાદ ફરી એક વખત બાંગલાદેશમાં રહેતા લઘુમતી હિંદુઓની દારુણ અને નિઃસહાય પરિસ્થિતિ પર ચર્ચા ચાલી છે. પરંતુ ખેડ એ વાતનો છે કે, ૧૯૪૯ હોય, ૧૯૭૧ હોય કે ૨૦૧૬ - અહીંનાં હિંદુઓની સ્થિતિ જેમની તેમ બની છે, ત્યારે પ્રસ્તુત છે બાંગલાદેશી હિંદુઓની વથી પર વિશેષ લખ્ય...

બાંગલાદેશના ઉત્તરી પંચાગઠ જિલ્લાના પ્રસિદ્ધ દેવીગંજ મંદિરનાં ૫૦ વર્ષથી પૂજારી જનેશ્વર રોયની કેટલાક હથિયારધારી કહૃરવાદીઓએ સરેઆમ ગળું કાપી હત્યા કરી દીધી હતી. ઘટના બાદ અહીંના હિંદુઓ પોતે બાંગલાદેશમાં હિંદુ તરીકે જન્મવાની ક્ષણને કોસી રહ્યા છે અને હવે કયા હિંદુનું ગળું કહૃરવાદી ઈસ્લામના છરાની ભેટ ચડશેનો અંદાજો લગાવી રહ્યા છે.

ભારતમાં ભયંકર માર-કાપ મચી છે. સરકાર હિંદુ કહૃરવાદીઓના ઘૂંટણ્યાયે પડી ગઈ છે. પરિણામે ચારેકોર અસહિષ્ણુતા ફેલાઈ છે. શાંતિપ્રિય અને સહિષ્ણુ મુસ્લિમ કોમના લોકોને હિંદુ કહૃરવાદીઓ ધરમાંથી કાઢી-કાઢી રહેંસી રહ્યા છે. ભારતમાં ઈસ્લામ ખતરામાં છે વગેરે...વગેરે...જેવી હોહાની મૌસમ આપણે ત્યાં સમયે સમયે આવતી રહે છે. ખાસ કરીને જ્યારે કોઈ રાજ્યમાં ચૂંટણી યોજાવાની હોય ત્યારે આ મૌસમ પૂરબહારમાં ખીલે છે. જાતે જ પોતાને સેક્યુલર ગણાવતા આ દેશના રાજકીય પક્ષો, એમની જ જમાતના કેટલાક બુદ્ધિજીવો અને માધ્યમો ભારતના કોઈ ખૂણામાં રહેતા કોઈ મુસલમાન વ્યક્તિને નાનો અમથો પણ ધસરકો પડે ત્યારે કાનના પરદા ફાટી જાય એટલી હદે રાડારાડ કરી મૂકે છે. માધ્યમોમાં ભારતમાં લઘુમતીઓની સ્થિતિ અને પરિસ્થિતિને લઈને કલાકોના કલાકો ચચ્ચાઓ ચાલે છે, પરંતુ બીજી બાજુ પડોશી દેશ પાકિસ્તાન અને બાંગલાદેશ જેવા દેશોમાં હિંદુ લઘુમતીઓનાં ગળાં રહેંસીને

### રાઈટ બ્રાઇસનું વિમાન

ઈ.સ. ૧૯૦૩માં રાઈટ બંધુઓએ ફ્લાઇર નામનું વિમાન પ્રથમ વખત ઉડાવ્યું હતું. આ વિમાનના એન્જિનનું વજન ૨૦૦ પાઉન્ડથી ઓછું હતું અને ૧૨ હોર્સ પાવરની તાકાત હતી. આ વિમાન ૧૨ સેકન્ડ માટે ઉડ્યું હતું.

અમેરિકાની એરોસ્પેસ ટેકનોલોજી કંપનીએ વિમાનની વચ્ચે એક પારદર્શી જગ્યા બનાવી ત્યાં બેઠકો બનાવી. અહીં બેઠેલા યાત્રીઓ વિમાનમાં બેસીને સંપૂર્ણ આકાશને નિહાળી શકે છે. કંપની આ પેટન્ટ માટે પ્રયત્ન કરે છે. ■

હત્યાઓ કરાય છે, છતાં ભારતનો કોઈ જ બુદ્ધિજીવી કે સેક્યુલર તેની વિરુદ્ધ અવાજ ઉડાવવાનું તો ઢીક, પરંતુ ઘટનાને લઈને એક હરફ સુદ્ધાં ઉચ્ચારતો નથી. ભારતમાં લઘુમતીઓની સ્થિતિને લઈને કલાકોના કલાકો ચર્ચા કરતાં માધ્યમો પાકિસ્તાન બાંગલાદેશમાં વસતી હિંદુ લઘુમતીઓની વાત આવે ત્યારે મિયાંની મીંદરી બની જાય છે.

વિશ્વમાં હિંદુઓની સૌથી વધુ વસતી છે એવા દેશોમાં ભારત, નેપાળ અને ત્યારબાદ બાંગલાદેશ ગીજા કરે આવે છે. હાલ અહીં લગભગ દોઢ કરોડની આસપાસ હિંદુઓ વસતી રહ્યા છે. ૧૯૪૭ના ભારત-પાકિસ્તાન ભાગલા વખતે પૂર્વ પાકિસ્તાન ગણાતા બાંગલાદેશમાં ૨૮ ટકા હિંદુ વસતી હતી. પરંતુ ૬૦ના દાયકામાં સ્વતંત્ર બાંગલાદેશની ચળવળ બાદ પાક. તરફી કહૃરવાદીઓ અને પાકિસ્તાની સૈન્યએ આ ૨૮ ટકા હિંદુ જનસંખ્યા પર જે અત્યાચારો કર્યા તેનો આખો ઇતિહાસ છે, જેને પરિણામે લાખો હિંદુઓ બાંગલાદેશ છોડી ભારતના શરણાર્થી બન્યા. ૧૯૭૧માં અલગ બાંગલાદેશ બચ્ચા બાદ પણ અહીંના હિંદુઓની પરિસ્થિતિમાં લેશમાત્ર પણ સુધારો આવ્યો નહીં અને ૧૯૭૭ બાદ અહીં કહૃરવાદ અને હિંદુદેખની એવી આંધી ફૂંકાઈ કે ૧૯૮૧ સુધીમાં હિંદુઓની વસતી અડધાથી પણ વધુ ટકા ઘટીને ૧૨ ટકા રહી ગઈ.

(સોઝન્ય : 'સાધના')

### ગાર્ડન કે બિલ્ડિંગ

ઈટાલીના મિલાન શહેરમાં બોસ્કો વર્ટીકલ નામની બે બિલ્ડિંગને સૌથી સુંદર લાંબી બિલ્ડિંગનો એવોઈ મળ્યો છે. તે બિલ્ડિંગના દરેક ફ્લોર પર એક મોટી બાલ્કની છે. જેમાં આશરે ૬૦૦ વૃક્ષો અને ૧૪ હજાર છોડ ઉગાડવામાં આવ્યા છે. આ વૃક્ષોથી ગરમીમાં ઠંડક અને શિયાળામાં ઠંડા પવનથી રક્ષણ મળે છે. આ બિલ્ડિંગમાં હવા અને સોલર એનર્જી વિદ્યુત પુરવઠો પૂરો પાડવામાં આવે છે. ■



## અંતર પણ જરૂરી

• સ્વ. જ્યવદન પટેલ •

ઈસુએ તો કહ્યું છે : ‘તમે તમારી જાતને ચાહતા હોવ, એટલું જ તમારા પડોશીને પણ ચાહો.’ આપણે ત્યાં એક બીજી પણ કહેવત છે કે પહેલો સગો પડોશી. વાત બિલકુલ સાચી છે. તમારાં નજીકનાં સગાં તો કદાચ તમારાથી દૂર દૂર કોઈ બીજા ગામ કે નગરમાં રહેતાં હશે. તમારા સુખ-દુઃખમાં તો તમારો પડોશી જ પહેલાં દોડી આવશે. નાનું-મોહું કામ હશે કે નાની મોટી મુશ્કેલી હશે તો પહેલો અવાજ પડોશી સાંભળશે અને એ દોડી આવશે. તમારે બેસતાં ઉઠતાં પડોશીની જરૂર પડવાની છે.’

સુખેથી અને શાંતિ રહેવું હોય તો કદી પડોશીને દુશ્મન બનાવશો નહીં; પડોશીની સાથે તમારે આડવેર હશે અણાબનાવ હશે, કડવાશ હશે તો તમે કદી ચેનથી કે નિરાંતરથી ઊંઘી શકશો નહીં. તમારે સતત ભયમાં અને ફફડાટમાં જીવું પડશો. પડોશી સાથે સારો સંબંધ હશે તો તમે હળવાશથી નિશ્ચિત બનીને જીવી શકશો. પડોશીને પ્રેમ કરો એનો અર્થ જ એ કે તમારા પડોશી સાથે હંમેશાં સારો સંબંધ રાખો. થોડું સહન કરવું પડે તો પણ, થોડું ઘસાઈ છૂટવું પડે તો પણ તમારા પડોશી સાથેનો સારો સંબંધ જાળવી રાખજો.

પડોશી સાથે સાથે સંબંધ રાખવો એનો અર્થ એવો પણ નથી કે તમારા ઘરના છેકે રસોડા સુધી કે શયનખંડ સુધી પ્રવેશવા એને છૂટ આપવી. પડોશી સાથે સારો સંબંધ રાખીએ, પરસ્પર સહકારથી, સુમેળથી સ્નેહથી જીવીએ, એની મુશ્કેલીમાં આપણે એને મદદ કરીએ, આપણી મુશ્કેલીમાં એ આપણી સાથે આવીને ઊભો રહે, એ બધું જ સાચું પણ પડોશી સાથેના સંબંધમાં પણ અમુક અંતર રાખવું જરૂરી બને છે. આવું અંતર ન રાખીએ તો

ક્યારેક ‘અતિ પરિચયાત્ અવજ્ઞા’ જેવું બને છે. વધારે પડતા નજીક જવામાં પણ જોખમ રહેવું છે. સંબંધની મીઠાશ જરૂરી છે. પણ વધું પડતી મીઠાશ જ્યાં હોય ત્યાં જલદી જીવાત પડતી હોય છે.

સોમનાથભાઈ અમારી ઓફિસમાં કામ કરે છે. એમને ત્યાં ઘેર તો ટેલિફોન હતો નહીં; એમના પાડોશી મનસુખભાઈને ત્યાં ફોન હતો. મનસુખભાઈના ફોનનો ટેલિફોન નંબર અમને બધાને એમણે આપી રાખ્યો. અમે ફોન કરીએ એટલે તરત જ મનસુખભાઈના ઘરનાં માણસો સોમનાથભાઈને બોલાવે. ઘણો સમય આમ ચાલ્યું. અમે એક દિવસે ફોન કર્યો તો જવાબ મળ્યો : “સોમનાથભાઈના ઘર સાથે હવે અમારો સારો સંબંધ નથી.” અમે આ વાત સોમનાથભાઈને કરી. તો સોમનાથભાઈએ મનસુખભાઈની વિરુદ્ધ પુરાણ શરૂ કરી દીધું. અને કહ્યું : “એક દિવસની રાતે અમારા એક સંબંધીનો ફોન આવ્યો અમને બોલાવ્યા જ નહીં. એમનો છોકરો બીમાર હતો ત્યારે અમે ઉંગારા કર્યા હતા. એમને અક્ષમાત નડચો હતો, ત્યારે હોસ્પિટલમાં અમે ખકા ખાધા હતા. એ મનસુખભાઈ કેવા કેવા બે નંબરના ધંધા કરે છે, એ શું અમે નથી જાણતા? એ માણસને અમે ધારીએ તો ઘરીના છઢા ભાગમાં જેલ કરાવી દઈએ એમ છે. એનો એક છોકરો તો જુગારી અને દારૂદિયો છે.” માત્ર એક જ વખત રાત્રે ટેલિફોન આવ્યો, બોલાવ્યા નહીં, એમાં તો સોમનાથભાઈએ એમને કેટલી બધી ગાળો દઈ દીધી.

એ જ મનસુખભાઈ અમને મળ્યા ત્યારે એમણે નમ્રતાથી ખુલાસો કર્યો : “રાત્રે અગિયાર વાગે ટેલિફોન આવે, એમને બોલાવા કોણ જાય? બસ તમારા સોમનાથભાઈએ તો વાતનું વતેસર કરી

નાખ્યું. અને આજ સુધી અમે સારો સંબંધ રાખ્યો હતો, તેની પર પાણી ફેરવી લીધું. હવે મને સમજાયું છે કે પડોશી સાથે સારો સંબંધ કે સારો વ્યવહાર જરૂર રાખવો, પણ એને ખૂબ નજીક તો નહીં જ આવવા દેવો. અમે સંબંધ વધાર્યો તો એ આજે અમારું ભૂંકું બોલે છે ને!” કહેવાનો મતલબ એ છે કે પડોશીના સંબંધમાં પણ સમતોલપણું હોવું જોઈએ. તમે પોંચો આપો અને તમારો આખો ને આખો હાથ કરી ખાનાર પડોશીઓ પણ હોય છે. તમે સૂવા માટે ઓટલો આપો અને આખોને આખો ઓરડો પચાવી પાડનારા પડોશીઓ પણ હોય છે.

સુમનભાઈ સુખી અને સજજન માણસ છે. અમારી સોસાયટીમાં એમનો બંગલો હતો. એમની પડોશમાં જ પ્રમોદભાઈ વસ્તારી હતા એટલે એમણે સુમનભાઈ પાસે એમના બંગલાનો એક રૂમ થોડા દઢાડા માટે વાપરવા માંગ્યો. સંબંધ સારો હતો એટલે સુમનભાઈએ એક ઓરડો વાપરવા આખ્યો. બે-ત્રાણ મહિના થયા. ચાર-દિન મહિના થયા. સુમનભાઈએ એ ઓરડો ખાલી કરવા જણાવ્યું તો ભારે તકરાર થઈ ગઈ. આજે પણ પ્રમોદભાઈ રૂમ ખાલી કરતા નથી, સુમનભાઈ કહે છે : પડોશીને મૂંજવાણ હતી, મેં મદદ કરી તો મારી આ દશા થઈ. સારો સંબંધ હતો. સંબંધ જળવાઈ રહે એ માટે મેં ઓરડો વાપરવા આખ્યો. આજે સંબંધ કડવો જેર થઈ ગયો છે. પડોશી તરીકેનો ધર્મ બજાવવા જતાં આવું પણ બનતું હોય છે.

કોઈ વાર પસ્તાવાનો વારો પણ આવે છે. તમે તમારા પડોશી સાથે સારો સંબંધ રાખો છો. એના સારા-માઠા પ્રસંગે તમે હાજર થઈ જાવ છો. એ પણ તમારા સારા-માઠા અવસરે હાજર થઈ જાય છે. તમારે ઘેર સારી વાનગી બની હોય તો

તમે એને ઘેર મોકલાવો છો; એને ઘેર સારી રસોઈ કે મીઠાઈ ફરસાણ થયાં હોય તો એ તમારે ત્યાં મોકલે છે. બાબે કુટુંબો વચ્ચે આમ સારો મેળ જામી ગયો છે. તમે એના ઘરની, એના ઘરના માણસોની ટેવો, સ્વભાવ, ખામીઓ જાણો છો. એ તમારી અને તમારા ઘરના માણસોને બરાબર ઓળખે છે. સારો સંબંધ હોય એટલે સ્વાભાવિક જ તમે તમારા ધંધાની વાતો પણ એને કરો, વ્યવહારની અને કૌટુંબિક જીવનની કેટલીક ખાનગી રાખવા જેવી વાતો પણ સહજભાવે લાગણીથી એને કહી દો. આમ તમારો પડોશી તમારા અંગત જીવનની ઘણી વાતો પણ જાણતો હોય.

પણ કોઈવાર, કોઈ મામૂલી વાતમાં મતભેદ પડે કે તકરાર થઈ જાય, અને સંબંધ બગડે ત્યારે તમારા વિષે જે કાંઈ જાણતો હોય કે એને તમારા અંગત જીવનની વાતોની જાણ થઈ હોય તે બધી વાતો ડેર ડેર કહેતો ફરે તો? આવું ઘણી વાર બનતું હોય છે. સારો સંબંધ હોય ત્યાં સુધી ઠીક છે પણ સંબંધ બગડવો ત્યારે? ત્યારે તમારી બધી નબળાઈઓ અને કમજોરીઓની વાતો એ જાહેરમાં કહેતો ફરે તો? તો તમને કેટલું નુકશાન થાય? અને તમને પસ્તાવો પણ થાય કે, અરેરે! આવા માણસ સાથે મેં સંબંધ રાખ્યો? આવા માણસને મેં મારા જીવનની ખાનગી વાતો કરી? જે નહીં કહેવું જોઈએ એ બધું જ મેં મારા એ પડોશી સમખ ખુલ્લું કરી દીધું. એનું જ આ પરિણામ ને? આના કરતાં તો મેં એની સાથે અમુક અંતર રાખીને વાત કરી હોત તો કેવું? વધારે પડતા નજીક જવામાં પણ એક પ્રકારનું જોખમ છે. તમારા પડોશી સાથે જરૂર મીઠો સંબંધ રાખો, પણ એની આગળ, મીઠો સંબંધ છે, એટલે સાવ ખુલ્લા થઈ જશો નહીં.

પડોશી પર વિશ્વાસ મૂકવામાં પણ

વાંધો નથી; પણ બધી બાબતોમાં વિશ્વાસ મુકાય નહીં. તમે એની આગળ તમારા ધંધાની કે અંગત જીવનની વાતો કરતા પહેલાં લાખ વાર વિચાર કરજો. કોઈ વાર તમે નિખાલસ ભાવે પણ કરેલી વાતોનો દુરુપયોગ પણ થઈ જાય, અને તમારે સહન પણ કરવું પડે. એટલે જ પડોશી સાથેના વ્યવહારમાં પણ થોડું અંતર જરૂરી છે. બધા જ પડોશી એકસરખા હોતા નથી. બધા જ બધી રીતે સારા હોતા નથી, કે બધા જ બધી રીતે ખરાબ હોતા નથી. એટલે બધા જ પડોશી પ્રત્યે અવિશ્વાસ રાખીને વ્યવહાર કરવો એ રીત બરાબર નથી. વિશ્વાસ જરૂર મૂકો, પણ છેતરાઈ જવું પડે કે સહન કરવું પડે ને પસ્તાવું પડે એટલી હદ સુધી વિશ્વાસ મૂકશો નહીં. જીવન સુખથી જીવવા માટે માત્ર ભાવનાપ્રધાન હોવું બરાબર નથી, એ માટે વ્યવહારું અને વાસ્તવિક પણ બનવું જોઈએ.

સારો પડોશી મળવો એ પણ એક સદ્ગ્ભાગ્ય છે. અને સારો પડોશી મળવવો હોય તો પોતે સારા પડોશી બનવું જોઈએ. જે શાખપડોશી હોય, એની સાથે નિકટનો સંબંધ કેળવાઈ જાય એ સ્વાભાવિક છે. નજીકના પડોશીઓ વચ્ચે ‘વાટકી’ વ્યવહાર હોય છે. આ વાટકી વ્યવહાર એટલે તમારે ત્યાં પ્રસંગ હોય કે મહેમાન આવ્યા હોય, સારી વાનગી બનાવી હોય તો વાટકીમાં તમે મોકલો, સામેથી એ પણ મોકલે. કોઈ વાર ઘરમાં ખાંડ-ચા કે એવી ચીજ ખલાસ થઈ ગઈ હોય, તમે વાટકી લઈ એને ત્યાંથી લઈ આવો, એ તમારા વેરથી લઈ જાય, આવું નામ વાટકી વ્યવહાર.

આ રીતના વાટકી-વ્યવહાર આમ એક રીતે તો સારી વાત છે. એથી રોજ રોજના સંબંધોમાં મીઠાશ વધે છે. એકબીજાને નજીક આવવામાં પણ વાટકી-વ્યવહાર મદદરૂપ થઈ પડે છે. પણ આ

વ્યવહારમાં પણ નાનો અમથો વાંધો પડે છે ત્યારે મનહુંખ ઊભાં થાય છે. તમે તમારા પાડોશી ઈન્હુબેનને ત્યાં, તમારા ઘેર કાંઈ સારી વાનગી હોય કે સારો પ્રસંગ હોય તો દિશ મોકલતાં હોવ, પણ કોઈ વાર કોઈ કારણસર મોકલી શક્યાં નહીં, ત્યારે મન ઊંચા થાય છે. સંબંધોમાં પણ મન મોહું હોય તો જ સંબંધ ટકી રહે છે.

એટલે જ મૂળ વાત પડોશી સાથેના સંબંધો પણ માપસરના હોવા જોઈએ. વધારે પડતા મીઠા કે વધારે પડતા નજીકના નહીં હોવા જોઈએ. પડોશી પડોશી વચ્ચેના સંબંધોમાં પણ મર્યાદાની એક લક્ષ્મણરેખા તો હોવી જ જોઈએ.

અમારાં એક સંબંધી તરલાબહેન છે. ખૂબ જ માયાણુ, પ્રેમાળ અને વિવેકી મહિલા છે. આડોશ-પાડોશ બધા સાથે એમને સારા સંબંધ છે. એમનું સ્નેહી-વર્તુળ પણ ખૂબ મોહું છે. તરલાબહેન કહે છે : દરેક સંબંધની એક મર્યાદા સમજને હું વ્યવહાર રાખું છું. કેટલાક લોકો આપણા આંગણા સુધી આવી શકે, કેટલાક વરંડા સુધી આવી શકે, કેટલાક દીવાનખાના સુધી આવી શકે. છેક રસોડા સુધી કે છેક આપણા અંતરંગ ઓરડા સુધી આવવા દઈ શકાય એવા સંબંધ તો બે-પાંચ જ હોઈ શકે. બધાની સાથે સારો સંબંધ રાખવો એનો અર્થ એ નથી કે બધાની આગળ આપણા ઘરની, કુટુંબની આપણા અંગત જીવનની વાતો કહી દેવી. જે વાત જેને કહેવાની હોય એને જ કહેવાય. આ ગણિત પ્રમાણે હું ચાલું છું એટલે સંબંધોમાં પસ્તાવાનો વારો આવતો નથી. સંબંધો સારા હોવા એનો અર્થ એ નથી કે બારી-બારણાં-ખડકી ખુલ્લાં મૂકવાં. સંબંધોમાં પણ મર્યાદાનો પરદો હંમેશા જરૂરી બની રહે છે.

(‘શક્તિદર્શનમ्’ માંયી સાભાર)



છરખચંદ ગાડા (મો. ૯૮૨૮૪ ૪૦૦૪૦) ★ નીલેશ ગાડા ★ રીતેશ ગાડા

લગનપદ, ઘરપરાશ, લ્હાણી તથા હોટલ કેન્ટીન વાડી ફરસખાના માટેના મોટા વાસણોના હોલસેલ વેપારી

અલ/૧૦૪૦/૭, વિજય ટ્રાન્સપોર્ટ પાસે, જુ.આઈ.ડી.સી., અંકલેશ્વર. ફોન : ૦૨૭૪૬-૩૨૬૩૦૩, ૨૨૦૬૪૨

E-mail : kaykay\_industries@yahoo.com

## મને ના જાણતું કોઈ....

• કેશુભાઈ દેસાઈ •

ઇશ્વરનો ઈનકાર સામાન્ય માણસ ન કરી શકે. એ માટે પણ વિશિષ્ટ પ્રજા અને પ્રતિભા જોઈએ. ઇશ્વરને બહુ નજીકીથી જાણનાર જ એને ખોંખારીને પડકારી શકે. સરેરાશ માનવી માટે તો ઇશ્વર એ છેલ્લી સત્તા છે, કેની કૃપાથી બધી જ તકલીફો - આવિ, વ્યાધિ અને ઉપાધિમાંથી છુટકારો મળી શકે છે. એ ખુશ થઈ જાય તો રંકને રાય બનાવી દે અને ખફા થાય તો ધનોતપનોત કાઢી દે. ભારતીય દર્શન મોક્ષને માનવ-જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય ગણે છે. આ મોક્ષ ફક્ત અને ફક્ત પરમાત્માની કૃપાથી પ્રાપ્ત થઈ શકે. ઇશ્વર જેવી બહારની સત્તાને પડકારનારી અનીશ્વરવાદી વિચારધારાના પ્રવર્ત્તિને પણ એટલું તો સ્વીકારવું પડ્યું કે માણસ એનાં કર્મો દ્વારા સદેહે ઇશ્વરપણું પ્રાપ્ત કરી શકે છે. આવા એક મહાત્માને તો આપણે વિષ્ણુના નવમા અવતાર લેખે જ સ્વીકારી લીધા. બુદ્ધ તો મારા-તમારા જેવા સીધાસાદા નિર્દોષ માણસ હતા. પુત્ર સંન્યાસી ન બની જાય એટલા સારુ એના સમાટ પિતાએ એને બહારની દુનિયાથી અલગ પાડી દીધો હતો. બિચારો એટલુંય નહોતો સમજતો કે માણસ છે તે માંદોય થાય, એને ઘડપણ પણ આવે અને ‘નામ એટલાનો નાશ’ એ ન્યાયે મરી પણ જાય. એ જ સિદ્ધાર્થ બોધિવૃક્ષ નીચે તપ્યે તપીને બુદ્ધ બની ગયો. પણ પોતે જ સાચા, એવું મનાવવાનો આગ્રહ એમણે ક્યારેય નથી રાખ્યો. ઊલટાનું લોકોને કહ્યું પોતે જ પોતાનો દીવો બનો. અખ્ય દીપો ભવ.

મહાવીરે પણ કહ્યું કે માણસ અધ્યાત્મનાં સોપાન ચઢતાં ચઢતાં આ ભવમાં જ ભગવાન ‘અરિહંત’ બની શકે. કદાચ એ સિદ્ધિ મેળવતાં એને હજીરો અવતાર પણ લેવા પડે; પરંતુ ઇશ્વર કોઈ બહારની સત્તા નથી, એ આપણી અંદર જ બેઠેલો છે.

એ જ વાત ઇશ્વરકૃપાનો ડગલે ને પગલે અનુભવ કરનારા અને પ્રાર્થનાને હદ્યની અનિવાર્ય જરૂરિયાત ગણનારા પરમ શ્રદ્ધાળું યુગપુરુષ ગાંધીએ કરી. એમણે દરિદ્રનારાયણમાં ઇશ્વરનાં દર્શન કર્યા. ભગવાનને મળવા એમને મંદિરમાં જવાની જરૂર ન જણાઈ. આઈન્સ્ટાઈન જેવા વિજાનીએ પરમ શક્તિના અસ્તિત્વનો ઈનકાર નથી કર્યો પરંતુ ‘ધ ગ્રાન્ડ ડિઝાઈન’ નામના ગ્રંથમાં સર્દીના મહાન વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગે એક એવું નિવેદન કર્યું છે જે ઇશ્વરના અસ્તિત્વ સામે પડકારરૂપ ગણી શકાય એવું છે. તેઓ લખે છે કે બ્રહ્માંદીની રચના ભૌતિકશાસ્ક્રિપ્ટના નિયમો અનુસાર થયેલી છે. એને સમજવા માટે પણ વિજાનના નિયમો જ ખપ લાગશે. એમાં વચ્ચે ‘ઇશ્વર’ નામની કોઈ એજન્સીને લાવવાની જરૂર જ નથી. દુનિયા - આ પૃથ્વીનો ગોળો કે એના પરની વિવિધરંગી જીવસૂચિ વિજાનના નિયમો અનુસાર થયેલી છે. ‘બિગ બેંગ’ કહેતાં મહાવિસ્કોટ જ સૂચિના સર્જનનું કારણ છે. એ કોઈ પરમાત્માની ઇશ્વરાથી સરજાયેલ નથી બલકે સ્વયંનિર્ભિત છે.

આપણા રેશનાલિસ્ટો જ વાત કરતા રહ્યા છે પરંતુ એમની સામે ઇશ્વરમાં માનનારો બહુ મોટો સમુદ્દર છે, જે ધર્મગ્રંથોમાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે અને માને છે કે ઇશ્વરની ઇશ્યા વિના પાંદડું ય ફરકી શકે નહીં. સમગ્ર સૂચિ એ પરમ ચેતનાની જ લીલાનો ચેતોવિસ્તાર છે અને માણસ તો એના હાથનું રમકડું કે કઠપૂતળી માત્ર છે. ધર્મ અને વિજાન વચ્ચે સમન્વયનો સેતુ સ્થાપનારો એક પ્રબુદ્ધ વર્ગ દરેક વૈજ્ઞાનિક બાબતને ધર્મ સાથે અને ધાર્મિક ગૃહીતોને વિજાન સાથે સાંકળતો રહ્યો છે. ગાયત્રીમંત્ર કે અન્ય બાબતોનું વૈજ્ઞાનિક અર્થધટન અને એના પ્રભાવનું મોનિટરિંગ

પણ કરાતું રહ્યું છે. ધર્મને લાગેવળગે છે ત્યાં સુધી તમામ ધર્મી ઇશ્વરની આશ સ્વીકારે છે અને પ્રાર્થના, ઉપાસના, ઈબાદત કે સાધના, તપ વગેરેમાં શ્રદ્ધા ધરાવે છે. આપણા સૌથી લાડકા અને સર્વજ્ઞસંપત્તિ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે : જ્યારે જ્યારે સૂચિ પર ધર્મની ગ્લાનિ થાય છે અને અધર્મનું જોર વધે છે ત્યારે હું સર્જનાનોના રક્ષણ માટે અવતાર ધારણ કરું છું. ગીતા ભારતીય સંસ્કૃતનું હાઈ સમજાવતો દર્શન-ગ્રંથ છે. અર્જુનને પણ શંકા તો જાય છે કે ઇશ્વર હશે બરો? શ્રીકૃષ્ણને નાદ્ઘૂટકે પોતાનું વિશ્વરૂપ બતાવવું પડે છે. ‘જ્ઞાન વિજાનયોગ’ નામનો ભગવદ્ગીતાનો સાતમો અધ્યાય જુઓ. એના થોડાક શ્લોકો ઉતારું છું : ‘મારું સર્વોત્તમ નિર્વિકાર સ્વરૂપ નહીં જાણતા અજ્ઞાનીઓ, અપ્રગટ એવા મને પ્રગટ થયેલો માને છે.’ (૨૪)

‘યોગમાયાથી ઢંકાયેલો હું સર્વને પ્રત્યક્ષ નથી, તેથી આ મૂઢ લોકો અજ્ઞાના અને અવિનાશી એવા મને પૂરેપૂરો અળખતા નથી.’ (૨૫)

આ બે શ્લોકો પછીનો શ્લોક આપણી આજની ગોણિને અનુરૂપ હોઈ સંસ્કૃતમાં પણ રજુ કરી દઉં.

‘વેદાં સમતીતાનિ વર્તમાનિ ચાર્જનું, ભવિષ્યાણિ ચ ભૂતાનિ - માં તુ વેદ ન કશન.’

(હે અર્જુન, હું ભૂત - ભવિષ્ય અને વર્તમાનની તમામ હકીકતો જાણું છું; પરંતુ મને કોઈ જ જાણતું નથી.) હવે જ્યારે ઇશ્વરે સ્વમુખે આટલી કબુલાત કરી જ લીધી છે ત્યારે સ્તીફન હોકિંગ એના વિશે સંદેહ કરે તો એથી એને શો ફેર પડે છે? પરંતુ સબૂર, ઇશ્વરની આ ત્રાણ એક વિચિત્ર લીલા છે. એ હરહંમેશ રહસ્યમય રહ્યો છે. એટલેસ્તો દુનિયા આખી એની પાછળ

પાગલ છે. જરૂર સ્ટીફન હોકિંગને પણ એણે જ પોતાની વિરુદ્ધ સ્ટેટમેન્ટ કરવા માટે પટાવી લીધા હોવા જોઈએ. ઈશ્વરથી મોટો કોઈ જાહુગર જોયો છે?

.....ચાલો, કાનુંડાનો કાન આમળીએ

### આ જીહેરાત વાંચો :

“જો આપ મુશ્કેલીમાં હોવ, આઘાત પામેલા હોવ, હુંખી હોવ અને એવું વિચારતા હોવ કે આપની સમસ્યાનો કોઈ ઉકેલ નથી - જેવી કે માંદળી, આપની વ્યક્તિગત, કૌઠુંબિક અથવા પ્રિયજનને લગતી સમસ્યા, નાણાંકીય, વૈવાહિક, આત્મિક, વ્યવસાયિક કે અદાલતોના કેસો અથવા શૈક્ષણિક અથવા કોઈ ખાનગી બાબતને લગતી સમસ્યા વગેરે માટે નિર્ણય લેવામાં મૂંજવણ અનુભવતા હોવ; જો તમે શું કરવું ક્યાં જવું અથવા તમારી સમસ્યાનો કેવી રીતે ઉકેલ લાવવો અને એમાંથી કઈ રીતે બહાર નીકળવું એ જાણવા માગતા હોવ-તો અમે તમને કહેવા માગીએ છીએ કે એક મિત્ર છે જે તમને મદદ કરવા તમારી વાટ જુએ છે.”

તેનું નામ ઈસુ છે.  
આવો...અનુભવો...આશીર્વાદિત બનો..

આ એક ધાર્મિક મેળાવડા માટેનું જીહેર નોતરું છે. એમાં ઈશ્વરપુત્ર ઈસુ દુઃખિયારા જીવોનાં દુઃખદર્દ સાંભળવા અને તેનો ત્વરિત ઉકેલ આણવા તૈયાર બેઠા હોવાની રજૂઆત કરવામાં આવી છે. વાંચનાર સુવિદિત છે કે ઈસુ તો બે હજાર વરસ પૂર્વે વધ્યસંભ પર ચડી ગયા હતા. પછી ઈસ્ટરના દિવસે પુનર્જીવિત થઈ શ્રદ્ધાળું અનુયાયીઓને અભ્યવચ્યન આપતા ગયા હોવાનું પણ શાખમાં લખ્યું છે. આવી જ વાતો શિરડીના સાંદીબાબા કે ભગવાન સ્વામિનારયાણ વિશે થતી રહી છે. દિવંગત સંત મહાત્માઓની સાથે ચમત્કાર જોડી દઈ એમની ધર્મપીઠો વિકસાવવાના કિસ્સા જાણીતા છે. એકંદરે આ બધું ઈશ્વર અને ઈશ્વરી તત્ત્વોનું એક યા બીજા સ્વરૂપે થતું રહેતું માર્કેટિંગ છે. સાદી ભાષામાં એ

ભગવાનના નામનો વેપલો છે. એને તે વધતે ઓછે અંશે દરેક ધર્મ-સંપ્રદાય કે પંથમાં નિરંતર, આહિ અનાદિથી ચાલતો રહ્યો છે. બલકે એ પ્રકારનું ‘માર્કેટિંગ’ ધર્મ - સંપ્રદાયના યોગક્ષેમ માટે અનિવાર્ય ગણાતું રહ્યું છે. શ્રદ્ધાળું જીવોએ ડરવાની શી જરૂર? દયારામ કહે છે : ‘ચિત્ત તું શીદને ચિંતા ધરે? કૃષણને કરવું હોય તે કરે!’ પરંતુ ઈશ્વર કોઈ બીહાળવું હિંસક પ્રાણી હોય એમ દરેક ધર્મ એના અનુયાયીઓને એનાથી ડરવતો રહ્યો છે. અર્જુનને પોતાની આણ મનાવવા ખુદ શ્રીકૃષ્ણને પોતાનું વિરાટદર્શન કરાવવું પડ્યું હતું. ઈસ્લામમાં પણ ખુદાનો ખોઝ રાખીને વર્તવાની શિખામણ અપાઈ છે. અંગ્રેજીમાં ‘ગોડ ફિયરિંગ મેન’ જેવો કોમ્પ્લીમેન્ટરી શબ્દસમૂહ પ્રચલિત છે. ભગવાનથી ડરીને ચાલનારો માનવી ખોટું કરતાં સો વાર વિચાર કરશે. આપણી ભાષામાં એનો વધુ સારો પર્યાય ચલાણમાં છે. ભલાભોળા સીધી લીટીના માણસ માટે આપણે ‘પાપભીરુ’ વિશેષાણ વાપરીએ છીએ. ઈશ્વરની નહીં, પાપથી ડરવાની જરૂર છે. ઈશ્વરને તો ખુદ ગાંધીજીએ પણ જોયો નહોતો પરંતુ એની ઢાલ છેક છેલ્લા શ્વાસ સુધી એમનું મનોબળ ટકાવવામાં મદદરૂપ થતી રહી. અંધારાથી ડરનારા બાળ મોહનને ઘરની કામવાળીએ ‘રામ’ નામનો મંત્ર આપી દીધો. અજાણતાં જ રંભા નામની એ તદ્વન સાધારણ સ્વી ભવિષ્યના મહાત્માની આદિગુરુ બની ગઈ. રસ્કિન, ટોલ્સ્ટોય અને રાજચંદ્ર કરતાં પણ વધુ દઢ સંસ્કાર ગાંધીજીને એ અભિષ્ણ કામવાળી પાસેથી મળ્યા છે. બીક લાગો ત્યારે રામનામ રટવાનું ચાલુ કરી દેવું. બીક આપોઆપ ભાગી જશે. બાળમાનસ માટે આટલું અમથું સૂચન એના જીવનપથનું અખૂટ પાથેય બની રહ્યું. એ બે અભિરનો મંત્ર મૂઢી હાડકાંના કાઠિયાવાડી વાણિયાને વીસમી સદીનો વિશ્વનાયક બનાવી રહ્યો. અજાણતાં જ મહાત્મા ગાંધીએ ‘રામ’ નું અહરિનશ માર્કેટિંગ કરીને દુનિયાભરમાં એ ‘ઈન્ડિયન ગોડ’ ને લોકપ્રિય બનાવી દીધા. એમણે રામ, રહીમ

અને ગોડને એકમેકના પર્યાય ગણાવી ઈશ્વર એક જ છે અને જુદા જુદા સમયે જુદી જુદી જગ્યાએ જુદાં જુદાં રૂપે પ્રગાટ થતો રહ્યો છે, એવી સર્વાશ્રલેખી અવધારણાનો પ્રચાર અને પ્રસાર કર્યો. રાજકારણ અને રામકરણ બેઠ ખભેખભો મિલાવી ચાલતાં રહ્યાં. અલબત્ત ગાંધીજીના રામ અને વિશ્વહિંદુ પરિષદ કે ભારતીય જનતા પાર્ટીના રામ વચ્ચે આભ જમીનનું અંતર છે. ગાંધીજીના રામ એ કેવળ મંદિરમાં બિનાજતા દશરથનાંદન અયોધ્યાપતિ રામ નથી. એ તો ઘટઘટમાં સમાયેલા, હદ્યમંદિરમાં બિરાજનારા રામ છે. એમને તમે ઈશ્વર પણ કહી શકો અલ્લાહ પણ કહી શકો અને બીજા જે કોઈ નામે બોલાવવા હોય તે નામે બોલાવી શકો. જ્યારે પણ આર્તિહદ્યે એમને પોકારવામાં આવે છે ત્યારે એ નિર્બણનું બળ બનીને પ્રગટે છે. ગાંધીજીની આત્મકથાના એક પ્રકરણનું શીર્ષક છે. : ‘નિર્બલ કે બલરામ.’ સાથીદાર છેતરીને રૂપજીવિની પાસે પહોંચાડી દે છે ત્યારે થરથર ધૂજતા મોહનદાસના હોઠ પર રામનું નામ ફરકે છે. એ વિષમ પરિસ્થિતિમાંથી એમને રામનું નામ જ ઉગારી શક્યું હતું. સામે પક્ષે કુનેહપૂર્વક અયોધ્યાનરેશ રામનું નામ આગળ ધરી ભારતીય જનતા પાર્ટીએ સત્તાના સિંહાસન પર કબજે મેળવ્યો હતો તે પણ આપણે જાણીએ છીએ. ઈશ્વરમાં તો વિશ્વની મોટાભાગની વસતિ શ્રદ્ધા ધરાવે છે, સાખ્યવાદી રાખ્દોમાં પણ અંગત માન્યતા પર કોઈ પાંદી નથી પરંતુ હિંદુસ્તાન તો ઈશ્વરની જન્મભૂમિ છે. અહીં ઈશ્વર વારંવાર અવતાર અને અંશાવતાર લેતો રહ્યો છે. જેન ધર્મદર્શન મુજબ તો પ્રબળ પુરુષાર્થ દ્વારા માણસ સાદેહે ભગવાનપણું પામી શકે છે. એ ઉચ્ચ અવસ્થાને ‘અરિહંત’ પછ કહેવામાં આવ્યું અને નવકારમંત્રમાં સૌ પહેલા નમસ્કાર પણ અરિહંતોને કરવામાં આવ્યા. ‘નમો અરિહંતાણ’ અનીશ્વરવાદી લેખાયેલા બૌદ્ધ અને જૈન મતમાં પણ આખરે એ દશાંગુલ ઉફરા ચૈતન્યનો સ્વીકાર અને પુરસ્કાર તો

કરાયો જ છે. સાંપ્રદાયિક સૌહાર્દનો પરિચય આપ્યો છે. સનાતન વૈદિક ધર્મ એકેશ્વરવાદી છે; પરંતુ સત્ય કે સત્ત્વ તત્ત્વ એક જ હોય છતાં કવિઓ અને વિધવિધ સ્વરૂપે બક્ત કરતા રહ્યા છે. એ રીતે પ્રકૃતિને પણ પરમાત્માની જ પ્રતિકૃતિ માની લઈ આપણે પૂજવા લાગ્યા. મનોવિજ્ઞાનીઓ કહેશે કે આદિમાનવે ડરી જઈને પ્રકૃતિતથ્વોને પૂજવાનું શરૂ કર્યું હોવું જોઈએ. હું જરા જુદ્ધ અભિપ્રાય ધરાવું છું. હિમાલય કે ગંગાને શું આપણે બીકના માર્યા પૂજાએ છીએ? આપણે પીપળાને ડરના માર્યા વિષશુના નિવાસ તરીકે સ્વીકારી લીધો હશે? એવી દૂરની પણ શક્યતા ખરી? પેલી જાણીતી કહેવત યાદ છે? ‘ભૂતનું મુકામ પીપળો...’

કદાચ એવું હોય તો પણ માનવજીતિ તો ભય વિના પ્રીતિમાં ક્યાં પરોવાય છે? આ બધા લોકદેવતાઓ અને નરબલિ સહિતના ભોગ માગતી રહેતી દેશના ખૂઝે ખૂઝે બેસી ગયેલી લોહીતરસી ‘માતા’ ઓને પણ ‘પાલ્બિસટી’ ગમતી હોય એમ નથી લાગતું? એમનું પણ સતત માર્કેટિંગ થતું જ રહે છે. ધર્મ સંપ્રદાયો હવે સંપૂર્ણપણે ‘પ્રોફેશનલ’ બની ચૂક્યા છે. દરેક ધર્મ-સંપ્રદાય કે પંથ અને પેટાપંથ દ્વારા એમના અનુયાયીઓ વધે, આર્થિક સમૃદ્ધિ વકરે અને બીજાની સરખામણીમાં એમની દુકાન વધારે સારી ચાલતી રહે, એ દિશામાં બધા જ પ્રયાસો કરવામાં આવે છે. લોકશાહી દેશમાં ધાર્મિક સ્વતંત્રતાનો પૂરેપૂરો ફાયદો ઉદાવવામાં આવે છે. એકબીજા સાથે તંદુરસ્ત હરીફાઈ થતી હોય ત્યાં સુધી કોઈની સામે ફરિયાદ ન હોઈ શકે, પરંતુ સ્પર્ધામાં આગળ નીકળી જવા માટે જાતજીતના પરચા અને ખરા-ખોટા ચમત્કારોનો હવાલો આપી ભવીભોળી પ્રજાને ભરમાવવામાં આવે ત્યારે મન વિષાદથી ભરાઈ જાય છે. શ્રદ્ધા ઘણી પવિત્ર ભાવના છે. મનુષ્યજીતિને મળેલું એ દેવી વરદાન છે. એ શ્રદ્ધાને જ સ્થાપિત હિત બની ગયેલી ધર્મ સંપ્રદાયની પીઠો કે વ્યક્તિઓ દ્વારા રીતસર ‘એક્સ્પ્લોર્ટ’ કરવાના કારસા ઘડાતા જોઉં છું ત્યારે ઈશ્વર સાંભળતો હોય તો એની સામે રાડ નંબાઈ જાય છે : જો, તારા બનાવેલા આ લોકો તને બનાવી રહ્યા છે! હવે તો સમાધિમાંથી જાગ ભલા માણસ! તેં તો જીવમાત્રને અભયવચન આપી રાખ્યું છે કે ધર્મની જ્યારે જ્યારે પણ ગલાનિ થશે અને અધર્મ માથું. ઊંચકશે ત્યારે પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતાં, ધર્મસંસ્થાપનાર્થી સંભવામિ યુગેયુગે.... ફૂલ્લા પત્યે શ્રદ્ધા રાખનારા તમામને જશોદાની જેમ એનો કાન આમળવાનો પણ હક્ક હોવો જોઈએ.

ગાંધીનગર  
મો. ૯૮૭૯૪૪૩૭૩૨

## ભારત સરકારે જૈનોને લઘુમતી કોમ જાહેર કરવાથી થનાર લાભો

(અનુસંધાન : પાના નં.-૪૭ ઉપરથી ચાલુ)

૩. મૌલાના આજાદ અલ્યુસંખ્યક માટે આર્થિક વિકાસની નિગમની ઋણ યોજનાઓ.
૪. અલ્યુસંખ્યક વિવિધ ક્ષેત્રોમાં ક્ષેત્રવિકાસ કાર્યક્રમોને કાર્યોન્નિત કરવા અનુદાન યોજના.
૫. રાજ્યમાં અલ્યુસંખ્યક વર્ગની સમસ્યાઓના સંદર્ભમાં સંશોધન, કાર્યને દેખરેખ કરવા માટે અધિકારી / કર્મચારીઓના પ્રશિક્ષણ તથા બની રહેલ યોજનાઓની જાણકારી આપવા સંબંધિત યોજના.
૬. રાજ્યના અલ્યુસંખ્યક વિવિધ ક્ષેત્રમાં છાત્રો માટે ઔદ્યોગિક પ્રશિક્ષણ કેન્દ્રની સ્થાપના માટે અનુદાનની યોજના.
૭. રાજ્યના અલ્યુસંખ્યક ક્ષેત્રોમાં જેન છાત્રો માટે તાંત્રિક સંસ્થાની સ્થાપના માટે અનુદાનની યોજના.
૮. રાજ્યના લોકસેવા આયોગ દ્વારા લેવાતી પ્રશાસનિક સેવા પ્રતિયોગિતા પરીક્ષાઓ માટેની પ્રશિક્ષણ યોજના.

### ભાગ-૩

જૈન છાત્રો માટે : મેટ્રીક પૂર્વ છાત્રવૃત્તિ યોજના

જૈન છાત્રો માટે : મેટ્રીકોત્તર છાત્રવૃત્તિ યોજના

જૈન છાત્રો માટે : મેટ્રીટ અને સાધન આધારીત છાત્રવૃત્તિ યોજના.

જૈન છાત્રો માટે : નિઃશુલ્ક કોચિંગ સંબંધિત યોજના.

પ્રાથમિક - માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના આંતરિક માળખાકીય વ્યવસ્થા (ઇન્ફાસ્ટ્રક્ચર)ના વિકાસ માટેની યોજના.

અલ્યુસંખ્યક વિવિધ જિલ્લાઓમાં ભલુકોત્તીય વિકાસ માટેની યોજના.

શ્રી મૌલાના આજાદ શિક્ષણ સંસ્થાઓમાં મેધાવી જૈન છાત્રો માટે છાત્રવૃત્તિ, શૈક્ષણિક સંસ્થાઓમાં પાયાની સુવિધાઓને વિકસિત કરવા અનુદાનની યોજના.

૨૦૨, સુંદર ગોપાલ કોમ્પ્લેક્સ,  
આંબાવાડી સર્કલ પાસે, આંબાવાડી,  
અમદાવાદ-૩૮૦ ૦૦૬.  
મો. ૯૮૨૬૫ ૭૭૬૯૮

## PRAKASH METAL CRAFT PVT. LTD.

E-56/57, Sarvoday Nagar, 1st Panjrapole Lane, Mumbai-4.

Tel. : 2242 7461 Telefax : 2242 6636

E-mail : prakashmetalcraft@rediffmail.com • Website : www.prakashmetalcraft.com

MFG. ST. STEEL UTENSILS

**Prakash®**



## છોકરાંને ખાતર....

• સોમાભાઈ પટેલ •

મનહરભાઈ અને મીનાક્ષીબહેનને આખરે ગ્રીનકાર્ડ મળી ગયું અને એના પગલે અમેરિકા જવાનો વિજા પણ મળી ગયો.

કેટલાં વર્ષથી એ આ દિવસની રાહ જોતાં હતાં? લગ્ન કરીને અમેરિકા ગયેલી મોટી બહેન કેલાસે ‘ફાઇલ’ કરી ત્યારે બનેના મનમાં અમેરિકા જવા માટેનું ગુલાબી સ્વખ રમતું હતું. પરંતુ એ પછી બાર વર્ષ વિતી ગયાં. આખરે વિજાનો કોલ આવ્યો. આ દરમિયાન ચાર વર્ષનો વત્સલ આજે ૧૧ મા ધોરણમાં આવી ગયો હતો અને બે વર્ષનો વિનય દ્વારા ધોરણમાં. અને... ૩૦ વર્ષના મનહરભાઈ આજે ૪૨ની વયે પહોંચ્યા હતા. આમ છતાં ઘણાં વર્ષનું સેવેલું સ્વખ અંતે પૂર્ણ થયું હતું એનો બનેના મનમાં આનંદ હતો.

પરંતુ બંને જાણ વિજા લઈ મુંબઈથી અમદાવાદ આવતી રાતની ટ્રેનમાં બેઠાં એ પછી મનહરભાઈનું મન વિચારવમળે ચઢ્યું : અમેરિકા જવું કે ન જવું? હવે અમેરિકા ન જઈએ તો પણ શો વાંધો? અહીં ક્યાં દુખી છીએ? કેલાસે ‘ફાઇલ’ કરી ત્યારની વાત જુદી હતી. એ વખતે નોકરી ન હતી અને ધંધાની શરૂઆત કરી. વત્સલ અને વિનય નાના હતા. ગ્રીનકાર્ડ મેળવવાની એક તાલાવેલી હતી, જવાનો ઉમંગ હતો... આજે બિજનેસ સારો ચાલે છે. એનાથી તો સુખી થયા. હવે ૪૨ વર્ષ જિંદગીની યાત્રા નવેસરથી કરવાની! જામેલો ધંધો છોડી, સગાંસંબંધીઓ, મિત્રવર્તુણે છોડી અમેરિકા જેવા અજ્ઞાયા દેશમાં ફરીથી એકડો ઘૂંઠવાનો! એ ફાવશે? મીનાક્ષીને તો અમેરિકા જવાની જરાયે દૃષ્ટા નથી, એનેય ત્યાં જોબ તો કરવી જ પડશે! એણે અહીં તો કશું જ કર્યું નથી. વત્સલને ધોરણ નીમાની અને વિનયને ૧૦માની બોર્ડિની પરીક્ષા આપવાની તક

પણ હવે તો નહિ મળે. અહીં બિજનેસમાં બધું બરાબર ગોઠવાઈ ગયું છે, પ્રોગ્રેસ પણ સારો છે, ત્યારે હવે અમેરિકા જઈ ઊલમાંથી ચૂલમાં શા માટે પડવું? જઈને શું મેળવવાનું છે એ તો ભવિષ્ય કહેશે, પરંતુ નહિ જઈએ અને ગ્રીનકાર્ડ જવા દઈશું તોયે શું ગુમાવવાનું છે? ટ્રેનમાં બેઠેલા મનહરભાઈના ચગડોળે ચઢેલા ચિત્તમાં આમ આંખી રાત સંકલ્પવિકલ્પ ચાલ્યા કર્યા. એમને વિચાર કરતાં એવું લાગતું હતું કે હવે ૪૨ વર્ષ અમેરિકા જઈને શા માટે અશાંતિ ઊભી કરવી?

પરંતુ તેમને વત્સલ અને વિનયનો વિચાર આવ્યો. મનમાં થયું : નહિ જઈએ તો આ બને છોકરા અમેરિકા જવાની તકો કાયમને માટે ગુમાવશે. લોકો આજે પોતાનાં સંતાનોને અમેરિકા મોકલવા માટે શું શું નથી કરતાં? ગ્રીનકાર્ડ મળે તેમ ન હોય તો સ્ટુડન્ટ વિજા પર અને એય શક્ય ન હોય તો પચ્ચીસ ત્રીસ લાખ રૂપિયા ખર્ચનેય મોકલે છે; જ્યારે આ તો ધેરબેઠાં ગંગા આવી છે. વત્સલ અને વિનય ભણવામાં હોશિયાર છે. બે-ત્રાણ વર્ષમાં તો કોલેજમાં આવશે. અમેરિકામાં સારી લાઈનમાં ભણવાની તક મળશે તો એમનું ભાવ ઊજું બનવાનું. વળી સામે ચાલીને આવેલી આ તક જવા દઈશું તો લોકો શું કહેશે? હિંમત હારી ગયા, મનહરભાઈ...!

અને મનહરભાઈના ચિત્તમાં થોડા વખત પહેલાં અમેરિકા ન જવા માટેનું જે પલ્લું નીચું જતું હતું તે એકાએક ઊંચકાયું અને અમેરિકા જવા માટેનું પલ્લું નીચું ગયું! એમને થયું : પોતાને ખાતર નહિ તોય આ બને છોકરાને ખાતર પણ અમેરિકા તો જવું જ. તેઓ જ્ઞાતા હતા કે આ ઉમરે પરદેશમાં નવેસરથી બધું કરવામાં, જોબ કરીને ઠરીઠામ થવામાં મુશ્કેલીઓ તો પડવાની. અહીંના બહોળા

કુટુંબના પ્રેમભર્યા સંબંધો છોડીને, ત્યાં એકલા, સંઘર્ષમય જીવન જવવું પડવાનું. પરંતુ આ બધું છતાં, પોતાનાં બને સંતાનોના ઊજણા ભાવિને ખાતર તેમણે અમેરિકા જવાનો પાકો નિર્ણય કરી લીધો.

ગાડી વહેલી સવારે પાંચ વાગ્યે અમદાવાદ સ્ટેશનને આવીને ઊભી રહી ત્યારે, રાતની આખી જર્ની દરમિયાન મનોમંથન અનુભવતા મનહરભાઈના ચિત્તમાં હવે અમેરિકા જવા વિશે કોઈ પ્રકારની દ્વિધા રહી ન હતી.



મનહરભાઈ અને મીનાક્ષીબહેન તેમના બે પુત્રો વત્સલ અને વિનય સાથે છેવટે અમેરિકાના શિકાગો શહેરમાં આવી ગયા. પણ હજુ ઈન્ડિયાની ભૂમિનું દર્શય એમની નજર સમક્ષ તરવરતું હતું. અમદાવાદ ઓરપોર્ટ પર કેટકેટલાં સ્વજનો અને મિત્રો એમને વિદ્યાય આપવા આવ્યાં હતાં! ઈન્ડિયામાં મનહરભાઈ અને મીનાક્ષીબહેન બનેનાં બહોળાં કુટુંબ હતાં. પિતૃપક્ષનાં અને શસુરપક્ષનાં માણસો પણ ખૂબ સુખી અને પ્રેમાણ હતાં. આટલાં વર્ષના સહવાસથી આ બધાં સાથે તે બંને એવાં તો હળીમળી ગયેલાં કે તેમને અંદરથી તો આ બધું છોડીને અમેરિકા આવવાની ઈચ્છા જ ન હતી, પણ એ બધું ભૂલીને છેવટે આવી જ ગયાં – છોકરાંને ખાતર!

મનહરભાઈ અને મીનાક્ષીબહેન બને આમ તો ગ્રેજ્યુઅએટ, પણ અહીં એમની ડિગ્રીની શી કિંમત? બનેને અહીં મહેનતની જોબ કરવાની આવી. મહરભાઈને ફેક્ટરીમાં આખો દિવસ પરદેશીઓ સાથે, બોલ્યાચાલ્યા વગર સતત કામ કરવાનું કાહું લાગે. વારેવારે ઈન્ડિયા સાંભરે. દેશમાં પાછા જવા જવ ઊંચો-નીચો થાય.

મીનાક્ષીબહેનને સવારે છ વાયે ઘેરથી જોબ પર નીકળી જવું પડે. મનહરભાઈને સાત વાગ્યે. બજેની જોબની દિશાઓ જુદી. હજુ કાર નહોતી એટલે કોઈ પરિચિતની રાઈડ લઈને જવા-આવવાનું. છતાં મીનાક્ષીબહેન વહેલાં ઊઠી પોતાનું અને મનહરભાઈનું લન્ય તૈયાર કરી વહેલાં જોબ પર નીકળી પડે. મનહરભાઈનું ચાલ્યું હોત તો એ ક્યારનાયે ઇન્દ્રિયા જતા રહ્યા હોત; પણ મીનાક્ષીબહેન મજબૂત મનનાં. મનહરભાઈ મનમાં પડેલો વિચાર વ્યક્ત કરે એ પહેલાં જ મીનાક્ષીબહેન કહેતાં : તમે કહો તો આપણે કાલે જ ઇન્દ્રિયા જતાં રહી શકીએ; પણ પછી આ બજે છોકરાનું શું?

પછી તો મનહરભાઈ પણ પરિસ્થિતિથી ટેવાઈ ગયા. બજેએ સખત મહેનત કરવામાં રાત-દિવસ ન જોયાં. મીનાક્ષીબહેન તો વીક-ઓન્ડમાં પણ જોબ કરે. વર્ષ દરમિયાન શહેરમાં ગુજરાતી કોમ્યુનિટીના ઘણા કાર્યક્રમો થાય, પણ ક્યાંય જવાનું નહિ. બસ ઘર અને જોબ, જોબ અને ઘર...એપાર્ટમેન્ટનું ભાડું, ટ્રાન્સપોર્ટશન, ઇન્સ્યોરન્સ અને વિશેષ તો બજે સંતાનોને ભણાવવાનો ખર્ચ... મહેનત કર્યા વગર છૂટકો ન હતો.

બજેએ રાતદિવસ મહેનત કરવામાં પાછું વાળી ન જોયું. પરિણામે આઈ દસ વર્ષના અંતે તેઓ સારી રીતે સેટલ થઈ ગયાં. ગાડી લીધી. ટીક ટીક સગવડવાનું પોતાનું હાઉસ પણ લીધું. હવે વત્સલ પણ ફાર્માસિસ્ટ થઈને જોબ કરવા લાગ્યો હતો. વિનય બીજી શહેરની સારી કોલેજમાં એડમિશન મેળવી એકાઉન્ટિંગના છેલ્લા વર્ષમાં ભણતો હતો.

મનહરભાઈ અને મીનાક્ષીબહેન હવે કંઈક હરીને ઠામ થાયાં હતાં. પણ ત્યાં હવે બીજો તબક્કો આવીને ઊભો - વત્સલના લગ્નનો. બજેના મનમાં એવું ખરું કે ઇન્દ્રિયાની છોકરી મળે તો સારું. ભારતીય સંસ્કાર અને કુટુંબભાવના જળવાય. બધો વિચાર કરી તેઓ એક મહિનાની ૨૪ લઈને ઇન્દ્રિયા આવ્યાં. વત્સલ કમ્પ્યુટર એન્જિનિયર અને વળી અમેરિકન સિટીઝન

એટલે ઘણી છોકરીઓનાં માબાપ તરફથી સારી સારી ઓફરો આવવા લાગી. બજેએ કેટલીક છોકરીઓ જોયા પછી વત્સલને અમેરિકાથી બોલાવ્યો. બધાંએ એવું નક્કી કરેલું કે વત્સલ છોકરી પસંદ કરે તો અહીં લગ્ન કરીને જ અમેરિકા જવું. બન્યું પણ એવું જ. વત્સલને સ્વાતિ નામની એક યુવતી ગમી ગઈ. આ યુવતી આમ તો બી.એસ.સી., એમ.એલ.ટી. જ ભણેલી હતી, પણ દેખાવે સુંદર હતી અને પિતા સુખી-સંપત્ત હતા. તરત લગ્ન લેવાયાં. બધાં અમેરિકા પરત આવ્યાં. વત્સલ સિટીઝન, એટલે સ્વાતિને પણ અમેરિકા આવતાં વધુ વાર ન લાગી.

સ્વાતિ એનાં માતાપિતાની એકની એક દીકરી. મનસ્વી સ્વભાવની. કશી કઠણાઈ જીવનમાં વેઠેલી નહિ. ઘરમાં નોકર-ચાકર, ગાડી. અહીં જતે કામ કરવાનું આવ્યું. પતિ, સાસુ, સસરા બધાં સખત કામ કરવા ટેવાયેલાં, પછી એ બેસી રહે કે આળસ કરે તે કેમ ચાલે? સાસુનું દબાણ અને પતિની સમજાવટ પણ ક્યાં સુધી ચાલે? ઘરના વાતાવરણની પ્રસ્તાતા ઓસરવા લાગી. પરિણામ? વત્સલે દૂર એક એપાર્ટમેન્ટ ભાડે રાખી લીધું. બજે તેમાં રહેવા ચાલ્યાં ગયાં.

મનહરભાઈ અને મીનાક્ષીબહેન ઘરમાં એકલાં પડ્યાં. અત્યાર સુધી આખું કુટુંબ સાથે હતું. વત્સલ પણ સારી કંપનીમાં જોબ કરતો હતો, એથી ઘણી રાહત થઈ હતી. અમેરિકામાં દીકરા લગ્ન પછી જુદા રહે એ નવાઈની વાત ન હતી; પણ એમનો એવો જ્યાલ હતો કે ઇન્દ્રિયાથી આવેલી વહુ બે-ચાર વર્ષ સાથે રહેશે તો કુટુંબ સાથે હળીમળી જશે. દરમિયાન વિનય પણ ભણીને જોબ કરતો હશે એટલે કુટુંબને આર્થિક રીતે સંપત્ત થતાં વાર નહિ લાગે.

પણ એમની ઘારણા ખોટી પડી. વત્સલ વહેલો અલગ ચાલ્યો ગયો. હવે એની પાસેથી કશી મદદ મળે એવી અપેક્ષા ન હતી. એના જીવનમાં બધી કમાણી ખર્ચાઈ ગઈ હતી. ઘર ચલાવવા, ઘરનો, ગાડીનો, ઇન્સ્યોરન્સનો હમો ભરવા બજેએ

જોબ કરવી જરૂરી હતી. વિનયના મૌંઘા ભજતરનો પણ બોજ એમણે જ ઉકાવવાનો હતો.

વળી પાછી જિંદગીની દોડ ચાલુ થઈ...

દિવસો પસાર થવા લાગ્યા. દરમિયાન, વત્સલની પત્ની સ્વાતિ પ્રેગનન્ટ હોવાના સમાચાર આવ્યા. મીનાક્ષીબહેનના જીવનમાં ફરીથી ખુશીની લહેર આવી. એ બે વાતે ખુશ હતાં : એક તો તે દાદી થવાનાં હતાં. બીજું, આ નિમિત્તે હવે વત્સલ-સ્વાતિ પોતાને ત્યાં પાછાં રહેવા આવી જશે. તેઓ હવે અવારનવાર વત્સલને ત્યાં જવા લાગ્યાં. થોડાક દિવસ પછી તેમણે વત્સલને અને સ્વાતિને પોતાના ઘેર રહેવા આવી જવા કહ્યું, જેથી બજેને અનુકૂળતા રહે. પોતાને બે ઘેર દોડાડોડી ન કરવી પડે અને સ્વાતિની દેખભાગ પણ સારી રહે. પણ વત્સલ અને સ્વાતિ એ વખતે કંઈ જ ન બોલ્યાં.

મીનાક્ષીબહેનને આ બજેનું મૌન અકળાવતું હતું; પણ અંદરથી તો એ જાણતાં જ હતાં કે સ્વાતિની પ્રેગનન્સીની સારવાર અને ડિલિવરી પ્રસંગે તેમજ એ પછી હવે એમને પોતાની જરૂર રહેવાની જ. અત્યારે નહિ તો થોડા દિવસ પછી પણ એમને આ ઘેર આવ્યા વગર ક્યાં ચાલવાનું હતું? દીકરાને માની જરૂર ભલે ન રહી, પણ હવે વહુને સાસુની જરૂર તો પડવાની જ!

પણ ડિલિવરીના છેલ્લા બે મહિના બાકી રહ્યા ત્યારે એક દિવસ વત્સલે મીનાક્ષીબહેનને કહ્યું, “મમ્મી, એક સમાચાર આપવાના છે. સ્વાતિનાં મમ્મી પણ આવવાનાં છે!”

“ક્યારે?”

“આવતી કાલે જ!” વત્સલ ઠંડકથી બોલ્યો.

“આવતી કાલે જ?” નહિ, વત્સલ? મીનાક્ષીબહેનને ઝાટકો લાગ્યો.

“આવવાનું નક્કી થાય પછી કહું ને!

એ બને હાલ તો વિઝિટર વિઝા પર આવશે, પછી શક્ય હશે તો એક્ષેન્શન માળીશું.” વત્સલ જ્ઞાણો કશું ન બન્યું હોય એમ શાંતિથી બોલ્યો.

“એમ વાત છે ત્યારે!” મીનાક્ષીબહેન અંદરથી લાગેલા આધાતને દબાવીને બોલ્યાં. આધાત એટલો ઉંડો હતો કે એ ઘડીભર કશું જ બોલી શક્યાં નહિ. દીકરાને અને વહુને પોતાના ઘેર પાછાં લાવવાની વાત તો દૂર રહી, પણ એમને ખાતરી થઈ ગઈ કે હવે એમને દીકરાને ઘેર આવવાની જરૂર રહી ન હતી. એમજો વહુનાં માતાપિતાને અમેરિકામાં બોલાવી ગોઠવણ પણ કરી લીધી હતી!

થોડોક સમય ઘરમાં કોઈ જ ન બોલ્યું.

સમય થયો એટલે મીનાક્ષીબહેન ઊઠ્યાં. પોતાના ઘેર આવ્યાં. મનહરભાઈને વાત કરી કે વેવાઈ-વેવાઝ કાલે જ આવવાનાં છે અને વત્સલ એમને ઓરપોર્ટ પર લેવા જવાનો છે.

મનહરભાઈ શું બોલે? એ મૌન રહ્યા એટલે મીનાક્ષીબહેન જ બોલ્યાા, “હવે કાલે હું વત્સલને ત્યાં જઈશ નહિ. મારી હવે ત્યાં જરૂર પણ શી?” મીનાક્ષીબહેનના છેલ્લા વાક્યમાં ભારોભાર વેદના હતી.

મનહરભાઈ કંઈક ગંભીર બનીને બોલ્યા, “મીનાક્ષી, તું કહેતી હોય તો આપણે હવે ઈન્દ્રિયા જતાં રહ્યાએ.”

“પાછી ઈન્દ્રિયા જવાની વાત?”

“હાસ્તો! છોકરા સાથે ન રહે એ તો ઠીક, પણ એમને આપણી જરૂર જ ન હોય તો પછી આપણે અહીં શા માટે રહેવું? છોકરાને ખાતર તો...”

“હા, છોકરાનો ખાતર આપણે અમેરિકા આવ્યાં, પણ...”

“પણ શું?” મનહરભાઈએ મીનાક્ષીબહેન સામે જોતાં પૂછ્યું.

“હજુ આપણા વિનયનું ભણવાનું હમણાં જ પૂરું થયું છે, પણ એનું લગ્ન કરવાનું બાકી છે અને...” થોડી વાર અટકીને મીનાક્ષીબહેન બોલ્યાં, “વત્સલ ભલે ને ગયો, પણ હજુ આપણો આ નાનો છે ત્યાં સુધી આમ હિમત હારવાની શી જરૂર?”

મનહરભાઈના મુખ પર ગંભીરતાની છાયા ફરી વળી. કશું જ બોલ્યા વગર એમણે એક પત્ર મીનાક્ષીબહેનના હાથમાં મૂક્યો. એ પત્ર વિનયનો હતો.

પત્ર ખોલીને વાંચતાં પહેલાં જ મીનાક્ષીબહેને ઈન્નેજારીપૂર્વક પૂછ્યું, “શું લખે છે, વિનય?”

“વિનયે લગ્ન કરી લીધું છે...” મનહરભાઈ વેદનાગ્રસ્ત હૃદયે નીચું જોઈ બોલ્યાં.

“શું! વિનયે લગ્ન કરી લીધું ક્યા? ક્યારે? આપણને ફોન પણ ન ક્યા?” મીનાક્ષીબહેનના મુખમાંથી એક સાથે પ્રશ્નો સરી પડ્યા!

“એની કોલેજમાં ભણતી એક ઈટાલિયન યુવતી સાથે. ફોન પર વાત કરવાનું ઠીક ન લાગતાં એણે પત્ર લખીને જણાયું છે. સાથે યુવતીનો ફોટો પણ મોકલ્યો છે...”

મીનાક્ષીબહેન શૂન્યમનસ્ક બની ગયાં! આ આધાત વધારે ઘેરો અને અસહી હતો.

ઘણા વખત સુધી બનેમાંથી કોઈ જ ન બોલ્યું. શું બોલવું એ જ કોઈને સમજાતું ન હતું.

થોડા વખત પછી મીનાક્ષીબહેન આંસુ સાથે તૂટક શબ્દોમાં બોલ્યાં, “છોકરાં પોતાની સાથે ન રહ્યાં એનું દુઃખ નથી, પરંતુ પોતાનાં જ ન રહ્યાં એનું દુઃખ કોને કહેવું?”


(‘આહ! અમેરિકા! વાહ અમેરિકા’ – માંયી)

### માણસ : વિચાર કરનારું પ્રાણી

(અનુસંધાન : પાના નં.-૪૪ ઉપરથી ચાલુ)

બનાવ્યાં તે કહોવાતાં નથી, ઋતુ એમને સ્પર્શતી નથી, એટલું ખરું કે પેલો વહેર અમને સ્વરૂપ મળ્યું અને જીવીએ છીએ એ જાણતો નથી તો કોને માટે અમે મરીને પણ જીવીએ છીએ? એ વિચારવાની એમની સ્થિતિ જ હોતી નથી. માત્ર કુન્નિમ દેહ હોય છે - અને જવવિહોણાં ઈંડાંનો આહાર એ માંસાહાર હોય જ નહીં; જીવતાં ન જીવ્યો તે મરીને પણ જીવે છે; ઉપયોગ હતો તે હવે પણ ઉપયોગી છે એમનું અસ્તિત્વ તો રૂપબેટ છે જ; શહીદ પોતે ન થાય, બીજા કરે પણ મરીને જીવવાનું ખરું - અને પરાર્થે જીવન, પરાર્થે મરણ, શહીદી હોય છે, એનાં તો ગુણકીર્તિન હોય; મરનારા ભલે એ ન સાંભળે, જીવતાંએ ક્યાં સાંભળવાની સ્થિતિમાં જ હતા? પરાર્થે જીવા મર્યાનાં તો અહોગાન થાય; પણ તે કરવા માટે તો જીવતા માણસ હોવા જોઈએ જ. અને પોતે પણ એવી જ સ્થિતિમાં એવી જ ભૂમિકા ભજવતા હોય એ ન જાણવું, એ પણ અસ્તિત્વ હોય છે; પરાર્થે જીવવાનો, બીજાને અને બીજાને જ ઉપયોગી થવામાં તો ભારે મહિમા છે. જે પોતાને માટે જીવે છે તે જીવતા જ નથી, એવું કહેનારા તો પછી દર પેઢીએ આવ્યા જ કરે છે, તેઓને એમાંથી જીવન પ્રામ થતું હશે. જાણો છો કે જીવ અને જીવનની અનેક વ્યાખ્યા કેમ થઈ છે? કોઈ વ્યાખ્યા હજી પૂર્ણ કેમ નથી થઈ? ભવિષ્યનો વિચાર કરો તો આપોઆપ જવાબ મળી શકે, માત્ર વિચાર કરવાથી કશું જતું નથી, માણસ વિચાર કરનારું પ્રાણી છે એ સિદ્ધ થાય છે.

સોઝન્ય : “દેંબોદાન”



**DEEP JYOT**  
STATIONERY MART  
MFG. OF : EXERCISE & ACCOUNT BOOKS &  
ALL TYPES OF OFFICE FILES

JAYESH S. PAREKH  
M. : 98241 06623

FACTORY : Plot No. 4601,  
G.I.D.C., Ankleshwar-393 002.  
Ph. : 253137

## માણસ : વિચાર કરનારું પ્રાણી

• રતિલાલ ‘અનિલ’ •

ક્યારેક એવો વિચાર પણ આવે છે કે એ કોચલામાં તો એનો સંપૂર્ણ દેહ ઘઢાયો. પોતાની ચાંચથી એની દીવાલ તોડીને બચ્યું શા માટે ઈડાની બહાર આવે છે? એનો દેહકાર તો સંપૂર્ણ થયો. ત્યાં કહે છે કે નર્યો અંધકાર હતો, એને જીવને હોય તે તમામ અંગોયે ઈડાની કેદમાં પ્રામ થયાં તે સાથે એને આંખો પણ મળી અને ઈડાની કેદનો અંધકાર એ સહી શકી નહીં, એટલે ઈડાની દીવાલોની બહારનો પ્રકાશ, બહારનું જગત જોવા અને જીવવા માટે પોતે જ ચંચુપહાર કરીને બહાર આવ્યું. બહારના જગતમાં ઉજળા અંધકાર જોવા માટે ઈડાની કેદમાંથી પોતે જ બહાર આવ્યું. એ જ જીવ નંદુસક હોય તો બીજ ગ્રહણ કરનાર જીવ સાથે સંયોગ કરીને હું પોતે જ જે બહારનું જગત જોઉં છું તે જ તું પણ જુએ અને હું જોઉં છું તે પૂર્ણ નથી અથવા હું જે સહું છું તે એકલો સહન કરી શકું એમ નથી તે તુંયે સહન કરી બહારના પ્રકાશ કે જગતને તુંયે જુએ, મારા અધૂરા દર્શનમાં આગળ વધે તે માટે; પણ, ‘બીજો જીવ’ એટલે શું? અનેકાનેક ઈડાની દીવાલ તોડી બહાર આવેલાં બચ્યાં તેઓ પણ ઈડાની દીવાલ તોડનારાં બચ્યાં જ જન્માવ્યા કરે છે, કારણ? બહારનું જગત પોતે દીવાલ બને અને કોઈ જ ચાંચ એ દીવાલને તોડી ન શકે એ માટે? પ્રશ્ન માત્ર પ્રશ્ન જ રહે છે. કારણ કે પ્રશ્ન થાય અને ઉકેલવા માટે જે કંઈ કરે એમાંથી વધારાનો પ્રશ્ન આપોઆપ જન્મે અને પોતાના જન્મને જ પ્રશ્નોનો જનક ક્યારેક જુએ. કોઈક જીવ જુએ પણ બીજા જીવ તો આહાર બનવા માટે નિરૂપાયે જીવતા હોય... પણ દીવાલની બહાર આવેલા જીવ એ વિશે વિચારે ત્યાં તો નહીં જેવી વિચારણાએ મરે કે મરાવી દેવાય ત્યારે બીજાઓ પ્રશ્નો (ઉકેલવા નહીં તો સમજવા

માટે જીવશે પણ, ત્યારેયે આહાર માટેનાં મોઢાં ઉઘડુંનાં જ હશે તો? તેમને માટે દીવાલ તોડેલી કે આહાર માગતા, જોતાં મોઢાં માટે? જેનો જવાબ નહીં એવા પ્રશ્નો થયા કરે છે અને ઈડાની બહાર તો ખોરાક વિના જીવવાય નહીં એટલે પ્રથમ ચિંતા આહારની અને એ માટેનાં પ્રપંચમાં તો તાબે થવાનું હોય, એમાં અસ્તિત્વ અને જગત વિશે વિચારવાનો સમય જ ક્યા? અસ્તિત્વ એટલે જે રીતે જેટલું જીવા તે? આમ તો જેમાં જીવ ન હોય તે પણ આહાર બને એવા જગતમાં આહાર જ બને છે. પણ તેને આત્મા જ નહીં, પ્રવંચના નહીં, આત્મનિંદાયે નહીં. કદાચ એ બોધ પરોક્ષપણે ઈડાની બહાર આવેલા જીવો માટેય હોય. જીવો બસ જીવો, શા માટે? પ્રશ્ન જ નથી. એ વિચારવાનો સમય જ નથી, મહત્વ હોય જીવવાનું, તે જીવા કરો, જીવાય કે જીવી શકો એટલો સમય - એ જ જીવન?

માંસાહાર નહીં જ એવી ગાંધીડોસાની જદના જવાબમાં કેટલાકોએ કે તેમની ભૂખે શોધી કાઢ્યું કે કેટલાંક ઈડામાં તો જીવ જ નથી. એનો આહાર કરવામાં વળી હિસા અને માંસાહાર કેવો? અને એમની ભૂખે પુરવાર કર્યું કે કેટલાંક ઈડાં સાચે જ નિર્જવ છે. એટલે ડોસાનેયે કબૂલાલું પડ્યું કે એનો આહાર માંસાહાર નથી. અને તો હવે તો એમાં પ્રશ્ન પણ નથી... હવે તો માત્ર ઈડા અને છેલ્લે તેમના માંસ માટે મરધાં ઉછેરવામાં આવે છે, માત્ર એટલા જ માટે - તેઓ સૂર્યનો પ્રકાશ નહીં, બલ્બનો પ્રકાશ જુએ છે અને કૃત્રિમ પ્રકાશમાં માત્ર ઈડા અને છેવટે પોતે બીજાના આહાર માટે જ, પાલકની ઈચ્છાઓ ઉછેરવામાં આવે છે - એમનો નિવાસ ખુદ એક મોટું કોચલું હોય છે કૃત્રિમ પ્રકાશનું અને બધા જ પાડોશમાં હારોહાર જીવે, શા

માટે, જીણે નહીં, ખોરાક મળે છે - પોતે છેવટે ખોરાક થવા? એ પ્રશ્ન એમને હોય નહીં, પાલતુ બને છે તેઓ શા માટે જીવે છે એ જાણતાં નથી. એમની સામે ખોરાક હોય છે, પોતે ખોરાક થઈ શકે એ માટેનો ખોરાક છે એવું તો કોણ વિચારે? ભૂખનો પ્રશ્ન ન હોય તો હવે જીવ વિચારતાં જ નથી; એ હલાલ થાય ત્યારે તે જીવવાની સ્થિતિમાં જ હોતા નથી. તો વિચારની સ્થિતિમાં હોય? અને હોય તોયે એનો અર્થ એને માટે હોય બરો? આથી જાણવા નહીં તો શોધવા માટે એઝે જીવવું પડે, પણ જીવવા-મરવાની સ્વતંત્રતા તો એને માટે હોતી જ નથી. અને ક્યારેક એવું બને છે કે પાલતુઓ દ્વારા એવો રોગ ફેલાય છે કે માણસો તેના ભોગ બને - એટલે એમને જીવતા ઊંડાં ખાડામાં ભંડારી દેવામાં આવે છે... અને છતાં એમનો વંશ ચાલ્યા કરે એવી વ્યવસ્થા, જોગવાઈ પણ પાલકોએ, ઈડાનાં આહારી લોકો માટે કરેલી જ હોય છે. એટલું ખરું કે પોતાની ચાંચથી ઈડાંનું કવચ તોડનાર શિશુને, છોલ્લે જન્મેલા શિશુનેથ નહીં થતો હોય - આ તો કહેવાતાં માનવ ‘મૂખા’ એટલે આવી કલ્પના અને વિચાર આવે છે, અને કેટલાંક ઈડાંમાં જીવ જ નથી હોતો એવા જીવવિહોષા જીવ પણ હોય છે, એમને ‘વાંજિયામેણું’ હોય જ નહીં... જીવ જ નથી, એ જીવતો જ નથી એટલે મરતોય નથી. શી રીતે મરે? જગદીશચંદ્ર બોજે તો વૃક્ષોમાંયે જીવ છે એવું પુરવાર કરેલું; એમને એ માટે કેદની સજા થઈ નહોતી કારણ કે એમની એ શોધ પછીય માણસે જંગલ કાચ્યાં અને જે વેરે નકામો પડી રહેતો તે કોઈ વળી બરફને લાકડાના વહેરના કવચની જરૂર છે એ માટે થોડો લઈ જતો, તો બાકી રહેલા વહેરમાંથીયે વિજ્ઞાનીએ કૃત્રિમ બોર્ડ (અનુસંધાન : જુઓ પાના નં.-૪૪ ઉપર)

## ભારત સરકારે જૈનોને લઘુમતી કોમ જહેર કરવાથી થનારા વિશેષ લાભો

● સંકલન : દિનેશચંદ્ર જે. શાહ ●

ભારતીય સંવિધાન અલ્યુસંખ્યકનાં નિયમો પ્રમાણે સરકારે જૈનોને ૨૮-૩૦ નિયમથી ધાર્મિક અલ્યુસંખ્યક જહેર કરવાની ઘોષણા થઈ છે. આ અવિસૂચનાથી જૈન સમુદાયને કોઈ નુકસાન છે કે લાભ તે જાણવાનું જરૂરી છે. સાથે કોઈને શંકા પણ ઉઠી રહી છે, એને દૂર કરવી આવશ્યક છે. જૈનોને અલ્યુસંખ્યક થવાથી શું લાભ અને નુકસાન થાય છે તેની કાયદાકીય માહિતી જેટલી મળી છે તે અહીં રજૂ કરી છે.

**● હાનિ :** અલ્યુસંખ્યક ઘોષિત થવાથી કોઈપણ પ્રકારની હાનિ નથી.

**● મુખ્યધારા :** આ ઘોષણાથી જૈનો રાષ્ટ્રીય મુખ્યધારાથી અલગ નહીં થાય. ફક્ત આપણા ધર્મ, શિક્ષા અને સંસ્કૃતિનું સારી રીતે રક્ષણ કરી શકીએ. જ્યાં સુધી કાનૂનનો પ્રશ્ન છે, જૈનો પર હિંદુ વિધિ જ લાગુ પડશે જેમકે વિવાહ, ગોદ લેવાની પ્રથા, નાભાલિગનું રક્ષણ, ભરણપોષણ એવો જ પ્રભાવ સમાન નહીં થાય. એવો સ્પષ્ટ આદેશ ભારતીય સંવિધાન સન ૧૮૫૮માં હિંદુ કાનૂનમાં થયો છે.

૧. હિંદુ લગ્ન અધિનિયમની ધારા ૨(૧)ખ
૨. હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમની ધારા ૨(૧)ખ
૩. હિંદુ સંરક્ષણિની અધિનિયમ ધારા ૩(૪)
૪. હિંદુ દંતક ગ્રહણ તથા ભરણપોષણ અધિનિયમની ધારા ૨(૪)

આ બધા નિયમો જૈન ધર્મને હિંદુ સમાજ ધારાથી લાગશે.

**● શંકાનું નિવારણ :**

૧. અલ્યુસંખ્યક સંવિધાનના નિયમ પ્રમાણે ૨૮ કે ૩૦ની તરફથી ઘોષિત છે.
૨. અલ્યુસંખ્યક ન તો પણત જાતિ કે જનજાતિ માટે નિયમ છે. ૧૬(૪), ૧૬(૫), ૩૪૦, ૩૪૧ અને ૩૪૨નાં નિયમ પ્રમાણે અલ્યુસંખ્યકને નોકરીમાં વિધાનસભા કે લોકસભામાં કોઈ પ્રકારનું રીજર્વેશન પ્રાપ્ત નહીં થાય.

**● જૈન શિક્ષણ સંસ્થાઓ :**

૧. જૈન શિક્ષણ સંસ્થા પોતાનું અલગ અસ્તિત્વ બનાવી રાખશે.
૨. મેનેજમેન્ટ પર જૈનોનો કંટ્રોલ રહેશે.
૩. જૈન વિદ્યાર્થીને પ્રથમ પ્રવેશ આપવામાં આવશે.

૪. જૈનોને નોકરીમાં પ્રથમ સ્થાન મળશે.
૫. શાળામાં જૈન ધર્મની પ્રાર્થના - સ્તુતિ થઈ શકશે.
૬. જૈન સંસ્કૃતિની જાણકારી અને પ્રચારનો ખાસ હક્ક હશે.

### જૈન સમુદાયને લઘુમતી દરજાના લાભ અને ફાયદા

ભારત સરકારે હવે જૈન સમુદાય માટે ધાર્મિક લઘુમતી દરજાની જહેરાત કરી છે. તેના લાભ અને ફાયદા નીચે મુજબ છે.

**● લાભ અને ફાયદા :**

સરકાર બહુમતી સમુદાયના મંદિરો અને ધાર્મિક સંસ્થાઓને લઈ શકે છે. પરંતુ કોઈપણ લઘુમતી પૂજા સ્થાનો અને અન્ય સંસ્થાઓને સ્પર્શ શકતી નથી. તેથી આ ધાર્મિક લઘુમતી દરજાને જૈન મંદિરો, યાત્રાધામ કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ અને અન્ય સંસ્થાઓના રક્ષણ માટે મદદ કરશે.

કેટલાક અન્ય લાભ અને ધાર્મિક લઘુમતી દરજાના લાભ નીચે મુજબ છે :

૧. જૈનો માટે ધાર્મિક લઘુમતી દરજાને વિશ્વમાં Jainism સૌથી જૂના જીવંત ધર્મો સાથે જીવનની અનન્ય જૈન રીતે એક રક્ષણ ભાતરી કરશે. જૈન સમુદાયને ભારતીય બંધારણના જોગવાઈઓ મુજબ વગેરે તેના ધર્મ, ભાષા, સંસ્કૃતિ સંરક્ષણ માટે લાયક હશે.
૨. સરકાર આવા મંદિરો, સમાધિ, યાત્રાધામ કેન્દ્રો, ટ્રસ્ટો વગેરે જૈન ધાર્મિક સ્થળો ન લઈ શકે. આ ઉપરાંત સરકાર આવા કેન્દ્રોની સલામતી, સુરક્ષા અને વિકાસ માટે પગલા લેશે.
૩. જૈન ધાર્મિક ટ્રસ્ટ માલિકીની મિલકતો ભાડા નિયંત્રણ અધિનિયમમાંથી મુક્તિ આપવામાં આવશે.
૪. જૈન શૈક્ષણિક સંસ્થાઓ, જૈન ધર્મ અને તેના તત્ત્વજ્ઞાન શીખવા માટે યોગ્ય ઠરશે.
૫. શાળા, કોલેજ, ધાત્રાલય, સંશોધન સંસ્થાઓ, હોસ્પિટ્લો વગેરે સરકારી જમીન સહાયિત દરે મેળવી શકશે.
૬. શૈક્ષણિક અને અન્ય સંસ્થાઓ ચલાવવામાં સરકારનો હુસ્તક્ષેપ ઓછો થશે.
૭. જૈન સંસ્થાઓ જૈન વિદ્યાર્થીઓ માટે ૫૦% બેઠકો અનામત કરી શકશે.

૮. પ્રશંસાપાગ અને બીપીએલ વિદ્યાર્થીઓને શાળાઓમાં ટ્યુશન ફી માં પૂર્ણ મુક્તિ મળશે.
૯. જૈન વિદ્યાર્થીઓને યુનિવર્સિટીઓ દ્વારા ચલાવવામાં કોલેજો કોચિંગમાં કોચિંગ સબસિડી મળશે.
૧૦. જૈન વિદ્યાર્થીઓ બિજનેસ અને વહીવટી ફોર્મ્સમાં તાલીમ માટે અનુદાનપાત્ર રહેશે.
૧૧. જૈનોને બિજનેસ માટે ટેકનિકલ અને અન્ય શિક્ષણ માટે આર્થિક મદદ - લોન મળી શકશે.
૧૨. સરકારે વિદ્યાર્થીઓ અને યુવાનો જૈન સાંસ્કૃતિક રમતો અને પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહન ગ્રાન્ટ અને શિષ્યવૃત્તિ આપી શકશે.
૧૩. સખાવતી અને ધાર્મિક કારણો માટે દાન માટે સંપત્તિ કરમુક્ત થશે.
૧૪. જૈન સમુદાયને સરકાર રોજગાર ખાસ લાભ મળશે.

#### ● વિશેષ લાભો :

૧. જૈન પોતાના ધર્મની શિક્ષા, સંરક્ષણ અને પ્રસાર કરી શકશે.
૨. રાજ્યનાં અલ્યુસંઝ્યક આયોગમાં એક પ્રતિનિધિનો સમાવેશ થશે.
૩. રાજ્ય અલ્યુસંઝ્યક આયોગમાં જૈનોના હિતોની રક્ષા કરશે.
૪. જૈનો સાથે કોઈ ભેદભાવ થશે તેને દૂર કરવાની કોશિશ આયોગ કરશે.
૫. ઉદ્યોગ અને સમાજકલ્યાણ વિભાગ દ્વારા વિચાર વિમર્શ કરી તેના પર લોન વગેરેની મંજૂરી આપશે.

#### ભારત સરકાર દ્વારા માઇનોરીટી પ્રમાણે જૈન વિદ્યાર્થીઓને સ્કૂલમાં ધોરણ-૫ થી ૧૦ માટે મળતા લાભ

- ★ **આવક :** પરિવારની સંયુક્ત આવક : ૧ લાખથી ઓછી.
- ★ સ્કૂલ એડમિશન ફી રૂ. ૫૦૦/- લેબે વર્ષમાં એકવાર મળે.
- ★ સ્કૂલ ફી માસિક રૂ. ૩૫૦/- અથવા જે હોય તે ૧૦ મહિનાની મળે છે અને તે સ્કૂલના બેંક ખાતામાં જમા થાય છે.
- ★ **એલાઉન્સ :** માસિક રૂ. ૧૦૦/- વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા થાય છે.

#### ★ શરતો :

- ◆ ઓછામાં ઓછા ૫૦ ટકા માર્ક્સ હોવા જોઈએ.
- ◆ એક પરિવારમાંથી ફક્ત બે વિદ્યાર્થીને જ લાભ મળે.
- ◆ નિયમિત હાજરી હોવી જોઈએ.
- ◆ Income Certificate / Salary Certificate – રૂપિયા ૧ લાખથી ઓછી આવકનું.
- ◆ ટર્મ ફી અને સ્કૂલ ફી બેંકના ખાતામાં જમા થાય છે.

◆ આ માટેના ફોર્મ ઓનલાઈન વેબસાઈટ પરથી અથવા મંત્રાલયમાંથી મેળવવા, યોગ્ય રીતે ભરી સ્કૂલમાં જમા કરવા.

◆ વિદ્યાર્થીના નામનું પર્સનલ ખાતું નીચે જણાવેલ બેંકમાં ખોલાવવું  
State Bank of India  
Bank of Maharashtra

#### ★ જરૂરી દસ્તાવેજો :

- ◆ ફોર્મ પર ફોટો લગાવી વિદ્યાર્થીએ સહી કરવી.
- ◆ વાર્ષિક આવકનું પ્રમાણપત્ર સ્ટેમ્પ પેપર પર એફિટેવીટ / ફેન્કિંગ કરાવવું.
- ◆ સરનામાનો પુરાવો રેશનિંગ કાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ વગેરે.
- ◆ માર્કશીટ, ગત વર્ષ પાસ થયેલા રીજલ્ટની સહી કરેલ ફી રસીદ.
- ◆ માઈનોરીટી સર્ટીફિકેટ સ્થાનિક જૈન સંઘમાંથી મેળવવું.

#### ★ વધુ જાણકારી માટે :

Website : [www.schoolmaharashtra.gov.in](http://www.schoolmaharashtra.gov.in)

#### ભાગ-૧

૧. ધોરણ-૫ થી ૭ શિક્ષારત વિદ્યાર્થીઓ માટે ઉપસ્થિતિને પ્રોત્સાહન આપવા ભત્તાની યોજના.
૨. અલ્યુસંઝ્યક સમાજની પાઠશાળામાં ભણનાર વિદ્યાર્થીઓને મફત ગણવેશ આપવાની યોજના.
૩. અલ્યુસંઝ્યક પાઠશાળાઓમાં પાયાની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરવા હેતુ અનુદાનની યોજના.
૪. અલ્યુસંઝ્યક દ્વારા સંચાલિત શિક્ષા સંસ્થાઓમાં ધાર્મિક અને ભાષિક અલ્યુસંઝ્યકનો દરજાજો પ્રદાન કરવાની યોજના.
૫. મરાઠી / ગુજરાતી ફાઉન્ડેશન વર્ગની યોજના.
૬. ઉચ્ચ વ્યવસાયિક શિક્ષણ પ્રામણ કરવા રાજ્યના અલ્યુસંઝ્યક છાત્રોને ધાત્રવૃત્તિની યોજના.

#### ભાગ-૨ : રાજ્ય સરકારની રોજગાર વિશે અને વિકાસની યોજનાઓ

૧. અલ્યુસંઝ્યક ઉમેદવાર માટે રોજગારલક્ષી યોજનાઓ.
૨. અલ્યુસંઝ્યક ઉમેદવાર માટે પોલીસની ભરતી પૂર્વ પરીક્ષા પ્રશિક્ષણ માટે યોજનાઓ.

(અનુસંધાન : જુઓ પાના નં.-૪૧ ઉપર)

## સંશાય

● ઇલા કે. શાહ ●

સુપથ અને સ્નેહા લગ્નગ્રંથિથી જોડાયાં. લગ્ન અને સગાઈ વચ્ચે લગભગ છ માસનું અંતર હોવાથી બંને પરસ્પર વિચારોની આપ-લે કરી શક્યા, લાગણી, પ્રેમ અને સહાનુભૂતિ દ્વારા સુપાત્રો મળ્યાનો આપસમાં સંતોષ થયો.

સુપથનું મિત્રવર્તુળ વિશાળ હતું, પરંતુ પોતાનો ખાસ-જિગરજાન દોસ્ત કહેવાય તે માત્ર મલય જ હતો. ઘરની નજીક જ રહેતો હોવાથી ને સાથે ભણતો હોવાથી શૈશવકણનો મિત્ર હતો, સ્નેહાને કહી રાખેલું કે “જો સ્નેહા, મલય મારો જિગરનો ટુકડો જ કહેવાય, ગાઢ મિત્રતા હોવાથી જુદ્ધાઈ નથી. તારે એને મારી જેમ જ સાચવવાનો છે. પહેલેથી તેને આપણાં ઘરનો સર્બ્ય જ ગણેલો છે.”

“ભલે, તમારો જિગરી દોસ્ત છે તો હું તેઓને એ રીતે જ સાચવીશ” સ્નેહાએ કહ્યું.

મલય મિલનસાર, ભોળો ને ટીખળી સ્વભાવનો હતો. હસી-મજ્જાક, મશકરીથી સૌને હસાવી દિલ જીતી લેતો. ઓફિસેથી છુટી સીધો જ સુપથને ઘેર આવી જાય. પહેલાંની આ આદત જ હતી. સુપથનાં બા તથા બેનો સાથે આ રીતે મન મળી ગયું હતું. તેથી તેનાં ઘરે પછી જ જાય. હાલ તો બેનો સાસરે ને બા પરલોક સીધાવી ગયાં એટલે સ્નેહાભાબી સાથે જ મશકરી કરાયને? આવતાં જ ટહુકો કરે, “કેમ? ભાબી? આજે શું બનાવ્યું છે? ગરમાગરમ નાસ્તો કરાવજો હોં, વરસાદની કંડકમાં મજા આવશે.”

“અરે, મલયભાઈ, દાળવડાં તૈયાર જ છે, જરૂર ખવડાવીશ.” સ્નેહા પ્રેમથી કરીને ખવડાવતી. ઓફિસેથી આવી થોડીવાર બેસી પાછો જાય, સુપથ આવે એટલે આવી જાય. મોડા સુધી ટોળટપ્પાં,

વાતો બધું જ ચાલે. બહાર ફરવા પણ જાય. આ તેનો નિત્યકમ હતો.

સમયનું ચક ગતિમાન બન્યું. સ્નેહા નાનકડા પણ્ણું મમ્મી બની. સ્નેહાનું પિયર બહારગામ હતું. પણ મલય સુપથની સાથે અવાર-નવાર મળવા માટે જતો. મલય અપરિણિત હતો. સ્નેહા હવે મોકળા મને તેની મશકરી કરી શકતી. મલયભાઈ, લગ્ન ક્યારે કરો છો? હવે સાથીદાર લાવી દો, જેથી અમને ય કંપની મળો.”

“બસ, હવે તૈયાર જ છું, મેમસાબ મળો એટલી જ વાર છે.” તેમ કહેતો.

સમયગાળો વ્યતિત થતાં સ્નેહા શ્વસુર ગૃહે પાછી ફરી. હવે તો મલય થોડો પણ ટાઈમ મળો તો પણ પણ્ણું રમાડવા આવી જતો. સ્નેહાને તો ભાઈ સમાન જ હતો. સુપથનો ખાસ મિત્ર ને વળી, મિલનવાર, આનંદી સ્વભાવ તેથી મનમિલાપ વધતો ગયો. સુપથ કરતાં મલયમાં વધુ ધ્યાન કેન્દ્રિત થતું હોય તેવું લાગ્યું.

આટલો વખત પસાર થયો ત્યાં તો સુપથના સ્નેહસાગરમાં સંશયનો કીડો પ્રવેશી ગયો. સુપથના જીવનમાં પ્રવેશોલી શંકાએ સુપથમાં આમૂલ પરિવર્તન લાવી દીધું.

પ્રતીક્ષા કરી રહેલી સ્નેહા સુપથનું આગમન થતાં જ હસીને કહે, “સુપથ, તને ખબર છે, આજે મલયભાઈ, પણ્ણ માટે શું લાવ્યા?” તો કોઈવાર કહેશે, ‘પણ્ણું આજે બધું જ તાવ હતો, સારું થયું મલયભાઈ હતા.’’ આજે તો મલયભાઈને ભાવતી વાનગી બનાવી છે, જો સુપથ પેલું નવું પિક્ચર આપણે સાથે જ જોઈશું.”

સુપથનાં હૈયે લાગેલાં ઘામાં જાણો મસાલો ઉમેરાયો ને તેના દિલમાં ચચરાટ થયો.

બધી જ વાતમાં કેન્દ્રમાં ‘મલય’ જ હોવાથી સુપથનાં હૈયે વહેમનાં વંટોળની જાગ કે ડમરી ચઢી. ઓફિસેથી આવી

સૂનમૂન બેસી જતો. હસી-ખુશીને તિલાંજલિ આપી દીધી. સ્નેહાને નવાઈ લાગી, પણ કાંઈ અણાજતો વિચાર તો આવે જ નહિ. સ્નેહાએ તો પ્રેમભર્યા હૈયે કહ્યું, “ચાલ, સુપથ જમી લઈએ, મલયભાઈનાં કહેવાથી તારે માટે પાણીપૂરી બનાવી છે.”

“તું મલયને જમાડી લે, મને ભૂખ નથી, મને ઠીક નથી, જમવું નથી.” તેમ કહી રૂમમાં સૂઈ રહ્યો. સ્નેહાએ સુપથને મનાવવા ઘણી કોશિષ કરી પણ વર્થ. તે રડવા લાગી.

સુપથનું હૈયું આજે વજ જેવું કઠળ બન્યું હતું. તેનાં દિલની અટારીએ વિચારોની ઉથલ-પાથલ મચી ગઈ હતી. સંશય (શંકા) ના કીડાનો સળવળાટ આતંક મચાવે તેવું લાગતું હતું. પ્રેમ, લાગણી અને આનંદની ઓટ વર્તાવા લાગી.

હવે સ્નેહાનાં ધીરજનાં બંધ તૂટ્યા. સ્નેહ સંબંધોના સથવારે જીવનરથ ડગ માંડતો હતો ને આ શું થયું? સહનશીલતા સળવળી, પ્રેમની પ્રતીક્ષા પરાકાણાએ પહોંચેચી. પંદર દિવસ પસાર થયા, પણ કારણ સમજાતું નહોતું.

સ્નેહા સુપથનાં વહેમી માનસને પારખી ન શકી. તે બોલી, “કહે, સુપથ, તને શું થયું છે? આપણાં સ્નેહસાગરમાં તારો પાવનપ્રેમ હિલોળાં લેતો હતો, તેમાં ખોટ ક્યાંથી આવી? મારી કઈ ભૂલની આ સજ છે? મને તો તારાં પ્રેમપરિમલનાં પ્રાંગણમાં આળોટવા દે. દુઃખનાં દરિયામાં ડુબકી મારવાનું મને નહીં ફાંચે. આંસુ અને સબૂરી (ધીરજ) એ બે સિવાય બીજી કોઈ મૂડી મારી પાસે નથી” અને એટલું કહેતાં ધ્યસકે ધ્યસકે રડવા લાગી. આ સમયે મલય કામ હોવાથી બહાર ગયો હતો.

સમગ્ર વાતાવરણમાં ઉદાસીનતાનું

(અનુસંધાન : જુઓ પાના નં.-૬૨ ઉપર)

## ગુજરાતનું વિકાસલક્ષી બજેટ

ગુજરાતના નાણામંત્રી સૌરભમાઈ પટેલે રજ ફેલુઆરીએ ગુજરાતનું ૨૦૧૬-૨૦૧૭ તું અંદાજપત્ર વિધાનસભામાં રજૂ કર્યું હતું. પહેલી નજરે જોતા બજેટનું કદ વધ્યું છે. સાંશેયલ સેક્ટર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. બજેટમાં અનેક નવી જોગવાઈ કરવામાં આવી છે. બજેટ અંગે અનેક પ્રતિક્રિયા આવી રહી છે. ત્યારે આવો જાહીએ વિકાસલક્ષી ગુજરાતના આ બજેટના કેટલાંક અંશો...

- ★ બજેટની વાર્ષિક યોજનાનું કદ રૂ. ૮૫,૫૫૭ કરોડ ગત વર્ષની સરખામણીએ કદમાં રૂ. ૬,૨૬૨ કરોડનો વધારો.
- ★ ૨૦૧૬-૧૭ રૂ. ૨૪૫.૪૯ કરોડની પુરાંત.

### બજેટ પર એક નજર...

- ★ સુજલામૃ સુજલામૃ યોજના માટે રૂ. ૧૪૨૮૪ કરોડની જોગવાઈ.
- ★ નર્મદા યોજના માટે રૂ. ૬,૦૫૦ કરોડનું આયોજન
- ★ જળસંપત્તિ અને કલ્પસર માટે રૂ. ૫,૨૪૪ કરોડનું આયોજન
- ★ કૃષિ અને સહકાર વિભાગ માટે રૂ. ૫,૭૮૨ કરોડનું આયોજન
- ★ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના વાર્ષિક આવક મર્યાદા રૂ. ૪.૫૦ લાખથી વધારી રૂ. ૬ લાખ કરાઈ; પર્સેન્ટાઇલની મર્યાદા ૮૦% થી ઘટાડીને ૮૦% કરાઈ.
- ★ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન માટે રૂ. ૧,૦૦૦ કરોડની ફાળવણી
- ★ શિક્ષણ વિભાગ માટે રૂ. ૨૩,૮૧૫ કરોડની ફાળવણી
- ★ સામાજિક ન્યાય અધિકારિતા માટે રૂ. ૨,૭૨૮ કરોડની જોગવાઈ
- ★ વિકસતી જાતિઓ માટે રૂ. ૧,૧૦૫ કરોડની ફાળવણી
- ★ સમાજ સુરક્ષા માટે રૂ. ૬૨૩ કરોડની ફાળવણી
- ★ એક લાખ હેક્ટરમાં સિંચાઈ સુવિધા વધશે, કલ્પસર માટે રૂ. ૫,૨૪૪ કરોડનું આયોજન.
- ★ બંદરો અને વાહન વ્યવહાર માટે રૂ. ૧,૩૧૭ કરોડની ફાળવણી
- ★ ઊર્જા અને પેટ્રોકેમિકલ માટે રૂ. ૭,૭૮૪ કરોડની ફાળવણી
- ★ ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે રૂ. ૩,૫૪૫ કરોડની ફાળવણી
- ★ વાઈબ્રેન્ટ ગુજરાત ૨૦૧૭ માટે રૂ. ૭૦ કરોડની જોગવાઈ.

- ★ ધોલેરા સર માટે રૂ. ૧,૮૦૬ કરોડ,
- ★ સ્ટાર્ટ અપ પ્રોજેક્ટ માટે રૂ. ૫૦ કરોડની જોગવાઈ.
- ★ શ્રમ-રોજગાર માટે રૂ. ૧,૫૧૬ કરોડની જોગવાઈ
- ★ પ્રવાસન-યાત્રાધામ વિકાસ માટે રૂ. ૮૮૪ કરોડની ફાળવણી
- ★ આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે રૂ. ૮,૨૧૨ કરોડની ફાળવણી
- ★ મહિલા અને બાળવિકાસ માટે રૂ. ૨,૬૧૫ કરોડની ફાળવણી
- ★ સામાજિક ન્યાય અધિકારિતા માટે રૂ. ૨,૭૨૮ કરોડની જોગવાઈ
- ★ માર્ગમિકાન વિભાગ માટે રૂ. ૮,૪૦૨ કરોડની ફાળવણી
- ★ સમાજસુરક્ષા માટે રૂ. ૬૨૩ કરોડની ફાળવણી કરાઈ.
- ★ રમતગમત માટે રૂ. ૫૭૦ કરોડની ફાળવણી કરાઈ.
- ★ શહેરી વિકાસ-ગૃહનિર્માણ માટે રૂ. ૧૧,૨૫૬ કરોડની ફાળવણી
- ★ રાજ્યમાં કુલ રૂ નવા ફલાયાઓવર બનશે. તે માટે રૂ. ૫૧૫ કરોડની જોગવાઈ.
- ★ અમદાવાદમાં બનશે બે નવા ફલાય ઓવરાબ્રિજ : (૧) નરોડા ફલાયાઓવર, (૨) પકવાન જંકશન ફલાય ઓવરાબ્રિજનો સમાવેશ.
- ★ રાજ્યમાં સ્થપાશે દેશની પ્રથમ ઓર્ગેનિક ફાર્મિંગ યુનિવર્સિટી. ઓર્ગેનિક ફાર્મિંગ યુનિ. માટે રૂ. ૧૦ કરોડની જોગવાઈ.
- ★ જેડૂતો માટે કૂડ પ્રોસેસિંગ અને એચો બિજનેસ પોલિસી અંતર્ગત રૂ. ૨૫ કરોડની જોગવાઈ.
- ★ સાંચાંદ ખાતે મહિલા ઔદ્યોગિક પાર્ક બનાવાશે.
- ★ GIDC દ્વારા ઔદ્યોગિક પાર્ક માટે રૂ. ૨૦૦ કરોડની જોગવાઈ.
- ★ MSME એકમો માટે રૂ. ૫૮૬ કરોડની જોગવાઈ.
- ★ ટેક્સટાઈલ ઉદ્યોગો માટે રૂ. ૫૦૦ કરોડની જોગવાઈ.
- ★ ઔદ્યોગિક વિસ્તારો માટે રૂ. ૨૦૦ કરોડની જોગવાઈ
- ★ રાજકોટ ખાતે રૂ. ૧૦ કરોડના ખર્ચે સ્થપાશે એક્ઝિબિશન સેન્ટર.

- ★ અગરિયા અને મીઠા ઉદ્યોગ માટે રૂ. ૩૧ કરોડની જોગવાઈ.
- ★ રાજ્ય સરકારે સ્માર્ટ વિલેજ યોજના માટે કરી રૂ. ૧૮૫ કરોડની જોગવાઈ. રાજ્યના ૩૦૦ ગામોને સ્માર્ટ વિલેજ બનાવાશે.
- ★ ભાણિલાઓ માટે મુખ્યપ્રધાનનો ઐતિહાસિક નિર્ણય - ગભર્શયના મુખના કેન્સર, સ્તન કેન્સરની સરકારી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલોમાં આવકની કોઈ પણ મર્યાદા વગર અપાશે વિનામૂલ્યે સારવાર.
- ★ બાળાયતી પાકો માટે ચાર નવા “સેન્ટર ઓફ એક્સેલન્સ” સ્થપાશે.
- ★ સુગર કો. ઓપ. મિલોની સુધારણા માટે રૂ. ૫૦ કરોડની જોગવાઈ.
- ★ ખેડૂતોને ખરીફપાક માટે રૂ. ૩ લાખ સુધીની લોન મળશે - રાજ્યના ૩૮ લાખ ખેડૂતને મળશે સીધો લાભ; ૧% ટકાના દરે મળશે રૂ. ૩ લાખની લોન; રૂ. ૩૭૫ કરોડની જોગવાઈ.
- ★ અમદાવાદના મેટ્રો પ્રોજેક્ટ માટે રૂ. ૭૨૨ કરોડની જોગવાઈ. સુરત મેટ્રો અને અમદાવાદ - ગાંધીનગર ફેઝ - ૨ માટે જોગવાઈ.
- ★ ગરીબોને ઘર મળે એ માટે રૂ. ૭૫૦ કરોડની જોગવાઈ.
- ★ પ્રવાસન સ્થળોમાં ફિલ્મ શૂટિંગને વેગ આપવા ફિલ્મ ફેસ્ટિવલના આયોજન માટે રૂ. ૧૦ કરોડની જોગવાઈ.
- ★ વડોદરા તેમજ સુરતની સરકારી મેડિકલ કોલેજમાં ૧૫૦ બેઠકો વધશે.
- ★ ૧૦૦ નવી ૧૦૮ એમ્બ્યુલન્સનો વધારો થશે.
- ★ ૧૫ લાખથી વધુની કાર અને ૫ લાખથી વધુની કિંમતના ટુ-હૃદીલર મોંધા થશે.
- ★ વાંસ અને વાંસની બનાવટો પર લાગતો ૫ ટકાનો વેરો નાખૂંદ
- ★ ૫૩૦૨૮ આંગણવાડીના ૪૫.૫૫ લાખ બાળકો માટે રૂ. ૨૩૨૫.૨૨ કરોડ.
- ★ ગુજરાતના ૫૮ રસ્તા ફોર લેન બનાવાશે.
- ★ મુખ્યપ્રધાન અમૃતમૂર્તિ યોજના માટે રૂ. ૧૬૦ કરોડની ફાળવણી
- ★ એક વર્ષમાં ૬૬,૦૦૦ જગ્યાઓ માટેની ભરતી બહાર પડશે.
- ★ ગરીબ પરિવારની દીકરીનો મેડિકલ અભ્યાસનો તમામ ખર્ચ રાજ્ય સરકાર કરશે, વિજ્ઞાન પ્રવાહ માટે નવી ૪૧ શાળાઓ શરૂ કરાશે.

સોઝન્ય : “સાધના”

### નુદ્દિયો....

હાણે કેળા હેરણ ફેરણ,  
હાણે કેળા હિલણ મિલણ,  
હાણે રોણું પ્રભુ પાર્શ્વજે શરણ શરણ,  
'રશ્મનુ' ચુમે તોજા ચરણ ચરણ.

- રશ્મન ખોના (મુંભે)

## બુટીક જ્વેલર્સ

સેમી કલ્યાર મોતી, રાઇસ મોતી, રીયલ મોતી,  
કલ્યાર મોતી, શુદ્ધ ચાંદીના દાઢીના,  
કુંદનના સેટ (જડતર) અને ૧૮ કેરેટ સોના  
અને ચાંદીમાં અમેરિકન ડાચમંડ જ્વેલરી  
૧ ગ્રામ સોનાના દાઢીના મળશે.  
(પેરોઈંગર રોજ બેસો છે.)

૨, હરિ ભુવન, જ્વેર રોડ, મુલુંડ (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૮૦.  
ફોન : (૦૨૨) ૨૫૬૧ ૮૫૪૧ ● મો. ૮૮૨૧૪ ૭૩૫૦૧

પ્રો. : જ્વેર ની. ખોના

### આ જગમાં થોડા મલે!

જાણે ભાષાને ભાવ, અંતરના ઊંડાણથી  
પ્રગટાવે પુષ્ય પ્રકાશ, આ જગમાં થોડા મલે!  
લખે લાણ્યા અનેક, ટેવના પરિણામથી  
મર્મ માણી જે લખે, આ જગમાં થોડા મલે!  
- રશ્મનારો રષ્ટકાર, ભાગ-રમાંથી સાભાર



**Viketa  
Electronics**

An ISO 9001-2000 COMPANY

**MANUFACTURERS OF  
ELECTRICAL PANEL BOARDS**

4759, GIDC Industrial Estate,  
Ankleswar-393 002. Dist. Bharuch.  
Phone : 02646-226257 Fax : +91-2646-252759  
Mobile : 9824101111, 9824762141  
E-mail : viketa53@rediffmail.com



## વાતસલ્યનું સુખ

• સ્વામી સચિદાનંદ •

વ્યક્તિની વાત જવા દો, પણ સમાજિ - કુદરતનું મુખ્ય લક્ષ્ય પોતાના અસ્તિત્વનું સાતત્ય છે. મારું અસ્તિત્વ કાયમ રહે. પોતાનું અસ્તિત્વ સમામ થઈ જાય તેવું કોઈને ન ગમે. પોતાના સાતત્યને જ્ઞાનવી રાખવા કુદરતે વંશવેલો ચાલુ રાખ્યો છે. જે છે તેનો નાશ ન થાય. કદાચ નાશ થાય તો પણ નવા રૂપે તેનો જન્મ થતો રહે. મરણની પ્રક્રિયા વિનાશની નથી, સમાપ્તિની નથી, નવા જન્મની તૈયારી છે.

દશરથનો વંશ સમામ થવાના છેડે પહોંચી ગયો હતો, પણ શ્રદ્ધાએ સાથ આપ્યો. શ્રદ્ધા હારે નહિ, તૂટે ખરી. તૂટવાનું કારણ વ્યક્તિની અધૂરી અને ખોટી સમજ હોઈ શકે. દશરથ અને રાણીઓનો એક એક દિવસ યુગ જેવો વીતી રહ્યો છે. સૌને પેલા દિવસની પ્રતીક્ષા છે. જે દિવસે કોઈ બાળકનું રૂદન મહેલને ગજીવી મૂકશે. નવજાત બાળકનું પ્રથમ રૂદન સાંભળનારી વંધ્યા માતાની ધન્યતાની સીમા નથી રહેતી. સ્વી પુરુષ નથી, સ્વી એ સ્વી જ છે. તેનું વાહન લાગણી છે. જ્યારે નદીમાં લાગણીનું પૂર આવે ત્યારે સ્વીરૂપી નદી ગાંડીતૂર થઈને દોડવા લાગે છે. તેમાં આપોઆપ વેગ આવે છે. નદીને પાછા વળતાં નથી આવતું. લાગણી તો સમુદ્રમાં પણ છે. તે મોઝાનું રૂપ ધારણ કરીને ઘૂઘવાટા કરતો પ્રચંડ વેગથી દોડે છે, પણ કિનારે અફળાઈને પાછો વળી જાય છે. તેને પાછાં વળતાં આવડે છે. તે સતત કિનારા તરફ દોડે છે, અફળાય છે અને પછી પાછો ફરી જાય છે. સ્વી-પુરુષમાં આ જ ભેદ છે. સમુદ્ર આપોઆપ મર્યાદામાં રહે છે. સ્વીને પ્રયત્નપૂર્વક મર્યાદામાં રાખવી પડે છે. નદીની મર્યાદા સમુદ્ર છે. ગાંડીતૂર નદી પણ જો મહાસાગર સુધી પહોંચી જાય તો આપોઆપ શાંત થઈ જાય. જેને કોઈ મહાસાગર, સાગર કે ઉપસાગર પણ નથી મળતો તે નદીનું ગાંડપણ કિનારા તોવીને કિનારે વસતા લોકોને દુઃખી અને અશાંત કરતું રહે છે. ગાંડીતૂર નદી અને થોવનગાંડી સ્વી વિશ્વાસપાત્ર ન હોય. તેમાં જેંપલાવનાર રૂબે નહિ તો તણાય તો ખરો જ. સ્વીમાં જે તાણી લેવાની શક્તિ છે તે સૂર્યના ગુરુત્વાકર્ષણમાં પણ નથી. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ શોધનાર અને માપનાર ન્યૂટન વૈજ્ઞાનિક નીકળ્યો પણ સ્વીના ગુરુત્વાકર્ષણને માપનારો હજુ સુધી કોઈ જ્ઞાની-વિજ્ઞાની-યોગી-મહાયોગી નથી. સ્વી ન હોત તો સંસારમાં તણાવાનું પણ ન હોત. તો તો કદાચ જીવન જ ન હોત. તણાવું એ પણ જીવન જ છે.

આપણે ક્યાંથી ક્યાં તણાઈ ગયા? પેલો બહુ પ્રતિક્ષિત દિવસ આવી ગયો : પ્રથમ પ્રસૂતિ વખતે સ્વીના મનમાં પરસ્પરમાં વિરોધી અનેક ભાવોકુભાવો થયા કરતા હોય છે. તેને તનથી

જ માત્ર નહિ મનથી પણ સાચવવી પડતી હોય છે. આવતું મોટું બાળક કેવી રીતે પ્રગટ થશે? હે ભગવાન શું થશે? મરી તો નહિ જવાય ને? જો બાળકજન્મના આનંદના ભાવો ન હોત તો કોઈ સ્વી પ્રસૂતિના ઊંડા પાણીમાં ઊત્તરવાનું કદી પસંદ જ ન કરત. માની વેદના મા જ જાણો. પેલા બાળકને શી ખબર કે તેને પ્રગટાવવા માઝે કેટલું જોર કર્યું હતું! કેટલી પીડા સહન કરી હતી. કેટલી ચીસો પાડી પાડીને વાતાવરણ ગજવી દીધું હતું. આ પીડા, આ વેદના, આ ચીસોનું કોઈ ઉદાહરણ જ ન હોય, પણ બાળક પ્રગટ થતાંની સાથે જ બધું શાંત. ના કોઈ ચીસ ન કોઈ ઊંઠકારો, આનંદ-આનંદ-પરમાનંદ. હવે બાળકનો વારો હતો. તે ચીસાચીસ કરી રહ્યું છે. તેનું ચાલત તો તે હજુ પણ બહાર ન આવત. પણ તેનું કશું ચાલ્યું નહિ. નવ મહિના ઊંધા માથે લટકીને અંતે તેને બહાર આવવું જ પડ્યું. કુદરત આગળ બધાં રંક છે.

દશરથના ઘરમાં એકસાથે ચાર-ચાર પારણાં બંધાયાં. ચારે તરફ આનંદ જ આનંદ થઈ ગયો. ચારે પુત્રરત્નો એક જ રામ નવમીના દિવસે જન્મ્યા છે. છતાં લોકો તેમને નાના-મોટાં કહે છે. જ્યારે હર્ષ અને આનંદનો ઊભરો આવે ત્યારે લોકો આપોઆપ નાચવા લાગે છે, ગાવા લાગે છે. નાચવા માટે જ જન્મેલી અસ્સરાઓ અને ગાવા માટે જન્મેલા કિન્નર-ગાંધ્યો જૂમીજૂમીને પૂરા અયોધ્યામાં નાચવા-ગાવા લાગ્યાં. પૂરા અયોધ્યામાં હર્ષનું પૂર ઊમટ્યું. હર્ષના આવેગમાં માણસ ઉદાર થતો હોય છે. આવા સમયે દાન-દક્ષિણા-ભેટ-બદ્ધિસ-ઈનામ જરૂર આપવાનો જોઈએ. આવા પ્રસંગે પણ જે ઉદાર થતા નથી તે લૂધા હોય છે. તે પોતાના સેવક વર્ગનું મન જીતી શકતા નથી. દુભાયેલો સેવક વર્ગ સ્વામીની પડતી દશમાં રાજુ થતો હોય છે. રાજાએ મન મૂકીને બેટો આપી, દક્ષિણા આપી, ઈનામ આપ્યાં. શ્રદ્ધાથી અપાય તે દક્ષિણા છે. ઉદારતાથી અપાય તે બેટ છે અને કાર્યની કદર કરીને અપાય તે ઈનામ છે. આ ગ્રાણોના દ્વારા વ્યક્તિ પ્રસંગને ધન્ય બનાવતી હોય છે

તુલસીદાસજી રામજન્મને જન્મ નથી માનતા, પ્રાગટ્ય માને છે. ભગવાનનો જન્મ ન હોય. તે તો અજન્મા છે. તેનું તો પ્રાગટ્ય જ હોય. “ભયે પ્રગટકૃપાલા...” કહીને તેમણે એક જ સ્તોત્રમાં બધું કહેવાનું કહી દીધું છે.

તેમના દેખાએખી આજકાલ કેટલાક પામર માણસો પણ પોતાનો પ્રાકટ્ય દિવસ ઊજવે છે. ભાઈ સાહેબ, ભગવાન થઈ ગયા, કશું ન થઈ શકાયું એટલે ભગવાન થઈ ગયા. બહુ સરળ કામ છે. માત્ર પામરતાને ઢાકતી એક ભગવતાની ચાદર જ

ઓઢી લેવાની. ભક્તો તો તૈયાર જ છે. તેમને તો જ્યજ્યકાર કરવાનું વ્યસન લાગુ પરી ગયું છે.

વાલ્ભીકિ સાવધાન છે. તેમણે તો જન્મને જન્મ જ માન્યો છે. બારમા દિવસે દશરથે વશિષ્ઠજ્ઞને બોલાવીને નામકરણ સંસ્કાર કરી દીધા. હવે રામ, ભરત, લક્ષ્મણ અને શત્રુંન નામથી ચારે ઓળખાવાના છે.

નામ મિથ્યા નથી, સત્ય છે. શ્રીરામ સત્ય છે તો તેમનું નામ પણ સત્ય જ છે. તુલસીદાસજી તો રામ કરતાં પણ રામના નામને વધુ મહાન માને છે. તેમણે તો નામમહિમા માટે લાંબું લિસ્ટ આપ્યું છે.

રામામ મનિદીપ ધૂ જહ દેહરી દ્વાર  
તુલસી ભીતર બાહર હું જો ચાહસિ ઉજિયાર ॥  
નામ જહ જપી જગાહે જોગી, બિરતિ બિરંયિ પ્રપંચ બિયેગી.  
જયહિં નામ જન આરત ભારી, મિટહિં કુસંક્ટ હોહિ સુકારી.  
જામુ રામકો કલ્યતડુ કલ્યાન નિવાસુ,  
જો સુમિરત ભયો ભાંગતે તુલસી તુલસીદાસુ ॥

અરે, જે નામનું સ્મરણ કરવાથી તુલસી ભાંગ જેવા છોડમાંથી તુલસીદાસ સંત થઈ ગયો. આ બધો નામનો જ પ્રતાપ કહેવાય.

ભક્તિમાર્ગમાં નામ અને રૂપ બસે સત્ય છે. રામ સત્ય છે અને તેમનું નામ પણ સત્ય જ છે. તેથી તો ભક્તો નામ જપીને સિદ્ધિ પ્રાપ્ત કરતા હોય છે.

દશરથ અને રાણીઓને વાત્સલ્યસુખ પ્રાપ્ત થયું. તેમના જીવનમાં વહાલસુખ હતું, વિષયસુખ હતું, વૈભવસુખ હતું અને સત્તાસુખ પણ હતું. માત્ર વાત્સલ્યસુખ ન હતું. વાત્સલ્યસુખ વિના બાકીનાં બધાં સુખો ઝેર જેવાં થઈ ગયાં હતાં. હવે તો પાછલી અવસ્થામાં વાત્સલ્યસુખ પણ મળ્યું. રાજી અને રાણીઓ ધન્ય ધન્ય થઈ ગયાં.

સંતાનપ્રાપ્તિ એ માયા કે ઉપાધિ નથી. તે જીવનના મહત્વના પ્રશ્નોનો ઉકેલ છે. જીવન જ્યારે છેડે પહોંચે છે ત્યારે ત્રણ પ્રશ્નો વિકરાળ થઈને વ્યક્તિને સતાવે છે.

જીવન પ્રશ્નોથી ભરેલું રહે છે. પ્રશ્નો ઉકેલ માગે છે. વણઉકેલાયેલા પ્રશ્નો ચિંતા ઉત્પન્ત કરે છે. ચિંતાથી અશાંતિ થાય છે. પ્રશ્નોના ઉકેલથી જ ચિંતા મટે છે. ચિંતા મટતાં જ આપોઆપ શાંતિ પ્રાપ્ત થાય છે.

જ્યારે કોઈ કુદરતી પ્રશ્ન ઊભો થાય છે ત્યારે કુદરત પોતે જ તેનું સમાધાન આપતી હોય છે. પ્રશ્નો ઊભા કરનાર કુદરત હોય તો તેનું સમાધાન પણ કુદરત જ કરતી હોય છે.

વાત્સલ્ય વિનાનું વહાલ લાંબા ગાળે કંટાળો અને ત્રાસ આપનારું થઈ શકે છે. પતિ-પત્ની વચ્ચે ગમે તેટલું વહાલ હોય

પણ જો તેમને વાત્સલ્ય ન મળ્યું હોય તો લાંબાગાળે તેમાં નીરસતા આવી શકે છે. ગમે તેટલું વહાલ હોય પણ જો વિષયસામર્થ ન હોય તો પણ વહાલમાં ફિકાશ આવવા લાગે છે. પૌરુષથી પુરુષ વહાલનો અધિકારી બને છે. તે ન હોય તોપણ કોરું વહાલ લાંબો સમય પ્રભાવશાળી રહેતું નથી. વહાલસુખ અને વિષયસુખની પરિણાતિ વાત્સલ્યસુખમાં થતી હોય છે. આ કુદરતી ઉકેલ છે. જેના ખોળામાં શિશુ કિલકિલાટ કરી રહ્યું છે, તેને કોઈ ટોનિક લેવાની જરૂર નથી. શિશુની કિકિયારીથી મોટું કોઈ ટોનિક નથી. તેનાથી મન ભરાયેલું રહે છે. ભરાયેલું મન જ તૃપ્તિ આપે છે. સંસારથી મન ભરાતું નથી તે વાત સાચી નથી. પતિથી, પત્નીથી, બાળકોથી મન ભરાય છે. જો બધાં અનુકૂળ મળ્યાં હોય તો મન તો તેનું ખાલી હોય છે જેને આમાંનું કશું મળ્યું નથી હોતું. દશરથ અને રાણીઓનું મન ભરાયેલું છે, તૂમ છે. કારણ કે વાત્સલ્યનો ધોખ મળી ગયો છે.

વારસદારનો પ્રશ્ન પણ ચિંતા ઉપજાવે છે. જેની પાસે ઘણો મોટો વારસો હોય છે પણ કોઈ વારસદાર નથી હોતો, તેને શાંતિ ન હોય. માત્ર વારસદારના અભાવથી જ અશાંતિ નથી થતી, પણ વારસો મેળવવાની ખટપટોથી અશાંતિ થાય છે. વારસદાર વિનાના વારસા ઉપર નજીકના કેટલાય લોકોની નજર ચોંટી હોય છે. તે પેલાના મૃત્યુની રાહ જોતા રહે છે. કેટલીક વાર તો ઉતાવળા થયેલા વારસાલોભીઓ ન કરવાનું પણ કરી બેસતા હોય છે. સંપત્તિ આકર્ષણ વિનાની નથી હોતી. સંપત્તિનો સૌથી મોટો રક્ષક વારસદાર છે. પતિ હોવામાત્રથી ક્ષી સુરક્ષિતતા અનુભવે છે. તેના સૌભાગ્યચિક્નો જોઈને લઙ્ગા લોકો દૂર રહે છે. સૌભાગ્યચિક્નો વિનાની સ્વી લઙ્ગાગાંઓને આડકતરી રીતે આમંત્રણ આપે છે. આવી જ રીતે વારસદાર વિનાની સંપત્તિ પણ નજીકના અને દૂરના માણસોને આકર્ષે છે. તેને મેળવવા ખટપટો શરૂ થઈ જાય છે. ખટપટોની પરાકાણ હત્યામાં પણ પરિણમતી હોય છે. આવા માણસને શાંતિ ન હોય, કદાચ હોય તો પ્રભુ શરણાગતિથી હોય. દશરથનો વારસદારનો પ્રશ્ન પણ ઉકેલાઈ ગયો છે. તેથી શાંતિ છે.

શાંતિ અને હર્ષમાં ફરક છે. સળગતો પ્રશ્ન ઉકેલાવાથી શાંતિ મળે છે. પણ ધાર્યા કરતાં વધુ સારું પરિણામ મળવાથી હર્ષ થાય છે. હર્ષ હસાવે છે, ખડખડાટ હસાવે છે. રોમેરોમે ફૂલ ખીલવે છે. શાંતિ તો હાસ્ય વિનાની ધીરગંભીર પણ હોઈ શકે છે. યોગીઓ ગંભીર મુદ્રામાં તો હોય છે પણ હર્ષમુદ્રામાં નથી હોતા. હર્ષમુદ્રામાં તો યોગીરાજ શ્રીકૃષ્ણ હોય છે. હસન મધુરમ્...

દશરથ અને રાણીઓના દિવસો માત્ર શાંતિમાં જ નહિ હર્ષમાં વીતી રહ્યા છે. હર્ષ પછી શોક આવશે જ એવી સતત બીક લગાડીને જીવનને તેલ પીધેલા ડાચા જેવું બનાવી લેવું ન જોઈએ. દિવસ પછી રાત આવશે એવું માનીને દિવસનો લહાવો

## આગમ અને આત્મા

### ● નામનિષ્ઠ ●

પરમાત્મા એક પછી એક આગમની ધારાઓ પોતાના મુખકમલમાંથી પ્રગટાવતા હોય અને એ આગમધારાઓ ભાવિક જીવોનાં અંતરને ભીજવતી હોય. એ ક્ષણ કેવી હોય? પરમાત્મા જ્યારે દિવ્ય મુખકમલમાંથી આગમધારા વહાવતા હોય અને એક એક વ્યક્તિનાં માનસમાં એમ થાય કે, પરમાત્મા બીજા કોઈને કહેતા નથી. પરમાત્મા મને જ કહે છે અને મારું જ કહે છે...!

પરમાત્મા મહાવીરની વાણીમાં એક વિશેષતા હતી... પરમાત્માના સમવસરણમાં અનેક વ્યક્તિઓ આવતી હોય... અનેક લોકો પોતાના પ્રશ્નો લઈને પ્રવેશ કરતાં હોય... અનેક પોતાની સમસ્યા લઈને ત્યાં આવ્યા હોય.. પરમાત્માની વાણીને સાંભળે અને દરેકને પોતાની સમસ્યાનું સમાધાન એકજ શબ્દમાં મળી જાય..! પરમાત્મા ભલે વિશાળ જનસમૃદ્ધાયને સંબોધતા હોય પણ દરેક વ્યક્તિને પોતપોતાની રીતે પોતપોતાનું સમાધાન મળી જાય! અને આ જગતનો નિયમ છે જ્યારે સમાધાન મળે છે, ત્યારે સમાધિ મળે છે!

જ્યારે આપણા પ્રશ્નોનું આપણી સમસ્યાનું સમાધાન મળે છે, ત્યારે અંતરમાં એક સંતોષનો ભાવ ઊગે છે, સમાધિ મળે છે...! આજ સંતોષ અને સમાધિને કારણે વ્યક્તિને સમર્પણતા લાવવાનો વિચાર જન્મે છે!

અને એવી જ સમર્પણતા જન્મી હતી ગૌતમસ્વામીને!

ના! એકલા ગૌતમસ્વામીને જ નહીં... પણ અનેક અનેક ભાવિકોને પણ આવી સમર્પણતા જન્મી હતી! અનેક ભાવિકોને પરમાત્માનાં ચરણમાં શરણ મેળવવું હતું.... પણ શરણ મેળવી શક્યા

એવા અગ્નિયાર મેઈન હતા...!

એક માળી જ્યારે આખોય બગીયો તૈયાર કરે.... ત્યારે તેમાં થોડાં નાનાં નાનાં છોડ પણ હોય અને મોટાં વૃક્ષો પણ હોય... શોભાનાં ઝાડ પણ હોય અને ફળ આપતાં વૃક્ષો પણ હોય... માત્ર બીજ ઉગાડનારાં વૃક્ષો હોય... અને એકલાં દેખાવ માટે જ ફૂલોનાં ઝાડ પણ હોય..!

“માળી તો એ જ કહેવાય જે બધાંની માવજત કરે!”

હા! માળી માવજત તો આખા બગીયાનાં બધાં જ વૃક્ષોની કરે... પણ એ જ જાણતો હોય કે આમાંથી ક્યાં વૃક્ષને કેટલું પાણી આપવું... કોને કેટલું સિંચન કરવું... અને કોના ઉછેર પાછળ કેટલો ભોગ આપવો? એ જાણતો હોય છે, ક્યા માત્ર શોભાનાં વૃક્ષ છે અને ક્યાં ફળ આપનારાં છે? પરમાત્માના સમવસરણ રૂપી ઉવાનમાં પરમાત્મારૂપી માળી સૌથી વધારે માવજત કોની કરે?

શું પરમાત્મા રાગ દ્વેષ ન રાખે, પણ વિવેક જરૂર રાખે! પરમાત્મા આ મારું કે આ તારું એવો ભેદ ન રાખે, પણ વિવેક તો અવશ્ય રાખે જ!

આપણા બત્તીસે બત્તીસ આગમમાં જો સૌથી વધારે નામ આવતું હોય તો તે છે ગણધર ગૌતમનું.

આનો અર્થ શું એમ છે કે વીતરાગી પરમાત્માને ગૌતમ વધારે વહાલો હતો? શું ગૌતમ પ્રત્યે રાગ હતો? ના! તો પછી કેમ વારંવાર ગોયમા... ગોયમા...! કહે છે...! શું ભગવાન મહાવીરને ગૌતમ અને સુધર્મા વધારે પ્રિય હતા? ના...!!! ભગવાન મહાવીર તો માળી!

અને જે માળી બની શકે છે, અને જ એક એક છોડની માવજતની ખબર પડે છે.

માણવા આવવું એ અલગ વસ્તુ છે અને માળી બનવું એ અલગ વાત!

આપણે બધાં અત્યારે પરમાત્માએ ખીલવેલા આ શાસનરૂપી ઉવાનને માણવાવાળાં છીએ... અને એના માળી છે ભગવાન મહાવીર સ્વામી!

ભગવાન મહાવીર સ્વામીએ જોયું કે અહિયા આસોપાલવ પણ છે અને આંબા પણ છે. એ જાણતા હતાં કે આંબા ઉપર વધારે ધ્યાન દેવાથી અનેક ફળો આવશે... અનેક બીજ નીકલશે અને એ બીજ બીજા અનેક આંબાઓને ખીલવશે!!

એવી જ રીતે જો એક ગૌતમને દેશના આપીશ તો એ એના અનેક શિષ્યોને ઉપદેશ આપશે... એના અનેક શિષ્યો બીજા અનેક પ્રશિષ્યોને ઉપદેશ આપશે... એમ કરતાં કરતાં... પરમાત્માનું શાસન ૨૧,૦૦૦ વર્ષ સુધી ચાલશે!

પરમાત્માએ ગૌતમને દેશના આપી... સુધર્મા સ્વામીને જ્ઞાનાપ્યું... સુધર્મસ્વામીએ જંબૂસ્વામીને આપ્યું... જંબૂસ્વામીએ પ્રભવસ્વામીને આપ્યું... આમ કરતાં કરતાં... પરમાત્માની આ પરંપરા આજ આપણા સુધી ગ્રામ થઈ ગઈ... પરમાત્માની એ વાણી આગમ દ્વારા આપણને પ્રામ થઈ...!

જો આગમ ન હોય તો?

એક નાનકડી વાત છે... એક વિદેશી પર્યાટક એક વખત આઙ્કિકાના જંગલમાં ગયો. ત્યાં બધાં આદિવાસીઓ જ રહેતાં હતાં... એમનાં શરીર ઉપર મેલના થરના થર હતાં... કોઈ મળે તો ય ભલે અને ન મળે તોય ભલે! કોઈને કોઈની સાથે કાઈ લેવા દેવા નહીં...! ઘરબાર જેવું છે નહીં... અને ખાવા માટે ઝાડ ઉપરથી ફળ તોડીને ખાઈ લે છે!

જ્યારે વિદેશી પર્યાટકે જોયું કે અહિયાં

તો કાંઈ છે જ નહીં! જે આદિવાસીઓએ જિંગળીમાં ક્યારેય અરીસા જેવી વસ્તુ જ જોઈ ના હોય... જેણે પોતાનો ચહેરો જ જોયો ન હોય... જેણે ક્યારેય પોતાનું પ્રતિનિબંધ જ જોયું ન હોય એને પોતાની ઓળખાણ થાય જ કેવી રીતે?

“જેણે અરીસો જોયો ન હોય, એણે દેહની ઓળખાણ ક્યારેય ન કરી હોય!”

“જેણે આગમ જોયા ન હોય, એણે આત્માની ઓળખાણ ક્યારેય કરી ન હોય!”

અરીસો જેમ આપણા દેહનું... આપણા અંગેઅંગનું દર્શન કરાવે છે, એમ આગમરૂપી અરીસો તો આપણા અંતરનું દર્શન કરાવે છે...!!

અંતરનો આકાર કેવો છે? અને અંતરમાં સદ્ગુણો કેટલા છે?

“સ્વયંનું સ્વયં દ્વારા નિરીક્ષણ કરવા માટે જે પરનો આધાર લેવો પડે છે...એનું નામ છે... “આગમ”!

સ્વયંનું ...સ્વયં થકી...સ્વયં વડે...સ્વયંનું નિરીક્ષણ કરવા માટે જે પરનો આધાર લેવો પડે છે એ છે પરમાત્માની વાણી...!

અને એ પરમાત્માની વાણી જ સ્વનું સ્વથી નિરીક્ષણ કરાવે છે!

હવે, પેલા વિદેશી પર્યટકે એક સાથે ૧૫ આદિવાસીઓનો ચુપ ફોટો પાડ્યો... અને એક પદ્ધી એક બધાને બતાવવા લાગ્યો... બધાએ ફોટો જોયો. અને એમાંથી ચૌદ જણાને ઓળખી શક્યા... પણ એક વ્યક્તિ બધાંથી ન ઓળખાણી...! બધાં ફોટા જોતા ગયા અને બધાનો પ્રશ્ન એક જ હતો કે આપણા પંદરમાં એક જણ અજાણ્યો છે...

બધાં બીજાને તો ઓળખી શકતાં હતાં, પણ પોતાની જાતને કોઈ ઓળખી શકતું નહતું. કેમકે ક્યારેય કોઈએ પોતાની જાતને અરીસામાં જોઈ જ ન હતી!

બસ!

“સ્વયંની... સ્વયં દ્વારા સ્વયં થકી... સ્વયં વડે... જે ઓળખાણ કરાવવામાં આધારભૂત બને છે એને કહેવાય છે “આગમ!” આજ સુધી હું બધાંને જાણતો આવ્યો છું, આજ સુધી હું બધાંને ઓળખતો આવ્યો છું... આજ સુધી મારી પાસે બધાંના Reports પણ છે... આજ સુધી હું બધાંની ચાલ અને ચલગતને જોતો આવ્યો છું... પણ...! આજ સુધીમાં મેં ક્યારેય મારું નિરીક્ષણ કર્યું નથી...!

પેલા પંદરે આદિવાસીએ સર્વાનુમતે... એક સાથે એક જ વાત જાહેર કરી કે, આમાં ચૌદ જાણીતા છે, પણ એક અજાણ્યો છે! “પોતાને...પોતાની જાત વડે...પોતાના મોઢે પારકો જાહેર કરવો... એનું નામ અજ્ઞાન...”

એને પોતે પોતાની જાતને ઓળખવી, એ છે આગમની આરાધના. પણ બને છે એવું કે, અરીસાને જોઈને કદાચ આપણે આપણી જાતને ઓળખી શકીએ છીએ... અરીસાને જોઈને કદાચ આપણે આપણું નિરીક્ષણ કરી શકીએ છીએ... અરીસામાં જોઈને કદાચ સ્વયંની કક્ષા શું છે એને સમજ શકીએ છીએ...પણ, આજ સુધી આપણે આપણી જાતને ઓળખી હોય...આપણે આપણને જોયા હોય એવી ક્ષણો કેટલી?

સ્વએ સ્વને જોઈ હોય એવી ક્ષણો કેટલી?

આપણે આપણા ‘સ્વ’ ને કોઈ દિવસ જોયો હોય...જાણ્યો હોય...માણ્યો હોય...એવો એકેય સમય બરો? બસ!

આ જ આપણી ખોટ છે!

“આપણું છે એને આપણે પૂછ્યા નથી અને પારકું છે એને આપણે પૂછ્યા વિના રહેતા નથી!”

આપણું છે એને આપણે સાચવતા નથી અને જેને સાચવીએ છીએ એ કોઈ દિવસ સાચવતાં નથી!

“જ્યારે સ્વયંના આત્માની સ્વયંના આત્મા સાથે ઓળખાણ વધવા લાગે છે,

ત્યારે જગત માટેની ફરિયાદ ઘટવા લાગે છે!” આ છે આધ્યાત્મિક સંદેશ...!

જ્યારે સ્વયંનું સ્વયં સાથે ઓળખાણ થાય છે... સ્વયંનું નિરીક્ષણ થાય છે... આત્મા જ્યારે આત્માને ઓળખવા લાગે છે... આત્મા જ્યારે દેહને ઓળખવા લાગે છે... આત્મા જ્યારે ‘દેહ મારાથી પર છે’ એવું સમજવા લાગે છે, ત્યારે તેની બધી જ ફરિયાદો ઘટવા વિના રહેતી નથી...!

ધણા એમ કહે છે, તમે અત્યારે આગમની વાત કરો છે... આત્માની વાત કરશો. આત્માનો ઉપદેશ આપશો... પણ આત્માનો ઉપદેશ આ કાળમાં... અત્યારના સમજમાં શું કામનો? અત્યારે આત્મા વિશેની વાતો સાંભળે કેટલા...? સમજે કેટલા...? અને સ્વીકારે કેટલા...? અને અમલમાં મૂકે કેટલા...?

જ્યારે વ્યક્તિ સ્વને ઓળખવા લાગે છે... સ્વયંના આત્માને ઓળખવા લાગે છે... ‘હું કોણ છું?’ એની સમજ પડવા લાગે છે... ‘હું આત્મા છું...’ એવો જ્યાલ આવવા લાગે છે... ત્યારે તેને સમજ પડવા લાગે છે...કે આ મારાથી પર છે...પર છે માટે હું કાયમ છું. અને આ કાયમ નથી! આપણે રોજ સ્નાન કરીએ છીએ... આપણે શરીરને સ્નાન કરાવીએ છીએ... શરીરને નવરાયાં પહેલા જેવું હતું અને નવરાયા પછી જેવું છે...એ બેમાં ફરક કેટલો?

પરમાત્મા કહે છે... તમારી ક્ષણો...ક્ષણો... તમારા જીવનની એકએક ચર્ચા વખતે... તમારા જીવનના એકએક કાર્યક્રમ વખતે... જો તમારા અંતરમાં એકવાર તમારી ઓળખાણ હશે... તો જગતનાં બધાં જ કામ કરવા છતાં પણ... તમે કર્માથી એકદમ હળવાકુલ હશો...!

“મને પગ કે હાથ હુંબે છે, એવી ફરિયાદ ક્યારે જન્મે?” જ્યારે મારું સોએ સો ટકાનું મમત્વ... મારું સોએ સો ટકાનું ધ્યાન મારા હાથ કે પગ પ્રત્યે હોય ત્યારે જ ફરિયાદ જન્મે! જેને આપણે પોતાનું માનીએ છીએ એનું જ આપણે ધ્યાન

રાખીએ છીએ...! અને જેને આપણે પોતાનું માનતા નથી. તેની આપણે ઉપેક્ષા કરીએ છીએ...!

જેને પોતાનું માનીએ છીએ તેનો આપણને પ્રેમ છે, અને પ્રેમ છે માટે એનું બરાબર ધ્યાન રાખીએ છીએ! જેની પ્રત્યે આપણને પોતાપણાનો, સ્વપણાનો, મારું જ છે આ...એવો ભાવ થતો નથી...એના પ્રત્યે કદાચ ફરજ બજાવતાં હોઈશું પણ એના પ્રત્યે આપણને લાગણી નહીં હોય! અને લાગણી નહીં હોય તો એનામાં જે કંઈ થતું હશે ને...એની આપણે ઉપેક્ષા કરીશું!

“જે આપણું છે, ત્યાં આપણું ધ્યાન છે!”

જ્યાં આપણું નથી, ત્યાં આપણું ધ્યાન નથી! અને આ જ આપણી ખોટ છે...કે જે આપણું છે...એને આપણે સમજ્યા નથી..અને જે આપણું નથી તેને આપણું સમજ્યા...સમજ્યાને જ જિંદગી પસાર કરી નાખીએ છીએ...!

જે સમયે પરમાત્માના આગમની ધારાઓ... પરમાત્માના મુખકમલમાંથી પ્રવાહિત થઈ રહી હતી અને જ્યારે ગૌતમસ્વામી અને સુધર્મા સ્વામી આગમની ધારાઓને સમજ રહ્યાં હતાં... શીખી રહ્યાં હતાં... અંતરમાં ઉતારી રહ્યા હતાં... અને જેમ જેમ અંતરમાં ઉત્તરાનું જતું હતું... તેમ તેમના અંતરમાં એક સંતોષ થતો હતો... તેમના મનનું સમાધાન થતું હતું... એમના અંતરમાં સમાધિનો ભાવ જન્મી રહ્યો હતો...કે, ખરેખર! “હું જે છું એ આ નથી, અને આ જે છે, તે હું નથી!”

ઘણા લોકો કહેતા હોય છે, કે શું કરીએ? ઉપાશ્રય આવવાનું તો ઘણું મન થાય છે પણ પગનો હુઃખાવો બહુ હેરાન કરે છે. સવારના પથારીમાંથી બેહું થવાનું નથી. માંડમાંડ ઊભું થવાય છે... માંડમાંડ થવાય છે અને માંડમાંડ ઉપાશ્રય સુધી પહોંચાય છે...!

આજથી એક નિયમ બનાવી લો... રોજ સામાયિક કરીએ છીએ એનું ફળ શું? સાધનાનું ફળ શું?

“દેહ તો દેહ જ રહેલો છે... મારે દેહની ફરિયાદને ઘટાડવી છે!”

કેમ? કેમકે જે મારું હોય એની હું ફરિયાદ કરું પણ જે મારું નથી એની ફરિયાદ કરવા જેવી નથી!

જે મારાં હોય એની જ ફરિયાદ કરાય... પણ જે પારકાનું હોય તેની વધુ ફરિયાદ કરી શકાય નહીં...!

આજે તમારું બાળક તમારા ઘરમાં તોફાન કરતું હોય તો તમે એને સમજાવીને... શિખામણ આપીને રોકી શકો... પણ જે પારકાનું બાળક પારકાનાં ઘરમાં તોફાન તો શું તોડફોડ પણ કરતું હોય તો તમે શું કરી શકો?

આપણે ખાલી જોઈ શકીએ... પણ કંઈ કરી શકીએ નહીં? આ દેહ... આ શરીર, એ જો સાચી સમજ હોય તો, એ પારકાનું ઘર છે... એ મારું ઘર નથી!

હા! પણ આવી સમજ... આવા ભાવ... સમયે સમયે આવી શકતા નથી..! પણ! જ્યાં સુધી આવી સમજ અંતરમાં વસશે નહીં...ત્યાં સુધી આપણી સમસ્યાનું સમાધાન થવાનું નથી!

સમસ્યાઓનું સર્જન બે વ્યક્તિ વચ્ચે સર્જય કેમ?

બે વ્યક્તિની વચ્ચે સમસ્યા ત્યારે જ સર્જય જ્યારે સાથે કોઈ ગ્રીજું હોય!

એકલા હોઈએ ત્યારે માત્ર અશાંતિ હોય છે... પણ બેકલો થાય એટલે અશાંતિ વધ્યા વગર રહેતી નથી!

“એકડે એક અને બગડે બે!”

જે આપણું બગડે એનું નામ ‘બે’!

જ્યારે પરદેશ ગયેલી વ્યક્તિ સ્વદેશ પાણી ફરવાની હોય છે...ત્યારે તો પરદેશની બજારમાં નીકળે છે... પોતાનાં દેશ માટે કંઈક લઈ જવા માટે... કંઈક

કામ લાગે એવી વસ્તુ લેવા માટે... એ પરદેશનાં ફૂલો બહુ વખણાતાં હતાં... વ્યક્તિ બજારમાં પહોંચી... એક તરફ ફૂલોની મોટી બજાર હતી... એકઅનેકથી સુંદર ફૂલો મળતાં હતાં... અને બીજી તરફ જવેરીની બજાર હતી... જ્યાં એક એકથી સુંદર રત્નો મળતાં હતાં... કિમતી રત્નો ખૂબ સસ્તામાં મળી રહ્યાં હતાં... જ્યારે સુંદર ફૂલો ખૂબ મોંઘા મળી રહ્યાં હતાં... હવે એ વ્યક્તિ શું ખરીદશે?

ફૂલો કે રત્નો?

એ ધનાઢ્ય વ્યક્તિએ એક મોટી સૂટકેસ ભરીને સુંદરમાં સુંદર ફૂલો ખરીદા...!

રસ્તામાં એને એક સમજુ, અનુભવી વ્યક્તિ મળી ગઈ...! એણે પૂછ્યું...ભાઈ! તું આ શું લઈ જાય છે?

હું મારા દેશ માટે આ સુંદર ફૂલો લઈ જાઉં છું!

પણ! ભાઈ સામે જવેરીની બજાર છે...ત્યાં સરસ અને કિમતી રત્નો મળે છે!

ના! પણ મને રત્નો લેવાનું મન નથી થતું...મને આ સુંદર અને સુગંધી ફૂલો ગમે છે!

પણ! આ રત્નો લઈને તું તારા સ્વદેશમાં એને વેચીશ તો પણ તને ઘણી કિમત મળશે! તું અત્યારે રત્નો લઈ લે...પછી ત્યાં જઈને ફૂલો લઈ લેજે!

ના! મારે તો ફૂલ જ લેવા છે!

છતાં, પેલી સમજુ વ્યક્તિએ બહુ આગ્રહ કર્યો ત્યારે એણે માત્ર એક રત્ન લીધું...!

એક તરફ માત્ર એક રત્ન લીધું...અને એક તરફ આખી બેગ ભરીને ફૂલો લીધાં...!

ચાર-પાંચ દિવસ પછી પોતાના દેશ પહોંચ્યો... ત્યાંથી બે દિવસે પોતાને ગામ ગયો... બધાને ભેગાં કર્યા અને કહેવા લાગ્યો... હું તમારા બધાં માટે પરદેશથી

સુંદર અને સુગંધી ફૂલો લાવ્યો છું! અને હું મારું આપું ઘર એ ફૂલોથી શાણગારવાનો છું.

એની પત્નીએ પૂછ્યું, ‘તમે મારા માટે શું લાવ્યા છો?’  
તારા માટે પણ સરસ ફૂલો લાવ્યો છું!

એણે બેગ ખોલી... ફૂલોને જોયાં... અને એની આંખોમાંથી આંસુની ધાર વહેવા લાગી...!

એક માત્ર ‘રત્ન’ રત્નની જેમ ચમકતું હતું...અને બધાં જ ‘ફૂલો કરમાઈને...ચીમળાઈ ગયાં હતાં...’

કહેવાનો આશય એ જ કે, આ તમારો સંસાર...તમારો પરિવાર...તમારા સગાંસેહીઓ...બધાં ફૂલો જેવાં છે...અને ....તમે કરેલી સામાચિક એ “રત્ન” જેવી છે!

તમે ભરેલી બેગ ફૂલોની છે પણ એની સાથે તમે લીધેલો ધર્મ એક રત્ન સમાન છે!

હવે એ જ વિચારવાનું કે,

“જ્યારે આ ભવનો કિનારો છૂટશે, અને પરભવના કિનારા સુધી પહોંચશું ત્યારે આપણે ભરેલી બેગ આપણને કામ લાગશે કે આપણે હાથમાં લીધેલું એકાદ રત્ન!”

હે પરમાત્મા! મને ખબર હતી કે ફૂલ તો કરમાઈ જાય.. મને સમજ હતી કે ફૂલો તો કરમાવવાનાં જ હોય.. મને ખબર હતી કે... ફૂલો જેવા આ સંસાર...પરિવાર અને આ સમાજ... બધાં જ છોડવાનાં છે. છૂટવાનાં છે... છતાંય એને સાચવવામાં મારો ભવ ક્યાં ગયો એ ખબર પડી જ નહીં... અને જ્યારે ખબર રૂપી દાંતિયો મણ્યો ત્યારે માથામાં ટાલ પડી ગઈ હતી!

“અનુભવનો દાંતિયો મળે ત્યારે માથામાં ટાલ પડી ગઈ હોય છે!” ટાલ પડી ગયા પછી દાંતિયો શું કામનો?

એમ જ્યારે ખબર પડે કે આ મારો સંસાર... આ પરિવાર... આ સમાજ કાંઈ જ મારું નથી... મારું થયું નથી... તે પહેલાં...! હે પરમાત્મા આ ભવની અંદર... આ બધાં ફૂલોને મારે સાચવવાં છે... સંભાળવા છે... પણ આ ફૂલોને ક્યારેય મારી સાથે લઈ જવા નથી!

ફૂલને સાચવવાનાં હોય, સાથે લઈ ન જવાનાં હોય...!

રત્નને સાચવવાના પણ હોય અને સાથે લઈ જવાનાં પણ હોય! પણ, જે ફૂલને જ સાચવે છે... ફૂલને જ સંભાળે છે... અને ફૂલને જ સાથે લઈ જાય છે તે “FOOL” કહેવાય છે!

પણ, આ માંથાલો આ વાતને સમજ શકતો નથી!

પરમાત્માના આગમો આપણને એ જ દર્શન કરાવે છે કે, તારું વાસ્તવિક દર્શન કરી લે... તું કોણ...? તારું કોણ...? તારું શું...?

- શાસન પ્રમાણક પૂ. શ્રી નાનુમનિજી મ.સા.

## વાતસલ્યાનું સુખ

(અનુસંધાન : પાના નં.-૫૨ ઉપરથી ચાલુ)

જતો કરવો ન જોઈએ. રાત આવશે ત્યારે આવશે, અત્યારે તો દિવસ છે તેનો લહાવો લઈ લે ને! દિવસને રાત શા માટે બનાવે છે? જુવાનીની પાછળ ઘરપણ આવશે. તેવું વારંવાર ડરાવી ડરાવીને જુવાનીને શા માટે મડદું બનાવી દે છે. જ્યારે ઘરપણ આવશે ત્યારે જોયું જશે. અત્યારે તો કોઈ પર્વતનાં શિખરો સર કરી લેને. કોલંબસ કે વાસ્કો ડી ગામા થઈ જાને, સાત સમુદ્ર ખૂંદી વળને. જુવાનીને સાર્થક કરી લેને, શા માટે નકારાત્મક ચિંતનથી બરબાદ કરી રહ્યો છે?

હર્ષ પણીના શોકની શક્યતાનો ભય, વ્યક્તિને બેફામ થતી રોકવા માટે છે, મડદું બનાવવા માટે નહિ. ત્યાગી-વીતરાગીઓએ પોતાની અને દેશની જવાનીને મડદું બનાવી દીધી છે. તેમનો પરલોકલક્ષી ત્યાગ થનગનતા યૌવનને મડદું બનાવનારો થઈ જતો હોય છે. જીવનનો ગ્રાણ મહેશ્ચા છે. આ તો ઈચ્છાને જ નાભૂદ કરવાનું કહે છે. લો ગણી લો હજારો ઈચ્છા વિનાનાં જીવતાં મડદાં. આ બધાં મડદાં હર્ષનાં, એન્જોયનાં અને મહત્વાકંશાનાં હુશ્મન થઈ ગયાં છે. તેથી તો તથાકથિત અધ્યાત્મકેન્દ્રો ગંધાઈ ઊઠ્યાં છે. ગુફાઓમાં કે ભોંયરામાં પુરાયેલાં આ મડદાં રાષ્ટ્રની જુવાનીને નપુંસક બનાવી રહ્યાં છે. ગુફામાં જીવન બરબાદ ન કરો, બહાર નીકળો. એવેરેસ્ટ શિખર સર કરો તેવી પ્રેરણા આપો. ધરતીનો છેડો ખૂંદી વળો. શા માટે જુવાની બરબાદ કરી રહ્યા છો? ગુફામાંથી રોગ સિવાય કશું મળવાનું નથી. બહાર નીકળો. સાત સમુદ્ર અને સાત આસમાનો સર કરી લો. એવું કરતાં કદાચ મરી ગયા તોય શું? મૃત્યુ પણ ધન્ય થઈ જશે.

હર્ષમાં છકી ન જવું તે બરાબર છે પણ છકી જવાશે તેવા ભયથી હર્ષનો જ ત્યાગ કરી દેવો તે યોગ્ય ન કહેવાય.

દશરથનું આંગણું બાળકોથી કિલ્વોલ કરી રહ્યું છે. બાળકોની કિલકિલાટી સાંભળીને દશરથ ધન્ય ધન્ય થઈ રહ્યા છે. બાળકોના કિલકિલાટ વિનાના ઘરને સમશાનતુલ્ય મનાયાં છે. સ્મશાનમાં કિલકિલાટ નથી હોતો. કારણ કે મડદાને બધું આવડે છે પણ માત્ર હસતાં જ નથી આવડતું. તમે કદી હસતું મડદું નહિ જોયું હોય, કદાચ જો તે ખડખડાટ હોસે તો ડાઘુઓ ઊભી પુંછથીએ ભાગી છૂટે. મડદું તો રે છે અને રડાવે છે. તેથી તો સ્મશાનમાં પણ એક પ્રકારની શાંતિ હોય છે. હા, હર્ષ નથી હોતો.

ભવિષ્યના આવનારા શોકનો ભય લગાડીને જીવનને હર્ષહીન ન બનાવી મૂકો. હર્ષહીનોને પણ શોક તો આવતો જ હોય છે. અરે, આ તો કુદરતી પ્રક્રિયા છે. હર્ષનો લહાવો લ્યો, અને શોક આવે તો તેને પણ ખુમારીથી પચાવો. જીવનથી ભાગો નહિ.

(‘શાસન પ્રમાણક’ માંથી)



## શિક્ષાપત્રીના અંશો

● ભગવાન શ્રી સ્વામિનારાયણ / અનુ. : ડૉ. જગદીશ નિવેદી ●

- ✿ **શલોક-૧૧ :** હવે કેવી રીતે વર્તવું તે કહું છું. અમારા સત્સંગીએ ક્યારેય જીવહિસા કરવી નહીં તેમજ જ્ઞાનીને તો જૂ, માંકડ, ચાંચડ જેવા સાવ જીણાં જીવની પણ ક્યારેય હિસા ન કરવી.
- ✿ **શલોક-૧૨ :** તેમજ દેવતા કે પિતૃનાં યજ્ઞમાં પણ કોઈ પ્રકારના જીવની હિસા કરવી નહીં કારણ અહિસા એ જ મોટો ધર્મ છે એમ સર્વ શાખમાં કહું છે.
- ✿ **શલોક-૧૩ :** સ્ત્રી, ધન કે રાજ્યની પ્રાપ્તિ અર્થે પણ કોઈ મનુષ્યની હિસા તો કોઈ પ્રકારે ક્યારેય પણ ન કરવી.
- ✿ **શલોક-૧૪ :** આપધાત તો તીર્થમાં પણ ન કરવો, કોથથી ન કરવો, ક્યારેક કોઈ અયોગ્ય આચરણ થઈ જાય તો તેનાથી મુંજાઈને ન કરવો, જેર ખાઈને, ગળે ટુંપો દઈને, કૂવે પડીને, પર્વત ઉપરથી પડીને, એવી કોઈપણ રીતે આપધાત ન કરવો.
- ✿ **શલોક-૧૫ :** માંસ યજ્ઞનો પ્રસાદ હોય તો પણ આપતકાળમાં પણ ખાવું નહીં અને ગ્રાસ પ્રકારની સુરા અને અગિયાર પ્રકારનું મધ્ય દેવતાનું નૈવેદ્ય હોય તો પણ પીવું નહીં.
- ✿ **શલોક-૧૬ :** ક્યારેક ખુદથી કે અન્યથી અયોગ્ય આચરણ થઈ ગયું હોય તો શાખ વડે પોતાના અંગનું કે બીજાના અંગનું છેદન કરવું નહીં અથવા કોથથી પણ પોતાના અંગનું કે બીજાના અંગનું છેદન કરવું નહીં.
- ✿ **શલોક-૧૭ :** અમારા સત્સંગીએ ધર્મ કરવા માટે પણ ચોરી કરવી નહીં અને કોઈપણ વસ્તુને એના ધણીની આજ્ઞા વગર લેવી નહીં.
- ✿ **શલોક-૧૮ :** અમારા આશ્રિત સ્ત્રી-પુરુષોએ વ્યભિયાર કરવો નહીં અને જુગાર રમવું નહીં તેમજ ભાંગ, મફર, માજમ, ગાંજો જેવી કેફી વસ્તુ ખાવી પીવી નહીં.
- ✿ **શલોક-૧૯ :** જેના અન્ન-જળ ખપતાં ન હોય તેણે રાંધેલું અસ તથા તેનું જળ શ્રીકૃષ્ણ ભગવાનની પ્રસાદી - ચરણામૃત હોય તો પણ લેવું નહીં. એ જગતાથપુરીમાં જગતાથજીનો પ્રસાદ હોય તો તે લેવામાં દોષ નથી.
- ✿ **શલોક-૨૦ :** પોતાનાં સ્વાર્થ માટે પમ કોઈ ઉપર મિથ્યા આરોપ નાખવો નહીં તેમજ કોઈને ગાળ તો ક્યારેય ન દેવી.
- ✿ **શલોક-૨૧ :** દેવતા, તીર્થ, બ્રાહ્મણ, પતિત્રતા, સાધુ અને વેદની નિદા ક્યારેયકરવી નહીં અને સાંભળવી નહીં.
- ✿ **શલોક-૨૨ :** જે દેવતાને સુરા-માંસનું નૈવેદ્ય થતું હોય અને જેમની આગળ બલિ સ્વરૂપે જીવહિસા થતી હોય તે દેવતાનું નૈવેદ્ય ખાવું નહીં.
- ✿ **શલોક-૨૩ :** માર્ગમાં ચાલતા શિવાલય જેવાં જે દેવમંદિર આવે ત્યાં નમસ્કાર કરવો અને આદરથી દેવદર્શન કરવું.
- ✿ **શલોક-૨૪ :** કોઈ સત્સંગીએ પોતપોતાના વણ્ણાશ્રમનાં ધર્મનો ત્યાગ કરવો નહીં તથા પરધર્મ, પાખંડધર્મ કે કલ્યિત ધર્મનું આચરણ કરવું નહીં.
- ✿ **શલોક-૨૫ :** જેમનાં વચનમાં શ્રીકૃષ્ણ ભક્તિ અને નિજધર્મની નિદા થતી હોય તેવા વક્તાનાં મુખેથી કથાવાર્તા સાંભળવી નહીં.
- ✿ **શલોક-૨૬ :** જે સત્યવચન બોલવાથી પોતાનો દ્રોહ થાય કે પારકો દ્રોહ થાય એવું સત્યવચન ક્યારેય બોલવું નહીં અને તે કૃતધ્ની હોય તેનો સંગ ન કરવો તથા ક્યારેય લાંચ લેવી નહીં.
- ✿ **શલોક-૨૭ :** ચોર, પાપી, વ્યસની, પાખંડી, કામી તથા કિમિયાગર જેવા છ પ્રકારનાં ઠગનો સંગ કરવો નહીં.
- ✿ **શલોક-૨૮ :** જે મનુષ્ય ભક્તિ અથવા જ્ઞાનનાં આધારે છી, દ્રવ્ય અને રસાસ્વાદ મેળવવા માટે અતિશય લોલુપ હોય તેવા પાપીનો સંગ કરવો નહીં.
- ✿ **શલોક-૨૯ :** જે શાખમાં શ્રીકૃષ્ણનું કે શ્રીકૃષ્ણનાં બીજા અવતારનું યુક્તિપૂર્વક ખંડન થતું હોય એવા શાખ ક્યારેય માનવા નહીં તથા સાંભળવા નહીં.
- ✿ **શલોક-૩૦ :** પાણી કે દૂધ ગાળ્યા વગર પીવું નહીં તથા જે પાણીમાં જીણા જળચર હોય ત્યાં સ્નાન વગેરે કરવું નહીં.
- ✿ **શલોક-૩૧ :** જે દવામાં દારુ કે માંસ હોય તે દવા લેવી નહીં અને જે વૈઘને બરાબર જાણતા ન હોય તેવા વૈઘની આપેલી દવા પણ લેવી નહીં.
- ✿ **શલોક-૩૨ :** સમાજમાં જીર્ણ મંદિર, નદી-તળાવનાં કિનારા, માર્ગ, વાવેલું ખેતર, જાડની છાયા તથા બાગ જેવાં મળમુત્રનો ત્યાગ કરવા માટે વજ્ય સ્થાનોમાં ક્યારેય મળમુત્ર ન કરવું તથા થુંકવું પણ નહીં.
- ✿ **શલોક-૩૩ :** ગુમમાર્ગમાં દાખલ થવું નહીં અને નીકળવું નહીં અને કોઈની માલિકીની જગ્યામાં તેના માલિકને પૂછ્યા વિના રોકાવું નહીં.
- ✿ **શલોક-૩૪ :** અમારા સત્સંગી પુરુષોએ જીનાં મુખેથી

- જ્ઞાનવાર્તા સાંભળવી નહીં અને શ્રી, રાજ કે રાજનાં માણસ સાથે વિવાદ કરવો નહીં.
- ૩૫ શ્લોક-૩૫ : ગુરુ, શ્રેષ્ઠી, પ્રતિજ્ઞાવંત, વિદ્વાન તથા શાસ્ત્રધારી એમ પાંચ પ્રકારનાં મનુષ્યનું અપમાન કરવું નહીં.
- ૩૬ શ્લોક-૩૬ : વિચાર્ય વગર કશું કરવું નહીં, ધર્મસંબંધી કાર્ય તત્કાળ કરવું, પોતે જે વિદ્યા ભાયા હોય તે બીજાને ભાણવવી અને રોજ સાધુનો સંગ કરવો.
- ૩૭ શ્લોક-૩૭ : ગુરુ, દેવ અને રાજા પાસે ખાલી હાથે જવું નહીં, કોઈનો વિશ્વાસધાત કરવો નહીં તથા આત્મશ્લાઘા કરવી નહીં.
- ૩૮ શ્લોક-૩૮ : અમારા સત્સંગીએ જે વખ્ત પહેરવાથી પોતાનું અંગ દેખાય તેવું ભુંડું વખ્ત પહેરવું નહીં.
- ૩૯ શ્લોક-૩૯ : શ્રીકૃષ્ણની ભક્તિ ધર્મરહિત કોઈ પ્રકારે કરવી નહીં અને અજ્ઞાની મનુષ્યની નિંદાના ભયથી શ્રીકૃષ્ણની સેવાનો ત્યાગ કરવો નહીં.
- ૪૦ શ્લોક-૪૦ : શ્રીકૃષ્ણનાં મંદિરમાં આવેલા સત્સંગી શ્રી-પુરુષોએ મંદિરમાં વિજ્ઞતીયનો સ્પર્શ ન કરવો તથા મંદિરમાંતી બહાર નીકળીને રાખેતા મુજબ વર્તવું.
- ૪૧ શ્લોક-૪૧ : ધર્મવંશી ગુરુ પાસેથી શ્રીકૃષ્ણની દીક્ષા મેળવેલા બ્રાહ્મણા, ક્ષત્રિય અને વૈશ્ય એ ગ્રણ વર્ણનાં અમારા સત્સંગીઓએ ગળામાં તુલસીની બેવડી માળા દરરોજ પહેરવી તથા લલાટ, હદ્ય અને બે હાથ એમ ચાર ઠેકાણે ઉર્ધ્વપુંડુ તિલક કરવું.
- ૪૨ શ્લોક-૪૨ : તે તિલક ગોપીચંદન અથવા ભગવાનની પૂજા કરતાં કેસર-કંકુયુક્ત જે ચંદન વધ્યું હોય તેના વડે કરવું.
- ૪૩ શ્લોક-૪૩ : તે તિલકની મધ્યમાં ગોળ ચાંદલો કરવો. આ ચાંદલો ગોપીચંદનથી અથવા ચાંદિકાજ અને લક્ષ્મીજીની પ્રસાદીનાં કુમકુમથી કરવો.
- ૪૪ શ્લોક-૪૪ : પોતાના ધર્મમાં રહેલા શ્રીકૃષ્ણનાં ભક્ત એવા ચોથા વર્ણનાં લોકોએ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યની માફક જ તુલસીની માળા અને ઉર્ધ્વપુંડુ તિલક ધારણ કરવા.
- ૪૫ શ્લોક-૪૫ : અથી નાના ભક્તોએ ચંદન જેવા લાકડાની બેવડી માળાને ભગવાનની પ્રસાદી કરાવીને પહેરવી તથા લલાટમાં તિલક ન કરતાં કેવળ ચાંદલો કરવો.
- ૪૬ શ્લોક-૪૬ : અમારા આશ્રિત બ્રાહ્મણોએ પોતાની કુળ પરંપરા મુજબ ત્રિપુંડ કરવું અને રુદ્રાક્ષની માળા પહેરવી અને કુળપરંપરાનો ત્યાગ કરવો નહીં.
- ૪૭ શ્લોક-૪૭ : નારાયણ અને શિવ બંને એક સમજવા કારણ વેદમાં બનેને બ્રહ્મ કહ્યાં છે.
- ૪૮ શ્લોક-૪૮ : અમારા આશ્રિતે શાસ્ત્રમાં જે આપદું ધર્મ કર્યો છે તે આપતકાળમાં ધારણ કરવો પરંતુ કાયમ ધારણ ન

કરવો.

- ૪૯ શ્લોક-૪૯ : અમારા સત્સંગીએ દરરોજ સૂર્યોદય પહેલાં જાગવું અને શ્રીકૃષ્ણ ભગવાનનું સ્મરણ કરીને પછી શૌચવિષિ કરવા જવું.
- ૫૦ શ્લોક-૫૦ : ત્યારબાદ એક જગ્યાએ બેસીને દાતણ કરવું તથા પવિત્ર જગ્યાથી સ્નાન કરીને એક ધોયેલું વખ્ત પહેરવું અને એક વખ્ત ઓઢવું.
- ૫૧ શ્લોક-૫૧ : ત્યારબાદ પવિત્ર આસન પાથરી તેના ઉપર બેસીને પૂર્વ કે ઉત્તર તરફ મુખ રાખીને આચમન કરવું.
- ૫૨ શ્લોક-૫૨ : ત્યારબાદ દરેક સત્સંગી પુરુષે ચાંદલા સાથે ઉર્ધ્વપુંડુ તિલક કરવું તથા સધવા શ્રીએ પોતાના કપાળમાં કુમકુમનો ચાંદલો કરવો.
- ૫૩ શ્લોક-૫૩ : વિધવા શ્રીઓએ કપાળમાં તિલક કે ચાંદલો કરવો નહીં. ત્યારબાદ તમામ સત્સંગીઓએ મનકલિત ચંદનપુષ્પ વડે શ્રીકૃષ્ણ ભગવાનની માનસી પૂજા કરવી.
- ૫૪ શ્લોક-૫૪ : ત્યારબાદ શ્રી રાધાકૃષ્ણનાં ચિત્ર કે પ્રતિમાનું સાદર દર્શન કરી પોતાની શક્તિ મુજબ તેમનાં મંત્રનો જાપ કરીને પછી પોતાનું વ્યવહારિક કામકાજ કરવું.
- ૫૫ શ્લોક-૫૫ : અમારા સત્સંગીમાં અમરીષ રાજ જેવો ઉત્તમ ભક્ત હોય તો તેમણે પણ અમે જણાવ્યું તે કમમાં માનસીપૂજા સુધીની સર્વ કિયાઓ કરવી.
- ૫૬ શ્લોક-૫૬ : ત્યારબાદ આત્મનિવેદી ભક્તે પાપાણ અથવા ધાતુની શ્રીકૃષ્ણની પ્રતિમા અથવા શાલીગ્રામની પૂજા દેશકાળ પ્રમાણે પોતાની શક્તિ મુજબ કરવી અને શ્રીકૃષ્ણનાં અષાક્ષર મંત્ર (શ્રીકૃષ્ણાં શરણં મમ)નો જાપ કરવો.
- ૫૭ શ્લોક-૫૭ : ત્યારબાદ શ્રીકૃષ્ણ ભગવાનનાં સ્તોત્ર અને ગ્રંથનો યથાશક્તિ પાઠ કરવો. જે લોકો સંસ્કૃત ન જાણતા હોય તેમણે શ્રીકૃષ્ણના નામનું કીર્તન કરવું.
- ૫૮ શ્લોક-૫૮ : ત્યારબાદ શ્રીકૃષ્ણ ભગવાનને નૈવેદ્ય ધરીને પ્રસાદ લેવો અને આત્મનિવેદી વૈષ્ણવે સદા શ્રીકૃષ્ણ ભગવાનની સેવામાં પ્રીતિ રાખવી.
- ૫૯ શ્લોક-૫૯ : ભગવાન શ્રીકૃષ્ણ નિર્ગુણ એટલે કે માયાનાં ત્રાજ ગુણોથી રહિત છે. તેમનાં આત્મનિવેદી ભક્તની સર્વ કિયા પણ નિર્ગુણ થવાથી ભક્ત પણ નિર્ગુણ થાય છે.
- ૬૦ શ્લોક-૬૦ : આત્મનિવેદી ભક્તે શ્રીકૃષ્ણને અર્પણ કર્યા વગરનું જળ ક્યારેય ન પીવું. અને પત્ર, કંદ, ફળ જેવી વસ્તુ શ્રીકૃષ્ણને અર્પણ કર્યા વગર ખાવી નહીં.
- ૬૧ શ્લોક-૬૧ : અમારા સત્સંગી માટે વૃદ્ધાવસ્થામાં કે આપતકાળમાં શ્રીકૃષ્ણની સેવા કરવી અશક્ય હોય ત્યારે પોતે સેવા કરતાં હોય તે શ્રીકૃષ્ણનું સ્વરૂપ બીજા ભક્તને આપી, પોતે પોતાની શક્તિ મુજબ વર્તવું.

(સોઝન્યા : ડૉ. જગદીશ બિઠેડી)



ડૉ. બાબાસાહેબ આંબેડકરે દલિતોના મસીહા બની દલિતોના હક્કો અપાવવામાં તેમજ દેશનું બંધારણ ઘડી દેશના વિકાસમાં તેમજ સ્વતંત્ર ભારતના સપના સાકાર કરવામાં સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રો અગત્યનો ભાગ ભજવ્યો છે, જેનો પૂરેપૂરો ઘ્યાલ નીચે જણાવેલ વિગતો પરથી આવશે તેમાં કોઈ શક નથી.

ઈ.સ. ૧૯૧૮માં ડૉ. આંબેડકર કોલાપુર કાંતિકારી રાજી છત્રપતિ મહારાજના સંપર્કમાં આવ્યા. શાહુ છત્રપતિ મહારાજે એમને સમાચારપત્ર કાઢવામાં સહાયતા કરી. ૧૯૨૦ના દિવસે એમણે 'મૂક નાયક' નામનું સમાચારપત્ર પ્રસિદ્ધ કર્યું. ડૉ. આંબેડકર આ સામયિકના તર્ણી નહોતા, આ પત્રના સર્વેસર્વા હતા.

'મૂક નાયક'ના ઉદ્દેશો સ્પષ્ટ કરતાં એમણે પ્રથમ જ અંકમાં લખ્યું હતું : 'ભારત અસમાનતાઓનો દેશ છે. હિંદુ સમાજ એક મિનારા જેવો છે. એમાં અનેક મજલા છે. આ મજલામાં પ્રવેશદ્વાર તો છે જ નહીં. જે વ્યક્તિ જે મજલામાં જન્મ્યો એણે એ જ મજલામાં મરવાનું હોય છે.'

હિંદુ સમાજ વ્યવસ્થાના ત્રણ ભાગ છે : બ્રાહ્મણ, અબ્રાહ્મણ અને અધ્યૂત. બ્રાહ્મણોએ જ્ઞાન મેળવવાનો અભાવિત અધિકાર પોતાની પાસે રાખ્યો છે અને અન્યને એનાથી વંચિત રાખ્યા છે. દલિત વર્ગને તો કાયમી ગુલામી, અજ્ઞાન અને અત્યાચારોના જ ભોગ બનાવ્યા હોવાથી એમની મુક્તિ માટે અત્યાધિક પ્રયાસો કરવા પડશે. આ પ્રકારના પ્રયાસોની શૃંખલાનો આરંભ કરવા માટે 'મૂક નાયક' નું પ્રકાશન કરવામાં આવ્યું છે. આગળ જતા 'મૂક નાયક' સામયિક દલિતોના હિતો માટે મહત્વનું સાધન અને પ્રમુખ પ્રવક્તા બની ગયું. ૧૯૨૭માં તેમણે બાહીકૃત ભારત પાશ્કપત્ર પ્રકાશિત કર્યું.

સાહિત્યની વિગત રજૂ કરતાં પહેલાં ડૉ. બાબાસાહેબે મેળવેલ શિક્ષણ ઉપાધિઓની વિગત આપવી જરૂરી છે.

### ● શિક્ષણ :

ડૉ. બાબાએ Ph.D., D.S.C. અને M.Sc. ની ડિગ્રીઓ દેશ તેમજ વિદેશમાં અભ્યાસ કરી મેળવી હતી. તદ્વપરાંત કાયદાની પણ ઉપાધિ મેળવી ગરીબ અને દલિતોના કેસ હાથ પર લઈ ન્યાય અપાવ્યા. વર્ણવ્યવસ્થાને કારણે બધાથી દૂર બેસીને, પાણી વિના તરસ્યા રહીને તેઓ ભણતા પરંતુ મોટાભાગના વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેઓને ભણાવવામાં રસ નહોતા લેતા. પરિણામે બીજી હાઈસ્ક્યુલમાં ફારસી ભાષા શીખવી પડી. વોદરા સ્ટેટના મહારાજા સયાજીરાવ ગાયકવાડની પચ્ચીસ રૂપિયા માસિક શિષ્યવૃત્તિ મેળવી ૧૯૧૨માં મુંબઈના એલ્ફિસ્ટન કોલેજમાં તેઓએ બી.એ.ની પરીક્ષા પાસ કરી. ૧૯૧૩માં ઉચ્ચ શિક્ષણ મેળવવા ગાયકવાડની સહાયથી અમેરિકા ગયા. ત્યાં તેમણે

કોલાંબિયા વિશ્વ વિદ્યાલયમાંથી 'નેશનલ ઇવીડિડ ફોર ઇન્ડિયા' વિષય પર ૧૯૧૬માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. આ જ શોધગ્રંથ ૧૯૨૪માં 'ધી ઈવોલ્યુશન ઓફ પ્રોવિન્શિયલ ફાર્ઝિનાન્સ ઇન બ્રિટિશ ઇન્ડિયા'ના નામથી પ્રકાશિત કરવામાં આવ્યો. ૧૯૧૬માં એમ.એ.સી. (ઇકોનોમિક્સ)માં પ્રવેશ મેળવ્યો. લંડનથી તેમણે એમ.એસ.સી. (ઇકો. ડી.એસ.સી. ઈ.કો.) તથા બાર-એટ-લો પદવી પ્રાપ્ત કરી.

### ● પુસ્તકપ્રેમ :

ડૉ. બાબાસાહેબનો પુસ્તકપ્રેમ પુસ્તકાલયમાં સાકાર થયો. પરિણામે તેમનું 'રાજગુરુ' નિવાસસ્થાન પુસ્તકાલયમાં ફેરવાઈ ગયું. જેમાં ઈતિહાસ, રાજનીતિશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, બધા જ ધર્મગ્રંથોનાં ડૉ. બાબાના પુસ્તકો (ટૂકમા નામ) કુલ મળી ૩૫,૦૦૦ પુસ્તકો વસાવ્યાં.

૧. ધન અનટચેબલ્સ
૨. હુ વેર ધ શૂદ્રાજ?
૩. બુદ્ધ એન્ડ ડિઝ ધમ્મ
૪. વોટ કોંગ્રેસ એન્ડ ગાંધી હેવ ઇન ટુ ધી અનટચેબલ્સ?
૫. પાકિસ્તાન અને પાર્ટિશન બ્લોક ઇન્ડિયા
૬. સ્ટેટ્સ એન્ડ માઈનોરિગ્મ
૭. મહારાષ્ટ્ર એન્ડ લિંગકાસ્ટીક પ્રોવિઝન્સ
૮. વોટ્સ એન્ડ લિંગકાસ્ટીક સ્ટેટ્સ
૯. ધ પ્રોબ્લેમ ઓફ ધી રૂપી
૧૦. ધી ઈવોલ્યુશન ઓફ પ્રોવિન્શિયલ ફાર્ઝિનાન્સ ઇન બ્રિટિશ ઇન્ડિયા
૧૧. ઇમેન્સીવેશન ઓફ ધ અનટચેબલ્સ

### વ્યાખ્યાનસંગ્રહ (ટૂકમા)

૧. કાસ્ટ ઇન ઇન્ડિયા
૨. એનિહિલેશન ઓફ કાસ્ટ
૩. સ્પિચીઝ બિઝોર બુદ્ધ ગેધરિંગ
૪. રાન્ડે ગાંધી એન્ડ જીના
૫. ફેડરેશન વર્સીસ ફીડમ
૬. ઓન પાલમિન્ટ ટેમોક્સી
૭. સ્મોલ હોલ્ડિંગ્સ ઇન ઇન્ડિયા એન્ડ ધેર રેમેડીઝ
૮. વી.આઈ.પી. રેલવે ટિસ્પ્રેન્ડ, કલાસ વર્કમેન કોન્ફરન્સ
૯. લેબર એન્ડ પાલમિન્ટરી ટેમોક્સી
૧૦. દાસ ભગવાન ધસ સ્પોક એમ્બેડકર

### ડૉ. બાબાસાહેબના સુત્રો – મંત્રો :

ખાવ ઓછું ભણો વધુ (સૂત્ર)  
સ્વસહાયતા એ જ શ્રેષ્ઠ સહાયતા (મંત્ર)

### ● ગ્રામ ઔષ્ણિકીયાઓ :

૧. સ્વયંની સહાયતા સ્વયં કરવી.
  ૨. સ્વપ્રયત્ને ઉત્સત્તિ કરવી.
  ૩. સ્વાભિમાનપૂર્વક જીવનું.
- બાબાના મતે શિક્ષણ એ બેધારી તલવાર છે.  
તે ચલાવતા ન આવડે તો ખતરનાક સાબિત થાય.

### ગ્રામ મંત્રો :

૧. શિક્ષિત બનો.
૨. સંગઠિત બનો.
૩. સંઘર્ષ કરો.  
'શિક્ષણ વગર સર્વત્ર અંધકાર છે.'

### ● બહિષ્કૃત ભારત (સામયિક)

'જો ટીળિક અદ્ધૂત ધરમાં પેદા થયા હોત તો 'સ્વરાજ'

મારો જન્મસિદ્ધ અધિકાર છે એવો નારો બુલંદ બનાવવાને બદલે  
એવું જ કહેવા મજબૂર બનત કે....'

'અસ્પૃષ્યતાને નાટ કરવી' એ જ મારો જન્મસિદ્ધ અધિકાર  
છે. ઉપર મુજબનો લેખ બહિષ્કૃત ભારતમાં પ્રસિદ્ધ કર્યો.

ડૉ. આંબેડકર દુર્ઘટનાને કારણે પથારીવશ હતા ત્યારે તેમણે 'વોન્ટેડ એન્ટી પ્રિસ્ટફુડ એસોસિએશન' (પૂજારી વિરોધી સંગઠનની આવશ્યકતા) લેખ લખ્યો જે બોંબે કોનિકલમાં પ્રસિદ્ધ થયો. આ લેખમાં બ્રાહ્મણવાદને અદશ્ય કાલ્યનિક ભગવાન અને અસહાયક માનવપ્રાણી વચ્ચેના દલાલ ગણાવ્યા. તેમણે ધંધાદારી પૂજારીઓને કલંકરૂપ ગણાવ્યા.

### ● પ્રવચન :

રત્નાગિરીમાં જનજાગૃતિ માટે કહ્યું કે તમે તમારી ગુલામી પોતે જ નાખૂદ કરી શકો. સ્વાભિમાન વગરનું જીવન એ જીવન જ નથી. જો જીવનમાં કોઈ મૂલ્યવાન વસ્તુ હોય તો તે છે આત્મસન્માન અને આત્મગૌરવ. એ વિના માનવીનું મૂલ્ય છે જ નહીં.

આમ ઉપર જણાવેલ લેખમાં આપણે જોયું કે શિક્ષણ - સાહિત્ય વિના અંધકાર દૂર કરી પ્રકાશ મેળવી શકાય નહીં. ડૉ. બાબાની સફળતા તેમનું વાંચન, અભ્યાસ, પુસ્તકપ્રેમ, સાહિત્ય તેમજ દેશપ્રેમ દ્વારા જ દલિતોના મસીહાનું બિરુદ્ધ તેમજ 'ભારતરત્ન'નો ઈલકાબ મેળવવા લાયક બન્યા. આપણે પણ સૌ ડૉ. બાબાના જીવનની સિદ્ધિઓ અને તેમણે આપેલા સુત્રો – મંત્રો અને સિદ્ધાંતોનો ઉપયોગ કરી દેશ અને સમાજને ઉપયોગી બનીએ તેવી મનોકામના કરીએ.

મો. ૯૮૦૪૪ ૮૦૭૪૩

## JETHABHAI DOONGARSHI TRANSPORT Co.

### J. D. LOGISTICS



**H.O.** : 708/18, Bhavani Peth, Near Gurunanak Telephone Exchange, Pune-411 402.

Tel. : (020) 26434611 / 08425818000 ● Fax : (020) 26434525 ● E-mail : jdtcompany@gmail.com

**Admn. O. :** 313/315, Narshi Natha Street, Khajurwala Chamber, Masjid Buunder, Mumbai-400 009.

Tel. : (022) 23426818, 23400597 ● Fax : (022) 23451950 ● E-mail : jdadminoff@yahoo.co.in

#### DAILY PARCEL & FULL TRUCK LOAD SERVICES

FROM MUMBAI & GUJARAT TO PUNE & SOLAPUR AND RETURN

#### MUMBAI OFFICE

|            |             |
|------------|-------------|
| ANDHERI    | 09323963410 |
| BHAT BAZAR | 09323963409 |
| BHIWANDI   | 08425818022 |
| VASAI      | 09323320952 |
| VASHI      | 08425818023 |
| TARapore   | 09322407169 |
| ULHASNAGAR | 09324495236 |
| BHAYANDER  | 09820283922 |

#### PUNE & OTHER MAHARASHTRA OFFICE

|                 |                |
|-----------------|----------------|
| PUNE (BOOKING)  | 08425818009    |
| PUNE (DELIVERY) | 08425818012-16 |
| CHINCHWAD       | 08425818011    |
| WAGHOLI         | 08425818020    |
| FURSUNGI        | 08425818014    |
| TALEGAON        | 08425818021    |
| SOLAPUR         | 08425818030    |
| KOLHAPUR        | 08425818027    |

#### GUJARAT OFFICE

|                      |              |
|----------------------|--------------|
| AHMEDABAD            | 08866858858  |
| SURAT                | 09377763408  |
| VAPI                 | 09377763409  |
| RAJKOT               | 09327774777  |
| UTTAR PRADESH OFFICE |              |
| VARANASHI            | 09336939327  |
| VARANASHI            | 0542-2454585 |
| MAUNATH BHANJAN      | 09335015165  |

## શિષ્ટ સાહિત્યને પોધાતી કિંમતમાં, સામાન્ય લોકોમાં હૃદયસ્થ કરતું બુક મેનેજમેન્ટ અને તેના પુરસ્કર્તા મહેન્દ્ર મેધાણી

● ભદ્રાયુ વચ્છરાજની ●

સાહિત્યને લોકજીભેથી લોકહેયાં સુધી લઈ જવાનું કાર્ય કર્યું રાખ્યીએ શાયર જવેરયંદ મેધાણીએ. તો વાચનને વ્યક્તિ, ઘર અને સમાજ સુધી લઈ જવાનું વચ્ચેસ્થાપન કર્યું મહેન્દ્ર મેધાણીએ.

શબ્દબ્રહ્મને ચરિતાર્થ કરનાર મહેન્દ્ર જવેરયંદ મેધાણી બહુ અંતમુખી વ્યક્તિત્વ છે, પણ 'મિલાપ' કે 'લોકમિલાપ' શબ્દ સાંભળીને તેમનો ચહેરો આજે નેવું વર્ષે ખીલી ઉઠે છે! ચોવીસ વર્ષની ઉમરે પિતાશ્રીએ વિદ્યાય લીધી અને આ ચોવીસ વર્ષોમાં પિતાશ્રી રાણપુર-બોટાદ-મુંબઈ-કલકૃતા એમ ફરતા રહ્યા. ૧૯૨૦ થી ૧૯૨૮ સુધી તો જવેરયંદ મેધાણી લોકો વચ્ચે છેવાડાનાં ગામોમાં ફર્યું અને જીવા. તેથી તેમના દીકરા મહેન્દ્ર મેધાણીને પિતાશ્રીનાં બહુ સંસ્મરણો આજે યાદ નથી. હા, તેમને સતત વાંચતા-લખતા-ભ્રમણ કરતા જ જોયાનું યાદ છે, પણ ત્યારે કોઈ સમજ ન હતી કે પિતાશ્રી આવડા મોટા સાહિત્યકાર છે! દાદા કાલિદાસ મેધાણીનું સ્મરણ છે અને તે પણ વિશિષ્ટ! દાદા એજન્સીના પોલીસ ખાતામાં. બદલી થતી રહે. આ દાદાના અવસાન પાછળ દા'ડો કરેલો ત્યારે ભોજનમાં સૌને બુંદીના લાહુ મહેન્દ્રએ પીરસેલા. ત્યારથી આજ સુધી બુંદીના લાહુ મહેન્દ્રભાઈને બહુ જ ભાવે છે!

મહેન્દ્ર મેધાણીનો જન્મ મુંબઈમાં અને મેટ્રિક સુધીનું ભણતર પણ ત્યાં જ. કોલેજ કરવા અમદાવાદ આવ્યા અને એલ. ડી. આદર્સ કોલેજમાં જોડાયા. મુંબઈમાં જમુભાઈ દાણીએ ગુજરાતી અને મિસિસ ચોક્સીએ અંગેજ સરસ ભણાવેલું. એલ.ડી. માં બે વર્ષ રહ્યા ત્યારે રા. વિ. પાઠક પાસે ગુજરાતી શીખવાનો લહાવો મળ્યો. ઇન્ટરમાં સારા માર્ક્સ આવ્યા ને સ્કોલરશિપ મળી એટલે તે સમયના વાયરાને અનુસરી

૧૯૪૨ ના જૂનમાં એલ્ફિન્સ્ટન કોલેજ, મુંબઈમાં પ્રવેશ લીધો. ત્યાં જ 'હિંદ છોડો' ચળવળ શરૂ થઈ એટલે ઓગસ્ટમાં કોલેજ છોડી દીધી! બસ, જીવનમાં ભણવાનું ત્યાં પૂર્ણવિરામ મુકાયું. આજાદીની લડતમાં જોડાયા. તાર કાચ્યા, થાંભલા ઉથલાવ્યા. બોટાદમાં આવી ભાંગફોરિયા પ્રવૃત્તિમાં આનંદ માણાતા દીકરાને પિતાશ્રીએ લાહોર મોકલ્યો રામજ હંસરાજની કંપનીમાં. ત્યાં રતિલાલ જાટક્યાએ સાચવ્યા. પણ વિધિની વક્તા કેવી? લાહોરનું એ કારખાનું તો હથિયારો અને વોર મટીરિયલ બનાવતું હતું. ઉદ્ઘાતા માનસના હાથમાં જ હથિયારો બનાવવાનું આવ્યું! જો કે ત્યાં પોલીસ પહોંચ્યી એટલે ભાગ્યા કાશ્મીર. ત્યાં ફર્યા, કાશ્મીર જોયું. ૧૯૪૭ માં પિતાશ્રીનું અવસાન થયું ને ૧૯૪૮ માં અમેરિકા ગયા. ખાસ કંઈ આયોજન વગર. ભણવું હતું. ત્યાં રહી કોલંબિયા યુનિવર્સિટીમાં ભણી પત્રકાર થવું હતું, કૃષ્ણલાલ શ્રીધરાણીની જેમ! ન્યૂયોર્કના ઇન્ટરનેશનલ હાઉસમાં નિવાસ. સ્નાતક થયા નહોતા એટલે અનુસ્નાતકમાં પ્રવેશ તો મળે નહીં. પણ ત્યાં બે છાપાંએ અવિષિસરના પત્રકારત્વના ગુણો સીંચ્યા. ન્યૂયોર્ક ટાઈમ્સ અને કિશ્ચિયન ટાઈમ્સ, દણદાર છાપાં. રોજ સવારે લાવવાનાં ને આખો દિ' રૂમમાં બેસી રસપૂર્વક વાંચવાનાં. ત્યાં વળી 'રીડર્સ ડાયજેસ્ટ'નો મેળાપ થયો. મનમાં સંકલ્પ કર્યો, 'દેશ જઈ ગુજરાતીમાં આવું રીડર્સ ડાયજેસ્ટ શરૂ કરીશ.' ત્યારે જ યુનાઇટેડ નેશન્સની સ્થાપના થયેલી. જૂના કતલખાનામાં તેનું કાર્યાલય. ત્યાં જઈને મહેન્દ્ર મેધાણી બેસે ને વિચારે કે કોઈક દિવસ વિશ્વરાજ્ય થશે, તેની આ શરૂઆત છે!

છવીસ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ મુંબઈથી 'મિલાપ' માસિકનો પહેલો અંક

બહાર પડ્યો ત્યારે પેલો સંકલ્પ ફળીભૂત થયો. એ ગુજરાતીનું રીડર્સ ડાયજેસ્ટ. અન્યત્ર છપાયેલા લેખોમાંથી પસંદિત લેખો છાપવાના. જરૂર પડે ટૂંકાવીને છાપવાના. સારા વિચારો-સારા લેખો-સારાં પુસ્તકોનો પ્રચાર-પ્રસાર એટલે મિલાપ. બે હજાર ગ્રાહકો હતા તે જમાનામાં! મુંબઈમાં કુલમાં એક નાનો અને ચૂંટેલાં પુસ્તકોનો ભંડાર શરૂ કર્યો. પણ પછી ૧૯૫૩ માં મહેન્દ્રભાઈનાં અને તેમની પ્રવૃત્તિઓના મૂળિયાં નંખાયાં ભાવનગરમાં. માસિક બહાર પડે તે 'મિલાપ' ને પ્રકાશન સંસ્થા તે 'લોકમિલાપ...' પુસ્તક ભંડારમાં બધા પ્રકાશકોનાં પુસ્તકો મળે, પણ પ્રકાશકોનાં 'બધા' પુસ્તકો ન મળે! લોકમિલાપ દરેક પુસ્તકની પાછળ રહે, ચકાસે અને શ્રોષ લાગે તો જ તેને ભંડારમાં સ્થાન આપે. મહેન્દ્રભાઈ કહે છે : 'રવિશંકર મહારાજનું દર્શન હતું. તેઓ કહેતા કે તમારા ઘરમાં રૂપિયો આવે ત્યારે તેને ખખડાવીને જોજો કે તે બોંદો તો નથી ને? અમારે માત્ર ચોપડીઓ નહોતી વેચવી. અમારે તો સાહિત્ય માર્કફટ ભાવનાઓ અને વિચારોનો ફેલાવો કરવો છે. લોકમાનસમાં પરિવર્તન આવશે તો જ સમાજ બદલાશે. ભલે વાર લાગે. આપણે મરી જશું તો પાછા આવીશું, પણ કરીશું તો ઉત્તમ કામ જ...'

એક વિચાર આવ્યો. લોકો પુસ્તકો સુધી આવે તેની રાહ જોવાને બદલે લોકો જ્યાં છે ત્યાં પુસ્તકોને લઈ જઈએ તો? આ વિચારે જન્મ આપ્યો 'પુસ્તકમેળા' ને. મુંબઈમાં સુંદરભાઈ હોલમાં પહેલો પુસ્તકમેળો કર્યો. લોકમિલાપના ચાર-પાંચ કાર્યકરો અને બાકી સ્થાનિક મદદકર્તાઓ. ઉતારો સ્થાનિક મિત્રોના ઘરે, હોટેલમાં નહીં. ખર્ચ ઘટાડો પણ પુસ્તકો પોખાય તેવી કિંમતમાં વેચો. પૂના, વડોદરા,

ભર્ય, સુરત, રાજકોટ અને ત્યાંથી વિદેશોમાં પણ પુસ્તકમેળાઓ યોજવા લાગ્યા. લોકભારતીના વિદ્યાર્થી અને લોકમિલાપના ચાહક હિરજુભાઈ શાહ આફિકામાં રહે. એમણે કેન્યા, યુગાન્ડા અને ટાંજાનિયામાં વસતા ગુજરાતીઓ માટે ૧૯૬૭ માં પુસ્તકમેળો યોજવા મહેન્દ્ર મેધાણીને આમંત્રા. પુસ્તકો પહેલાં શિપમાં રવાના કરવાનાં. વેચાણમાંથી વળતર મળે તેમાંથી પ્રવાસખર્ય નીકળ્યું. ૧૯૬૮માં ગાંધી શતાબ્દી વર્ષ હતું. એક વર્ષ આગોતું આયોજન શરૂ કર્યું. ગાંધીની ભૂમિનો વ્યાપક પરિચય આપતાં ચારસો ભારતીય પુસ્તકો જે અંગેજમાં હતાં તેની યાદી બનાવી. સ્પોન્સરિંગ કમિટી બનાવી, જેમાં જે.પી., નારાયણ દેસાઈ, વી.ડી. કેસકર, ગાગનવિહારી મહેતા, મુલ્કરાજ આનંદ... આ નામો વિદેશોમાં પ્રઘ્યાત અને આદરપાત્ર. એક હજાર ડોલરમાં ચારસો પુસ્તકોની યાદી અને કમિટીની યાદી સાથે વિશ્વના દેશોને પત્રો લખ્યા. ન્યૂયૉર્કમાં નોર્મન કર્ઝિન 'સેટર ટે રિવ્યુ ઓફ લિટરેચર' નામથી અઠવાડિક બહાર પાડે, તેમાં આ પત્ર છપાયો ને કેનેડા, અમેરિકા, હૃદેનથી આમંત્રણો આવ્યાં. વિશ્વના અઢાર દેશોમાં જવાનું હતું, ચારસો ઉત્તમ પુસ્તકો લઈને. વળી, પુસ્તકો તો પહેલાં રવાના કરવાં પડે એટલે ખરીદવાં પડે એટલે નાણાંની જરૂર પડે. એ વખતે એક ડોલરના ચાર રૂપિયા હતા. લોકમિલાપને એક લાખ રૂપિયાની જરૂર હતી. મિલાપ માસિક દ્વારા અપીલ કરી : 'અમને એક વર્ષ માટે રૂ. ૧૦૦ ની વગર વ્યાજની લોન આપો.' ચપટી વગાડતાં એક લાખ રૂપિયા મળ્યા. ૧૯૬૮નું આખું વર્ષ અઢાર દેશોમાં ફરીને ગાંધીભૂમિના ઉત્તમોત્તમ પુસ્તકોના મેળાનું મહેન્દ્રભાઈએ જબું આયોજન કર્યું અને તે પણ લોકસહયોગથી લોકમિલાપ દ્વારા!

૧૯૭૨માં જવેરયંદ મેધાણીની પંચોતેરમી જન્મજયંતીએ તેમના સાહિત્યનો વ્યાપક ફેલાવો કરવા લોકમિલાપે મેધાણીનાં કાવ્યો, નવલિકાઓ અને

લોકકથાઓનાં અઢીસો અઢીસો પાનનાં ગ્રંથ પુસ્તકોનો સંપુટ 'કસુંબીનો રંગ' નામથી બહાર પાડ્યો. સાતસો પચાસ પાનનું સુંદર પ્રકાશન. કિમત રાખી રૂ. વીસ, પણ 'આગોતરા ગ્રાહક' થાવ તો માત્ર રૂપિયા દસ અને દસ સેટ મંગાવો તો તો માત્ર રૂપિયા પાંચમાં!!! મેધાણી કુંઠે પુરસ્કાર જતો કરેલો. 'આગોતરા ગ્રાહક' યોજનાની વિશેષતા એ કે જેટલાં વેચવાનાં એટલાં જ છાપવાનાં. કશું પડતર કે વ્યય નહીં. 'કસુંબીનો રંગ'ના સવા લાખ સેટના ઓર્ડર મળ્યા. મહેન્દ્રભાઈ કહે છે કે : 'રસ પડે, સમજાય અને પરવકે તેવું સાહિત્ય આપો તો લોકોને વાંચવું જ છે.' પછી તો સતત ચાર વર્ષ આ જ યોજના દ્વારા 'આપણો સાહિત્યવારસો' શીર્ષકથી જુદા જુદા લેખકોનાં પાંચ-પાંચ પુસ્તકો પ્રકાશિત થયાં. ચયનની જવાબદારી ઉમાંશકર જોશીએ વહન કરી, કારણ રૂ. જો. લોકમિલાપ ટ્રસ્ટના પ્રમુખ હતા. 'મિલાપ' માસિક પચાસ વર્ષ ચાલેલું. તેની ફાઈલોમાં કેટલું સંગ્રહાયેલું? તેમાંથી શ્રેષ્ઠતમ સાહિત્ય નવી પેઢી સુધી પહોંચાડીએ તો? તેમાંથી પ્રગટ થઈ 'અરધી સદીની વાચનયાત્રા' અને એ તો ગુજરાતમાં અને ગુજરાતીઓના ઘરેઘર પહોંચી! 'લોકમિલાપ' ની એક ઓળખ તે બિસ્સાંપોથીની. બગીસ પાનાં અને બુશર્ટના બિસ્સામાં સમાઈ જાય તેવી નાની પુસ્તિકાઓનાં ત્રીસ શીર્ષક થયાં ને તેની દસ લાખ નકલો છપાણી!

મહેન્દ્રભાઈ લોકો સુધી પહોંચવા હુમેશાં તત્પર. કોઈ કહે લોકો વાંચતા નથી તો મહેન્દ્રભાઈએ વાચનયાત્રા શરૂ કરી. મેધાણીભાઈની નેવુંમી જન્મજયંતીએ તેમજો નેવું દિવસની વાચનયાત્રા આરંભી. ધરે ધરે જવાનું. ધરનાંને અડોશપડોશના ચાલીસ પચ્ચાસની વચ્ચે અર્ધો પોણો કલાક બેસી શ્રેષ્ઠ કશુંક વાંચી સંભળવવાનું અને એમ વાચનનો ચેપ લગાડતા જવાનો!!! મહેન્દ્રભાઈને યુવાનીમાં શ્રમ કરવા માટે રોજ એક કલાક દળવાનો શોખ. ધરનાં, પડોશનાં, મિત્રોનાં અનાજને ધંટીમાં દળી દે. શોખ પોષવા દળણાં ઉધરાવવા પણ

જાય! પ્રસંગે ભેટમાં પોતે દળેલ થૂલી કે લાપસી આપી આવે! ભાવનગરના જાણીતા કાર્યકર આત્મારામ બહણી દીકરી કુમુદના લગ્નમાં લાપસી ભરડીને પહોંચેલી, ત્યારથી આજ સુધી કુમુદ તેના ભાઈ મહેન્દ્ર મેધાણીને રાખડી બાંધે છે!

**સૌઝન્ય :** "મુક્તી ઉંચેરાં ૧૦૦ માનવરણો"

### સંશાય

(અનુસંધાન : પાના નં.-૪૮ ઉપરથી ચાલુ) સામ્રાજ્ય છાવાઈ ગયું. પરંતુ સ્નેહાએ ડગુમગુને ડામાડોળ થતા સંસારરથને સ્થગિત થતો રોકવા સોગંદ ખાઈ, આજજી કરી ને ખરું કારણ જાણવા પ્રયત્ન કર્યો. પ્રભુ સમાન પણ્ણુને સુપથનાં ખોળામાં બેસાડી દીધો. તેનું નિર્દ્દ્દિષ્ટ કિલકિલાટ કર્યું હાસ્ય સુપથનાં હેઠાંને પિગળાવી ગયું.

અકળાયેલો, મૂંજાયેલો, સુપથ પોતાનાં જ દોસ્ત મલય પ્રતેની વધુ પડતી મહત્તમાને વહેમની નજરે નિહાળતો હતો. સંપૂર્ણ વ્યવહાર, સમગ્ર વાતચીતમાં મલયનું કેન્દ્રસ્થાન તેને ખૂંચતું હતું. સ્નેહ તો વાત સાંભળીને ડાવાઈ ગઈ. પોતાનાં જ પતિનાં કહેવાથી, તેની સાથે નિર્મણ, નિખાલસ વ્યવહાર કરવા છિતાં આવી શંકા? તે વિચારી રહી.

તે આવું સાંભળીને બોલી : "અરેરે! સુપથ, આવી નજીવી બાબત જે ખુલાસા વગર આગળ વધી હોત તો આપણે જુદાઈનાં પંથે પહોંચી જાત. સુખી લગ્નજીવનમાં ઈર્ષા ઉધઈનું કામ કરે છે. વિશ્વાસ ને પ્રેમથી તો સંસાર ઈમારતનાં ચાણતર થાય છે. મલય તો મારા નાનાભાઈ સમાન છે. મારા હદ્યસિહાસન પર તો માત્ર સુપથને જ સ્થાન હોઈ શકે. હવે કદી આવું અજુગાંતું વિચારતો જ નહિ."

સ્નેહાની સ્નેહાળ ને ફિલસૂફીભરી વાતો સાંભળી સુપથનું હદ્ય દ્રવી ઊઠ્યું. તેનું લાગજીશીલ હૈયું પશ્ચાતાપનાં પાણીથી ધોવાવા લાગ્યું. સંશય (શંકા) નાં કીડાને દૂર ફેંકી દઈ, વિશ્વાસની વેલને વધુ દઢ બનાવવા સ્નેહમયી સ્નેહાને પોતાનાં વિશાળ હદ્યમાં સમાવી લીધી.

**સૌઝન્ય :** "સંબંધોના સથવારે"

## ફિલ્મ રિવ્યુ

### નીરજા : વીરાંગનાને અશ્રુભીની શ્રદ્ધાંજલિ

સોનમ કપૂર, શબાના આજમી સ્ટારર નીરજા ૧૯૮૯ની પાંચમી સાઢેમ્બરે હાઈજેકની સત્યવટના પર આધારિત છે. પેન અંમ અંરવેળું એક પ્લેન પાકિસ્તાની આતંકવાદીઓએ હાઈજેક કર્યું ત્યારે એ ફ્લાઇટમાં એર-હોસ્પિટ નીરજા બનોટ પડ્યું હતી. નીરજાએ બહાદુરીથી હાઈજેકસ સામે ફાઈટ આપી અને ઉદ્દી પેસેન્જરનો જીવ બચાવ્યો. નીરજા બનોટને ભારત સરકાર દ્વારા આ બહાદુરી માટે અશોક ચક આપવામાં આવ્યું હતું. સૌથી નાની વયે અશોકચક મેળવવાનો નીરજાનો રેકોર્ડ આજે પડ્યું છે. પ્રસ્તુત છે નીરજાની વીરકથા...

ફિલ્મમાં નીરજાનું કેરેક્ટર સોનમ કપૂર કરે છે અને નીરજાના બોયફ્રેન્ડ જયદીપનું કેરેક્ટર મ્યુઝિક ડિરેક્ટર વિશાળ-શેખરનો શેખર રવજિયાણી કરે છે. શેખરની આ પહેલી ફિલ્મ છે. શબાનાએ નીરજાની મા રમા બનોટનું કેરેક્ટર કર્યું છે. ફિલ્મનું ડિરેક્શન રામ માધવાણીએ કર્યું છે. નીરજાની બે વાત અત્યંત મહત્વની છે. એક તો એ કે આ ફિલ્મની સ્કિપ્ટના રિસર્ચ માટે રજા કરોડ રૂપિયાનો તોતિંગ ખર્ચ કરવામાં આવ્યો હતો. બીજી મહત્વની વાત એ છે કે નીરજા બનોટ પર ફિલ્મ બનાવવા માટે જ્યારે રામ માધવાણી તેના ફેમિલીની આંફિશિયલ પરમિશન લેવા ગયા ત્યારે તેમની પાસેથી એક રૂપિયો પડ્યા લીધા વિના મંજૂરી આપી હતી.

બહુપ્રતીક્ષિત ફિલ્મ નીરજા સત્ય ઘટના પર આધારિત તેમજ પ્રશંસનીય અભિનય, પટકથા અને સ્કીનપ્લેનું વખાંશવાલાયક મિશ્રણ છે. આ ફિલ્મમાં જાંસીની રાણીની કોઈ કથા નથી, પરંતુ પંજાબની એક સામાન્ય યુવતી વિશેની કથા છે જેણે અસાધારણ પરિસ્થિતિનો સામનો કર્યો હતો અને પોતાના ડર પર કાબૂ મેળવીને, પોતાની હિંમતથી વિમાનના ઉપદ્રવાસીઓના જાન બચાવી, પોતાની જતનું બલિદાન આપીને દુનિયાને ચોંકાવી દીધી હતી. ફિલ્મમાં નીરજા નામની એરહોસ્ટેસ વિશેની વાર્તા છે જેણે પોતાની કામગીરી પ્રત્યેની નિષ્ઠા અને એક અપહૃત વિમાનના પ્રવાસીઓને બચાવવા માટે પોતાનો જાન કુરખાન કરી દીધો હતો.

આ ફિલ્મ આધારત અને ગર્વની અનુભૂતિના દોરમાંથી પસાર થતા એક પરિવાર વિશેની છે.

વાસ્તવિક જીવનમાં શહીદ થયેલી નીરજા બનોટનો જન્મ ૧૯૮૯ની ૭ સપ્ટેમ્બરે પંજાબના ચંદીગઢમાં થયો હતો. તેના પિતાનું નામ હરીશ બનોટ (અંગ્રેજ અખબારના ભૂતપૂર્વ પત્રકાર) અને માતાનું નામ રમા બનોટ છે. નીરજાનાં લગ્ન ૧૯૮૫ માં થયાં હતાં. તેનો પતિ અખાતના

એક દેશમા રહેતો હતો. નીરજા પડ્યું પતિની સાથે અખાતનાં દેશમાં ગઈ હતી, પરંતુ બાદમાં એનાં સાસરિયાંઓએ દહેજની માગણી કરતાં તે પીયર પાણી આવી ગઈ હતી. ત્યારબાદ નીરજાએ અમેરિકાની પેન એમ એરલાઇન્સની ફ્લાઇટ એટેન્ડનટની નોકરી માટે અરજી કરી હતી અને તેની પસંદગી કરવામાં આવી હતી. ૧૯૮૯ની પાંચ સાઢેમ્બરે મુંબઈથી કરાચી થઈને ફેન્કફટ-ન્યૂયોર્ક જતી પેન એમ ફ્લાઇટ-૭૭નું લિબિયાના ચાર અપહરણકારોએ કરાચીમાં અપહરણ કર્યું હતું ત્યારે સવારે દ્વારા હતા. તે વખતે નીરજા કેબિન ફૂમાં સૌથી સિનિયર હતી. ગ્રાસવાણીઓનો પ્લાન વિમાનને સાયપ્રસ લઈ જવાનો હતો. અને ત્યાં જેલમાં કેદ કરાયેલા એમના સાથીને છોડાવવાનો હતો, પરંતુ નીરજા બરા સમયે પાઈલટ્સને અપહરણ વિશે મેસેજ પહોંચાડી દે છે અને પાઈલટ્સ ત્યાંથી ભાગી જાય છે. અને પરિણામે ગ્રાસવાણીઓનો પ્લાન બગડી જાય છે. ત્યારબાદ નીરજા પ્રવાસીઓને કેવી હિંમતથી બચાવે છે તે ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. પ્રવાસીઓને બચાવવાનો પ્રયાસ કરતી નીરજાની ગ્રાસવાણીઓ ગોળી મારીને હત્યા કરી દે છે. નીરજાને તેના એ સાહસ બદલ


અશોક ચક મેડલથી મરણોપરાંત સમ્માનિત કરવામાં આવી છે. આ સમ્માન મેળવનાર નીરજા સૌથી નાની ઉમરની વ્યક્તિ બની છે. ફિલ્મમાં નીરજાનું પાત્ર સૌનમ કપૂરે ભજવ્યું છે જ્યારે તેની માતાની ભૂમિકા શબાના આજમીએ ભજવી છે. નીરજાના પિતાનો રોલ યોગેન્ડ્ર ટીકુએ કર્યો છે.

સોનમે તેની કારડિઈમાં અત્યાર સુધીની સૌથી ઉત્કૃષ્ટ અને યાદગાર ભૂમિકા અદા કરી છે. તેણે સાબિત કરી આપ્યું છે કે સારો રોલ મળે તો પોતાની અભિનય ક્ષમતાથી અને ન્યાય આપી શકે છે.

રામ માધવાણી દિગદર્શિત અને ફેશન ફોટોગ્રાફર અતુલ કસબેકર નિર્મિત નીરજામાં અમુક એવી ઘટનાઓ બતાવવામાં આવી છે જે ધબકારા વધારી દે છે. ખાસ કરીને અપહરણકારો દ્વારા વિમાનપ્રવાસીઓ પર કરાયેલા અત્યાચારનાં દર્શય. આ ફિલ્મની તુલના કોઈ પડ્યું ઈન્ટરનેશનલ હાઈજેકિંગ ફિલ્મ સાથે કરી શકાય.

નીરજા બનોટે માત્ર ૨૩ વર્ષની ઉમરમાં બતાવેલા અદ્યમ સાહસ, બહાદુરી અને સંવેદનાને ખાતર આ ફિલ્મ જોવી જોઈએ.

(સોનમ : 'સાધના')



● મો. ક. ગાંધી ●

'આરતે તો અમને એમ. કે. ગાંધી મોકલ્યા હતા. અમે તેમને મહાત્મા બનાવીને ભારત મોકલ્યા.'

ભારતમાં ગાંધીજીને સૌપ્રથમ વખત મહાત્મા કોણો ને ક્યારે સંબોધ્યા એ ભલે સંશોધનનો વિષય રવી પણ તેના ખાસ્તા વર્ષો પછીયે દેશ બહારની વ્યક્તિ તરીકે નેલ્સન મંડેલાની આ ઉક્તિમાં એક વ્યક્તિ તરીકે અને રંગભેદ સામે લડનાર સો દેશવાસીઓના પ્રતિનિધિ તરીકે તેમની પ્રતીતિ બરાબર જિલ્લાઈ છે. છેક ૧૯૧૫માં જ 'મહાત્મા' બનીને આવેલા પણ પોતે તેનો લગીરેય સ્વીકાર ન કરતા આ ગાંધીભાઈના નેતૃત્વ હેઠળ હજુ તો સમગ્ર દેશમાં સત્યાગ્રહનું મોજું ફરી વળવાને વાર હતી. અસહકારનું આંદોલન (૧૯૨૦ - ૧૯૨૨) કે દાંડીક્રય (૧૯૩૦) તો ઢિક, ભારતમાં પહેલવહેલો કહેવાતો એવો ચંપારણ સત્યાગ્રહ (બિહારના ગળી કામદારોના હક માટે, વર્ષ ૧૯૧૭) થવાનો પણ હજુ બાકી હતો, ત્યારે પોતાના વ્યક્તિત્વ અને અભિવ્યક્તિથી દેશભરના અગ્રહી નેતાઓમાં આગવી છાપ છોડી જનારી મહાત્માપૂર્ણ ઘટના એ મો. ક. ગાંધીએ બનારસ હિંદુ યુનિવર્સિટીમાં આપેલું ભાષણ. આ ભાષણ ન માત્ર આપણને તેમના વખતના, પણ તેમના પૂર્વના તેમજ પછીના રાજકીય નેતાઓ કરતાં પણ ગાંધીજી અલગ માટીના બનેલા હોવાની પ્રતીતિ કરાવી જાય છે...

બનારસ હિંદુ યુનિવર્સિટીના ઉદ્ઘાટન પ્રસંગે રણી ફેલ્લુઆરીએ અપાયેલો ભાષણનો સંપૂર્ણ પાઠ. આ પાઠનું સંપાદન જી. એ. નટેસન માટે ગાંધીજીએ કરેલું, તે વિશે તેમણે લખ્યું હતું કે : મેં અમાંથી માત્ર થોડા શબ્દાળું ભાગ કાઢી નાખ્યા છે, જે છાપેલા ભાષણમાં વાંચતાં અડયણ પડત.

મિત્રો, અહીં આવી પહોંચતાં મને ઘણી ઢીલ થઈ છે તે માટે હું તમારી નભ્રતાપૂર્વક ક્ષમા માગું છું. હું તમને જ્ઞાનવીશ કે ઢીલ માટે હું પોતે જોખમદાર નથી, તેમ કોઈ માનુષી શક્તિ જવાબદાર નથી. એટલે તો તમે મને તરત જ માફ કરશો. બાબત એવી બની છે કે મારી સ્થિતિ પ્રદર્શન માટે મૂકવામાં આવેલા પ્રાણી જેવી થઈ પડી છે. મારા રખેવાળો, અતિ માયાને લઈને, અકસ્માત, જે આપણા જીવનમાં અગત્યનો ભાગ ભજવે છે, તેને હંમેશાં વીસરી જઈ શકે છે. આજે મનો, મારા રખેવાળોને અનો મારા વાહકોને, જે અકસ્માતોની પરંપરા નહીં છે તેની તેઓએ ગણતરી નહોતી કરી. તેથી આટલી ઢીલ થઈ છે.

મિત્રો, હમણાં જ બેસી ગયેલાં બાનુ (મિસિસ બેસન્ટ) ના અપૂર્વ વક્તવ્યની અસર હેઠળ, કૃપા કરીને એમ માની ન લેશો કે આપણા વિશ્વવિદ્યાલયે સંપૂર્ણતા પ્રાપ્ત કરી લીધી છે અને બધા યુવકો જેઓ આ વિશ્વવિદ્યાલયમાં આવવાના છે, અને

જેઓ હજુ જન્મવાના છે, તેઓ પણ આવ્યા અને એક મહાસામ્રાજ્યના નાગારિકો બનવાની લાયકાત મેળવી બહાર પડ્યા. આવી કોઈ પ્રકારની અસર સાથે અહીંથી ન જશો. અને તમે, વિદ્યાર્થીઓ, જેને ઉદ્દેશી આજ સાંજનું મારું બોલવું છે, એમ હું માનું છું, તમે જો એક ઘડીભર પણ એમ માનતા હશો કે આધ્યાત્મિક જીવન, જેને માટે આ દેશ પંકાયેલો છે અને જેને માટે આ દેશનો કોઈ પણ હરીફ નથી, તે શબ્દ દ્વારા શિખવાડી શકાય છે, તો તમે માનજો કે તેમ કરવામાં તમે ભૂલો છો. જે સંદેશો, હું આશા રાખું છું કે હિંદુ એક દિવસ દુનિયાને આપશે તે તમે કદ્દી પણ શબ્દમાત્રથી જ નહીં પહોંચાડી શકો. મેં પણ ઘણાં ભાષણોનો સ્વાદ ચાખ્યો છે. છેલ્લા બે દિવસ દરમિયાન અહીં આપવામાં આવેલાં ભાષણોને હું આ વર્ગમાં નથી લેખતો, કારણ કે તેઓ જરૂરનાં હતાં. પરંતુ હું એટલું તો કહેવા ઈચ્છાં છું કે આપણે ભાષણો કરવામાં આપડી સામગ્રી લગભગ સાવ વાપરી ચૂક્યા છીએ. આપણા કાનને ખોરાક મળે કે આપણી આંખને ખોરાક મળે એ જ કંઈ પૂરતું નથી, પરંતુ આપણાં હદ્યને પણ પોષણ મળવું જોઈએ અને આપણા હાથપગ પણ ચાલવા જોઈએ. છેલ્લા બે દિવસમાં આપણાને એમ કહેવામાં આવ્યું છે કે હિંદી જીવનની સાદાઈ ઉપર આપણે કાબૂ જાળવી રાખવા માટે આપણી પ્રવૃત્તિ અને આપણાં હદ્ય વચ્ચે એક સૂર હોવો કેટલો જરૂરનો છે! પરંતુ આ તો પ્રસ્તાવના રૂપે છે. હું એમ કહેવા માગું છું કે આપણા માટે આ ઘણી નામોશી અને શરમની વાત છે કે આજ સાંજે આ મહાન કોલેજની છાયા હેઠળ, આ પવિત્ર નગરીમાં, મારા દેશબાંધવો પાસે જ પરદેશી ભાષામાં બોલવાની મને ફરજ પડી છે. હું જાણું છું કે જો આ બે દિવસમાં અપાયેલાં ભાષણોમાં હાજર રહેલા બધાની પરીક્ષા લેવા મને પરીક્ષક નીમવામાં આવે, તો, આ ભાષણોનાં વિષયમાં પરીક્ષા આપનારાઓમાં ઘણાખરા નિષ્ણળ નીવડશે. અને તેનું શું કારણ? કારણ એ જ કે તેઓ ઉપર તેની અસર

નથી થઈ. ડિસેમ્બર માસમાં ભરાયેલી મહાન કોંગ્રેસની બેઠકમાં હું હાજર હતો. તેમાં શ્રોતાવર્ગ મોટો હતો, અને તમે માનશો કે મુંબઈમાં મોટા શ્રોતાવર્ગ ઉપર તો જે ભાષણો હિન્દુસ્તાનીમાં કરવામાં આવ્યાં હતાં તે જ ભાષણોની અસર થઈ હતી. અને આ ભૂલવાનું નથી કે આમ મુંબઈમાં બન્યું હતું અને નહીં કે કાશીમાં કે જ્યાં બધા હિંદ્યા બોલે છે. અંગ્રેજ અને હિંદની ભાષાઓ વચ્ચે જેટલું અંતર છે તેટલું મુંબઈ ઈલાકાની સ્થાનિક ભાષાઓ અને હિંદ્યા વચ્ચે નથી, અને તેથી કોંગ્રેસનો શ્રોતાવર્ગ હિંદ્યામાં બોલનારાઓને વધારે સમજી શક્યો હતો. હું આશા રાખ્યું છું કે આ વિશ્વવિદ્યાલય એવી ગોઠવણ કરશે કે તેમાં ભાષાવા આવનાર વિદ્યાર્થીઓને તેઓની પોતાની માતૃભાષા દ્વારા શિક્ષણ આપવામાં આવે. આપણી ભાષા આપણું પોતાનું પ્રતિબિંબ છે, અને કદી તમે એમ કહેશો કે આપણી ભાષાઓ સર્વોત્તમ વિચાર પ્રગટ કરવા માટે બહુ કંગાળ છે તો હું તો કહીશ કે આપણો નાશ જેમ જલદી થાય તેમ આપણા માટે વધારે સારું છે. હિંદની રાષ્ટ્રીય ભાષા અંગ્રેજ બને, એવું સ્વખન જોનાર કોઈ છે? પ્રજા ઉપર આ બોજો શા સારું જોઈએ? ઘડીભર વિચારી જુઓ કે કેવી વિષમ શરત આપણાં બાળકોને એક અંગ્રેજ બાળક સાથે દોડવી પડે છે. પૂનાના કેટલાક પ્રોફેસરો સાથે ઊંડાણથી વાત કરવા મને તક મળી હતી. તેઓએ મને ખાતરી આપી હતી કે દરેક હિંદ્યા યુવક, અંગ્રેજ ભાષા દ્વારા પોતાનું જ્ઞાન મેળવતો હોવાથી, પોતાનાં જીવનનાં ઓછામાં ઓછાં છ અમૃત્ય વર્ષો ગુમાવે છે. આપણી શાળાઓ અને કોલેજોમાંથી બહાર પડતા વિદ્યાર્થીઓની સંખ્યા સાથે તેને ગુણી નાખશો, તો તમને જ્ઞાનો કે પ્રજાને કેટલાં હજારો વર્ષોનું નુકસાન થયું છે. આપણા ઉપર આ આરોપ છે કે આપણામાં આરંભ કરવાની શક્તિ નથી. આપણા જીવનનાં અમૃત્ય વર્ષો એક વિદેશી ભાષા ઉપર કાબૂ મેળવવામાં ગણવાં પડે, તો પછી આપણામાં તે શક્તિ કર્યાંથી હોય?

આ કામમાં પણ આપણે નિષ્ફળ નીવડીએ છીએ. ગઈકાલે તેમ આજે, મિ. હિંગિન્બોટમને પોતાના શ્રોતાવર્ગ ઉપર અસર કરવાનું જેટલું શક્ય હતું તેટલું બીજા કોઈ પણ વક્તા માટે શક્ય હતું? મારી પહેલાંના બોલનારાઓ શ્રોતાવર્ગને જીતી ન શક્યા તેમાં તેઓનો વાંક ન હતો. તેઓના બોલવામાં જોઈએ તેટલો માલ હતો. પરંતુ તેઓનું બોલવું આપણા અંતરમાં નહોતું ઊતરી શકતું. મેં એમ કહેવાતું સાંભળ્યું છે કે ગમે તેમ હો, પણ પ્રજાને દોરવાનું કામ અને પ્રજા માટે વિચારવાનું કામ હિંદમાં અંગ્રેજ ભણોલો વર્ગ કરે છે. તેમ ન હોય તો બહુ ભારે જ કહેવાય. આપણાને જે શિક્ષણ મળે છે તે માત્ર અંગ્રેજ જ છે. અવશ્ય, તેના બદલામાં આપણે કંઈક કરી બતાવવું જોઈએ. પરંતુ જો આપણાને છેલ્લાં પચાસ વર્ષ દરમિયાન આપણી દેશી ભાષાઓ મારફત શિક્ષણ આપવામાં આવ્યું હતું તો આજે આપણી પાસે એક સ્વતંત્ર હિંદ હતે, આપણી પાસે આપણા શિક્ષિત માણસો હતે, જેઓ પોતાની જ ભૂમિમાં વિદેશી જેવા ન રહ્યા હતે પણ જેઓનું બોલવું પ્રજાના અંતર ઉપર અસર કરી રહ્યું હતે. તેઓ દરિદ્રમાં દરિદ્ર વચ્ચે જઈ કામ કરતા હતે, અને ગયાં પચાસ વર્ષમાં તેઓએ જે કંઈ મેળવ્યું હતે તે પ્રજાને એક વારસારૂપે નીવડ્યું હતે. આજે આપણી સીઓ પણ આપણા ઉત્તમ વિચારોમાં ભાગ લઈ શકતી નથી. પ્રોફેસર બોજ અને પ્રોફેસર રોયનો અને તેઓની ઉજ્જવળ શોધોનો વિચાર કરો. શું એ શરમ જેવું નથી કે તેઓની શોધો જનસમૂહની સાર્વજનિક મિલકત થઈ શકી નથી?

હવે આપણે બીજા વિષય તરફ વળશું.

કોંગ્રેસે સ્વરાજ્ય વિશે એક ઠરાવ પસાર કર્યો છે, અને હું આશા રાખ્યું છું કે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી અને મુસ્લિમ લીગ પોતાનું કર્તવ્ય કરશે અને કેટલીક વ્યવહારું સૂચનારો રજૂ કરશે. પરંતુ મારે ખુલ્લા દિલથી કબૂલ કરવું

જોઈએ કે જે કંઈ તેઓ કરી શકશે તેમાં મને એટલો બધો રસ નથી પડવાનો જેટલો રસ વિદ્યાર્થી વર્ગ જે કંઈ કરશે અથવા જનસમૂહ જે કંઈ કરશે તેમાં પડશે. લખાણો આપણાને કોઈ પણ દહાડો સ્વરાજ્ય નથી આપવાનાં. ગમે તેટલાં ભાષણો પણ આપણાને સ્વરાજ્ય માટે લાયક નથી કરી શકવાનાં. આપણું ચારિત્ર જ આપણાને સ્વરાજ્ય માટે લાયક બનાવશે. આપણા પોતા ઉપર રાજ્ય કરવા આપણે શું પ્રયત્નો કરીએ છીએ? આજ સાંજના આપણે બધા સાથે વિચાર કરીએ એમ હું ઈચ્છાં છું. હું ભાષણ કરવા નથી માગતો, અને આજ સાંજના સ્પષ્ટ રીતે બોલતો હું તમને જણાઉં, તો કૃપા કરી એમ માનજો કે હું ભાષણ કરતો નથી પણ તમે બધા સાંભળી શકો તેમ વિચાર કરું છું. અને તેમ કરવામાં કદી વિવેકનો ભંગ થઈ જતો જણાય, તો તે માટે ક્રમા કરશો. ગઈ સાંજે હું વિશ્વનાથ મહાદેવના મંદિરમાં ગયો હતો. હું તેની ગલીઓમાંથી પસાર થતો હતો ત્યારે મને આ પ્રમાણે વિચારો આવ્યા. આ મહાન મંદિરમાં કોઈ એક અજાયો પુરુષ ઉપરથી ઊતરી આવે, અને તેને આપણે હિંદુ તરીકે કેવા હશું તેનો વિચાર કરવો પડે, અને કદી તે આપણાને ફિટકાર આપે તો શું તે તેમ કરવામાં વાજબી નથી? શું આ મહામંદિર આપણા પોતાના ચારિત્રનું પ્રતિબિંબ નથી? હિંદુ તરીકે મને લાગી આવે છે તેથી હું બોલું છું. આપણા પવિત્ર મંદિરની ગલીઓ જેવી અત્યારે ગંદી છે તેવી હોવી શું વાજબી છે? તેની આસપાસનાં ઘરો જેમ તેમ બાંધવામાં આવ્યા છે. ગલીઓ વાંકીચૂકી અને સાંકડી છે. આપણાં મંદિરો પણ જો વિશાળતા અને ચોખ્યાઈના આદર્શરૂપ ન હોય, તો પછી આપણું સ્વરાજ્ય કેવું હોઈ શકે? જે ઘડીએ અંગ્રેજો પોતાની ઈચ્છાથી કે ફરજ પડવાથી પોતાનું સર્વસ્વ લઈ હિંદ છોડી જશે, તે જ ઘડીએ શું આપણાં મંદિરો પવિત્રતા, શુદ્ધતા અને શાંતિનાં સ્થાનો બની જશે?

કોંગ્રેસના પ્રમુખ સાથે હું સાવ મળતો

થાઉં છું કે આપણે સ્વરાજ્યનો વિચાર કરીએ તે પહેલાં, આપણે આવશ્યક શ્રમ ઉદાવવો પડશે. દરેક નગરના બે વિભાગ હોય છે, છાવણી માટેનો ભાગ, અને બીજો ખુદ શહેર. ઘણો અંશે શહેર ગંધાતી બખોલ જેવું હોય છે. આપણે શહેરી જીવનથી અપરિચિત છીએ. પરંતુ જો આપણે શહેરી જીવન ઈચ્છતા હોઈએ તો આપણે તેમાં શહેરી ગ્રામ જીવનનાં તત્ત્વો દાખલ ન કરી શકીએ. ‘મજલાવાળાં મકાનોમાં વસનારા આપણા ઉપર વખતે થૂકશે તો!’ એવા સતત ભય સાથે મુંબઈના દેશી લતાઓમાં ચાલનારાઓનો વિચાર કંઈ રુચિકર નથી. હું રેલવેની ઘણી મુસાફરી કરું છું? ગ્રીજા વર્ગના મુસાફરોની મુશ્કેલીઓ હું જોઉં છું. પરંતુ તેઓને વેઠવી પડતી બધી હાડમારીઓ માટે રેલવે - વ્યવસ્થાને દોષ કોઈ રીતે આપી ન શકાય. શુદ્ધતાના ગ્રાથમિક નિયમો આપણે જાણતા નથી. ભોય ઘણીયે વાર સૂવા માટે વપરાય છે; તેનો વિચાર પણ કર્યા વિના આપણે ડબામાં ગમે ત્યાં થૂંકીએ છીએ. આપણે ડબાનો ગમે તેમ ઉપયોગ કરતાં જરા પણ વિચાર કરતા નથી. પરિણામે તેમાં કહ્યો ન જાય તેટલો ગંદવાડ થાય છે. કહેવાતા ઊંચા વર્ગના મુસાફરો પોતાના ઓછા ભાગ્યશાળી ભાઈઓને ડરાવી નાંખે છે. તેમ કરતાં મેં વિદ્યાર્થીઓને પણ જોયા છે. કેટલીક વાર તો તેઓ બીજાઓ કરતાં જરાય સારું વર્તન બતાવતા નથી. તેઓ અંગ્રેજ બોલી શકે છે, અને તેઓ જાકીટ પહેર્યું હોય છે; તેથી તેઓ ડબામાં બળથી દાખલ થવાનો અને બેઠક મેળવવાનો દાવો કરે છે. મેં ચોતરફ મારી નજર કરી છે, અને તમે મને તમારી સમક્ષ બોલવા તક આપી છે એટલે હું મારું અંતર ઉધારું છું. અવશ્ય, સ્વરાજ્ય પ્રતિ આપણી પ્રગતિમાં આપણે આ બાબતો સુધારવી જોઈએ.

હવે હું તમારી પાસે એક બીજો ચિત્તાર રજૂ કરું છું.

ગઈકાલના આપણા કાર્યના પ્રમુખ નામદાર મહારાજા હિંદની દરિદ્રતા વિશે બોલ્યા હતા. બીજા વક્તાઓએ તે ઉપર

ઘણો ભાર મૂક્યો હતો. પરંતુ નામદાર વાઈસરોયે જે મંડપમાં સ્થાપનકિયા કરી, તેમાં આપણે શું જોયું? નિઃશંક એક ભભકાદાર દેખાવ, જવેરાતનું પ્રદર્શન, જે જવેરાત પેરિસથી અહીં આવવા ઈચ્છનાર સૌથી મોટા જવેરીની આંખોને પણ ચકિત કરે એવું હતું. હું કિમતી રીતે શાશગારેલા અમીરોને લાખો ગરીબો સાથે સરખાવું છું. અને હું આ અમીરોને કહેતો હોઉં એમ મને લાગે છે કે “જ્યાં સુધી તમે તમારાં જવેરાતો નહીં ઉતારો, અને હિંદમાં તમારા દેશબંધુઓનાં હિત માટે તમે તેને નહીં સાચવો ત્યાં સુધી હિંદનો ઉધાર થવાનો નથી.” મને ખાતારી છે કે નામદાર શહેનશાહની કે લોર્ડ હાર્ટિંગની એવી ઈચ્છા નથી કે આપણા નામદાર શહેનશાહને આપણી પૂર્ણ વફાદારી બતાવવા માટે આપણે આપણી જવેરાતની તિજોરીઓ ખાલી કરી પગથી તે માથા સુધી શાશગારી બહાર નીકળવું જોઈએ. હું મારા જીવના જોખમે પણ શહેનશાહ જ્યોર્જ પાસેથી સંદેશો લાવી આપવા તૈયાર છું કે તેઓ આવા પ્રકારનું કંઈ ઈચ્છતા નથી. હિંદના કોઈ પણ મોટા શહેરમાં, પછી તે બ્રિટિશ હિંદમાં હો કે હિંદના બીજા ભાગોમાં કે જ્યાં આપણા દેશી રાજાઓ અમલ કરે છે, ત્યાં, મોટો મહેલ ચણાતો હું સાંભળું છું ત્યારે મને તરત જ તેની અદેખાઈ થાય છે અને મને લાગી આવે છે કે તે માટે પૈસો તો ખેડૂતો પાસેથી લેવામાં આવ્યો છે. વસ્તીનો પોણોસો ટકા કરતાં પણ વધારે ભાગ ખેડૂતોનો છે. મિ. હિગિન્બોટમે તેની મધુર વાણીમાં આપણાને ગઈ કાલે કહ્યું હતું કે તેઓ ધાસનું એક તણખલું વાવી બે તણખલાં ઉગાડનારા છે. તેઓની મહેનતનું લગભગ આખું ફળ આપણે લઈ લઈએ અથવા બીજાને લઈ જવા દઈએ તો આપણામાં સ્વરાજ્યની ભાવના બહુ હોઈ શકે નહીં. આપણો છુટકારો ખેડૂત મારફતે જ થઈ શકશે. વકીલો કે ડોકટરો કે મોટા જમીનદારો તે મેળવવાના નથી.

હવે, અંતમાં, છેલ્લા બે ત્રણ દિવસમાં જેણે આપણું મન ક્ષોભિત કરી મૂક્યું છે તે

અગત્યની બાબતને ઉદ્દેશીને બોલવાની હું મારી જરૂરી ફરજ સમજું છું. જે વખતે નામદાર વાઈસરોય કાશીના રસ્તાઓમાંથી પસાર થતી હતા, ત્યારે આપણે બધાએ ઘણી ચિંતાતુર પળો અનુભવી હતી. ઘણી જગ્યાએ છૂપી પોલીસને ગોઠવવામાં આવી હતી. આપણે ગભરાટમાં પડ્યા હતા. આપણાને એમ થાય છે કે આટલો બધો અવિશ્વાસ શા સારું? લોર્ડ હાર્ટિંગને આવી રીતે મૃત્યુના જરૂરામાં અસોસ (આંચ આવ્યા વગર) રહેવા કરતાં મૃત્યુ પણ વધારે ઢીક થઈ પડે. પણ સર્મર્થ શહેનશાહના પ્રતિનિધિ વખતે તેમ ન માને. તેમને સતત કાળના મોંમાં પણ રહેવાની જરૂર પડે. પરંતુ આપણા ઉપર આ છૂપી પોલીસ બેસાડવાની શું જરૂર હતી? આપણે ગુસ્સે થઈએ, આપણે ચિંતાઈએ, આપણે સામા થઈએ, પણ આપણે ભૂલવું ન જોઈએ કે હાલના હિંદ, પોતાની અધીયાઈને લીધે, બંડખોરોનું એક ખૂની લશકર ઉત્પત્ત કર્યું છે. હું પોતે પણ બંડખોર છું, પણ બીજી જાતનો. પરંતુ આપણામાં બંડખોરોનો એવો એક વર્ગ છે, અને જો હું આ વર્ગને મળી શકું તો હું તેઓને કહું કે જો હિંદને વિજેતાઓને જતવા હશે, તો બંડ માટે હિંદમાં અવકાશ નથી. બંડ એ ભયની નિશાની છે. આપણે જો પ્રભુમાં ભરોસો રાખીએ અને પ્રભુથી ડરતા રહીએ, તો પછી આપણાને કોઈથી પણ, મહારાજાઓ, વાઈસરોયો, છૂપી પોલીસો કે શહેનશાહ જ્યોર્જથી પણ ડરવા જેવું રહેશે નહીં. હું બંડખોરને તેના દેશ માટેના પ્રેમ સારું માન આપું છું. પોતાના દેશ કાજે માણ આપવાની તેની ઈચ્છામાં રહેવા શૌર્ય માટે હું તેને માન આપું છું; પરંતુ હું તેને પૂછું છું કે મારચું એ શું માનને પાત્ર છે? માનભરેલું મરણ મેળવવા માટે ખૂનીનું બંજર શું યોગ્ય નિમિત્ત છે? હું તેની સાફ ના કહું છું. કોઈ પણ ધર્મશ્રંધ્રમાં આવી રીતી માટે પરવાનગી નથી. જો મને એમ જણાય કે હિંદના છુટકારા માટે અંગ્રેજોએ અહીંથી જતા રહેવું જોઈએ, તેઓને હાંકી કાઢવા જોઈએ, તો હું જાહેર કરવામાં આનાકાની નહીં કરું કે

તેઓને જવું પડશે, અને હું ધારું છું કે તે માન્યતાના બચાવમાં મરવા હું તૈયાર હઈશ. મારા મતે, તે એક માનનીય મરણ કહેવાય. બોંબ ફેંકનારો ધૂપાં કાવતરાંઓ રચે છે. તે ખુલ્લી રીતે બહાર આવતાં ડરે છે, અને જ્યારે પકડાય છે ત્યારે તે આડે માર્ગ દોરવાયેલા પોતાના ઉત્સાહ માટે શિક્ષા વેઠે છે. મને એમ કહેવામાં આવ્યું છે કે આપણે જો આમ ન કર્યું હતે, જો થોડાક માણસોએ બોંબ ફેંક્યા ન હતે, તો ભાગલાની ચળવળના અંગે આપણને જે કંઈ મળ્યું છે તે ન મળતે.

**મિસિસ બેસન્ટ :** “મહેરભાની કરી તે વિષય બંધ કરો.”

આ જ વાત બંગાળમાં મેં કહી હતી. તે વખતે મિ. લાયન્સ સભાના પ્રમુખ હતા. મને લાગે છે કે જે હું કહું છું તે જરૂરનું છે. મને બંધ કરવા કહેવામાં આવશે તો હું તે કબૂલ કરીશ. (પ્રમુખ તરફ જોઈને) હું તમારા હુકમની વાટ જોતો ઊભો છું. જો તમને એમ લાગે કે અત્યારના મારા બોલવાથી હું દેશની અને સામાજિકની સેવા નથી કરતો, તો હું જરૂર બોલતો અટકીશ. (‘ચાલુ રાખો’ ના પોકાર)

**પ્રમુખ:** મહેરભાની કરી તમારો હેતુ સમજાવો.

હું મારો હેતુ સમજાવું છું. હું માત્ર... (પાછો વચ્ચે અંતરાય) મિત્રો, મહેરભાની કરી આ પ્રતિબંધની સામે ન થાઓ. આજ સાંજના મિસિસ બેસન્ટ એમ ધારે છે કે મારે બોલવું બંધ કરવું. તે હિંદને બહુ ચાહે છે. અને તેને એમ લાગે છે કે તમો યુવકોની પાસે આ પ્રમાણે ખુલ્લી રીતે વાત કરવામાં હું ભૂલ કરું છું. તેમ છતાં, હું એટલું જ કહું છું કે બંને પક્ષમાં રહેલું વહેમનું વાતાવરણ હિંદમાંથી દૂર કરવા દઈછું છું. આપણે આપણા પ્રામલ્ય સુધી

પહોંચવું હશે તો આપણને પરસ્પર પ્રેમ અને પરસ્પર વિશ્વાસ ઉપર રચાયેલું જ્ઞામાજ્ય જોશે. આપણે આપણાં ઘરોમાં ગમે તે બોલીએ તેના કરતાં આ કોલેજની છાયા ડેટન આપણે બોલીએ તે શું વધારે સાચું નથી? હું એમ માનું છું કે આ વાતો આપણે ખુલ્લી રીતે કરીએ એ વધારે સાચું છે. આ પ્રમાણે મેં અગાઉ કર્યું છે અને તેના પરિણામ ઉત્તમ આવ્યા છે. હું જાણું છું કે એવી કોઈ વાત નથી કે જેનો વાદવિવાદ વિદ્યાર્થીઓ નહીં કરતા હોય. એવી કોઈ વાત નથી કે જે વિદ્યાર્થીઓ જાણતા નથી. એટલે હું પ્રકાશ આપણા પોતા ઉપર જ નાનું છું. મને મારા દેશનું નામ અત્યંત પ્રિય છે. તેની હું તમારી સાથે આ વિચારો અદલબદલ કરું છું, અને તમારી પાસે રજૂ કરું છું કે હિંદમાં બંડ માટે અવકાશ નથી. આપણે આપણા રાજ્યકર્તાઓને જે કંઈ કહેવું હોય તે આપણે નિખાલસ મને અને ખુલ્લી રીતે કહેવું જોઈએ, અને આપણે જે કહેવાનું છે તેનાથી તેઓ જો નારાજ થાય તો તેનું પરિણામ આપણે વેદી લેવું જોઈએ. પરંતુ આપણે તેઓ હલકા પાડવા ન જોઈએ. ઘણી નિંદાથી સનદી નોકરીના એક માણસ સાથે હું એક દહડો વાત કરતો હતો. મારામાં અને તે નોકરીના માણસો વચ્ચે કંઈ બહુ સાચ્ય નથી, છતાં જે રીતભાતથી તે મારી સાથે વાત કરતો હતો તેના માટે મને તેનાં વખાણ કર્યા વિના ચાલ્યું નહીં. તેણે કહ્યું : “મિ. ગાંધી, તમે ઘરીભર પણ એમ માનો છો કે અમે બધા સનદી નોકરો ખરાબ છીએ, અને જે લોકો ઉપર અમે અમલ કરવા આવ્યા છીએ, તેઓ ઉપર અમે જીલમ ચુલમ ચુજારવા માગીએ છીએ?” મેં કહ્યું કે નહીં. “ત્યારે, તમને તક મળે તે વખતે આ બહુ નિંદાતી સનદી નોકરી વિશે બે બોલ બોલજો.”

અને અત્યારે હું તે વચ્ચે પાણું છું.

હું કબૂલ કરું છું કે હિંદી સનદી નોકરીના ઘણા જણા નિર્વિવાદ રીતે બહુ ગર્વિષ છે. તેઓ ગાસ વત્તવિ છે અને ઘણી વાર તેઓ અવિચારી જણાય છે. તેઓ માટે બીજાં ઘણાં વિશેષજ્ઞો વાપરી શકાય એમ છે. હું આ બધું કબૂલ રાખું છું અને હું એ પણ કબૂલ કરું છું કે હિંદમાં અમુક વર્ષો રહ્યા પછી તેઓમાંના કેટલાક કેટલીક રીતે ઉત્તરી ગયા હોય છે. પરંતુ તે શું બતાવે છે? અહીં આવ્યા તે પહેલાં તેઓ લાયક માણસો હતા, અને તેઓ કંઈક નીતિભ્રષ્ટ થયા છે, તો તે આપણું પોતાનું જ પ્રતિબિંબ છે. (નહીં એવો પોકાર). જરાક તમે પોતે વિચારી જુઓ; એક માણસ ગઈ કાલે સારો હોય અને મારા સંગમાં આવ્યા પછી તે ખરાબ નીવડે, તો તેના અધઃપાત માટે તે પોતે જોખમદાર છે કે હું? હિંદમાં તેઓના આવવાની સાથે જ, તેઓની આસપાસ ખુશામત અને જુદાઈનું વાતાવરણ ફરી વળે છે. આ વાતાવરણ આપણામાંના ઘણાને હલકા પાડે છે, તેમ જ તેઓને પણ પાડે છે. કેટલીક વાર વાંક કબૂલ કરવો સારો છે.

આપણને સ્વરાજ્ય જોતું હશે, તો આપણે તે લેવું પડશે. આપણને કદી પણ સ્વરાજ્ય આપવામાં આવશે નહીં. બિટિશ પ્રજા સ્વતંત્રતાને ચાહુનારી છે. છતાં, જે પ્રજા પોતાની મેળે જ સ્વતંત્રતા નહીં મેળવે, તેને તે અપાવવામાં કદી ભાગ નહીં લે. તમને રુચે તો બોઅર લડાઈમાંથી તમારા માટે સાર લો. આ લોકો થોડાંક વર્ષ ઉપર સામાજિકના શરૂ હતા, પણ આજે મિત્ર બન્યા છે.

એટલું બોલાઈ રહેતાં, વચ્ચે કોઈ બોલી ઉઠકું, અને માંચો ખાલી થવા લાગ્યો, એટલે ભાષણ ઓચિંતુ અહીં બંધ થયું. (ગાંધીજીનો અભરદેહ : ૧૩) (મુજા અંગ્રેજી, ૬ ફેબ્રુઆરી, ૧૯૧૬)

(સોઝન્ય : નવજીવન)



**સાંઘવ-રન્ન સ્વ. પૂ.શોઠ શ્રી મુરજી રાધવજી લોડાયાના સ્મરણાર્થે....**

**MRL CLEARING  
AND FORWARDING PVT. LTD.**

(CHA No. 11/374)

13/B, Sucheta Niwas, 285, Shahid Bhagat Singh Road, Fort, Mumbai-400 001.  
Tel. : +91 22 22661380 / 22661600 Fax : +91 22 22703624  
E-mail : imp@mrlshipping.com Web : www.mrlshipping.com

**Clearing, Forwarding & Shipping Agents**

**શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદનો ઇતિહાસ**

**પ્રકરણ-૪૭**

● સંકલન : દિનેશચંદ્ર જગજુવન શાહ ●

★ તા. ૨૧-૮-૨૦૧૧ના રોજ સંસ્થા દ્વારા સરસ્વતી સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદની પુરસ્કાર સમિતિ, શિક્ષણ અને ઈતર તેવલપમેન્ટ સમિતિ તથા યુવા વિકાસ સમિતિ દ્વારા અમદાવાદ - ગાંધીનગરમાં ધોરણ-૮, ધોરણ ૧૦ તથા ધોરણ-૧૨માં વિજ્ઞાન તથા સામાન્ય પ્રવાહના ૮૦ ટકાથી ઉપર એવા સમાજના ગ્રામ વિદ્યાર્થીઓ તેમજ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનાર અનુસ્નાતકોમાં ચાર તેજસ્વી વિદ્યાર્થીઓને દાતાશ્રી પરિવારો તરફથી સન્માનિત કરવામાં આવેલ હતા. આ સમારંભમાં અતિથિ વિરોધ તરીકે ડૉ. અભય છેડા (જાયડસ) તથા શ્રી ભરત ભાણજી ગાલા (રાજુ એન્ટરપ્રાઇઝ)એ હાજરી આપેલ. આ ઉપરાંત ધોરણ-૮થી અનુસ્નાતકોના વિદ્યાર્થીઓ, કે જેઓએ ૬૦ ટકાથી ઉપર ગુણ મેળવેલ હતા તેમને પણ ઈનામોથી નવાજેલ હતા.

આ સમયે વિદ્યાર્થી મિત્રોને કારકિર્દી ઘડતર માટે પ્રો. જ્યરાજ પંડ્યાએ માર્ગદર્શન આપેલ.

સમારંભનું સંચાલન શ્રીમતી ફાલ્ગુની હીરેન શાહે સુપેરે સંચાલન કરેલ હતું. આભારવિધિ શ્રી હીરેન કે. શાહે કરેલ. ત્યારબાદ સ્વરૂપી ભોજન બાદ સર્વે છૂટા પેલ હતા.

★ શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ દ્વારા તેનો વાર્ષિક સેહ મિલન સમારંભ, સામૂહિક ક્ષમાપના તથા સ્વામિવાત્સલ્ય જમણના કાર્યક્રમોની ઉજવણીનું આયોજન પાલવી ભવન ખાતે આવેલ સંકુલમાં રવિવાર, તા. ૧૮-૦૮-૨૦૧૧ના રોજ સવારે ૬.૦૦ કલાકે કરવામાં આવ્યું હતું. આ સમયે જુદી જુદી વાર્ષિક સ્પર્ધાઓના વિજેતાઓને, ઉચ્ચ શિક્ષણ મેળવનારાઓને, ઈતર પ્રવૃત્તિ ક્ષેત્રે શ્રેષ્ઠ દેખાવ કરનારને તેમજ સમાજના મુખ્યપત્ર ‘મંગલ મંદિર’ના વર્ષ ૨૦૧૦-૨૦૧૧ માટે ધોષિત થયેલા ‘શ્રેષ્ઠ દેખ’ અને ‘શ્રેષ્ઠ આંજો કાગર’ વિભાગના દેખકોને ઈનામ - પારિતોષિક એનાયત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં સમાજની અંદાજિત ૧૮૦૦ જેટલી વ્યક્તિઓ ઉપસ્થિત રહેલ હતી.

સમારંભની શરૂઆતમાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી અને પ્રમુખ શ્રી અશોકભાઈ મહેતાએ આ પ્રસંગે પધારેલ સર્વને આવકાર્ય હતા તથા સમાજની વિવિધ પ્રવૃત્તિઓની જાણકારી આપેલ હતી. સમાજના માનદ્દ મંત્રી શ્રી પ્રતાપભાઈ દંડ દ્વારા શાહીબાગ ખાતેના કચ્છી વિશ્રામ ગૃહ ખાતે આકાર લઈ રહેલ ‘કચ્છ સંસ્કૃતિ ભૂજિયમ’ વિશે રસપ્રદ માહિતી આપેલ હતી. જેના દ્વારા લોકો

કચ્છ બાબતે વધુને વધુ જાણકારી મેળવી શકશે તેવી ભાવના વ્યક્ત કરેલ હતી. ઉપરાંત તેમજે સમાજ દ્વારા હાથ ધરવામાં આવેલ ગૃહ ઉઘોગ વિશેની પ્રવૃત્તિ વિશેની જાણકારી આપતા કંબું હતું કે સમાજના જરૂરિયાતમંદ વ્યક્તિઓને પગભર થવા સમાજનો આ પ્રયાસ છે. સાથે સાથે મુંબઈ શહેરમાં શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ દ્વારા એક અતિથિ ભવન ઊભું કરવાના પ્રયત્નોની રૂપરેખા આપેલ હતી.

સમાજ દ્વારા સંચાલિત શ્રી કચ્છી વિશ્રામ ગૃહ - શાહીબાગ ખાતે ચાલુ થયેલ ‘શ્રી જલારામ અન્નકીત્ર’ તથા ત્યાં તબીબી સારવાર અર્થે કચ્છથી આવતા જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક અપાતી સગવડનો ઉલ્લેખ કરી દાતાઓને લાભ લેવા વિનંતી કરી હતી. કચ્છ તેવલપમેન્ટ કાઉન્સિલ પ્રાયોજિત કચ્છમાં આડિટોરીયરલ કોલેજ સ્થાપવાના નિર્જયની પણ જાણ કરેલ હતી.

શિક્ષણ અને ઈતર તેવલપમેન્ટ સમિતિના કન્વીનર શ્રી હીરેન કે. શાહે સમિતિ દ્વારા યુવાવર્ગના ઉત્કર્ષ માટેની પ્રવૃત્તિઓનો વિગતવાર ચિત્તાર આપેલ. જેમાં વિદ્યાર્થીઓ માટેની એપ્સ્ટ્રેટ્વ્યૂડ ટેસ્ટ અને વ્યક્તિગત રીતે કાઉન્સેલિંગની સમજણ આપેલ હતી.

કાર્યક્રમની આભારવિધિ સંસ્થાના સહમંત્રી શ્રી હસમુખભાઈ બાબુભાઈ શાહે એ કરતાં, દરેક સ્પર્ધાના સૌજન્ય દાતાશ્રીઓનો તેમજ સ્વામિવાત્સલ્ય જમણવારના સંયુક્ત દાતાશ્રીઓનો ખાસ આભાર માન્યો હતો. તદ્વારાંત દરેક સમિતિના કન્વીનરોનો, સમાજના હોદેદારોનો, સ્ટાફગણનો પણ આભાર માનેલ હતો.

આ કાર્યક્રમનું સંચાલન શ્રીમતી અલ્યાબેન મેહુલ શાહે સુંદર અને સંઝણતાપૂર્વક કર્યું હતું.

★ સંસ્થા દ્વારા અવારનવાર યોજાતા મેડિકલ કેમ્પની શ્રેણીમાં તા. ૧૩-૧૧-૨૦૧૧ના રોજ સંસ્થાના પાલવી ભવન ખાતે મેડિકલ સેન્ટર આયોજિત હાડકાના રોગ - તકલીફ, ફિલ્યોથેરાપી અને પેઈન મેનેજમેન્ટ સંબંધિત નિદાનો એક નિઃશુલ્ક કેમ્પ યોજાયો હતો. જેમાં સંસ્થાના ઓર્થોપેડિક મેડિકલ વિભાગમાં આવતા નિષ્ણાત તબીબોએ દર્દીઓને તપાસી દવાઓ, એક્સ-રે તથા ફિલ્યોથેરાપી અંગે માર્ગદર્શન આપેલ હતું. જેમાં તપાસજી બાદ ફિલ્યોથેરાપીની ટ્રીટમેન્ટ ધરાવતા દર્દીઓને આગામી એક માસ સુધી રાહતદરે સારવાર આપવાનું નક્કી થયેલ હતું.

★ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલ આધાર કાર્ડ બનાવવાની ગુંબેશ માટે સભ્યોના લાભાર્થી પાલડી ભવન ખાતે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીઓનો સહયોગ મળેલ હતો. સમાજની ૬૦૦ વ્યક્તિ સહિત કુલે ૧૫૦૦ જેટલી વ્યક્તિઓએ ભાગ લીધેલ હતો. આ બાબતે સંસ્થાના ખજાનચી શ્રી કે.ડી. શાહ દ્વારા 'યુનિક આઇન્ટાફિકેશન ઓથોરીટી ઓફ ઇન્ડિયા (આધાર)'ના અધિકારીઓનો સંપર્ક સાધી વ્યવસ્થા ગોઠવાયેલ હતી.

★ શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદની વયસ્ક સમિતિ દ્વારા દુબઈના એક વિદેશ પ્રવાસનું આયોજન કરવામાં આવેલ હતું. તા. ૧૫-૧૦-૨૦૧૧ના રોજ દુબઈ પહોંચી વિશ્વની અજ્ઞાયબ એવી નગરીની રોનક જોઈને વયસ્કોના મુખેથી ઉદ્ગાર નીકળ્યા કે ખરેખર સર્વ્ય તો અહીં જ છે. કુઝ, મોલ, સોનાથી કારીગરી થયેલ મસ્કિટ, દરિયા ડિનારો વગેરેની નજીકતતા - ભવ્યતામાં મહાલવાની વયસ્કોને ખૂબ જ મજા પડી ગઈ. આ ટૂરનું સફળતાપૂર્વક આયોજન વયસ્ક સમિતિના શ્રી રજની પારેખ તથા શ્રીમતી ફાલ્ગુનીબેન હીરેન શાહે સંભાળેલ હતું.

★ સંસ્થા દ્વારા સમાજના પરિવારના સભ્યો માટે 'અક્સમાત વીમા યોજના'નું મંગલાચરણ કરવામાં આવેલ હતું. તેમજ તા. ૧૮-૧૨-૨૦૧૧ના રોજ ધોરણ-૮થી ધોરણ-૧૨ના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અર્થે એસ્ટિલ્યુડ ટેસ્ટ તથા રાથી ૮ વર્ષના બાળકોના યોગ્ય જતન અંગે માતા-પિતા માટે 'પેરેન્ટલ કેર' વર્કશોપનું આયોજન કરવામાં આવેલ.

★ સંસ્થા દ્વારા અવારનવાર અલગ અલગ મેડિકલ કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. જેમાં આંખ, કાન-નાક-ગળા વગેરેના દર્દો માટેની સારવારની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવે છે. જેનો લાભ અમદાવાદના રહીશોને મળેલ હતો.

★ એક અનોખા કાર્યક્રમ દ્વારા સમાજના વર્ષ ૨૦૧૧ દરમ્યાન દેવગત પામેલ સ્વજનો માટે ભક્તિ સંગીત દ્વારા તા. ૮-૦૧-૨૦૧૨ના રોજ સ્મરણાંજલી કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેમાં દાતાઓ તરફથી રૂ. ૩૩,૦૦૦/-નું યોગદાન મળેલ હતું.

★ સ્વતંત્ર ભારતના ૬૪મા પ્રજાસત્તાક દિન તા. ૨૬-૧-૨૦૧૨ના રોજ હંમેશની માફક સંસ્થાના પાલડી ભવનના પટાંગણમાં ધ્વજવંદનનો કાર્યક્રમ સંસ્થાના ઉપપ્રમુખ અને ટ્રસ્ટી શ્રી કાંતિભાઈ વેલજ સાવલાના વરદ્દ હસ્તે કરવામાં આવ્યો હતો.

★ શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદને ૫૦ વર્ષ પૂરા થતાં વર્ષ ૨૦૧૨-૧૩ દરમ્યાન સુવર્ણ જ્યંતી વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ. જેની શરૂઆત તા. ૧૪-૪-૨૦૧૨ના રોજ કરવામાં આવેલ. આ પ્રસંગે દેશભરમાંથી પદ્ધારેલ મહેમાનોનું ભાવભીનું સ્વાગત કરવામાં આવેલ હતું. આ પ્રસંગે કચ્છની સંસ્કૃતિને ઉજાગર કરતાં સંસ્થા દ્વારા ચલાવાતા શ્રી કચ્છી વિશ્રામગૃહ - શાહીબાગ ખાતે નિર્માણ પામેલ 'કચ્છ સંસ્કૃતિ મ્યુઝિયમ'નું ઉદ્ઘાટન મુખ્ય દાતા શ્રી સુંદરજીભાઈ એમ. શાહના વરદ્દ હસ્તે કરવામાં આવેલ. સંથા સમયે અમદાવાદના જયશંકર સુંદરી હોલ ખાતે કચ્છના પ્રખ્યાત લોકગીત 'પ્રજવાણીના ઢોલ'ની ભાવસભર સુંદર રજૂઆત શ્રીમતી ફાલ્ગુનીબેન હીરેન શાહે તેમના સહકાર્યકરો દ્વારા ૨૪ કરી હતી.

★ સમાજના મુખ્યપત્ર 'મંગલ મંદિર'નો ઓગસ્ટ-૨૦૧૧નો ૪૦૦મો અંક કે જેમાં 'કચ્છ : ગઈકાલ, આજ અને આવતીકાલ'ની માહિતી બદલ પ્રકાશિત થયેલ હતો. જ્યારે ઓક્ટોબર-નવેમ્બર ૨૦૧૧નો અંક 'સંભારણા વિશેખાંક' તરીકે પ્રકાશિત કરવામાં આવેલ હતો. જેમાં સન ૧૯૭૫થી સન ૨૦૦૪ સુધીના 'મંગલ મંદિર'માં પ્રકાશિત થયેલા ઉત્તમ કષ્ટના સુંદર લેખો પસંદ કરી પ્રકાશિત કરવામાં આવ્યા હતા. જેણે વાચકવર્ગમાં ખૂબ ચાહના મેળવેલ.

★ ગુરુવાર, તા. ૨૧-૬-૨૦૧૨નો દિવસ એટલે અખાઢી બીજ - કચ્છી નવું વર્ષ. જેની ઉમગલેર ઉજવણી સુવર્ણ જ્યંતી વર્ષ ઉજવણી નિમિત્તે કરવામાં આવેલ. તે દિવસે સમાજ તરફથી સમાજના પરિવારજનોની માહિતી રજૂ કરતું વસ્તિપત્રક-૨૦૧૨નું વિમોચન, સૌજન્યદાતા નવનીત પરિવારના શ્રીમતી મધુરીબેન ગાલા, શ્રીમતી વિમળાબેન ગાલા, શ્રીમતી સંગીતાબેન ગાલા અને શ્રીમતી કવિતાબેન ગાલાના વરદ્દ હસ્તે કરવામાં આવેલ હતી. ત્યારબાદ કચ્છના જાણીતા અને વિશિષ્ટ કલાકાર શ્રી લાલ રંબિયા તથા તેમના સાથીદારોએ 'કચ્છી ડાયરો'ની જમાવટ કરી હતી. તેનું સંચાલન શ્રી ગુલાબ દેઢિયાએ કર્યું હતું.

★ શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ દ્વારા સુશ્વ વાંચનપ્રિય વાચકો માટે નિર્માણધીન લાઈબ્રેરીમાંથી સમાજના પરિવારજનોને તેમના પ્રિય લેખકોના તથા પ્રિય પુસ્તકો મેળવવાનું જાણવવામાં આવેલ. તે અંગે લાઈબ્રેરી સમિતિ દ્વારા ઘેર બેઠા વાંચવાલાયક મનગમતા પુસ્તકો મેળવોની યોજના ચાલુ કરવામાં આવી હતી.

"ROLEX" Brand



**Rushabh**  
STEEL CENTRE

MFGR. & DEALERS IN : Rolex SQUARE DABBA & TIFFIN

G-77, Sarvoday Nagar,  
Shri Mahendrakumar T. Shah Marg,  
(1st Panjrapole Lane), Mumbai-400 004.  
Tel. : 2242 2072, 3393 7310 • Fax : (022) 3008 0072

★ તા. ૮-૬-૨૦૧૨ના રોજ 'મંગલ મંદિર'ના તંત્રી તથા અદના કાર્યકર શ્રી સૂરજલાલ મહેતાનું જૈફ વયે અવસાન થયેલ. તેઓએ દેહદાન, નેત્રદાન કરેલ. તેમના અવસાનથી 'મંગલ મંદિર'ને ન પૂરાય તેવી ખોટ પડેલ હતી.

★ શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદની રૂપમાં વાર્ષિક સામાન્ય સત્ત્વા તા. ૨૨-૭-૨૦૧૨ના રોજ સવારના ૧૦ વાગે શ્રી કચ્છી જૈન ભવન - પાલકી ખાતે મળેલ હતી. સૌપ્રથમ સંસ્થાનાં ગ્રમુખશ્રીએ પદ્ધારેલ સૌ સત્યોને આવકાર આપેલ હતો તથા ત્યારબાદ સભાની કાર્યવાહી આગળ ચલાવવામાં આવી હતી.

માનદું મંત્રીશ્રીએ ગત વર્ષ દરમ્યાન સમાજ દ્વારા થયેલ કાર્યવાહીનો વિસ્તૃત અહેવાલ આપ્યો હતો. આ સભામાં દાતા ટ્રસ્ટીઓ તરીકે (૧) ડૉ. ચંદ્રકાંત કાનજી દેઢિયા, (૨) શ્રી મહિલાલ કુંવરજી ગોસર, (૩) શ્રી નવીનચંદ્ર વેરશી હરિયા તથા માનદું શ્રુપના ટ્રસ્ટીઓ તરીકે (૧) શ્રી મનુભાઈ ગોવિંદલાલ શાહ, (૨) શ્રી વીરેન્દ્ર રાધવજી લોડયા અને સ્વજન શ્રુપના ટ્રસ્ટી તરીકે શ્રી ચંદ્રકાંત દામજી શાહ (કે.ડી. શાહ)ની વરણી બિનહરીફ કરવામાં આવી હતી.

બપોરના ૧ વાગે મળેલ સમાજના નવા ટ્રસ્ટ મંડળની મિટિંગમાં વર્ષ ૨૦૧૨-૧૩ માટે શ્રી અશ્વિન હીરજી સાવલા તથા શ્રી કલ્યાણજી રવજી રંભિયાની કો-ઓપ્ટ ટ્રસ્ટી તરીકે વરણી કરવામાં આવી હતી.

શ્રી અશોકકુમાર સાકરચંદ મહેતાની મેનેજિંગ ટ્રસ્ટી તથા ગ્રમુખ તરીકે વર્ષ ૨૦૧૨-૧૩ માટે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. બપોરના ૨.૦૦ વાગે મળેલ નવી કારોબારી સમિતિની પ્રથમ મિટિંગમાં વર્ષ ૨૦૧૨-૧૩ માટે પ્રથમ ઉપપ્રમુખ તરીકે શ્રી કાંતિલાલ વેલજી સાવલાની તથા દ્વિતીય ઉપપ્રમુખ તરીકે શ્રી મનુભાઈ ગોવિંદલાલ શાહની વરણી કરવામાં આવી હતી. શ્રી પ્રતાપ નારાણજી દંડ માનદું મંત્રી તરીકે, શ્રી દિનેશ રતિલાલ મહેતા સહમંત્રી તરીકે, ખજનચી તરીકે શ્રી ચંદ્રકાંત દામજી શાહ (કે.ડી. શાહ) તથા સહ ખજનચી તરીકે શ્રી રમણિકલાલ કુંવરજી ગોસરની નિમણૂક કરવામાં આવી હતી. શ્રી દિનેશચંદ્ર જગજીવન શાહ અને શ્રી નિરંજન પૂનમચંદ મેશેરીની કો-ઓપ્ટ સભ્યો તરીકે તથા શ્રી સંદીપ અશોકકુમાર મહેતા અને શ્રીમતી સુલુબેન જલદીપ શાહની આમંત્રિત સભ્યો તરીકે વરણી કરવામાં આવી હતી તેમજ ૪૨ જેટલી સમિતિઓની રચના કરવામાં આવી હતી.

★ તા. ૨૨-૭-૨૦૧૨ની સુવર્ણ જ્યંતી વર્ષની સંધ્યા સમાજના પરિવારજનો માટે યાદગાર બની ગઈ. આ દિવસે મુંબઈના રંગમંચના કચ્છી કલાકારો દ્વારા કચ્છી નાટક 'જિંઘગી જલસો ભને વઈ'ની અમદાવાદના ટાગોર હોલમાં થયેલ રજૂઆતથી જીવનમાં બનતા બનાવો દ્વારા પ્રેક્ષકોને વિચારવંત કરી સંધ્યાને આનંદમય બનાવી દીધી.

★ સુવર્ણ જ્યંતી વર્ષ નિમિત્તે મુખ્ય કાર્યક્રમ-૬ દ્વારા તા. ૩૦-૮-૨૦૧૨ના રોજ સમાજનો વાર્ષિક સ્નેહ મિલન સમારંભ તથા સામૂહિક ક્ષમાપના કાર્યક્રમ અને સ્વામિવાત્સલ્ય જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજ દ્વારા કરવામાં આવેલ કામગીરી વિશેની જાણકારી, વિશિષ્ટ પ્રતિભાઓનું સંન્માન, વર્ષ દરમ્યાન 'મંગલ મંદિર'માં આવેલ શ્રેષ્ઠ લેખ / આંજો કાગરના લેખકોનું પુરસ્કાર દ્વારા બહુમાન કરવામાં આવેલ હતું. તેમજ બાળવર્ગથી ધોરણ-જના ઉતીર્ણ થયેલ બાળ મિત્રોને પણ પ્રોત્સાહિત પુરસ્કાર આપવામાં આવેલ.

★ સુવર્ણ જ્યંતી વર્ષના સાતમા કાર્યક્રમ અંતર્ગત તા. ૨૦-૧૦-૨૦૧૨ના રોજ નવરાત્રિના છંદ્ર નોરતે સમક પાર્ટી ખોટમાં સમાજના સભ્યો માટે રાસ ગરબાનો રંગારંગ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમજ સુવર્ણ જ્યંતી વર્ષનો આઈમો મુખ્ય કાર્યક્રમ તા. ૧૪-૧૧-૨૦૧૨ના રોજ નૂતન વર્ષ મિલન સમારંભ સમાજના સાંસ્કૃતિક હોલમાં શ્રી લવજી સ્વરૂપચંદ મહેતાના સૌજન્ય હેઠળ યોજવામાં આવ્યો હતો.

(ક્રમાંક)

## ગીતાફાન

કમોન્ડિયાણિ સંયમ્ય ય આસ્તે મનસા સ્મરન્ન /  
ઇન્દ્રિયાથાન્વિમૂળત્મા મિથ્યાચાર: ચ ઉચ્ચતે ॥૩-૬॥

આટલું જાણ્યા પણ પણ મૂર્ખ લોકો પોતાની ઇન્દ્રિયોને હઠથી રોકી મનથી વિષયોનું સ્મરણ કરતા રહે છે. તે મિથ્યાચારી - આંદબર કરનારા છે. પાંખંડી છે, નહીં કે જ્ઞાની! એ સિદ્ધ છે કે શ્રીકૃષ્ણના સમયમાં પણ આવી જ રૂઢિઓ હતી. લોકો જે કરવા યોગ્ય હોય તે છોડી ઇન્દ્રિયોને હઠથી રોકીને બેસી જતા અને કહેતા કે હું જ્ઞાની છું, પૂર્ણ છું પણ શ્રીકૃષ્ણ કહે છે કે ધૂર્ત છે. જ્ઞાનમાર્ગ સારો લાગે કે નિષ્કામ કર્મયોગ, બંને કામમાં કર્મ તો કરવું જ પડશે.

॥ ક્ષમા વીરસ્ય ભૂપાણામ् ॥

## રાયચંદ કાનજી ધૂલ્લા પરિવાર - સુથરી

"ધૂલ્લા વિલા", બંગલા નં.-૨૦, ડ્રીમલેન્ડ સોસાયટી, જયશાલી નગર, એન.આર. હાઈલેન્ડ પાર્ક, મુલંડ (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૮૨.

ફોન : ૨૫૮૨૪૪૪૪૪, ૨૫૬૨૪૪૪૪૪, ૨૫૮૧૪૪૪૪, ૬૬૩૪૩૫૭૭



## અમારા જમાનામાં તો....

• ડૉ. નલિની ગણાત્રા •

મારી પાસે મિલકતના નામે મીંડું છે. એ પણ પાછું મોહું!! કિંતુ જાહેર જનતા અને ખાનગી જનતા (સગાંવહલાં) ને ખબર પડી ન જાય કે હું ઠન ઠન ગોપાલ છું, એટલા માટે તક મળતાં જ હું, “અમારા જમાનામાં તો...” એવી રીતે વાત શરૂ કરીને મારી પાસે મિલકતમાં એક આખો જમાનો પડ્યો છે, એવું પ્રદર્શિત કરતી રહું છું. જો કે અમે જે જાહોજલાલીથી જીવ્યા એ અમારો જમાનો કોઈ માલમિલકતથી કમ નહોતો જ.

અમારો ભૂતપૂર્વ જમાનો એટલે અમારી બાલ્યાવસ્થા. હું, બાવો અને મંગળદાસની જેમ બચપનમાં મુખ્યત્વે ત્રણ જ પ્રવૃત્તિ હોય... રમવું, જમવું અને ભણવું. એટલે ‘મુન્નાભાઈની’ મજજાની લાઈફ! જોકે દરેકનું બચપન મારું ભવ્યતાને પાત્ર જ હોય. કિંતુ ભણવાની બાબતે “....થાય સરખામણી તો અમે ચાદ્યાતાં છીએ!!”

બાય ધ વે, આજે હું રમવા જમવાનું છોડીને ડાહી થઈને માત્ર ભણવાની જ વાત કરીશ. આમેય ભણવું અધરું છે, ભણવાની વાતો કરવી તો સહેલી છે. મારા જેવા અધરી ઉમરવાળાને સહેલા કામ જ પરવડે!

વાતની શરૂઆત હું મારા શિક્ષકોથી જ કરીશ. ગોળ મીઠો છે કે તીખો એ જાણવા માટે ગોળની કટકી જ ચાખવાની હોય, ગોળનો આખો રવો ગળચવાનો ન હોય. તેથી હું બધા શિક્ષકોની વાત ન કરતાં શિક્ષકગણનાં પ્રતિનિધિ રૂપે બે શિક્ષકની જ વાત કરીશ. અમારા પહેલા શિક્ષક તે એસ.પી. સર. જે અમને ગુજરાતી વિષય ભણવતાં. એમની ખૂબી એ હતી કે તેઓ કોઈ પણ પાઠ ભણવતા પહેલાં એ પાઠનો સાર અમને ‘નાનીમા’ ની વાર્તાની જેમ કહેતાં. અને એય રિમિત વદને અને મજેદાર શૈલીથી! અમે વિદ્યાર્થીઓ જ હતાં છતાં વગર ધમકાવ્યે

અને ચૂપચાપ એમનું લેક્ચર સાંભળતાં. ટૂંકમાં તેઓ દરેક પાઠને જાણે સુંવાળો, સુગંધિત અને સ્વાદિષ્ટ બનાવીને સમજાવતાં, જે અમારા મગજમાં શીરાની જેમ ઉતરી જતો. એમાં દુઃખ એક જ વાતનું થતું કે કોઈ વિદ્યાર્થીને ગુજરાતીમાં નાપાસ થવાની મહત્વાકાંક્ષા હોય તો પણ તે નાપાસ ન થઈ શકતો. કારણ?...બાલિદારી ગુરુદેવકી.

બીજાં શિક્ષક હતાં સંસ્કૃતના ટીચર ઉપાબેન પુરોહિત. ‘કારણ વગર કાર્ય થતું નથી’ એવો સામાન્ય નિયમ છે. પરંતુ મને કારણ વગર સંસ્કૃત વિષય નહોતો ગમતો. (આ હિસાબે તમે મને અસામાન્ય ગણી શકો!) એક સમયની વાત છે. સત્રાંત પરીક્ષા અંતર્ગત એ દિવસે સંસ્કૃતનું પેપર હતું. એમાં મને આવડતા એકાદ-બે પ્રશ્નનાં જવાબ તો મેં જાતે લખી નાખ્યા. પણ પછી શું? ચાલુ પરીક્ષાએ નવરાં બેસી રહીએ તો સારું ન લાગે એટલે મેં વિર્ચાર્યુ કે નવરી પડી ગઈ છું તો લાવ, પાડોશીને પુણ્ય કમાવવામાં મદદરૂપ બનું! અને આવી પવિત્ર ભાવનાથી હું બીજા પ્રશ્નના જવાબ લખવા મારી બાજુમાં બેઠેલી બહેનપણીના પેપરમાંથી ચોરી કરવાનો પ્રામાણિક પ્રયત્ન કરવા લાગી. (ન આવડતું હોય અને ચોરી કરીએ એ પ્રામાણિક ચોરી કહેવાય!) પરંતુ એ મારી સગી સખી હોવા છતાં પોતાની ઉત્તરવહી આડો હાથ રાખીને મને નહીં જોવા દેવાનો પ્રયત્ન કરવા લાગી. છતાં “નહીં માફ નીચું નિશાન” ના ધોરણે હું થોડી ઊંચી થઈ થઈને એની ઉત્તરવહીમાં જોવાની કોશિશ જરી રાખી રહી હતી. મારી આવી ઊંટ સરીખી આકર્ષક હરકતથી આકર્ષિતીને ટીચર મારી પાસે આવ્યા. હવે મારે ગભરાયા વગર છૂટકો નહોતો. પણ આ શું? ઉધા ટીચર તો મારા ખભે હાથ મૂકીને મને અંતિમથી, પ્રેમથી પૂછવા લાગ્યા કે, ‘નલિની તને શું તકલીફ છે?’

કેમ પરેશાન જણાય છે?’ એમની મૂહવાણીથી મારી પ્રામાણિકતા ફરી સપાઠી પર આવી ગઈ અને મેં હકીકત બયાન કરતાં કહી દીધું કે, “ટીચર, મને સંસ્કૃત વિષય ગમતો નથી, આવડતો પણ નથી. અને મારી આ ફેન્ડ મને એની ઉત્તરવહીમાં જોઈને લખવા દેતી નથી!” હવે બીજા ટીચર હોય તો આવો કાલો વેલો ડાયલોગ સાંભળીને ટીચી જ નાખે કારણ કે ગુજરાતી ‘ટીચ’ ધાતુ ઉપરથી જ અંગ્રેજી ટીચર શબ્દ બન્યો છે. પરંતુ આ તો સંસ્કૃતના ટીચર હતાં. તેથી અંગ્રેજ સંસ્કારી હતાં. એમણે તો સંધિ છૂટી પાડીને મને પ્રશ્ન અને એનો અર્થ સમજતાં શીખવ્યું અને પછી કહું કે, “જો આમાં ક્યાં કંઈ અધરું છે? ચાલ હવે જવાબ લખી નાખ.” એમનાં આવા ભાવભીના વર્તનથી ચમત્કાર એવો થયો કે આગામી સત્રાંત પરીક્ષામાં કલાસમાં સંસ્કૃતમાં મારા હાઈએસ્ટ માર્ક આવ્યા. એટલું જ નહીં, એ ટીચરે મારું પેપર વર્ગમાં બધા વિદ્યાર્થીઓને બતાવીને કીધું કે, જુઓ પેપર આ રીતે લખાય.

બાય ધ વે, એ વખતે “આ પ્રસંગે તમને કેવી લાગણી થાય છે?!” એવું પૂછવાનો ઠોઠ રિવાજ કે રમૂજ રિવાજ નહોતો. કારણ કે એ કણમાં તો સ્કૂલમાં ભણતાં છોકરડાંઓને પણ ખ્યાલ હતો જ કે, ખુશીનાં પ્રસંગે ખુશીની જ લાગણી થાય. યસ્સ, એ દિવસે એ ટીચરની પ્રશંસાસ્થી મને રત્નજિત એવોર્ડ મળ્યા તુલ્ય લાગણી જ થઈ તી. આમ અમારા શિક્ષકો આવા ઉમદા હતા. તેથી જ કોઈ સ્મૃતિચિહ્ન વગર આજ સુધી યાદ રહ્યા છે. એટલું જ નહીં એ શિક્ષકોના સુસંસ્કાર ચોરીછૂપીથી મારામાં ભરાઈ પડ્યાતા. જે મારા અધ્યાયન કાર્યમાં સ્વયંભૂ પ્રગટ થતા રહ્યા છે. યસ્સ, હું મારા વિદ્યાર્થીઓને પ્રેમથી અભયદાન આપતા હંમેશા કહેતી હોઉં છું કે તમે મને ગમ્યે ત્યારે ગમ્યે તે

પ્રશ્ન પૂછી શકો છો. હું તમને ક્યારેય વઢીશ નહીં અને એનો જવાબ મને નહીં આવડતો હોય તો પણ એકવાર તો તમને 'સમજાવી' દઈશ.

આમ અમારા સમયમાં શિક્ષકો એક સમર્પિત ભાવથી ભણાવવાની પદ્ધતિ તથા સૌજન્યતાનો અમારા જીવન તથા કારકિર્દિની સફળતામાં મોટો ફાળો રહ્યો. આજે આપણે વાંચીએ છીએ અને સાંભળીએ છીએ કે શિક્ષણનું સ્તર ખાડે ગયું છે. એના કારણોમાં મને ચાર પ્રકારનાં ભાર જવાબદાર લાગે છે. એમાં પહેલો ભાર ઉત્તાનું. અત્યારે 'ભાર વગરનું ભણતર બનાવવાની સુંદર વાતો અવારનવાર થતી રહે છે. એજ બતાવે છે કે આજનું ભણતર ભારવાળું છે. હવે જ્યારે તમે જ્ઞાણો જ છો કે ભણતર ભારવાળું થઈ ગયું છે તો હળવી પ્રાચીન પદ્ધતિ પાછી લાવી ભણતરને ભાર વગરનું હળવું બનાવી દો ને! વાર કેટલી? મને હજુ યાદ છે કે પ્રાથમિક સ્કૂલમાં અમારું સિલેબસ સરળ હતું. પુસ્તકો પણ ડાયેટિંગ કરતાં હોય એટલાં પાતળાં હતાં. જે અમે દફતર ઉઙ્ઝ કપડાની હળવી થેલીમાં ભરીને એ થેલીને ઉછાળતાં ઉછાળતાં દોડીને સ્કૂલે પહોંચી જતાં. ત્યારે ઓછું સિલેબસ હતું પણ 'અલ્યાહાર' જેવું પર્યાત હતું. જે આવશ્યક જ્ઞાનતત્ત્વોથી સભર હતું. એ ભણીને મારા જેવા કંઈ કેટલાયે અમલદાર થઈ ગયા. માપનું સિલેબસ હોવાથી વારંવાર રિવિઝન થઈ શકતું. પ્રેક્ટિસ મેક્સ 'મિલ્ખા' વિનર! રિપીટેશનને કારણે ગુજરાતીનાં એ ગીતો-કાવ્યો અને ગણિતનાં પલાખાં આજે પણ મોઢે છે. અરે, ત્રીજા ચોથા ધોરણ સુધી તો ગણિત, ગુજરાતી, વિજ્ઞાન... એમ બધા વિષયનું હોમવર્ક એક જ સ્લેટમાં સમાઈ જતું. હેર આવીને ઘડીકમાં હોમવર્ક પતાવીને મોડે સુધી રમ રમારમ રમવાનું જ. એય દોડમ દોડવાળી આઉટડોર રમતો જ રમતા. તેથી લાઈફબોય વગર જ બાળકોની તંદુરસ્તી અને મન-દુરસ્તીની રક્ષા થઈ જતી. જ્યારે અત્યારે તો કલાસની નોટ, ટ્યુશનના હોમવર્કની નોટ, 'વગેરે' ની નોટ...! અને હોમવર્ક એટલું આપે કે બિચ્ચારા બાળકોને હેર જવાનું જ મન ન થાય. હેર જાય તો ઘરકામ કરવું પડે ને? વિદ્યાર્થીને હોમવર્કનો ભાર અને વાલી (મા-બાપ) ને 'હોમ' બનાવવાનો ભાર અત્યારે 'ઈન' છે. અત્યારે ડિલો-દોઢ ડિલો તો 'ખાલી' દફતરનું વજન હોય. એમાં પુસ્તકો અને નોટોથી ખીચોખીય ભરેલું દફતર એટલું વજનદાર બની જાય કે વિદ્યાર્થી જ્ઞાણો વિદ્યાની 'અર્થી' ઉપાડીને જતો હોય એવું લાગે! 'અર્થી'નું વજન તો જે ઉપાડે એ જ જાણો!!

ત્રીજો ભાર છે ટ્યુશનનો. જે શિક્ષક અને વિદ્યાર્થી બનેને નિયોવી નાખે છે. આપણે ઘરમાં નવા કપડાં, વાસણ કે ફર્નિચર વસાવીએ અને જૂના પણ રાખી મૂકીએ તો ઘરમાં કેઓસ થઈ જાય, અભ્યવસ્થા સર્જીય. એ બધું ગોઠવ ગોઠવ કરવામાં જ સમય અને શક્તિ ખર્ચાઈ જાય. એવી જ દશા આજે શિક્ષણક્ષેત્રમાં છે. 'હાજિર હો...' નો હુકમ પાળવા મતલબ હાજરી પુરાવવા સ્કૂલે તો જવું જ પડે. અને 'ભણવા માટે' ટ્યુશનમાં જવું પડે! હવે 'પડે' તો વાગે તો ખરું જ ને? ટ્યુશનમાં ભણાવીને થાડી ગયેલા શિક્ષકમાં પોતાની જાતને પ્રેમ કરવાની પહોંચ નથી રહેતી ત્યાં વિદ્યાર્થી માટે એ ક્યા મોલમાંથી પ્રેમ લાવે? આમાં શિક્ષકોનો પણ વાંક નથી. શિક્ષકોના પગાર પ્રમાણમાં ઓછા છે અને ક્યાંક ફૂદડી કરીને લખેલું કે માસ્તર પણ એક માણસ છે. એટલે એને પણ મોંઘવારી નડે અને મોજશોખ અડે જ. તેથી એ ટંકાણ જેવા ટ્યુશન તરફ ફંટાયો છે. આજનો માસ્તર મા-સ્તર મટી બાપ-સ્તરનો બની ગયો છે. મતલબ મા જેવો પ્રેમાળ મટી બાપની જેમ પૈસા કમાવામાં પડી ગયો છે. પરંતુ જેમ કોપરેટિંગ કંપનીના કર્મચારીઓને "આકર્ષક પેકેજ" માં પગાર મળે છે તો તેઓ કંપનીને જ સમર્પિત રહી ટફ ટાર્ગેટ પણ પૂરા કરે છે અને સાઈડ બિઝનેસ કરવાનો વિચાર પણ નથી કરતા.

હું તો કહું છું કે સૌથી વધારે પગાર શિક્ષકનો હોવો જોઈએ. એના બેંકના જાતામાં પણ ન સમાઈ શકે એટલો પગાર આપો, પછી જુઓ કે ધરાયેલો માણસ શું નથી કરતો? એ ટ્યુશનની ટંકાણનો ત્યાગ કરી સચિતાનાં સ્વરૂપ બની સ્કૂલમાં જ પ્રેમથી, શાંતિથી, આનંદથી અને નિશ્ચિતતાથી ભણાવશે. પ્રેમ વગરનું કામ બોજ લાગે. પ્રેમ ભળે તો જ મોજ પડે. એટલે વિદ્યાર્થીઓ પણ મોજથી ભણશે.

એક સુંદર હકીકત એ છે કે ભણવું ફક્ત વિદ્યાર્થીઓને જ નથી ગમતું હોતું. જેલવા કૂદવાની કાચી ઉમરમાં ભણવું એ કાચા લોટ જેવું થૂ થૂ થૂ લાગે છે. પરંતુ ભણાવવામાં ધી-ગોળ રૂપી પ્રેમરસ અને રૂચિરસ ભેળવવામાં આવે તો ભણવું લાડવા જેવું સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બની જાય. તેથી મારું એક સૂચન છે કે સ્કૂલમાં શિક્ષકોની ભરતી કરતી વખતે માત્ર ડિશ્રી ન જોતાં તથા જન-વગ (ઓળખાણ) કે ધન-વગર (લાંચ) ને પ્રાધાન્ય ન આપતાં જેને વ્યસનની હંદે ભણાવવાનો શોખ અને ધગશ હોય એવા આદર્શ વ્યક્તિની જ શિક્ષક તરીકે નિમણૂક થવી જોઈએ.

દસ-ભાર વર્ષ પહેલાંની વાત છે. મારાં બાળકો જે સ્કૂલમાં ભણતાં'તાં એ સ્કૂલનાં આચાર્યા, શિક્ષકો અંગે વિદ્યાર્થીઓનો નિયમિત પ્રતિભાવો મેળવતાં. અને વિદ્યાર્થીઓ કોઈ શિક્ષકના શિક્ષણ અને સ્વભાવ અંગે અસંતોષ વ્યક્ત કરે તો એ શિક્ષક ને પ્રેમથી વિદાય આપી નવા શિક્ષકને 'સંગીત ખુરશી' ની જેમ ચાન્સ આપતાં. આવું ગણ ચાર વાર કરવું પડે તો પણ કરતાં. મારાં બને બાળકો દસમાં ધોરણમાં ટ્યુશન વગર ત્રાણું અને ચોરાણું ટકા લઈ આવ્યા'તા. શિક્ષકો જ સ્કૂલની શોભા છે.

પ્રાથમિક શિક્ષણ અને શિક્ષક એ વિદ્યાર્થિના જીવને ધોરી માર્ગ પર દોરી જતી કેડી છે. એ કેડી ઉમદા, વિશ્વસનીય અને પવિત્ર હોય એ જરૂરી જ નહીં, અનિવાર્ય ગણાય. સ્કૂલ લાઈફમાં શિક્ષક (અનુસંધાન : જુઓ પાના નં.-૭૪ ઉપર)

## શ્રીમતીજી સર્વિસે લાગ્યાં

● પત્રવી જિતેન્દ્ર મિશ્રી ●

કહું છું, સાંભળો છો?

આટલા વર્ષોથી એ જ તો કરતો આવ્યો છું.

સાંદું, પણ એમાં કહી બતાવવાની કંઈ જરૂર છે?

ના. પણ આ તો શું કે તેં પૂછ્યું એટલે મેં કહ્યું.

બહુ સાંદું. જાણો મને પૂછી પૂછીને જ કરતા હશો, ખરું ને?

તારે મારી સાથે જઘડો જ કરવો છે કે પછી ખરેખર કંઈ કહેવાનું પણ છે?

જોયું? તમે વાતમાં ને વાતમાં મારે શું કહેવાનું છે એય ભૂલાવી દીધું. તમે તો ભાઈસાબ ખરા છો.

કંઈ વાંધો નહીં. મને વાત સાંભળવાની કોઈ ઉત્સાહ નથી. તું તારે શાંતિથી, જ્યારે યાદ આવે ત્યારે વાત કરજે.

હં... શું કહેતી હતી હું? ...અરે હા, યાદ આવી ગયું. સાંભળો....

ફરમાવો...

વાત જાણે એવી છે કે હું કાલથી સર્વિસે જવાની છું.

શું? શું કહ્યું તેં? તું સર્વિસે જવાની? અને તે પણ કાલથી જ? તને વળી કોણે સર્વિસે રાખી?

આમ તો પહેલી તારીખથી જ જાત, પણ એક દુકાનની સેલ્સ ગર્લ મેરેજ કરીને રજા પર ઊતરી ગઈ છે. એટલે એ ભાઈ કોઈ બીજાને રાખી લે એ પહેલાં મને થયું કે એ જોબ માટે હું જ દ્રાય કરું.

હા, પણ તને કઈ રીતે ખબર પડી કે ત્યાં જગ્યા ખાલી છે? તેં જોબ માટેની જાહેર ખબર વાંચી કે એ માટે તેં એલિક્શન આપી હતી?

ના રે ના. નથી તો મેં જાહેર ખબર

વાંચી, કે નથી તો મેં એલિક્શન આપી. એ તો મોટાભાઈને ઓળખે છે એટલે આ જોબ મળી.

અચ્છા, પણ એ તને નહીં ઓળખતા હોય. વાંધો નહીં, થોડા સમયમાં જ ઓળખી જશે.

આહું આહું બોલ્યા વગર કહોને, કે હું સર્વિસે જાઉ કે નહીં?

હું તને ના કહું તો તું નહીં જાય?

પણ તમે 'ના' કહો જ શું કામ? તમને ટસરડા કરતા જોઈને મને વિચાર આવ્યો કે તમારી સાથે સાથે હું પણ કમાઉં તો તમને આર્થિક ટેકો થશે.

મને એવા ટેકાની જરૂર છે એવું તને કોણે કહ્યું?

કહેવાનું વળી કોણ હતું? એ તો સમજવાની વાત છે. રોજ આ કાગળિયાં ચીતર ચીતર કરો છો. ચોવીસ કલાક લખ લખ કરો છો ત્યારે મળી મળીને તમને શું મળે છે? તો મને વળી દ્યા આવી કે લાવ, તમને કમાવામાં જરા મદદ કરું.

તારી એ ભલી લાગણી બદલ હું તારો અંત:કરણપૂર્વકનો આભારી છું.

આહું તે શું બોલતા હશો તમે? ફોરીનમાં તો બધા....

ખ્લીજ ખ્લીજ, તારી એ ફોરીનની વાતો પછી કોઈ વાર કરજે. હમણાં તો મારે આ બે અધૂરા લેખ પૂરા કરવાના છે.

લેખો લખવાના એમાં વળી શું ધાડ મારવાની છે?

એમ, તો પછી એકાદો લખી તો જો. અરે! હમણાં લખી નાખું. પણ

કોઈના પેટ પર પાટુ મારવું ઠીક નહીં. મારે લેખો વાંચવા માટે થઈને વાંચવા માટે થઈને લોકો તમારા લેખો વાંચવાના મૂકી દે, તે મારાથી જોયું નહીં જાય. તેથી લખતી નથી સમજાયા?

સમજ ગયો, દ્યાની દેવી ફ્લોરેન્સ નાઈટિંગેલ, હું બધું જ સમજ ગયો.

ગુડ બોય. તો હું કાલથી સર્વિસે જાઉને? તારી સર્વિસનો સમય શું હશે?

આમ તો દસથી સાતનો સમય છે. પણ એ તો બીજા બધા માટે. હું તો બારથી ચાર જાઉ તો પણ ચાલે. ઓળખાણનો એટલો તો લાભ મળવો જોઈએને?

હું નથી માનતો એવું. ઠીક છે. જોબ માટે તારે જવાનું કયાં છે?

સરદાર પટેલ સ્ટેડિયમ પાસે.

ઓહ! એટલું બધું દૂર છે? તારાથી જવાશે કે?

માણસ ધારે તો લંકા પણ જઈ શકે, તો સ્ટેડિયમની શી વાત છે!

ભલે, પણ હાલ તો તું સ્ટેડિયમ જવાનું જ ધારજે. લંકાનું તો નોકરી પાકી થાય પછી વિચારજે. બાય ધ વે, તું કરવાની છે એ ફર્મનું શું નામ છે? એ લોકોની પ્રોડક્ટ શું છે?

"પાંચાલી" – સાડીની દુકાન છે.

"પાંચાલી?" – સાડીની દુકાન? અરે, પાંચાલીને તો ખુદ પોતાને સાડી પહેરાવવા માટે શ્રીકૃષ્ણને આજીજી કરવી પડી હતી અને તું પાંચાલીમાં લોકોને સાડી પહેરાવશે?

નેપોલિયન લખી ગયો છે ને કે 'વોટ ઈજ વેર ઈન નેમ?' મતલબ કે 'નામમાં શું દાટનું છે?'

એ વાતને નેપોલિયન નહીં, શેક્સપિયર કહી ગયેલો.

જ્યારે નામનું જ મહત્વ નથી ત્યારે એ વાત કહેનારનું નામ નેપોલિયન હોય, શેક્સપિયર હોય કે કોઈ આલિયો મવાલિયો હોય શું ફરક પડે છે?

હા મારી મા, કંઈ ફરક નથી પડતો.

પણ એ તો કહે, તું ‘પાંચાલી’ સુધી જઈશ કઈ રહેતે?

બસમાં જઈશ. મોંસ થઈ જશે એ દિવસે રિક્ષામાં જઈશ.

તો તો તારે રોજ રિક્ષા જ કરવી પડશે.

તો કરીશ. એટલો પગાર ઓછો આવ્યો છે એમ માનજો.

એની વે, પગાર કેટલો આપવાના છે?

પહેલી તારીખે ગણી લેજોને જનાબ.

અને આમ અમારા શ્રીમતીજી સર્વિસે લાગ્યાં. સાંજે હું ઘરે આવ્યો તારે...

અરે! તું ઘરે આવી ગઈ છે? મને તો એમ કે તું ‘પાંચાલી’માં બેઠી બેઠી એટલે કે ઊભી ઊભી ખી ગ્રાહકોને સાડીઓ પહેરાવતી હોઈશ.

એ તો હું પહેરાવી આવી.

અરે વાહ! આજે કેટલી સાડીઓ વેચી મેડમે?

દસ.

બસ?

પહેલા દિવસે તે વળી કેટલી હોય? પછી જોજો ને મારો ઝપાટો.

ભલે ચાલ, જમવાનું પીરસ.

આજે તો હું થાકી ગઈ હું એટલે જમવાનું બનાવ્યું નથી. બહાર જમી આવીશું?

હે ભગવાન, પહેલા દિવસથી જ ઉપાધિ શરૂ? ઢીક છે, હું જરા ફેશ થઈને આવું.

મને તમે જરા ૨૩,૭૨૬/- રૂપિયા આપજો ને પ્લિઝ.

શાને માટે?

સો રૂપિયા રિક્ષાના અને બાકીના મેં સાત સાડીઓ ખરીદી એના.

તે ‘પાંચાલી’માંથી સાત સાડી

ખરીદી? હમણાં તો આપણા ફેમિલીમાં કે ફેન્ડ સર્કલમાં કોઈને ત્યાં કંઈ પ્રસંગ નથી આવતો ને તે સાડીઓ ખરીદી? બાય ધ વે, મને જરા એ તો કહે, તું ત્યાં સાડીઓ વેચવા ગઈ હતી કે ખરીદવા?

તમે સમજતા કેમ નથી? હમણાં ભલે કોઈને ત્યાં કોઈ પ્રસંગ નથી પણ ક્યારે ને ક્યારે તો પ્રસંગ આવશે કે નહીં? અને સારા પ્રસંગે પોતાને પહેરવા તેમજ સગાંઓમાં વહેંચવા સાડીઓ જોઈશે તો ખરી જ ને? એટલે મેં અગમચેતી વાપરીને આજે જ લઈ રાખી.

હે ભગવાન! મારી સાથે આ ક્યા જનમની તારી દુશ્મની? તેં તો મને વગર અખાએ મૂંડી નાખ્યો.

એમાં ભગવાનનો શું વાંક?

મારી માવરી, હું તને કહું છું કરી નાખ્યોને તેં મને આર્થિક ટેકો?

મને ખબર જ હતી કે તમે મારી સાથે કચકચ કરવાના જ છો. પણ તમે જ વિચારો, પહેલા જ દિવસે ‘ફક્ત ત્રણ સાડીઓ જ વેચાઈ’ એવું દુકાનદારને કહું તો કેવું લાગે? એટલે મેં પોતે સાત સાડીઓ ખરીદી લીધી. તમે મને પેસા આપો અને મહિનાના અંતે પગારમાંથી વાળી લેજો. તમારે તો ખુશ થવું જોઈએ કે ચાલો, છેવટે કામ કરતી થઈ! પણ તમારા સ્વભાવમાં જ એ નથી ને...! તમને જો નહીં જ ગમતું હોય તો હું કાલથી જ નોકરીએ નહીં જાઉ, સમજ્યા?

બરાબર સમજ ગયો. મારી ભૂલ જ હતી કે મેં તને સર્વિસે જવા દીધી અને તે પણ સાડીની દુકાનમાં. તને સર્વિસે રાખનારો તને મારા કરતાં વધારે ઓળખતો હતો એમ મને તો લાગે છે. હું જ બેવકૂફ છું કે તને આટલા સમયમાં પણ ઓળખી ના શક્યો.

તો એમાં વાંક કોનો?

### અમારા જમાનામાં તો...

(અનુસંધાન : પાના નં.-૭૨ ઉપરથી ચાલુ)

જ વિદ્યાર્થીનો આદર્શ હોય છે. વિદ્યાર્થીની શિક્ષક માટે આંધળી શ્રદ્ધા હોય છે. શિક્ષક એકવાર ભૂલથી બોલી જાય કે ત્રણ અને ત્રણ પાંચ...તો વિદ્યાર્થી એ પાંચની છછ ન કરે. તેથી જ શિક્ષકની પસંદગીમાં સાવધાની આવશ્યક છે.

મૂળ વાતને આગળ વધારીએ. ટ્યુશનિયા માસ્તરનો ભાર, ભારે અને અધરા સિલેબસવાળો ભાણતરનો ભાર, દફ્તરનો ભાર અને ત્રણની ટ્રેડિઝ ન પડે એવી શુભ ભાવનાથી ચોથો ભાખાનો ભાર લાદી દેવામાં આવ્યો છે. બાળક પોતાની મા પાસે જ હળવો રહી શકે, પારકી મા પાસે નહીં. પોતાની ભાખા જ સુપાચ્ય હોય. તેથી વિદ્યાર્થીનોને, સોરી, વાલીઓને ગુજરાતી મીડિયમ તરફ વાળવા માટે પર્યામ સંખ્યામાં આદર્શ ગુજરાતી શાળાઓ-મોડેલ સ્કૂલો ઊભી થવી જરૂરી છે.

બેડાનો ભાર લાગવા માંડે તો અભણ પનિહારી પણ થોડું પાણી ઓછું કરી નાખે છે, કે પછી બેડાને માથેથી ઉતારીને કાંખમાં ગોઠવવાનો ફેરફાર કરે છે. તો શિક્ષિત સત્તાધીશો સિસ્ટમને સુધારવા કાં બચકાય? ઉપર્યુક્ત ચાર ભાર ચર્ચાથી નહીં, ઉચિત અમલથી જ હળવા થઈ શકે. પરંતુ જેઓ અમલનીએ ચર્ચા કરીને સૂર્ય જ જવા માંગે છે એને તો ‘ગુડનાઈટ મુખારક’ જ હેઠવનું પડે ને? ‘જાગ્યા’ વગર તો ગુડ મોર્નિંગ શક્ય જ નથી ને?

### ● ઉમ્મવડું :

કેટલાક શિક્ષકો ચિરસ્મરણીય હોય છે. તો કોઈક ચી...ર સ્મરણીય! (જેની યાદ ચીરી નાખે છે!)

મો. ૯૮૨૮૩ ૫૫૫૨૦

**Mfrs. of Aristo Brand Stainless Steel Utensils**

**ARISTO PLUS**

177/A, Panjrapole Road, Opp. Sarvoday Nagar, Mumbai-400 004.

Tel. : 2242 6555 / 2242 2666 • Fax : 2242 7324

E-mail : aristo\_stainless@yahoo.co.in • www.aristosteel.com



## કોસ કનેક્શન ફોન પર!

• ચિત્રસેન શાહ •

અમારા એક મિત્રની ફરિયાદ છે કે તેમના ફોનની લાઈન અવારનવાર બીજી કોઈ લાઈન સાથે જોડાઈ જાય છે. મિત્રનો ફોન નંબર ૪૧૫૧૬૧૧ છે અને તેમની લાઈન જે લાઈન સાથે જોડાઈ જાય છે તે કોઈ મિસ્ટર ત્યાગીનો ફોન નંબર ૪૧૫૧૬૧૨ છે. તેમણે ફોન ડિપાર્ટમેન્ટને ફરિયાદ તો કરી છે, પરંતુ જેમ મોટા ભાગના કેસમાં બને છે એવી જ રીતે ફરિયાદ કર્યા પછી તો ઉલટાની તેમની તકલીફ બેવડાઈ છે! કારણ કે પહેલાં તો ફિક્ટ મિસ્ટર ત્યાગીના ફોન સાથે જ તેમના ફોનનું કોસ કનેક્શન થતું હતું પરંતુ ફરિયાદ કર્યા પછી તો પોલીસ સ્ટેશન-સહિત બીજી ઘણા ફોન સાથે પણ તેમની લાઈન જોડાઈ જાય છે! આ સંજોગોમાં ઘણી વાર અમારા મિત્ર, મિસ્ટર ત્યાગી અને પોલીસ સ્ટેશન વચ્ચે ટેલિ-કોન્ફરન્સ પણ યોજાઈ જતી અને પરિણામે આ બંનેનાં નામ-સરનામાં પોલીસ ચોપડે ચરી ગયાં! પોલીસ સ્ટેશનના અધિકારીએ તો તેના સ્ટાફના કોઈ કલાર્કને કહ્યું હશે કે ‘આ બંને ફોન નંબર એક જગ્યાએ ટપકાવી લેશે. આપણે ફોન ડિપાર્ટમેન્ટને ફરિયાદનો પત્ર લખીશું ત્યારે જરૂર પડશો!’ પરંતુ કલાર્કનું ધ્યાન તો ભારત અને સાઉથ આફિકા વચ્ચે રમાતી વન-ડે મેચમાં હતું એટલે એણે તો ભૂલથી આ બંનેનાં નામ-સરનામાં ‘રીઠ ગુનેગાર’ ની યાદીમાં નાખી દીધા! તેથી શહેરમાં સોનાની ચેન બેંચવાનો કે એવો બીજો કોઈ બનાવ બને એટલે તરત જ પોલીસ સ્ટેશન તરફથી તો ‘મેરીલિંગ લિસ્ટ’ પ્રમાણે આ બંનેને પણ ફોન આવી જાય કે ‘આ બનાવના સંબંધમાં પોલીસ સ્ટેશનમાં આવી સાહેબને મળી જાઓ.’

મિસ્ટર ત્યાગી પ્રેસ રિપોર્ટર છે અને તેથી અવારનવાર થતા કોસ કનેક્શનને

કારણે અમારા મિત્રને તો ગામ-આખાના ન્યૂઝ મફતમાં સાંભળવા મળે છે!

એકબીજાથી ઘણા દૂર રહેતા અમારા મિત્ર અને ત્યાગી ફોનના કોસ કનેક્શનને કારણે ફોન પરની વાતચીતમાં એકદમ નજીક આવી ગયા હતા. જોકે ઘણી વાર તો બંનેને એકબીજા સાથે વાત કરવાની ઈચ્છા થાય ત્યારે પણ બંનેના અમદાવાદી જીવ (!) કોસ કનેક્શન થવાની રાહ જોતા બેઠા હોય!

અમે મિત્રને કહ્યું કે ‘સરકારી તંત્રમાં “ફરિયાદ” કરી બેસી રવા પાલવે નહીં. “ફરિયાદ” ની “જરી યાદ” પણ અપાવતા રહેવું પડે!’

તો તેમણે જવાબ આપ્યો કે “આગસ્માં રહી જાય છે!”

ઘણાનું આવું હોય છે! મેં કેટલાય એવા લોકોને જોયા છે, જેઓ સહેજે તકલીફ ઉઠાવવા તૈયાર નથી હોતા. દાખલા તરીકે, પેપરમાં જો પહેલા પાને જાહેરાત હોય કે ‘તમારે ઈન્સ્ટટ લખપતિ બનવું છે? તો વાંચો છેલ્લું પાનું!’

આગસ્તુ લોકો લખપતિ બનવા પણ છેલ્લા પાના સુધી જવા તૈયાર નથી હોતા! જોકે જાહેરાત આપનારે છેલ્લા પાને જે સ્કીમ મૂકી હોય છે તે સ્કીમ કરોડપતિમાંથી લખપતિ બનાવવાની જ હોય છે! એટલે આગસ્તુ લોકો કોઈ-કોઈ વાર અનાયાસે નુકસાનીમાંથી બચી જાય છે! ત્યાર બાદ અમારા મિત્રો તેમણે અનુભવેલા કોસ કનેક્શનના રસમદ ડિસ્ટ્રિબ્યુટર અમને સંભળાવ્યા.

એક વાર તેમને ફોન આવ્યો : ‘હેલો ૪૧૫૧૬૧૧?’

બાજુમાંથી ૪૧૫૧૬૧૨ વાળા ભાઈને બોલાવી આપશો?’

તેમણે જવાબ આપ્યો : ‘ભાઈસા’બ, આ ફોન નંબર છે, ફ્લોટ કે પ્લોટ નંબર નથી કે ૪૧૫૧૬૧૧ અને ૧૨ બાજુબાજુમાં હોય!’ (ક્યારેક અક્સમાત્ર આવી જાય એ જુદી વાત છે.)

આમ કહી તેમણે ફોન મૂકી દીધો.

એક વાર ફોનનું રિસીવર ઉપાડતાંની સાથે તેમને વાતચીત સંભળાઈ (જાણે કોઈ પાગલ કોઈ દારૂદિયાને કહી રહ્યો હતો.)

‘દારૂબંધીવાળા પ્રદેશમાં જાહેરમાં દારૂ પીવું એમાં ડાપણ નથી!’

આમ પોલીસથી માંડી પાગલ સુધી બધા જ જાણે છે કે જાહેરમાં દારૂ પકડાય, પીવાય નહીં!

છેલ્લે તેમણે એક રસમદ, રોમાંક અને રહસ્યમય ડિસ્ટ્રિબ્યુટર અમને સંભળાવ્યો.

અમારા મિત્રને ઘેર એક વાર રાત્રે ટી.વી. પ્રોગ્રામ જોઈ બધાં સૂર્ય ગયાં હતાં. રાત્રે એક વાયે બારણે ટકોરા પડ્યા. આંખો ચોળતાં-ચોળતાં અમારા મિત્રો બારણું ખોલ્યું તો સામે પોલીસ પાર્ટી-સહિત પી.એસ.આઈ. ઉભા હતા.

અમારા મિત્રો આંચકો અનુભવ્યો. પોલીસે કરડાકીથી કહ્યું : ‘અમારે ઘરની તલાસી લેવી છે’

‘કેમ?’

‘અહીં ખૂન થયું છે ને તમે પૂછો છો કેમ?’

‘ખૂન?! અમારે ત્યાં પ્રોપર્ટીનો કોઈ પ્રોબ્લેમ નથી કે કોઈનું ખૂન કરવાની જરૂર પડે! અમારે ત્યાં ખૂન થાય અને અમે ન જાણીએ તે કેવું? અમારા ઘરની વાત પોલીસ જાણે અને અમે ન જાણીએ?’

પરંતુ ઘણી વાર આવું થતું હોય છે. ઘરની ઘણી વાતો પોલીસવાળા જાણતા હોય છે, ‘ધરવાળા’ જાણતા નથી હોતા!

અમારા મિત્રે કહું : ‘લઈ લો તલાશી.’

પોલીસે આખા ઘરની તલાશી લીધી પરંતુ કંઈ વાંધાજનક મળ્યું નહીં.

ગુંચવાયેલા પી.એસ.આઈ. એ કહું : ‘રાત્રે નવ અને દસની વચ્ચે અમે ફોન પર કોઈ પાર્ટી સાથે વાત કરી રહ્યા હતા ત્યારે અમે કોઈ યુવતીની ‘બચાવો બચાવો’ એવી ભયાનક ચીસ સાંભળી હતી. ત્યાર બાદ ‘ખૂન-ખૂન’ એવા સ્પષ્ટ શર્ઝો પણ સંભળાયા હતા. પહેલાં તો અમને થયું કે અમે જે પાર્ટી સાથે વાત કરી રહ્યા હતા ત્યાં કોઈ બનાવ બન્યો લાગે છે તેથી ત્યાં તપાસ કરી પરંતુ ત્યાં કોઈ બનાવ નો’તો બન્યો. ત્યાર બાદ અમને ફોનના કોસ કનેક્શનની વાત યાદ આવતાં અમે મિસ્ટર ત્યાગીને ત્યાં તપાસ કરી. ત્યાં પણ કોઈ બનાવ બન્યો નો’તો. ઊલટાનું તેમણે તો કહું કે તેમણે પણ “બચાવો-બચાવો” અને “ખૂન-ખૂન” ના અવાજો સાંભળ્યા હતા, તેથી અમે તમારે ત્યાં તપાસ કરવા આવ્યા છીએ. તમે રાત્રે નવ અને દસની વચ્ચે ક્યાં હતા? શું કરતા હતા? તે સમયે કોઈ ફોન આવેલો?’

આવા પ્રશ્ન સાથે પોલીસે પોતાનું વકતિવ પૂરું કર્યું. અમારા મિત્રે જવાબ આપ્યો :

‘તે સમયે અમે બધાં ડ્રોઇંગરૂમમાં બેસી ટી.વી. પ્રોગ્રામ જોઈ રહ્યાં હતાં ત્યારે કોસ કનેક્શનવાળા મિસ્ટર ત્યાગીનો ફોન પણ આવેલો. તેમની સાથેની વાતચીતમાં વચ્ચે વચ્ચે બીજી કોઈ વાતચીત પણ સંભળાતી હતી. ટી.વી. સિરિયલ પૂરી થઈ અને અમે બધાં સૂવા ચાચ્યા ગયાં.’ ટી.વી. ‘સિરિયલ’ શર્ઝ બોલતાની સાથે જ અમારા મિત્રના મગજમાં એક જબકારો થયો : ‘અમે ટી.વી. સિરિયલ “આહટ” જોઈ રહ્યાં હતાં. “આહટ” ના તે એપિસોડમાં એક પ્રેતાત્મા એક સુંદર યુવતીની ગળચી દબાવે છે અને યુવતી “બચાવો-બચાવો” ની મરણચીસ સાથે ઢળી પડે છે. અમારો બાર-તેર વર્ષનો મુત્ર કે જે હોરર સિરિયલનો શોખીન છે તે મોટેથી “ખૂન-ખૂન” ની બૂમ પાડતો પોતાના રૂમમાં સૂવા ચાલ્યો ગયેલો!’

પોલીસંત્રે આ બધા અવાજ કોસ કનેક્શન દ્વારા સાંભળ્યા હતા અને પરિણામે પોલીસ પાર્ટી આ ખૂનનો બેદ ઉકેલવા કમર કસતી ધસી આવી હતી અમારા મિત્રને ત્યાં!

આ હતી કોસ કનેક્શનને કારણે થયેલી રામાયણ!

ફોન નં.-૩૭૪/ઓ, સેકટર-૨૦, રાજ્યાંત્રી સિનેમા પાસે,  
ગાંધીનગર-૩૮૮ ૦૨૦. ફોન : (૦૨૬) ૨૩૨૬૦૫૮૮

## મનોમંથનના ચિંતનરંતો

★ ભૂલનું ઉત્તમ પ્રાયશ્ચિત્ત ઉમંગથી ફરી શરૂ કરવું એ જ છે.

- કાદર વાતેસ

★ કોઈ માણસ એમ કહે કે એણે કદી ભૂલ કરી નથી, તો ચોક્કસ માનજો કે એણે જાતે કદી કોઈ કામ કર્યું નથી.

- વોસ હક્કાવી

★ કદી ન સુધરે તેવી ભૂલ ન કરતાં.

- અનુમતાનંદશી

★ જ્યારે બે વ્યક્તિ જઘડે ત્યારે બનેની ભૂલ હોય છે.

- ટીકિત

★ મને તો એક પણ માણસ એવો નથી દેખાતો જે પોતાનો દોષ પોતે જોઈ શકે અને પોતાને દોષિત માને.

- કન્ફ્યુશિયસ

★ બીજાઓએ તમારી પ્રત્યે જે જે અપરાધ કર્યા હોય તેને ભૂલી જવા એ જ તેનો ઉપાય છે.

- સાયકસ

★ શત્રુઓની અવગણના ન કરવી જોઈએ; આપણી ભૂલો બતાવનારાઓ એ લોકો જ હોય છે.

- સંકલિત

★ ખામી કાઢવી બહુ સરળ છે, પણ સારું કાર્ય કરવું બહુ અધરું છે.

- પુરાક

★ જો માનવી શીખવા માગે તો એની દરેક ભૂલ એને કંઈ ને કંઈ શિખામણ આપે જ છે.

- ટીકનસ

★ માણસની એક જ વખતની ભૂલ ક્યારેક લોકોની દસ્તિમાં હુંમેશની ભૂલ બની જાય છે.

- સંકલિત

★ પાડોશીની સો ભૂલો સુધારવા કરતાં પોતાની એક ભૂલ સુધારવી વધારે સારી છે.

- ગાંધીજી

★ હું મારી જાતને ખૂબ જ સમજદાર વ્યક્તિ માનવાની ભૂલ કરી બેસું છું, એથી જ ઘણી અનધિકાર ચેષ્ટાઓ થઈ જાય છે.

- સંકલિત

**MILAN®**  
**MASALA**

**K. K. MASALAWALA**  
31, K.N. ROAD, MASJID (W), MUMBAI-400 009.  
TEL. : 2377 4209 2375 7674  
TELEFAX : 2379 0883

**MILAN®**  
**MASALA**



## બાલુકેં જયું ગાલિયું

સંકલન : ગુલાબચંદ ધારશી રાંબિયા

### બચુડો

અધા : પુતર બચુડા?

બચુડો : કો અધા કુરો કમ આય?

અધા : જરા તપાસ તા કર ક નુથાબાપા વકીલ જુ ઓફિસને વેને ને મીઠાઈવારે મંછારામ તે ચિટ્ઠીંગ જો કેસ કરેજો ચ્યાં તે... સે નથુબાપા કુરે મેં છેતરાણા આંઈ?

બચુડો : (તપાસ કે ને ચે) નથુબાપા મંછારામજુ દુકાન તા ગુલાબજાંબુ ગેણાં વા. તડે અન મિઠાઈમેજા ન તા ગુલાબ નકર્યા કે ન ત જાંબુ નકર્યા. અતરે ચિટ્ઠીંગજો કેસ કરેલા વ્યા વા.

### ખિલજા મ ભલા

પપ્પા : મોન્ટુ, તારો શું વિચાર છે? સ્કૂલે નિયમિત જતો નથી, ઘરે વાંચતો નથી... તું મોટો થઈને શું કરીશ?

મોન્ટુ : પપ્પા, તમે ચિંતા ન કરો. મોટો થઈને હું સ્વામિજી બની જઈશ. મોટા મોટા ઓફિસરો, રાજકારણીઓ બધા જ મને પગે લાગશે.

☺ ☺ ☺ ☺ ☺

ચંપક : આ ચાઈનાની બનાવટવાળી બધી વસ્તુઓ તકલાઈ જ હોય છે. કોઈ ટકાઉ હોતી જ નથી.

મયંક : પણ હું જે જાણું છું એ મુજબ ચાઈનાની એક વસ્તુ વરસોના વરસ થયા હજુ સુધી એમની એમ જ છે.

ચંપક : ના હોય... એવી ટકાઉ વસ્તુ કઈ છે?

મયંક : ચાઈનાની દીવાલ.

☺ ☺ ☺ ☺ ☺

બંટી : ચંકીએ નવી કોલેજ ખોલીને એનું નામ બહુ વિચિત્ર રાખ્યું છે.

બબલી : એવું તે શું નામ રાખ્યું છે?

બંટી : ચંકી ગર્લ્સ કોલેજ ફોર બોઝ.

☺ ☺ ☺ ☺ ☺

મોહન : યાર, આ બિખારી પણ ખરો નીકળ્યો.

સોહન : કેમ શું થયું?

મોહન : અમે બધા પચ્ચિસેક જણા ખરા તાપમાં બસ સ્ટેન્ડ પર બસની રાહ જોઈ ઉભા હતા, ત્યાં તે આવ્યો... બધા પાસે રૂપિયો રૂપિયો માંગ્યો, રિક્ષા રોકીને રિક્ષામાં જતો રહ્યો.

☺ ☺ ☺ ☺ ☺

મોટુમલ : અરે છોટુમલ, છાપામાં આ સમાચાર વાંચ્યા? કમળાએ માણસામાં ૫૦ માણસોનો ભોગ લીધો.

છોટુમલ : હાસ્તો... આ બાઈ ઘણી જબરી, જોરાવર લાગે છે.

☺ ☺ ☺ ☺ ☺

રામલાલ : સાંભળ્યું છે કે તમાંનું સ્મિત જોરદાર છે... એના પર હજારો મરતા હોય છે...

સ્મિતા : ખરી વાત છે પણ તમારે મારું શું કામ છે?

રામલાલ : ખાસ કોઈ કામ નથી. આ તો ઘરમાં મચ્છર ખૂબ જ વધી ગયા છે. તમે આવો તો દવા છાંટવી ન પડે.

☺ ☺ ☺ ☺ ☺

પ્રેમી : આજ તો બહુ જ સુંદર લાગે છે. કાંઈક બોલ તો ખરી... હું તારા બોલનો બંધાળી બનવા મારું છું.

પ્રેમિકા : (ધીમેથી...) મોંબાં માવો ભર્યો છે ને એ હમણા શુંકાય એમ નથી... નશો ચઢ્યો નથી.

☺ ☺ ☺ ☺ ☺

શિક્ષક : અલ્યા ચીન્ટુ - પીન્ટુ તમે બંને કોપી કરીને પાસ થયા તોય થઈ કલાસ? જરાક તો વિચારવું તું...

ચીન્ટુ : સાહેબ, કોપી કરવામાં ચોઈસ ના મળે. જે મળે એનાથી ચલાવી લેવું પડે.

☺ ☺ ☺ ☺ ☺

મોહન : જીવનમાં બહુ પોઝિટીવ જ ઈચ્છાવું જોઈએ. એનાથી પ્રગતિ થાય છે.

સોહન : પણ મારાથી એનું નહીં વિચારાય.


મોહન : કેમ?

સોહન : હું હમણાં જ એચ.આઈ.વી.નો ટેસ્ટ આપી આવ્યો છું.

૮/૧૬, ગંગામણિ ફ્લેટ્સ, વસ્ત્રાંગ સોસાઈટી, ગોપાલચોક,  
મહિનગર, અમદાવાદ-૩૮૦ ૦૦૮. ફોન : ૨૪૪૬૮૭૬૦

મંત્રીલે ઉન્હીંકો મિલતી છે  
જિનકે સપનાં મેં જાન હોતી છે  
ધૂંહી પંચ હોને સે,  
કુછ ભી નહીં હોતા  
હોંસલો સે ઊદાન હોતી છે.

સૌજન્ય : “માણસરનું ભાવજગત”



### અંગદાન અને ધર્મ

કેશુઆરીના અંકમાં મે 'કેરળ પ્રદેશનું અંગદાન અભિયાન' નામે લખાણ 'રીડર્સ ડાઈજેસ્ટ' માંથી અનુવાદ કરીને આપેલ.

આના પ્રતિભાવરુપે થોડા દિવસ પહેલાં એક ભાઈનો ફોન આવેલ. તેમણે પોતાનો પરિચય આપેલ નથી, પણ તેઓ સમાજના સત્ય અથવા મંગલ મંદિરના વાચક હોઈ શકે.

મૂળ વાત - તેમનું કહેવાનું એ હતું કે તેઓ પણ આવા દાનનો પ્રચાર કરતા હતા, પરંતુ અમુક કિસ્સાઓ જોયા પછી એમને લાગ્યું કે આમાં દાતાને દોષ લાગે એટલે હવે પ્રચાર કરવાનું બંધ કરેલ છે!

તેમણે બે દાખલા આચ્છા એ લીવર દાનના હતા. તેમનું કહેવું કે લીવર શરાબથી જ ખરાબ થાય છે અને બંને વખતે દાન લેનારે ફરી પીવાનું ચાલુ કરેલ. એક કિસ્સામાં તો પત્નીએ લીવરદાન કરેલ. (લીવરનો અડધો ભાગ જીવન દરમિયાન પણ દાન કરી શકાય; અડધું લીવર દવાઓના સહારે રીજનરેટ થઈ જાય.)

લાગે છે કે આ ભાઈ પણ અમુક જૈન મુનિઓની આ ખતરનાક માન્યતાથી પ્રભાવિત છે.

તેમણે કહેલ બીજા કિસ્સામાં શું પત્નીએ "મરવા દો એને" એમ કહીને દાનનો ઈન્કાર કરી દેવો? ભવિષ્યમાં એ સુધરણે એવી આશા પણ નહીં રાખવાની?

આવા અંગત જાણકારીના ૧-૨ કિસ્સાનો દાખલો લઈ, એ ભાઈ અંગદાનનો વિરોધ કરવા લાગ્યા છે! દુનિયાની વાત જવા દઈએ તો ભારતભરમાં અંગદાન મળવાનાં પરિણામે હજારોની સંખ્યામાં લોકોને નવું જીવન મળ્યું છે અને મળશે એ નહીં જોવાનું? ઘરાંગણે અમદાવાદ સિવિલમાં ઋષિતુલ્ય ડૉ. નિવેદીના હાથે થયેલ કિડની ટ્રાન્સપ્લાન્ટમાં હજારો વ્યક્તિઓને નવું જીવન મળ્યું છે. દુનિયાભરમાં થતા નેત્રદાનથી હજારો અંધજનોને દસ્તિ મળી છે. આ બધા લાભાર્થીઓ હંમેશાં મહાત્મા બનીને રહેશે એવી બાંહેધરી દાતાએ કે ડોક્ટરોએ લેવાની? આ તે કેવી વિચારસરણી! અને બધાનાં કાળ બનવાનો અધિકાર આપણને કોણે આચ્છો?

દાન સુપાત્રે આપવું એ ખરું, પણ આ બાબત જ્યારે કોઈ જાણીતી વ્યક્તિ કે સંસ્થાને નાણાં કે વસ્તુનું દાન અપાતું હોય ત્યારે જ શક્ય બને. એમાંથી ભવિષ્યની કોઈ ગેરન્ટી ન મળે. બાકી જ્યારે કોઈ વ્યક્તિ અન્ય કોઈ જાણીતી કે અજાણી વ્યક્તિને

તેનું જીવન બચાવવાના શુભ આશયથી અંગદાન કરે ત્યારે તેની ભાવનાનું જ મહત્વ છે. માત્ર શુભ ભાવનાથી જ વ્યક્તિ ભવસાગર તરી ગયાની કથાઓ જૈન સાહિત્યમાં ઘણી મળે છે.

બીજી વાત એ ભાઈએ કહી કે સાધુ - સાધીઓ તો મોક્ષમાર્ગના પ્રવાસી છે, તેઓ આમાં શા માટે પડે? મારા એ લખાજાની આખરે મારી ટીઘણી ઉપર, આ પણ તેનો પ્રતિભાવ હતો.

સવાલ એ છે કે શા માટે નહીં? શા માટે સાધુ ભગવંતો રક્તદાન કે અંગદાન ન કરી શકે, કે તેનો ઉપદેશ ન આપી શકે? જે સમાજ તેઓની ૧૦૦% જીવન જરૂરિયાતો ખુશી ખુશી અને ભાવનાપૂર્વક પૂરી કરતો હોય એ સમાજ માટે આટલું કરવામાં જો મોક્ષમાર્ગમાં બધા પડતી હોય તો એ મોક્ષમાર્ગ ન હોઈ શકે.

મગનલાલ સંઘરી  
ફોન : (૦૭૯) ૨૬૭૭૧૯૮૪



'મંગલ મંદિર'માં 'વલોવતન' ખૂબ જ આકર્ષક બનતું જાય છે. આપણા પ્રદેશના તાજી સમાચાર મળતા જ રહે છે. પણ એક સૂચન છે કે આપણા પ્રદેશના ઘણા સ્થળ એવા છે જે આપણે ભૂતકાળમાં જોયા છે પણ હાલ એ સ્થળ એટલે કે ટપકેશ્વરીની ગુફાઓ માટે કોઈ જાણકારી મળશે તો ખૂબ જ આનંદની લાગણી અનુભવશે.

ખૂબ જ રમણીય સ્થળ અને એની ગુફાઓ વિશે જાણકારી આપશો. પહેલાં 'જેસલ તોરલ' ફિલ્મમાં થોડા ઘણા સીન ત્યાંના જોયેલા છે. બાકી બચપણામાં એ સ્થળની મુલાકાત જાતિના મેળામાં લીધેલ છે ત્યારે તો બહુ જ નાના હતા. એ ગુફામાં વડીલો જુગાર રમતા. અને અમે બધા બાળકો પકડદાવની રમતો રમતા. બધી યાદ તાજી કરવા માટે ફરી કોઈક જાણકારી મળશે તો આનંદ થશે.

બીજું 'જાણવા જેવું' - આ કોલમ પણ સારી છે. ખૂબ મહેનત કરીને એની જાણકારી રજૂ કરવામાં આવે છે એ પણ ખૂબ જ પ્રશંસાને પાત્ર છે.

અતકા એ. સંઘરી - અમદાવાદ  
મો. ૮૪૨૬૧ ૪૧૮૪૮



આપણો કચ્છી જૈન સેવા સમાજ, વર્ષોથી સ્વાતંત્ર્ય દિન અને પ્રજાસત્તાક દિનની ઉજવણી હર્ષોલ્લાસથી ઉજવીને ધ્વજવંદનના પ્રોગ્રામો કરી રહ્યો છે. તો એ વિશે હું મારા સૂચનો કે અભિપ્રાય, જે માનો તે વ્યક્ત કરું છું.

આપણે 'ધ્વજવંદન' કરવા માટે હંમેશાં કોઈપણ અગ્રેસર વ્યક્તિને આમંત્રણ આપીએ છીએ. એમના હાથે ધ્વજવંદન કરવીએ છીએ તે ખૂબ જ સારી વાત છે. પણ મને એવું લાગી

રહ્યું છે કે હવે થોડા ફેરફાર કરી આપણે આપણા સમાજના બાળકોને પ્રોત્સાહન મળે અને દેશ ભક્તિની ભાવના જગાડવા એક નવતર ગ્રયોગનું આયોજન કરવું જોઈએ. જે બાળક સારા ટકાએ પાસ થઈને આપણા સમાજનું નામ રોશન કરે અથવા તો કોઈ પણ સારી પ્રવૃત્તિમાં સારી નામના મેળવે એવા બાળક (વિદ્યાર્થી)ને ધ્વજવંદન કરવાનો ચાન્સ આપવો જોઈએ.

જે કોઈ વ્યક્તિ માંડવાની જી.ટી. હાઇસ્ક્યુલમાં ભાડ્યા હશે એ લોકોને કદાચ યાદ હશે કે આપણા વખતમાં જે વ્યક્તિ (વિદ્યાર્થી)ની ઉંમર સૌથી નાની હોય એને ધ્વજવંદન કરવાનો મોકો મળતો હતો. જેથી તેઓ ગૌરવની લાગણી અનુભવતા હતા.

ખેર, મેં તો મારો વિચાર વ્યક્ત કર્યો છે. બાકી તો આપણી કારોબારી કે કમિટીને જે યોગ્ય લાગશે તે જ થશે.

આલકા એ. સંદ્ઘવી - અમદાવાદ  
મો. ૯૮૨૬૧ ૪૧૬૫૮

### જિંડગી એક ગાડી

આપણી જિંડગી પણ એક ગાડી છે. સંકલ્પની ગાડી છે જેમાં ઉત્સાહના પૈડા, ધર્મનું એન્જિન, કર્મનું ઈધણ, સંયમનું સ્ટીયરિંગ, મર્યાદાનું એક્સ્સીલેટર, અનુશાસનની બેક તેમજ સમ્યકું દર્શન, જ્ઞાન અને ચારિત્યનાં ટુલ્સ હોય તો આ ગાડી ચોક્કસ મોક્ષની મંજિલે પહોંચી શકે છે.

### ઇ ગરવી ધરા માં ગુજરીજી

જિત વર્ષે ગુજરાતી જગમે, તાં ઉલ્લો કરે ગુજરાતજી, માં ગુજરીજી યાદ અયે ઉતા, ઇ ગરવી ધરા માં ગુજરીજી. (૨૭)  
શાહ-સોધાગર-સાહસિક, ધૂનિયા ફેરેં વણિકજી,  
શાન વધારીયેં ગુજરાતજી ઉતા, ઇ ગરવી ધરા માં ગુજરીજી. (૨૮)  
નર્મદા-નહેરજી લહેરસેં, થીધી ગુજરાતતેં મહેરજી,  
ભારેમાસ મલલખ પાક ડીધી, ઇ ગરવી ધરા માં ગુજરીજી. (૨૯)  
ઇન ગરવી મિઠીસેં સર્જણાસી, ઇ થૈ અમૂલ દેન કુધરતજી,  
'રશ્મિન' યેં દિલમે ધબકે વિઠી, ઇ ગરવી ધરા માં ગુજરીજી. (૩૦)

રશ્મિન જે રણકાર : ભાગ-૩ માંથી સાભાર

● શુલેચ્છા સહ ●

નાયનભાઈ મેપાણી

**Krystal Colloids Pvt. Ltd.**  
Processors – Manufacturers – Exporters

301, 'Shivam' Appartment, V. L. Road,  
Mulund (W), Mumbai-400 080.  
Phone No. : 5670158

## અન્ય સંસ્થાઓના સમાચાર

### નિદા મહેશ્વરી સમાજની બહેનો પ્રગતિનાં પંથે

નિદા મહેશ્વરી સમાજની બહેનોએ ધૂંઘટ પ્રથાને તિલાંજલી આપ્યા બાદ સમાજમાં ચાલી રહેલી અંધશ્રદ્ધાઓ તેમજ કુરીવાજોને પણ તિલાંજલી આપવાનો સંકલ્પ કર્યો હતો. સમાજમાં શેતાનની જેમ ધૂસી ગયેલા દારુ, બીજી તેમજ ગુટખાનાં વ્યસનોએ સમાજને ગરીબ બનાવ્યો છે. એમાંથી મુક્ત થવાનો નિર્ણય લેવાયો હતો.

તા. ૨૪-૨-૨૦૧૬નાં ધણી માતંગનાં પ્રાંગણમાં સંસ્થા દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં વી.આર.ડી.આઈ., સંસ્થાની બહેનો કાજલબેન મોરી, આરતીબેન, અને બેલાબેને સુંદર માહિતી આપી હતી. ગૃહઉદ્યોગો દ્વારા આપાતી તાલીમ દ્વારા પ્રવૃત્તિઓ શરૂ કરવાનાં પ્રોગ્રામમાં સમાજની ૧૨૦ ઉપરાંત બહેનોએ હાજરી આપી હતી અને વી.આર.ડી.આઈ. દ્વારા શરૂ કરવામાં આવેલ દરેક પ્રવૃત્તિમાં જોડાવવા નિર્ણય કરવામાં આવ્યો હતો, અને દસ અને પંદરની સંખ્યામાં શ્રુપ બનાવી સંસ્થા દ્વારા ચલાવાતી વિવિધ પ્રવૃત્તિમાં જોડાવવા જાહેરત કરી હતી.

પ્રોગ્રામનું સંચાલન દેવલબેન મહેશ્વરીએ સુંદર રીતે કરી આ યોજનામાં બધી બહેનોને જોડાવવા વિનંતી કરી હતી.

સમાજનાં આગેવાનો મગનભાઈ સિંચણિયા, રવજીભાઈ કટુઆ, શામજીભાઈ દનીયા, મનોજ વારસંભિયાએ હાજરી આપી હતી.

અંતમાં કોટીવૃક્ષ અભિયાનનાં શ્રી એલ.ડી. શાહે બહેનોમાં આવેલી જગૃતિને બિરદાવ્યા હતા અને ગૃહ ઉદ્યોગોમાં જોડાઈ આર્થિક સ્થિતિ સુધારીને બાળકોને ઉચ્ચ શિક્ષણની પ્રેરણા આપી અન્ય સમાજોની સાથેની બરોબરી કરવા ઈજન આપ્યું હતું.

### શ્રી કચ્છી વિસા ઓસવાળ જૈન મહાજન - ભુજ

શ્રી ક.વિ.ઓ. જૈન મહાજન - ભુજ સંચાલિત શ્રી રતનશી ટોકરશી વોરા મેડિકલ ચેક-એપ સેન્ટર મધ્યે સંસ્થાના પ્રમુખ અને રાજ્યમંત્રી શ્રી તારાચંદ્રભાઈ છેડાના માર્ગદર્શન ડેટન સ્પાઈન સર્જનના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

સંસ્થાના મેડિકલ કન્વીનર ડૉ. દેવચંદ ગાલા તથા મેડિકલ ઓફિસર ડૉ. અશોકભાઈ ત્રિવેદીના જણાવ્યા અનુસાર સંસ્થા દ્વારા સ્થાનિકે ઉપલબ્ધ ન થઈ શકે તેવા નિષ્ણાત ડોક્ટરો અમદાવાદ કે મુંબઈ જેવા શહેરોથી અત્રે બોલાવી જરૂરિયાતમંદ દર્દીઓના રોગોનું નિવારણ કરવામાં આવે છે. તે જ રીતે આજના આ કેમ્પમાં અમદાવાદ ખાતેના પ્રસિધ્ય સ્પાઈન સર્જન ડૉ. સુબીર જવેરીને

અત્રે બોલાવી કેમ્પનું આયોજન કરવામાં આવેલ. જેમાં કચ્છભરમાંથી ૧૧૫ જેટલા જરૂરિયાતમંદ દર્દીઓએ ભાગ લીધેલ હતો. સંસ્થા દ્વારા ગરીબ દર્દીઓને લગતી વિવિધ તબીબી સારવાર ગુજરાત સરકારની વિવિધ યોજના ડેટન કરાવી આપવામાં આવે છે. તથા અત્યંત જટીલ સારવાર માટે દાતાશ્રીઓ તરફથી દાન મેળવી દર્દીઓના રોગોનું નિવારણ કરી અપાય છે.

આ મેડિકલ કેમ્પમાં સંસ્થાના ટ્રસ્ટી શ્રી હિરેનભાઈ પાસડ, શ્રી વિનોદભાઈ ગાલા, ડૉ. દેવચંદ ગાલા (મેડિકલ કન્વીનર), શ્રી સુરેન્દ્રભાઈ સાવલા, શ્રી હીરાલાલભાઈ શાહે સેવા આપેલ. દર્દીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કેમ્પને સફળ બનાવવા સંસ્થાના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.

### જૈન ગુજર - બે નાત દ્વારા માંડવીમાં પરિચય મિલન યોજાયો

તા. ૧૨ અને ૧૩ માર્ચના રોજે માંડવીના કચ્છી જૈન ગુજર સમાજ દ્વારા માંડવીના જૈનપુરી ખાતે જૈન સમાજનો પ્રથમ યુવા - યુવતીઓનો પરિચય મિલન યોજવામાં આવેલ હતો. ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ચેનાઈ, હૈદ્રાબાદ, સિકંદ્રાબાદ, કોચીન, મધ્યપ્રદેશ વગેરે સ્થળોએથી ૪૦૬ જેટલા યુવક - યુવતીઓએ ઉમેદવારો તરીકે રજિસ્ટ્રેશન કરાવેલ હતા. આમાંથી ૨૭૭ જેટલા લગ્ન ઈચ્છુક ઉમેદવારો જોડાયેલ હતા. આ પસંદગી મેળામાં બે યુગલ એકબીજાને પસંદ આવી જતાં રિંગ સેરેમની યોજવામાં આવી હતી. જેમાં સમાજે સુવર્ણ વીઠીની ભેટ આપી હતી.

ભુજના અલ્પેશ ગાંધીએ અંજારના વૈશાલીબેન તથા મુંબઈના નિહારભાઈ શાહે વૈશાલીબેન દોશી પર પસંદગી ઉત્તરાત્મા વૈશાલી નામ ધારક બંને યુવતીઓ માટે મુરતિયા મળી જતાં, બે સગાઈ કરવામાં આવી હતી.

આ પ્રસંગે તમામ માહિતી પૂરી પાડતાં પરિચય મિલનની પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માંડવી સંસ્થાના હોદેદારો સર્વશ્રી હરનીશ શાહ, જયંતીભાઈ શાહ, પારસભાઈ શાહ એ સુંદર સહયોગ આપ્યો હતો. બે દિવસ ચાલેલ પરિચય મેળામાં વડોદરા સ્થિત પરંતુ મૂળ માંડવીના ડૉ.આર.ડી.ના હુલામજા નામથી ઓળખાતા જીયેશભાઈ આ સમગ્ર કાર્યક્રમના આયોજનમાં સહભાગી બન્યા હતા.

આ મેળામાં ૨૭૭ ઉમેદવારોના ૪૫૦ જેટલા માતા-પિતા હાજર રહ્યા હતા. એકબીજાની પસંદગી માટે ૬૫૦ રીકવેસ્ટ આવેલ જેમાંથી ૧૫૦ જેટલી મિટિંગો થયેલ.

ઇલેક્ટ્રિસિટી સખાય કોડ રિવ્યુ પેનલમાં  
સતત છુટી ટર્મ માટે ભાવનગર ડિસ્ટ્રીક્ટ  
ચેમ્બર ઓફ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને  
મૂળ કચ્છ નલિયાના વતની  
શ્રી મહેન્દ્રભાઈ એસ. શાહની પુનઃ નિયુક્તિ

ગુજરાત રાજ્યના ઇલેક્ટ્રિસિટી એક્ટ, ૨૦૦૩ અન્વયે  
રચવામાં આવતી ઇલેક્ટ્રિસિટી સખાય કોડ રિવ્યુ પેનલની પુનઃ  
રચના ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન  
(જ.દ.આર.સી.) દ્વારા તાજેતરમાં કરવામાં આવી છે. જેમાં  
આ સંસ્થા ભાવનગર ડિસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન  
અને મૂળ કચ્છ નલિયાના વતની શ્રી મહેન્દ્રભાઈ એસ. શાહની  
સતત છુટી ટર્મ માટે બે વર્ષની મુદત માટે પુનઃ નિયુક્તિ કરવામાં  
આવી છે.

## પુસ્તક વિમોચન

ગાંધીનગર સ્થિત માંડવીના શ્રી ચિત્રસેન શાહના પુસ્તક  
“હાસ્યનું મેઘધનુષ”નું વિમોચન તા. ૨૧-૨-૨૦૧૬ના રોજ  
ગાંધીનગર સાહિત્ય સમાજના વાર્ષિકોત્સવ પ્રસંગે વરિષ્ઠ  
સાહિત્યકાર ડૉ. કેશુભાઈ દેસાઈના વરદ્દ હસ્તે કરવામાં આવેલ.

આ પ્રસંગે નામાંકિત સાહિત્યકારો તેમજ સાહિત્ય રસિકોની  
બહોળી હાજરી ઉપસ્થિત રહી હતી.

‘મંગલ મંદિર’ના ગ્રાહકોને ગૂર્જર પ્રકાશન પ્રકાશિત રૂ.  
૧૨૦/-નું આ પુસ્તક લેખક પાસેથી રૂ. ૮૦/-માં મળી શકશે.  
લેખકનો મોબાઇલ નંબર ૮૪૦૮૫ ૪૧૫૫૧ છે.

## મેદા છાયે આધી રાત

હિંદી સાહિત્યના મહત્વના કવિ ગીતકાર નીરજ,  
કવિ સંમેલનોની આન-બાન-શાન ગણ્યાય છે. વર્ષ  
૧૯૬૬માં આવેલી ‘નઈ ઉમર કી નઈ સફર’થી તેમજો  
શરૂઆત કરી. ગીતના શબ્દો હતા. ‘કારવા ગુજર ગયા  
ગુબાર દેખતે રહે...’ આ ઉપરાંત તેમના પ્રયાત ગીતોમાં  
તેરે મેરે સપને તું ‘જીવન કી બગિયા મહકેગી, લટકેગી,  
ચહકેગી’ પ્રેમ પૂજારીનું ‘ફૂલો કે રંગસો, ટિલકી કલમસો,  
તુલ્યકો લિખી રોજ પાતી’ કન્યાદાનનું ‘લિખે જો ખત તુઝે’  
અને લોકોના હદ્યમાં ખૂબજ મહત્વનું સ્થાન ધરાવતું  
કિલ્ય શર્મિલીનું ગીત ‘મેદા છાયે આધી રાત બેરેન બન  
ગઈ નીટિયા’ તેમની લાજવાબ રચનાઓ છે.

## કચ્છ જ્યોજ્યું જશનામી મહિલાંથિ....

### વજબાઈ ખીમજી - જ્યો (૧૪)

દિના સપનેલા સોનજી માળા ને અતિથિગૃહજે હોલાલ હેમજો વડો હાર  
ધન્ય આંકે વેજબાઈ ખીમજી, એળા જ્યો વારેંજા ઉદ્ગાર.

### રાણબાઈ જેઠાબાઈ દેવન - જ્યો (૧૫)

વડી ઉમરજી ને અશક્ત દેરાસર ચરી ન શકે ઈ ખરી ગાલ  
જ્યો દેરાસરમે બંધાયાં ચંપ્રભુજી તેરી રાણબાઈમાં તત્કાલ.

### ગંગાબાઈ ઉર્ફ ધનબાઈ હીરજી ઉકેડા - જ્યો (૧૬)

આંભલવાડી તેથાર કરાયને મથાનું નિભાવલા દિના પિંડજા ખેતર  
ધન્ય ગંગાબાઈ ઉર્ફ ધનબાઈ અંઈ કંમ કર્યાં ધજ ખરેખર.

### કુ. ગરણાં બંકીમચંદ્ર પદમશી ખોના - જ્યો/મુંબઈ (૧૭)

જ્યોજી બેટી જરણાં, આય જશવંતને જશનામી  
નાતમે પ્રથમ લેડી સોલીસીટર થૈ, નારી જગતમેર્કે રોશની,  
પેલો દાદા ને પોય પણ્ય થા સોલીસીટર ધી તોજા ભાય ભારી જોરથાર  
રશ્મિન ચેતો બેના ધન્ય તોકે, અંગ્રે પ્રગતિ કરીજ પારાવાર.

### સ્વ. શ્રી મહિબાઈ લાલજી રતનશી ને

### લક્ષ્મીબાઈ વિશનજી - જ્યો (૧૮/૧૯)

બોય બેણું બેરી કરી જીવદ્યાલા જ્યો પાંજરાપોળ કે દિના જભરો દાન  
મણિબાઈ લાલજી રતનશી ને લક્ષ્મીબાઈ વિશનજી કે જેજા પ્રણામ.

### અ.સૌ. ધનલક્ષ્મી કુલીન મેશેરી /

### અ.સૌ. ભાવના ખુશાલ મેશેરી - જ્યો (૨૦/૨૧)

ધન્ય આંકે ધનલક્ષ્મી કુલીન મેશેરી, ધન્ય ભાવના ખુશાલ મેશેરી  
અજ પણ વખણાજે જ્યો સેનેટોરીયમમે વડી રકમજી આંજુ દાનેથરી.

### સ્વ. શ્રી કવિયગી ધીમતી રતિલાલ મોમાયા - જ્યો - વડાલા (૨૨)

શ્રી પંડિત રતયંદજી જૈન કન્યા શાળાજા ધણે વરે પ્રિન્સીપાલ વા  
કવિયગી ધીમતી રતિલાલ મોમાયા, ઉદ વરે કર્યાં શિક્ષણ સેવા.

રશ્મેન ખોનાનો કાવ્યસંગ્રહ

“દાન્ય! દશોંજી નાત : ભાગ-૧”માંથી સાબાર

● શુલેચ્છા રહ.... ●

### સો. લીનાબેન હંસકુમાર શાહ

### મ. હેમંત સર્જકલ ઈ. લી.

૧૪૦૩, શોભા સુમન, ચૌદ્દે માળે, ડૉ. મદનમોહન માલવિયા રોડ,  
ટેલીફોન અંકચેન્જની સામે, મુંબુંડ (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૮૦. ફોન : ૨૫૬૮૬૧૦૨

## જાણવા જેવું

સંકળન : રજનીકાર્ટ પારેન્સ (મો. ૯૯૬૬૦૦ ૫૩૪૨૭)

આ અંક જ્યારે આપના હાથમાં આવશે ત્યારે ધોરણ-૧૨ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી ચૂક્યા હશે. પરિણામની રાહ જોતા હશે અને આગળના અભ્યાસ માટે આયોજન કરી રહ્યા હશે.

વિદ્યાર્થીઓ માટે ધોરણ ૧૨ પછી સરકાર દ્વારા B.Voc. નામના કોર્સની શરૂઆત કરવામાં આવી છે. આ કોર્સ ધોરણ ૧૨ પછીના કોઈપણ કોર્સ BBA / B.Com. / BAM કરતાં પણ શ્રેષ્ઠ અને ઉચ્ચ કક્ષાનો છે. સરકારી કોર્સ હોવાથી આની વધુ જાહેર ખબર જોવા મળશે નહિ એટલે આ ખૂબ જ અગત્યની વિગત અહીં મેળવો. :

- (૧) B.Voc. કોઈ કોલેજ કે યુનિવર્સિટીએ નહિ પણ ખુદ સરકારે UGC અને AICTE દ્વારા બનાવેલો છે.
- (૨) સરકાર દ્વારા B.Voc. માં ધોરણ-૧૨ પછી વિદ્યાર્થીઓને તુરત જ નોકરી અથવા રોજગારી આપવામાં આવે છે.
- (૩) વિદ્યાર્થી ધોરણ ૧૨ પછી તરત જ ભણતાની સાથે જ કમાતો પણ થઈ જાય છે.
- (૪) વિદ્યાર્થી પોતાની કમાણીમાંથી જ પોતાની ફી ભરી શકે છે ઉપરાંત વધારાની આવક પણ મેળવી શકે છે. આમ વાલી માથે બોજને બદલે સ્વનિર્ભર થઈ જાય છે.
- (૫) વિદ્યાર્થી ભણવાની સાથે અનુભવ પણ મેળવે છે, જે તેને વિદેશ ભણવા કે કમાવા જવામાં ખૂબ જ મદદરૂપ નીવડે છે.
- (૬) વિદ્યાર્થીને બીજે કોઈ ડિગ્રી કોર્સ કરવાની જરૂરત રહેતી નથી.
- (૭) વિદ્યાર્થી B.Voc. કર્ચ પછી તુરત જ કુલ ગાઈમ જોબ મેળવી શકે છે અથવા આગળ M.B.A./Ph.D. જેવા કોર્સમાં ઓડમિશન મેળવી શકે છે.
- (૮) વિદ્યાર્થી B.Voc. સાથે CA/CS વગેરે કરી શકે છે અથવા નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પણ કરી શકે છે.

### ● B.Voc. ચલાવનાર સંસ્થા :

સરકાર દ્વારા ૧૯૭૬માં Tata Institute of Social Science (TISS) ની રચના કરવામાં આવી છે. જે આ કોર્સ આજા દેશમાં ચલાવે છે. તેના કેમ્પસ મુંબઈ, હૈદરાબાદ ગુવાહাটી તુલાજપુર વગેરે જગ્યાએ છે.

### ● ગુજરાતમાં કયાં?

ગુજરાતમાં રાજકોટ ખાતે TISS નું કેમ્પસ શરૂ થવા જઈ રહ્યું છે જ્યાં ધોરણ-૧૨ની માર્ય ૨૦૧૬માં પરીક્ષા આપવાનાર વિદ્યાર્થીઓ B.Voc. માં પ્રવેશ મેળવી શકશે.

### ● પ્રવેશ પ્રક્રિયા :

૧. વિદ્યાર્થીઓએ ડા. પ/ના મૂલ્યનું એપ્લિકેશન ફોર્મ TISS

રાજકોટ ખાતેથી મેળવી ભરવાનું રહેશે.

૨. ફોર્મ વહેલા તે પહેલાના ધોરણે મળશે. ફોર્મ ખાલી થઈ ગયા બાદ મળવાપાત્ર નથી. ફોર્મની વહેંચણીની શરૂઆત થઈ ગયેલ છે.

### ● B.Voc. માટે પ્રવેશ લાયકાત

૧. કોઈપણ પ્રવાહમાં ૪૦% સાથે ધોરણ-૧૨ પાસ કરેલું હોવું જોઈએ.
૨. કોર્સના વિદ્યાર્થીઓને અશ્રીમતા આપવામાં આવશે.
૩. પ્રવેશ મેરીટ લિસ્ટના આધારે મળશે.

### ● B.Voc. એડમિશન સીટ કેપેસિટી

૧. એડમિશન સીટ ફક્ત ૧૦૦ હોવાથી એટલાજ વિદ્યાર્થીઓને પ્રવેશ મળી શકશે.
૨. સરકારી કોર્સ હોવાથી કોઈપણ જાતનું ડેનેશન આપવામાં ભરમાવું નહીં.
૩. આ કોર્સમાં અનામત સુવિધા નથી.

### ● B.Voc.ના ફોર્મ મેળવવા સંપર્ક :

TISS SVE RAJKOT

C/o. સિસ્ટર નિવેદીતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કવોલિટી એજ્યુકેશન જલારામ પ્લોટ, યુનિવર્સિટી રોડ, રાજકોટ.

Call : ૭૩૮૩૩ ૩૭૫૯૬, ૯૮૨૫૬ ૨૮૯૧૦, ૮૧૨૮૬ ૬૮૯૫૭

E-mail : tiss.rajkot@gmail.com

### ● ખાસ સુચના :

ધોરણ-૧૨ પછી તુરત જ રોજગારી અને ભણતાર બંને આપતો આ એકમાત્ર કોર્સ છે. જો આપ કોઈ ધોરણ-૧૨ના વિદ્યાર્થીઓને જાણતા હો, તો એના માટે વહેલા તે પહેલાના ધોરણે તુરત જ ફોર્મ મેળવી લેવા વિનંતી છે.



## ખાસ જૈન વિદ્યાર્થીઓ માટે

અમેરિકા સ્થિત ઈન્ટરનેશનલ એલોમની એસોસિએશન ઓફ શ્રી મહાવીર જૈન વિદ્યાલય ટ્રસ્ટ દ્વારા ખૂબ જ સારા પ્રમાણમાં કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને લોન - સ્કોલરશીપ આપવામાં આવે છે. કાર્યવાહી સંભાળતા એક મહાનુભાવ આપણા શ્રી કચ્છી જૈન સેવા સમાજના સર્બ્ય છે. તો જે વિદ્યાર્થીઓએ આ યોજનાનો લાભ લેવો હોય તેમણે નીચેના સ્થળે સંપર્ક સાધવો.

### ● શ્રી ધનસુખલાલ મોતીલાલ શાહ

૧૧, પુનીત નગર નં.-૩, ઉમિયા વિજય સોસાયટી પાસે, સેટેલાઈટ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૧૫.

ફોન : (૦૭૯) ૨૬૭૫૪૪૭૦, મો. ૮૮૨૭૬ ૬૮૧૫૮

(અનુસંધાન : જુઓ પાના નં.-૮ ઉપર)

| ૭ NanoNine™ શાખા રમત-૧૧૫ સંકળન : ૨૭નીકાંત પારેન |    |    |    |    |    |    |    |    |    |    |  |
|---|----|----|----|----|----|----|----|----|----|----|--|
| ૧   |    | ૨  |    | ૩  |    | ૪  |    | ૫  |    | ૬  |  |
|   |    |    | ૭  |    |    | ૮  |    | ૯  |    |    |  |
| ૧૦  | ૧૧ |    |    | ૧૨ |    |    |    |    |    | ૧૩ |  |
| ૧૪  |    |    | ૧૫ |    | ૧૬ |    | ૧૭ |    | ૧૮ | ૧૯ |  |
|   |    |    | ૨૦ |    | ૨૧ | ૨૨ |    |    | ૨૩ |    |  |
| ૨૪  |    |    |    | ૨૫ |    |    |    |    |    |    |  |
| ૨૬  |    |    | ૨૭ |    |    |    | ૨૮ | ૨૯ |    | ૩૦ |  |
| ૩૧  |    |    | ૩૨ | ૩૩ |    | ૩૪ | ૩૫ |    |    |    |  |
|   |    | ૩૬ |    |    | ૩૭ |    | ૩૮ |    |    |    |  |
| ૪૨  |    | ૪૩ | ૪૪ |    |    |    | ૪૫ |    | ૪૬ | ૪૭ |  |
| ૪૮  |    |    |    | ૪૯ |    |    |    |    | ૫૧ |    |  |

૧૭૬ રમત ભરનારનું નામ : \_\_\_\_\_

સરનામું : \_\_\_\_\_

ફોન/મો.

આપણીના જવાબો શ્રી કંથી કેન ભવન - પાવડીના સરનામે માટેલા વિનંતી. (૧૭૬ રમતના જવાબ માટેલાવાની અંતિમ તારીખ : ૩૦-૪-૨૦૧૬)

**આડી ચાવીઓ**

૧. વહુ, ધરની માલિક સ્થી (૪)
૩. નકલ, ઉતારો (૪)
૪. લખાણ, ખત, ટૂંકો નિબંધ (૨)
૬. નિયમ (૨)
૭. એક મજબુત મોટર ગારી (૨)
૮. મત આપવાના અવિકારવાળો (૪)
૧૦. પાણી આવાજ જવા માટે બાંધેલો સાંકડો માર્ગ (૪)
૧૪. શરીર ઉપરના વાળ, રૂંબું (૨)
૧૫. અજવાળિયાની છેલ્લી તિથિ, પૂર્ણિમા (૩)
૧૭. મત ભિન્ન હોય તે (૪)
૧૮. ધાની વાત (૨)
૨૦. લીલું ઘાસ, ચારો, એક સંખ્યા (૨)
૨૧. ધાન આપનાર, દાનેશ્વરી (૩)
૨૨. તંતુ, દોરો, રેસો (૨)
૨૩. ગઢેડો (૨)

૨૪. આકાશ, આભ (૩)
૨૫. પરષ્ણવા જતો વર (૪)
૨૬. અંધારું, તમો ગુણ (૨)
૨૮. ગરીબ, રંક, લાચાર (૨)
૩૧. પ્રતિશા, ટેક, વચન (૨)
૩૨. કુદરતી બરફના ટુકડા (૨)
૩૪. આખરુ, પ્રતિષ્ઠા (૨)
૩૬. ખેડ્યા વિનારું, ખુલ્લું, ઈમારત વિનારું (૪)
૩૮. મને ગમતું (૪)
૩૯. ફૂલની મોટી માળા, પરાજ્ય (૨)
૪૦. નિષ્ઠણ ન નીવડે એવું અમોદ શશ્વ (૪)
૪૧. તીર (૨)
૪૩. વસ્તુ ભરવાનું નળાકાર એક પાત્ર (૩)
૪૫. છળ, પ્રપંચ, કારસ્તાન (૪)
૪૮. બુધ્ય, અક્ષલ, સમજ (૨)
૪૯. આલોચના, અવલોકન, નિરીક્ષણ (૪)
૫૦. આંખ, નયન (૩)

૫૧. જીવ વિનારું, બુધ્ય વિનારું (૨)

**ભાની ચાવીઓ**

૧. ધજા પકડનારો, ધજાનો દંડ (૪)
૨. દુઃખ, કષ્ટ, પીડા (૩)
૩. તિરસ્કાર, માનહાનિ (૪)
૪. લીલુના રસનું શરબત (અ) (૩)
૫. કાગળ, પત્ર, ચિહ્ન (હિ) (૨)
૬. પાણી, જળ (૨)
૮. અંતઃકષા, દિલ, ઈચ્છા, મરજી (૨)
૯. નોતરું, મિજબાની (અ) (૩)
૧૧. અસત્યસત્ત (૬)
૧૨. આખરુ, પ્રતિષ્ઠા, આદર (૨)
૧૩. મુખ્ય, વહુ, શ્રેષ્ઠ, પ્રમુખ, સભાપતિ (૩)
૧૫. નવા પાણીનું નદીમાં જોરાબંધ આવવું તે (૨)
૧૬. આધાર, ભરોસો (૩)
૧૭. પુષ્ટિ માર્ગના આચાર પ્રમાણે ચાલનારું (૪)
૧૮. જુસ્તુટો ટેકરાનો ખૂણો, કરાડ (૩)
૧૯. પ્રાણીઓએ જગતમાં રહેવા કરેલું કાણું, ભાવ, કિંમત (૨)
૨૨. તારો, આંખની કીકી, રાજા હરિશ્ચંદ્રની પત્ની (૨)
૨૩. ઘાસ, કડબ, નકારું ઘાસ (૨)
૨૪. છતર, છત્રી (૪)
૨૫. વડ, આખરુ (૨)
૨૭. પકડવું તે, પકડવાનું એક ઓજાર (૩)
૨૮. નવાં પાનવાળી ડાળી, કુપળ (૫)
૩૦. વાલીનો પુત્ર, બાજુબંધ (૩)
૩૧. ચિહ્ની, કાગળ, પાંદડું (૨)
૩૩. રાણ ઊગતા ફૂલનો છોડ (૪)
૩૫. નમવું તે, દેવપૂજાનું પાણી (૩)
૩૬. પાણી પીવાની સાર્વજનિક જગ્યા (૩)
૩૭. શરાબનો એક પ્રકાર (૨)
૪૦. રાજાની સ્થી (૨)
૪૧. બાફેલી કેરીનો રસ (૩)
૪૨. વીસ ઘા (કાગળ) (૨)
૪૪. માર્ગ, રાહ (૨)
૪૫. સાંભળવાની ઠિન્દ્રિય, નાકું, છિદ્ર (૨)
૪૬. એક તેજાનો (૨)
૪૭. માથું, તોંકું, બોંકું, અપંગ (૨)

શરીરના શાશ્વત ભલે  
સોનું અને ચાંદી હોય,  
આત્માના અલંકાર તો સદ્ગુણ  
અને સાદાઈ જ છે.

## જાણવા જેવું

(અનુસંધાન : પાના નં.-૮૨ ઉપરથી ચાલુ)

અન્તે

### ડૉ. સુનિલ એન. શાહ

૧૪/૧૦, વીર વિજય સોસાયટી, સંધવી હાઈસ્કુલ પાસે,  
નારાણપુરા, અમદાવાદ-૩૮૦ ૦૧૩.

ફોન : (૦૭૯) ૨૭૪૧૭૭૮૮ મો. ૮૮૨૪૦ ૬૮૭૧૬



ધોરણ-૧૦માં ૮૦ ટકાથી વધારે માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીને  
આગળ અભ્યાસ માટે આર્થિક સહાયની જરૂરત હોય તેમણે  
NGO Prerna (Supported by Infosys Foundation)

નો સંપર્ક કરવો. આ NGO રીટન ટેસ્ટ લેશે અને તેમાં સફળતા  
મેળવનારને આર્થિક સહાય કરશે. આ માટે તેમણે નીચેના  
સરનામે સંપર્ક સાધવો.

580, Shubhakar, 44th Cross,  
1st A, Main Road, Jaynagar, 7th Block,  
**Bangalore.**

### ■ CONTACT NO. :

- |                  |                |
|------------------|----------------|
| 1. Ms. Saraswati | M. 99009 06338 |
| 2. Mr. Shivkumar | M. 99866 31301 |
| 3. Ms. Bindu     | M. 99645 34667 |

E-mail : [www.infosys.com/infosys-foundation](http://www.infosys.com/infosys-foundation)

## ૭ NanoNine™ શબ્દ રમત-૧૧૪નો ઉકેલ

|    |     |    |    |    |    |    |    |    |    |    |    |
|----|-----|----|----|----|----|----|----|----|----|----|----|
| કો | હિ  | નૂ | ર  |    | અ  | મી |    | વા | સુ | કિ |    |
| થ  |     | પુ |    | રા | ખ  |    |    |    | ડો | ન  |    |
| મી | ટ   | ર  |    |    | રો | મ  | ન  |    | લ  | આ  | દા |
| ર  | સ   |    |    |    | ટ  | દુ | કા | ર  |    | બ  |    |
|    | ર   | જ  | ની |    |    | ડો | ર  |    | પા |    | ન  |
| ક  |     | ર  | ર  | લ  |    |    |    | ઉ  | ર  | દ  | મ  |
| થ  |     | ર  | જ  | વા | ડી |    |    |    |    | રા | ન  |
| રો | હિ  | ત  |    | દ  | ન  |    | પા | ને | ત  | ર  |    |
| ટ  | ચ   |    | પ  |    |    |    | ર  | ક  | મ  |    |    |
|    | કા  |    | ર  |    | જ  | ણ  | સ  |    | ના |    | બ  |
| આ  | રું |    | વ  |    | ટા |    | મ  | હી |    | ક  | દા |
| ઘ  |     |    | શ  | તા | ગુ |    | ણિ |    | ગુ | લા | મ  |

માસ ફેબ્રુઆરી-૨૦૧૬ના અંકમાં છ્યાયેલ નેનો શબ્દ રમત-૧૧૪ના  
વધા સાચા ઉકેલ મોકલાવનારના નામ

૧. સરલાબેન શાહ - અમદાવાદ
૨. ચંદ્રાબેન શાહ - સેટેલાઈટ, અમદાવાદ
૩. સ્મિતા શાહ - અમદાવાદ
૪. વર્ષી પારેખ - અમદાવાદ
૫. કિશોર શાહ - અમદાવાદ
૬. સરોજ શાહ - અમદાવાદ
૭. જશવંત કોઠારી - અમદાવાદ
૮. કુસુમ ત્રેવાડિયા - અમદાવાદ
૯. લક્ષ્મીબેન ખરી - અમદાવાદ

૧૦. વિનોદ મહેતા - અમદાવાદ
૧૧. કશિશ શાહ - અમદાવાદ
૧૨. શાંતિભાઈ શાહ - અમદાવાદ
૧૩. હર્ષ પરીખ - અમદાવાદ
૧૪. ચંદ્રાબેન શાહ - ભડ્કા, અમદાવાદ
૧૫. વાસંતી વોરા - અમદાવાદ
૧૬. નવલ શાહ - અમદાવાદ
૧૭. પ્રતિમા શાહ - અમદાવાદ
૧૮. અરવિંદ ભણ - અમદાવાદ
૧૯. જયંતી મહેતા - અમદાવાદ
૨૦. હસમુખ ટેઢિયા - અડાલજ
૨૧. નવલભેન નીસર - સુરત
૨૨. સરોજ ચંદુરા - સુરત
૨૩. પ્રદીપ ખોના - ગાંગા
૨૪. નવીન લાલકા - ગાંગા
૨૫. કુમુદ શાહ - સિકંદ્રાબાદ
૨૬. પ્રભા શેઠિયા - વલસાડ
૨૭. શોભના દંડ - અંકલેશ્વર
૨૮. હર્ષી જ્યેશ મહેતા - અમદાવાદ
૨૯. સરોજ શાહ - અગાસ
૩૦. પ્રહુલ્લ શાહ - અગાસ
૩૧. ભાનુ જી. શાહ - અમદાવાદ

એપ્રિલ સાચા જવાબ મોકલાવનારાઓમાંથી લક્કી ડો કરતાં, તજા  
વિજેતાઓનાં નામ નીચે પ્રમાણે છે. તેઓને પોતાના ઇનામો સમજાના  
પાલકી ખાતેના કાર્યાલયમાંથી મોબાઇલ નંબર : ૮૮૮૮૦ ૫૩૪૨૧  
૫૨ જાણ કરી મેળવી લેવા વિનંતી છે.

૧. કુસુમ ત્રેવાડિયા - અમદાવાદ
૨. કુમુદ શાહ - સિકંદ્રાબાદ
૩. કશિશ શાહ - અમદાવાદ

## NanoNine™ Sudoku

**શરૂઆત :** (૧) ૧થી ૮ના અંકડા જિલ્લી-આડી લાઈનમાં ફક્ત એક જ વખત હોવા જોઈએ. (૨) ૧થી ૮ના અંકડા ૩ X ૩ ના ચોકટામાં પણ એક જ વખત હોવા જોઈએ.

કેલુલારી-૨૦૧૬ના અંકમાં છપાયેલ

સુડોકુ-૧૦૦૦૦ના બધા જ્ઞાન ઉકેલ મોકલનારના નામ

૧. અન્નપૂર્ણ મહેતા
૨. રૂપિકા મહેતા
૩. ઉષા શાહ
૪. સરોજ શાહ
૫. સિમતા શાહ
૬. ચંદ્રા શાહ
૭. ધર્મિષા શાહ
૮. કશિશ શાહ
૯. શાંતિલાલ શાહ
૧૦. પ્રતિમા શાહ
૧૧. અવંતી દંડ
૧૨. કલ્યાણ વસા
૧૩. વિનોદ મહેતા
૧૪. જ્યેષ્ઠ મહેતા
૧૫. ખુશી વોરા
૧૬. હર્ષ વોરા
૧૭. નીના ગોરજ
૧૮. નિમિષ વોરા
૧૯. નેહા ભાવેશ પારેખ
૨૦. પ્રભા શેઠિયા
૨૧. મહેન્દ્ર શાહ
૨૨. હર્ષદ ગાંધી
૨૩. હેમલતા ટેઢિયા
૨૪. મૂલકુમારી લાલકા
૨૫. સોનલ શાહ
૨૬. સરોજ શાહ

ઉપર્યુક્ત જવાબ મોકલાવનારાઓમાંથી લક્કી દ્વારા અનુસાર નજી વિઝેતાઓ નીચે પ્રમાણે છે. તેઓએ પોતાના ઈન્યામો પાવતી ભવન ખાતેના કાર્યવિધાનમાંથી મોબાઇલ નંબર :

૮૮૮૮૦ ૫૩૫૨૧ ફોન પર જગ્યા કરી મેળવી લેવા વિનંતી.

વિઝેતાઓ :

૧. ખુશી વોરા - અમદાવાદ
૨. કલ્યાણ વસા - અમદાવાદ
૩. સોનલ શાહ - નાગપુર

ઉકેલ :  
કુંઠા - ૧૦૭૧  
કુંઠા - ૧૦૭૧

|   |   |   |   |   |   |   |   |   |
|---|---|---|---|---|---|---|---|---|
| 2 | 9 | 6 | 7 | 3 | 4 | 8 | 5 | 1 |
| 4 | 5 | 7 | 9 | 8 | 1 | 6 | 2 | 3 |
| 3 | 1 | 8 | 2 | 5 | 6 | 4 | 9 | 7 |
| 6 | 8 | 9 | 5 | 2 | 7 | 1 | 3 | 4 |
| 5 | 7 | 4 | 1 | 9 | 3 | 2 | 6 | 8 |
| 1 | 3 | 2 | 6 | 4 | 8 | 9 | 7 | 5 |
| 7 | 6 | 5 | 4 | 1 | 2 | 3 | 8 | 9 |
| 8 | 2 | 1 | 3 | 7 | 9 | 5 | 4 | 6 |
| 9 | 4 | 3 | 8 | 6 | 5 | 7 | 1 | 2 |

A

|   |   |   |   |   |   |   |   |   |
|---|---|---|---|---|---|---|---|---|
| 6 | 1 | 9 | 5 | 8 | 2 | 3 | 4 | 7 |
| 4 | 2 | 7 | 9 | 1 | 3 | 8 | 6 | 5 |
| 5 | 8 | 3 | 6 | 4 | 7 | 1 | 2 | 9 |
| 1 | 6 | 4 | 7 | 2 | 8 | 9 | 5 | 3 |
| 7 | 9 | 5 | 1 | 3 | 6 | 4 | 8 | 2 |
| 8 | 3 | 2 | 4 | 5 | 9 | 6 | 7 | 1 |
| 9 | 4 | 1 | 8 | 7 | 5 | 2 | 3 | 6 |
| 3 | 5 | 8 | 2 | 6 | 1 | 7 | 9 | 4 |
| 2 | 7 | 6 | 3 | 9 | 4 | 5 | 1 | 8 |

B

|   |   |   |   |   |   |   |   |   |
|---|---|---|---|---|---|---|---|---|
| 2 | 8 | 7 | 3 | 6 | 9 | 1 | 4 | 5 |
| 5 | 4 | 6 | 8 | 2 | 1 | 9 | 3 | 7 |
| 9 | 3 | 1 | 5 | 4 | 7 | 8 | 6 | 2 |
| 4 | 2 | 9 | 1 | 8 | 5 | 3 | 7 | 6 |
| 7 | 5 | 8 | 4 | 3 | 6 | 2 | 9 | 1 |
| 6 | 1 | 3 | 9 | 7 | 2 | 4 | 5 | 8 |
| 1 | 7 | 5 | 2 | 9 | 3 | 6 | 8 | 4 |
| 8 | 9 | 2 | 6 | 5 | 4 | 7 | 1 | 3 |
| 3 | 6 | 4 | 7 | 1 | 8 | 5 | 2 | 9 |

C

|   |   |   |   |   |   |   |   |   |
|---|---|---|---|---|---|---|---|---|
| 7 | 4 | 9 | 1 | 3 | 6 | 5 | 2 | 8 |
| 3 | 6 | 8 | 5 | 2 | 9 | 7 | 1 | 4 |
| 1 | 2 | 5 | 7 | 8 | 4 | 6 | 3 | 9 |
| 5 | 9 | 2 | 4 | 7 | 3 | 8 | 6 | 1 |
| 8 | 1 | 7 | 9 | 6 | 2 | 4 | 5 | 3 |
| 4 | 3 | 6 | 8 | 5 | 1 | 9 | 7 | 2 |
| 6 | 5 | 1 | 3 | 9 | 8 | 2 | 4 | 7 |
| 9 | 7 | 3 | 2 | 4 | 5 | 1 | 8 | 6 |
| 2 | 8 | 4 | 6 | 1 | 7 | 3 | 9 | 5 |

D

## NanoNine™ Sudoku

રજનીકાંત પટેલ (ECCCO ૫૩૪૨)

સુડોકુ ક્રમાંક-૧૦૭૨ અને રજૂ કરવામાં આવે છે. તેના ચારે ભાગ ભરીને 'મંગલ મંદિર' કાર્યાલય પર મા. ૩૦-૪-૨૦૧૬ સુધીમાં મોકલી આપવા વિનંતી. તદ્દન ખરા જવાબો મોકલનારનાં નામ જૂન-૨૦૧૬ના અંકમાં પ્રસારિત કરવામાં આવશે.

સુડોકુ ભરનારનું નામ : \_\_\_\_\_

સરનામું : \_\_\_\_\_

ફોન/મોબાઈલ : \_\_\_\_\_

A

ક્રમાંક - ૧૦૭૨

B

|   |   |   |   |   |   |   |   |  |
|---|---|---|---|---|---|---|---|--|
| 5 | 9 |   | 3 |   | 7 |   | 5 |  |
|   |   | 4 | 3 | 2 | 9 |   |   |  |
| 3 |   |   | 1 | 9 |   |   |   |  |
| 8 | 7 |   |   |   | 3 | 9 |   |  |
|   |   | 7 | 3 |   |   | 2 |   |  |
| 2 |   | 5 | 4 | 6 |   |   |   |  |
| 6 |   | 1 |   |   | 4 | 5 |   |  |
| 3 |   | 6 | 9 |   |   |   |   |  |

|   |   |   |   |   |   |  |   |   |
|---|---|---|---|---|---|--|---|---|
| 8 |   | 1 | 5 |   | 4 |  |   | 9 |
|   |   | 8 |   | 6 |   |  |   | 5 |
| 7 |   | 2 | 8 |   |   |  |   | 4 |
| 8 | 9 |   | 6 |   |   |  |   | 1 |
|   |   | 7 |   |   | 8 |  | 6 |   |
| 2 |   |   | 9 |   | 5 |  | 7 | 3 |
| 8 |   |   | 6 |   | 1 |  | 7 | 2 |
| 5 |   |   | 3 |   | 4 |  |   |   |
| 3 |   |   | 7 | 8 | 2 |  |   |   |

C

D

|   |   |   |   |   |   |   |   |   |
|---|---|---|---|---|---|---|---|---|
| 6 | 1 | 9 | 5 | 8 | 2 | 3 | 4 | 7 |
| 4 | 2 | 7 | 9 | 1 | 3 | 8 | 6 | 5 |
| 5 | 8 | 3 | 6 | 4 | 7 | 1 | 2 | 9 |
| 1 | 6 | 4 | 7 | 2 | 8 | 9 | 5 | 3 |
| 7 | 9 | 5 | 1 | 3 | 6 | 4 | 8 | 2 |
| 8 | 3 | 2 | 4 | 5 | 9 | 6 | 7 | 1 |
| 9 | 4 | 1 | 8 | 7 | 5 | 2 | 3 | 6 |
| 3 | 5 | 8 | 2 | 6 | 1 | 7 | 9 | 4 |
| 2 | 7 | 6 | 3 | 9 | 4 | 5 | 1 | 8 |



સંકલન : દિનેશચંદ્ર જગજીવન શાહ

- ★ કચ્છની અખબારી આલમના પીઠ પત્રકાર, અંજારના અમૃતલાલ હીરજી પંચાનું તા. ૧૭-૨ના રોજ હદ્યરોગના હુમલાથી મૃત્યુ થયેલ છે. કચ્છે એક સાચા અને સંનિષ્ઠ પત્રકાર ગુમાવેલ છે. કચ્છના મુખ્ય અખબાર 'કચ્છમિત્ર'ની સ્થાપના સમયથી તેઓ સંકળાયેલા હતા. તેમની સ્મશાન યાત્રા બેન્ડવાજી પર ધાર્મિક ધૂન સાથે અંજારમાં નીકળી હતી.
- ★ **પર્યટન - વિકાસ ક્ષેત્ર :** ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન શ્રીમતી આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં યોજાનારા ટ્રાવેલ માર્ટમાં ૫૦ એમ.એ.યુ. થકી રૂ. ૨૫૪૭ કરોડનું રોકાણ આવે તેવી સંભાવના છે. રાજ્યના પ્રવાસન મંત્રી સૌરભભાઈ પટેલે કચ્છના વિષ્યાત સફેદ રણની સાથે ધોળવારાનો વિકાસ કરવાનું આયોજન હોવાનું જણાવેલ હતું. જે પ્રવાસીઓનું આકર્ષણ બની રહેશે. સફેદ રણમાં ૭૫૦ મકાનો ઊભા કરાયેલ છે, જેમાં વધારો પણ કરવામાં આવશે. પ્રવાસન સ્થળે પહેલી વખત આવું થયેલ છે. વર્ષ ૨૦૧૪-૧૫માં ૨.૫૦ લાખ પ્રવાસીઓએ સફેદ રણની મુલાકાત લીધેલ. જેમાં ૧૨૪૦૦ જેટલા વિદેશી પ્રવાસીઓ હતા. આ ટ્રાવેલ માર્ટમાં અત્યાર સુધી ૭૫ જેટલા રોકાણકારોએ અંદાજિત ૨૦૦૦ કરોડના પ્રવાસન ક્ષેત્રે મૂડી રોકાણમાં રસ દાખલ્યો છે.
- ★ **સાહિત્ય તવારીખ ગાથા :** તાજેતરમાં ભુજમાં મળેલ સાહિત્ય પરિષદમાં 'કચ્છનું ગુજરાતી સાહિત્ય' નામનું પુસ્તક રજૂ કરાયેલ હતું. જેનું સંપાદન હરેશ ધોળકિયા દ્વારા તથા પ્રકાશન રસનિધિ અંતાણી, ઈન્સિટ્યુટ ઓફ યુથ ડેવલપમેન્ટ દ્વારા બહાર પડેલ છે. જેમાં કચ્છની સાહિત્ય સર્જન પ્રવૃત્તિનો વ્યવસ્થિત ઈતિહાસ તૈયાર કરવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે.
- ★ **કુટિર અને ગ્રામોધોગ નીતિ :** રાજ્યના કુટિર ઉદ્યોગપ્રધાન સૌરભ પટેલ દ્વારા આ નવી નીતિમાં કચ્છની લુમ થતી નીરોજા - કચ્છની રોગાણ કળા, વાઢા કોલીની કાષકલા અને મુદ્રાની નામદા કલાના પુનરુત્થાન માટે પાઈલોટ પ્રોજેક્ટ તરીકે 'વન વિલેજ વન પ્રોડક્ટ'ને ઉચ્ચ્ય

ગુણવત્તાયુક્ત ઉત્પાદન કરી તેને વેચાણમાં પણ વળતર આપવાની યોજના છે.

- ★ **પશુપાલન શિબિર :** વેસલપર (રેહા) ગામે જિલ્લા નિયામકના અધ્યક્ષ સ્થાને મળેલ પશુપાલન શિબિરમાં માહિતી અપાઈ હતી કે કચ્છના કંકરેજ ગાય દૂધ ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે. પશુના આહાર માટે ઘાસના નાના ટુકડા કરી આપવાથી ઘાસની બચત થાય છે તેમજ ગાયને ખાણમાં અથવા નીરણમાં નમકના વપરાશથી ગાયની તંદુરસ્તી અને દૂધ ઉત્પાદનમાં લાભ થાય છે.
- ★ **નર્મદા નીર :** ગુજરાત રાજ્યના બજેટમાં નર્મદાની કચ્છ બ્રાંચ કેનાલ માટે એક હજાર કરોડથી વધુની ફાળવણી સરકારે કરેલ છે. આ ફાળવણી કચ્છની કૃષિ અંગે કાયાપ્લટ કરનારી અને ખેતી માટે સંજીવની બની રહેશે તેવી લાગણી વ્યક્ત કરાઈ છે.
- ★ **ટ્યુકડી જાહેરાત :** તાજેતરમાં કચ્છી વીસા ઓસવાળ જેન સમાજની 'ખબર પત્રિકા'માં લગ્ન અંગેની ટ્યુકડી જાહેરાતે વિવાદ જગાવ્યો છે. જેમાં જણાવાયું હતું કે 'મુંબઈ સ્થિત ગર્ભશ્રીમંત યુવતી માટે ડોંબીવલી (મુંબઈનું એક પરુ) સિવાય મુંબઈમાં ક્યાંય પણ રહેતો હોય તેવા વેલસેટલ યુવકોએ સંપર્ક કરવો' આના કારણે ડોંબીવલી સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે.
- ★ **નેપાળના વડાપ્રધાન કચ્છની મુલાકાતે :** કચ્છના ભયાનક ભૂકંપ બાદ રૂ. ૨૨ કરોડના ખર્ચે નવસર્જન પામેલ ભીમાસર ગામની મુલાકાત દરમ્યાન નેપાળના વડાપ્રધાન ખડગપ્રસાદે નવસર્જનની વિસ્તૃત માહિતી મેળવી હતી. તે સમેતે મુંબઈ સ્થિત ઉદ્યોગગૃહો આરતી ચુપ, એક્સલ, નવનીત ચુપ, એસ.પી.એમ. જેવી સંસ્થાઓ દ્વારા નેપાળના ભાતોશિયા ગામે પ્રથમ તબક્કામાં ૫૦૦ જેટલા મકાનો રૂ. ૧૫ કરોડના ખર્ચે બનાવી આપવાની દરખાસ્ત રાજ્યમંત્રી તારાચંદ છેડા દ્વારા ૨૪૪ કરેલ હતી.
- ★ **કોલેજ મંજૂરી :** રાજ્યના બજેટમાં લખપત તાલુકાના દ્યાપર ગામ ખાતે આર્ટસ, કોમર્સ કોલેજ મંજૂર કરાતાં દ્યાપર સારસ્વતમું સંચાલિત હાઇસ્ક્યુલમાં વિદ્યાર્થીઓમાં તેમજ લોકોમાં આનંદ ફેલાયો હતો.
- ★ **જળમંદિર અભિયાન :** મુંબઈ સ્થિત આરતી ફાઉન્ડેશન દ્વારા નાના રણમાં મોડક બેટ ખાતેના વરુણેશ્વર તળાવની જળસંગ્રહ શક્તિ વધારવા રૂપીયા ૨,૨૦,૦૦૦/-ના ખર્ચે શારકામ કરવામાં આવેલ છે. જેથી ધુડ્યાર પણ પક્ષીઓને પીવાના પાણીની રાહત થઈ છે.
- ★ **રાષ્ટ્રીય સિદ્ધિ :** નેશનલ ઈન્સિટ્યુટ ઓફ કો-ઓપરેટીવ

મેનેજમેન્ટ આરોહણ-૨૦૧૬ની સ્પર્ધા દેશમાંથી આવેલ ૫૦૦ જેટલા સ્પર્ધકોમાંથી ભુજના ચા ના વેપારી સુભાષભાઈ ઠક્કરના પુત્ર મનન ઠક્કરે 'ધ વિજનરી કોસન્ટ ડિસ્ટ્રિબ્યુઝન' એન્ડ સ્ટ્રેટજી' વિષયમાં પોતાની આવડત અને આગવા હુશ્રણું પ્રદર્શન કરી પ્રથમ સ્થાન મેળવી કર્યાનું નામ રોશન કરેલ છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે આયોજિત રાષ્ટ્રીય સ્પર્ધામાં શ્રી ઠક્કરે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

★ **રણોત્સવ સમાપન :** ૧૮ નવેમ્બર, ૨૦૧૫થી ૧ માર્ચ, ૨૦૧૬ સુધી ચાલેલ ૧૦૫ દિવસના કર્યાના ધોરડોના સફેદ રણમાં યોજાયેલા રણોત્સવ દરમ્યાન કુલ ૧૭,૨૮,૪૬૫ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. જેમાં સરકારને રૂ. ૧,૨૮,૭૧,૭૦૦/-ની આવક થઈ છે. આ રણોત્સવ દરમ્યાન દેશ વિદેશના રાજ્યોનું, રાજકીય મહાનુભાવો તથા પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. જેમાં ૧૮થી ૨૦ ડિસેમ્બર દરમ્યાન ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ડી.જે. કોન્ફરન્સનું પણ આયોજન કરાયું હતું.

★ **સિદ્ધ્ય :** મૂળ કર્યાના રાશપરના અને હાલ મુંબઈ સ્થિત કર્યી દશા ઓસવાળ જૈન જ્ઞાતિના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ખીમજી કુંવરજી એન્ડ કું. - મુંબઈના ભાગીદાર, નીલેશ શિવજી વિકમશી સી.એ.ના રાષ્ટ્રીય સંગઠનમાં ઉપપ્રમુખપદે વર્ષ ૨૦૧૬-૧૭ માટે નિયુક્તિ પામેલ છે. તેઓ નવનીત એજયુકેશન લિમિટેડ જેવી નામી અનેક સંસ્થાના ડિરેક્ટર છે.

★ **સૌર ઊર્જા પ્લાન્ટ :** મુંદ્રા તાલુકાના મોટી તુંબડી, રામાણિયાની એકરોના હિસાબે ખાલી પડેલ જમીન ઉપર એક અંતરરાષ્ટ્રીય કંપની દ્વારા સૌર ઊર્જાના મોટા પ્લાન્ટની આવવાની શક્યતા છે.

★ **સાક્ષરતા :** પાવર પદ્ધીના મુખ્ય મથક નીરોષા ગામે સાક્ષરતા અભિયાન હેઠળ ભુજના સ્વામિનારાયજી સંસ્થાના છાત્રો દ્વારા ચોકાવનારું સંશોધન બદાર આવ્યું છે જેમાં જણાવાયું છે કે ગામના ૫૦ ટકા લોકો અભિના આવવાની શક્યતા છે.

★ **અબડાસા ન્યાય :** કર્યાના ધર્મના ભંડાર તરીકે જાણીતા અબડાસાના પિયત ક્ષેત્રમાં રવિ પાક ધર્મનું ભારે વાવેતર બાદ સાનુકૂળ વાતાવરણ પ્રાપ્ત થતાં ૭૦થી ૮૫ કરોડના ધર્મ તૈયાર થયેલ છે. આ પાક ઉત્તારવા અબડાસામાં વસેલા પંજાબના બેડૂતોએ 'કંબાઈન્ડ હાર્વેસ્ટર' નામના ઉપકરણ પંજાબથી મંગાવેલ છે. આ વખતે એકર દીઠ ઉપર્થી ૪૦

મણ જેટલો ધર્મનો પાક ઉત્તરશે તેવી શક્યતા બેડૂતો દરખાવે છે. આ સીઝનમાં ૩૦થી ૩૫ હજાર એકરમાં ધર્મનું વાવેતર કરાયું છે.

★ **કમાંગરી કળા :** ૪૦૦-૫૦૦ વર્ષ પહેલાં મુસ્લિમ કારીગરોના હાથે સર્જયેલા કમાંગરી કળાના ચિત્રો અંજારમાં કેટન મેકમર્ડોના બંગલાની દીવાલો પર, ભુજના આઈના મહેલમાં, મુંદ્રામાં કલુભા વાધેલાની હવેલીમાં અને તેથી પણ વધુ જૂના ચિત્રો ધીણોધર નજીક થાન જાગીરના ઉપલા માળે, બિબદ્ધરના રામ મંદિરમાં અને અમુક જૈન દેરાસરોમાં ચિત્રિત થયેલ છે. આ ચિત્રકળા સાચવવાની વેદના તાજેતરમાં પોતાના કર્ય પ્રવાસ દરમ્યાન આવેલ મુંબઈની પ્રસિધ્ય જે.જે. સ્કૂલના નિવૃત્ત પ્રોફેસર પરેશભાઈ દરુ (છેલ પરેશ)એ વ્યક્ત કરેલ હતી.

★ **રાષ્ટ્રીય એવોર્ડ :** 'પાબી બેગ'થી હોલીવુડ સુધી વિખ્યાત કર્યાની હસ્તકળાના માહિર મહિલા કારીગર પબીબેન રબારીને દિલહીના ઈન્ડિયા હેબીટેટ સેન્ટર ખાતે ગોઠવાયેલ સમારોહમાં સુશ્કમ, લઘુ અને મધ્યમ ઉદ્ઘોગના કેબીનેટ મંત્રી કલરાજ મિશ્રાના હસ્તે ઉત્કૃષ્ટ પારંપરિક કળાનો રાષ્ટ્રીય એવોર્ડ આપવાનું નક્કી થયેલ છે.

★ **કર્ચી ભાષાનો અધિકાર :** બાબાણી બોલી કર્ચી ભાષા અંગેની માન્યતાના અધિકાર બાબતે તાજેતરમાં લુજ ખાતે યોજાયેલ સાહિત્યકારોના સન્માનિત કાર્યક્રમમાં અવાજ ઉઠાવવામાં આવેલ હતો. આ સમારંભમાં કર્ચી સાહિત્યકારોને 'કર્ચી સાહિત્ય રત્ન' એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ હતા. આ અવસરે કર્ચી ભાષા સાહિત્ય માટે આયું આયું ખર્યનાર માધ્યમ જોખી 'અશ્ક' કર્ચી ભાષાને બંધારણીય માન્યતા મળે તે માટે રાજ્ય તથા કેન્દ્ર સરકારને ઠારવ મોકલવાની રજૂઆત કરેલ. આ ગ્રસંગે ઉપસ્થિત રહેનાર રાજ્યમંત્રી તારાચંદ્રાંએ વ્યક્તિગત રીતે આ બાબતમાં સહયોગ આપવાની ખાતરી આપેલ હતી.

★ **માવઠાનો માર :** ઉત્તર ભારતમાં હિમવર્ષ અને વરસાદ અને ગુજરાતમાં માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં બદલાયેલા હવામાનના મિજાજને કારણે કર્ચીમાં કમોસમી વરસાદે દેખા દીધી. વાગડાના ખડીર પ્રાંતથી આર્થિક નગરી ગાંધીધામ સુધી વરસાદે છીડી પોકારેલ હતી. જેના કારણે જીરુ, ઈસબગુલ પકવનારા બેડૂતોના પાકમાં નુકસાનીના

| કોટન બેગમાં પરવકે તેવી રેન્જ | વિશેષતા : હોલ્સેલ ભાવે રીટેલ |
|------------------------------|------------------------------|
| ● ગરવાલ                      | ● કોરા કોટન                  |
| ● સુપરનેટ કોટા               | ● ટીસ્ટ્યુ કોટા              |
| ● ફેન્સી કોટા                | ● જૈન સિલ્ક                  |
| ● યંદેરી ટેમ્પલ              | ● પ્રિન્ટેડ જ્યોર્જેટ        |



“કાંચી”ની સાડી વાહ... વાહ... !!

મીનલ દેટિયા • ૦૯૯૩૦૭૦૪૭૪૩

**KANCHI A Blend of Indian Heritage**

૭૧/૭૩, શાહ ભુવન, ગ્રાઉન્ડ ફ્લોર, જુની હનુમાન લેન, કાલબાટેવી, સુંબઈ-૪૦૦ ૦૦૨.

Tel. : (022) 22060636 E-mail : sareekanchi@gmail.com Sunday Closed

ઓળા ફરી વધ્યા છે. વાતાવરણમાં પલટો આવવાથી સવાર-સાંજ ઠડક તથા બપોરના આકરો તાપ પરી રહેલ છે.

★ **ગંભીર બિમારીના ઓછાયા તળે અભડાસા :** અભડાસા તાલુકાના અનેક ગામોમાં કેન્સરની બિમારીએ માથું ઊંચકું છે. સ્થાનિકે તેમજ તાલુકા કક્ષાએ નિદાનની કોઈ સુવિધા ન હોતા લોકો ભયંકર બિમારીનો ભોગ બની રહ્યા છે. અને જ્યારે નિદાન થાય છે ત્યારે ખૂબ જ મોંઝ થઈ ગયું હોય છે. આ માટે ગ્રામ જાતની બિમારી અંગે લોકજગૃહિ ઉભી કરવામાં આવે તેમજ ઘર આંગણે સારવારની વ્યવસ્થા ગોઠવાય તેવી માંગણી ઉઠી છે. આ વિસ્તારમાં આવી જીવલેણ બિમારીના કારણે પ૦થી પ૫ વર્ષની ઉમરની ઘણી વ્યક્તિઓ ફાની દુનિયા છોડી ગઈ છે.

★ **દીટ એન્ડ રન :** ગાંધીધામના ઈફ્કો ગેટની સામે બસની રાહમાં ઉભેલા દર જણને નભીરાએ બેફામ કાર દોડાવી હડકેટે લેતાં ગ્રામ જણાનું મૃત્યુ થયું હતું જ્યારે દર જણા ઘાયલ થયા હતા. આ અંગેની તપાસમાં શિર્પિંગ ઉદ્યોગપતિનો પુત્ર પંક્લિસ સુનિલ મોતા કાર ચલાવતો હોવાનું જાણવા મળેલ. જે ભાગી જતાં, પોલીસે બે દિવસ બાદ આબુરોડીથી ધરપકડ કરેલ.

★ **નર્મદા યોજના ફાળવણી :** વર્ષ ૨૦૧૩-૧૪ અને ૨૦૧૪-૧૫ના વર્ષ માટે નર્મદા યોજના માટે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર પાસે કરવામાં આવેલ ૨૪૭૮.૦૧ કરોડ રકમની માંગણી બદલ કેન્દ્ર સરકાર દ્વારા માત્ર ૧૬૪૧.૫૦ કરોડ ફાળવવામાં આવતા ૮૭૬.૫૧ કરોડની રકમ ઓછી મળેલ છે. ગુજરાત સરકાર દ્વારા નર્મદા યોજના અંતર્ગત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તથા રાજ્યસ્થાનની સરકારો પાસેથી ૫૪૬૮.૪૮ કરોડની રકમ વસુલવાની બાકી છે. જે અંગે રાજ્ય સરકાર દ્વારા કોઈ પ્રયત્નો કરવામાં આવતા નથી તેવું કોંગ્રેસના શૈલેષ પરમારે વિધાનસભા ગૃહમાં ચર્ચા દ્વારા જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૫-૧૬માં નર્મદા યોજનાના બાંધકામ ખર્ચ પાછળ ઉપ૨૪૮.૫૬ કરોડના ખર્ચ સાથે કુલ ખર્ચ ૫૧૭૨૦ કરોડનો થયો છે.

★ **ભચાઉ નજીક ધરતી કંપન :** તા. ૧૫-ઉના રોજ સવારે દર ૪૪ કલાકે ૪.૦૧ની તીવ્રતાનો ધરતીકંપનો આંચકો ભચાઉ નજીક અનુભવાયેલ હતો. આ ધરતીકંપના આંચકાનું કેન્દ્રબિંદુ ભચાઉથી દર ક્રિ.મી. દૂર જમીનમાં ૧૮.૩૦ ક્રિ.મી.

ગૃહ ઇન્સિટ્યુટ ઓફ સિસ્મોલોજિક રિસર્ચની વેબસાઈટ અનુસાર નોંધાયેલ હતા. કંપનના આશરે ગ્રામ કલાકમાં એક મિનિટના અંતરે ૨.૪ અને ૧.૮ની તીવ્રતાના વધુ બે આંચકા નોંધાયેલ હતા. આઈ.એસ.આર. વેબસાઈટ અનુસાર જિલ્લામાં પરોઢના ૩.૩૪ કલાકથી બપોરના ૧૨.૮૮ સુધીમાં ઘોળવારી અને રાપર વચ્ચે ૧.૭ તથા ૧.૨ની તીવ્રતાવાળા કુલ છ આંચકા નોંધાયા હતા.

★ **૨૦ લાખનું દાન :** ભુજ તાલુકાના માધ્યમીક સ્થિત નવચેતન અંધજન મંડળ સંચાલિત વિકલાંગ વિદ્યાવિહારમાં ઉજ્જ્વળાની બાળકો ધોરણ-૧ થી ૧૨માં અભ્યાસ કરે છે. દાણી ક્ષતિવાળા બાળકો માટે બ્રેઇલ લિપિમાં પુસ્તકોનો લાભ મળે છે. સંસ્થાના આવા ઉમદા કાર્ય અંગે રજૂઆત કરતાં સૌરાષ્ટ્ર ટ્રસ્ટ દ્વારા રૂ. ૨૦ લાખનું દાન મળેલ છે.

★ **ભુજ - નલિયા મીટર ગેજનું રૂપાંતર :** વર્ષ ૨૦૦૮ના બજેટમાં કચ્છ માટે ભુજ - નલિયા મીટર ગેજનું બ્રોડગેજમાં રૂપાંતર કરવા માટે રૂ. ૪૫૦ કરોડની મહત્વાકાંક્ષી યોજનાનો ધમધમાટ શરૂ થયેલ છે. પ્રથમ તબક્કામાં રૂ. ૫૦ કરોડના ખર્ચ્યે મીટર ગેજના પાટા ઉખાઈને બ્રોડગેજની પહોળાઈમાં ગોઠવવાના કામની શરૂઆતની લીલી જંડી મળતાં હાલ ઉપ ક્રિ.મી. મુજબ અલગ અલગ ગ્રામ જગ્યાએ કામ શરૂ કરવામાં આવશે. જેમાં ભુજથી દેશલપર, દેશલપરથી મોથાળાથી નલિયા. આમ ગ્રામ જુદા જુદા ઠેકેદારો પાસે આ કામ કરાવવામાં આવશે. જેનાથી અભડાસા તાલુકામાં આવેલ સિમેન્ટ ફેક્ટરી તથા નલિયા વિમાન મથકને લાભ થશે તેમજ અભડાસા તાલુકાના પણ્ણામાં આવતી ઈન્ડસ્ટ્રીઓનું માલ પરિવહન જરૂરી બનશે. ■

## સ્પાષ્ટવક્તા

ચુંટાળી-પચાર માટે વલ્લભભાઈને પ્રજા ઉદારતાથી નાણાં આપતી. ૧૯૮૫ માં જે. આર. ડી. તાતાએ ફંડના બદલામાં માગણી કરી કે ઉમેદવારો નક્કી કરનાર સમિતિમાં એમનો એક માણસ હોય. સરદાર માગણીનો ઈન્કાર કરતાં પૂછ્યું : ‘તમે તમારી કંપનીમાં અમારા કોઈ માણસને મેનેજમેન્ટ કમિટીમાં મૂકશો ખરા?’ સાંભળીને તાતા ચુંટાળીફાળા માટેનો કોરો ચેક સરદારના હાથમાં વગર શરતે મૂકી દઈ સસ્પિટ વિદાય થઈ ગયા.

(‘કુમાર’ મારી)



## સરનામા ફેરફાર

- જિતેન્દ્ર દેવજી ખોના  
અ-૧૦૧, સત્યમ ઈન્શીઝનીઆ,  
ચંદન પાર્ટી પ્લોટ સામે,  
જોધપુર, અમદાવાદ-૩૮૦ ૦૧૫.

## પુત્રી જન્મ

- ચિ. વિષા વૃદ્ધા અનિલ મધુકાંત શાહ

## ભૂલ સુધાર

- ગત માસના અંકમાં શરણાઈ વિભાગમાં કમાંક-૩ માં  
ચિ. ચિંતન હીરજી ખીમજી ગાલાની જગ્યાએ  
ચિ. ચિંતન યોગેશ હીરજી ગાલા (છસરા - મુંબઈ)  
એમ વાંચવું.

પવિત્ર હદ્યમાંથી નીકળેલી પ્રાર્થના ક્યારેય નકામી  
જતી નથી.  
— મહાત્મા ગાંધીજી

## સમાજના સભ્યો જોગ જહેર વિજાપ્તિ

શ્રી કચ્છી સમાજ - અમદાવાદ, સમગ્ર કચ્છીઓ માટેની એક નામ - સરનામા - ટેલિફોન ડિરેક્ટરી બનાવવાનો પ્રોજેક્ટ હાથ પર લીધેલ છે. તે માટે તેઓએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવા માટે લીંક પણ આપેલ છે.

આપણા સમાજના મોટાભાગના સભ્યો કોમ્પ્યુટર કે ઇન્ટરનેટ વાપરતા નથી. તેથી સમાજના હોદેદારોએ શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદના વસતિ પત્રક-૨૦૧૨માં આપેલ સભ્યોનાં નામ - સરનામા મુજબની એન્ટ્રીઓ સમાજની ઓફિસમાંથી કરાવવાનું વિચારેલ છે. આપ સૌ સભ્યોને વિનંતી છે કે સમાજના વસતિપત્રક-૨૦૧૨માં છપાયેલ આપની વિગતમાં નામ - સરનામા કે ટેલિફોન નંબરમાં ફેરફાર હોય તો સમાજની ઓફિસમાં જાણ કરવી તથા આપની આજુબાજુમાં રહેતા અન્ય સભ્યોને પડા જાણ કરવી. તેથી આપણે આપણા સમાજની સભ્યોની વિગત વહેલાસર શ્રી કચ્છી સમાજ - અમદાવાદની સૂચિત ડિરેક્ટરીમાં પ્રસારિત કરાવી શકીએ.

તેઓની ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેની લીંક નીચે મુજબ છે :

[kutchisamaj.amdavad.com](http://kutchisamaj.amdavad.com)

## સાભાર સ્વીકાર

શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદની  
વિવિધ સેવાકીય યોજનાઓ માટે  
નીચે મુજબ દાતાશ્રીઓ તરફથી દાન / ભેટ પ્રાપ્ત થયેલ છે.

### વૈચાવવચ્ચે ખાતે

- રૂ. ૧,૦૦૧/- શ્રી જિતેન્દ્ર દેવજી ખોના - અમદાવાદ તરફથી  
નૂતન ગૃહ પ્રેરણ નિમિત્ત
- રૂ. ૬૦૦/- શ્રીમતી અરુણાભેન ચંદ્રકાંત કુરિયા - મુંબઈ

### વાયરસ્ક સમિતિ ખાતે

- રૂ. ૫,૦૦૦/- શ્રીમતી પ્રેમીલાભેન અશોક રામજી સાવલા તરફથી  
તેઓની લગ્નની વર્ષગાંઠ નિમિત્ત

### ડાયાલિસિસ સેન્ટર ખાતે

- રૂ. ૧,૧૧૧/- શ્રી ગજેન્દ્ર હીરાચંદ ગોરજી - અમદાવાદ

### જલારામ અનન્દશોન્ન ખાતે

- રૂ. ૬,૦૦૦/- શ્રી કચ્છી લોહાણા સમાજ - અમદાવાદ  
ક. સ્વ. કુલીનભાઈ માવજુભાઈ શેડિયા

### મંગલ મંદિર ભેટ ખાતે

- રૂ. ૫૦૧/- શ્રી અનિલ મધુકાંત શાહ - અમદાવાદ તરફથી  
પુત્રી ચિ. વિષાના જન્મ નિમિત્ત

સંસ્થા ઉપરોક્ત તમામ દાતાશ્રીઓનો ઘૂબ ઘૂબ આભાર માને છે.

કે. આર. શાહ

માનદ મંત્રી

શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ



## શિક્ષણ અને સર્વાર્ગી વિકાસ સમિતિ



### વાર્ષિક કાર્યક્રમોની વિગત

**સમિતિ દ્વારા દર વર્ષ નીચે મુજબના કાર્યક્રમોનું આયોજન કરાશે, જેની નોંધ લેવા વિનંતી.**

- ★ જાન્યુઆરી : Positive Parenting
- ★ ફેબ્રુઆરી / માર્ચ : ‘જ્ઞાન સાથે ગમ્ભેર’ – ૧ દિવસીય પિકનિક
- ★ એપ્રિલ : Career Guidance Workshop – ૮/૧૦ દિવસ માટે  
(માત્ર ધોરણ-૧૦ની પરીક્ષા આપી હોય તેવા વિદ્યાર્થીઓ માટે જ.)
- ★ જૂન : (૧) ‘આપના બાળકને ઓળખો’ – ધોરણ-૫, ૬, ૭ના બાળકો અને વાલીઓ માટે વર્કશોપ.  
(૨) ‘વિદ્યાર્થીઓને પડતાં સ્ટ્રેસમાં તેને કેમ મદદ કરશો?’ વિષય ઉપર ધોરણ-૧૧, ૧૨નાં વિદ્યાર્થીઓનાં વાલીઓ માટે વર્કશોપ.
- ★ જુલાઈ : • ‘કેવી રીતે ભણતું?’ વિષય ઉપર ધોરણ-૮ થી ૧૦નાં વિદ્યાર્થીઓની વર્કશોપ.  
• ધોરણ-૮થી ૧૦માં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ માટે વર્કશોપ. જેમાં તેમના વર્તન, ભણતરના સ્ટ્રેસ ઉપરાંત ન્યુટ્રીશન અંગે પણ ચર્ચા.
- ★ ઓગસ્ટ : ‘મુજધાવસ્થાનાં પ્રશ્નો’ – ધોરણ-૫, ૬, ૭ના બાળકોના વાલીઓ માટેની ચર્ચા - પ્રશ્નો - વિચારણા.
- ★ સપ્ટેમ્બર : ‘કેરિયર પ્લાનિંગ ધોરણ-૮થી શરૂ થાય છે’ ધોરણ-૮, ૯, ૧૦ના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે.
- ★ ઓક્ટોબર : “Multiple Intelligence & Life Skills” – ધોરણ-૧ થી ૪નાં બાળકો માટે વર્કશોપ.
- ★ ડિસેમ્બર : ધોરણ-૮, ૯, ૧૦ના વિદ્યાર્થીઓ માટે એસ્ટિલ્યુડ ટેસ્ટ.

#### ● નોંધ :

૧. કાર્યક્રમો ખૂબ જ રસપ્રદ અને માહિતીસભર રહેશે.
૨. આ વાર્ષિક ક્લેન્ડર છે. કાર્યક્રમ દર વર્ષે જે તે મહિનામાં જ રહેશે.
૩. ઉપરોક્ત કાર્યક્રમો જે તે વિષયના વિદ્યાન નિષ્ણાતો દ્વારા ધોરણામાં આવશે.
૪. કાર્યક્રમ માટેના નિષ્ણાતો જરૂરિયાત પ્રમાણે આવશે / બદલાશે.
૫. આપણા સમાજના બાળકો - શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ અને વાલીઓ (Parents) ખૂબ જ વિચારક વાલીઓ બની શકે તે આશયથી આ આયોજન કરવામાં આવેલ છે. દરેકને લાભ લેવા આગ્રહભરી વિનંતી.
૬. સૂચનો / નાવિન્યસભર ફેરફાર આવકાર્ય રહેશે.
૭. Parents ની વ્યાખ્યા માત્ર ‘માતા’ જ નથી, પિતા પણ આવે તેવી સમજ ઉવલપ કરવાનો પ્રયત્ન છે.
૮. મા-બાપ સિવાય, પરિવારમાં રહેતા વડીલો, દાદા-દાદી, કાકા-કાકી, નાના-નાની પણ Parents ની વ્યાખ્યામાં આવે છે. ઘરના બાળકોના સર્વાર્ગી વિકાસમાં બધાની સહિત્યારી જવાબદારી હોવાથી વડીલો ઉપરોક્ત કાર્યક્રમોમાં આવે, તેવી આશા છે.
૯. આ કાર્યક્રમ અમદાવાદમાં રહેતા સમગ્ર કચ્છી સમાજના બાળકો તથા વાલીઓ માટે છે તથા સમગ્ર ભારતનાં કચ્છી જૈન બાળકો તથા વાલીઓ માટે છે.
૧૦. બહારગામથી આવતા કચ્છી જૈન સમાજનાં બાળકોના વાલીઓએ એક મહિના અગાઉથી બાળકના નામનું રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.
૧૧. જે તે મહિનાનાં કાર્યક્રમોની તારીખ તથા સમય અગાઉથી ‘મંગલ મંદિર’માં જણાવવામાં આવશે. તે પ્રમાણે કાર્યક્રમો યોજવામાં આવશે.
૧૨. બહારગામથી આવતા કચ્છી જૈન બાળકો તથા વાલીઓ માટે સંસ્થા તરફથી રહેવા તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવશે.
૧૩. જે તે સમયે સમિતિ તરફથી જે તે કાર્યક્રમ માટે ફી નિયત કરવામાં આવશે. તે ભાગ લેનાર વિદ્યાર્થી બાળકે ભરવાની રહેશે.
૧૪. ઉપરોક્ત કાર્યક્રમ તથા તેની વિગતોમાં ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા સમિતિની રહેશે.

## વયસ્ક સમિતિ

### મોડાસા પિકનિક

તા. ૨૪ ફેબ્રુઆરી, ૨૦૧૬ના સવારે ૬.૩૦ કલાકે ૮૫ વડીલો સાથે પાલડીથી પ્રસ્થાન કરી નવા બબલપુરા પાસે આવેલ મહાવિદેહ ધામ આવ્યા. દર્શન - નવકારશી કરી દાદા-દાઈની વાડી મોડાસા માટે પ્રસ્થાન કર્યું. રસ્તામાં અંતાક્ષરી, કિલ્ભી ગીતો, જોક્સ, સવાલ - જવાબ અને ઉખાણાના સથવારે રસ્તો ક્યારે કપાઈ ગયો તેની જાણ પણ ન થઈ અને વીસેક એકરમાં ફેલાયેલ હરિયાળી અને વૃક્ષોથી આચ્છાદિત દાદા-દાઈની વાડીમાં આવ્યા. કેટલાકે ચા ને ન્યાય આઘ્યો.

વડીલ બહેનો આ રીસોર્ટમાં આવેલ સ્વિમિંગ પુલમાં મોજ માણવા, બાળપણ યાદ કરવા ઉત્ત્ય. ‘આટલે આટલે પાની કોને ઘેર રાણી’ એવી બાળપણની રમત સાથે - પાસિંગ બોલ રમતાં રમતાં સારો એવો સમય સ્વિમિંગ પુલમાં પસાર કર્યો.

ત્યારબાદ શ્રીમતી પ્રેમીલાભેન અશોકભાઈ સાવલાનું બહુમાન કરતા લગ્નની વર્ષગાંઠ નિમિત્તે કેક કાપી સૌએ તેમના લાંબા ઉર્ધ્વભર્યા લગ્ન જીવનની શુભેચ્છા પાઈવી. આ પ્રસંગે તેમના તરફથી રૂ. ૫,૦૦૦/-ના સ્પોન્સરશિપની જાહેરાત કરવામાં આવી હતી.

મગની દાળના મધમધતા શીરા અને ભજ્યાને ન્યાય આપી



સ્વિમિંગ પુલમાં આનંદ માણની વડીલ મહિલાઓ



શ્રીમતી પ્રેમીલાભેન અશોકભાઈ સાવલાનું બહુમાન કરતા  
શ્રીમતી મીનાક્ષી પારેખ, શ્રીમતી દમયંતી દંડ,  
શ્રીમતી પુષ્પા શાહ તથા શ્રીમતી લક્ષ્મીભેન વીરા.

શ્રી વસંતભાઈ છેડા ખાસ મુખ્યાથી પધારનાર છે. ભોજનની યોગ્ય વ્યવસ્થા માટે એ જ દિવસે સાંજે ૫.૦૦ વાગ્યા સુધી સૌએ પોતાનું નામ રજિસ્ટ્રેશન કરાવી લેવા વિનંતી.

### આગામી કાર્યક્રમ

સમિતિ તરફથી આગામી કાર્યક્રમ તા. ૩-૫-૨૦૧૬ને મંગળવારના રોજ શ્રી કચ્છી ઝેન ભવન - પાલડી ખાતે બપોરે ૪.૩૦ વાગ્યાથી ગીત-સંગીત, મિમિકી, સંગીત હાઉસનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમ માટે લોકલાડીલા કલાકાર

### કચ્છ સંસ્કૃતિ મ્યુઝિયમ

નીચે જણાવેલ સ્થળો મ્યુઝિયમ નિછાળવા જાહેર જનતાને ભાવભર્યું નિમંત્રણ છે. આ મ્યુઝિયમની મુલાકાતથી અમદાવાદમાં રહીને કચ્છ - દર્શનની એક ગ્રલક જોઈ શકશો. દેશ-વિદેશથી આવતા આપના કોઈપણ મહેમાનો સાથે આપ આ મ્યુઝિયમની અવશ્ય મુલાકાત લેશો.

મ્યુઝિયમ જોવા માટે કોઇ એન્ટ્રી ફી નથી.

સ્થળ : શ્રી કચ્છી વિશ્વામગૃહ, અરિહંતનગર દેરાસરની સામે, રાજ્યાનું હોસ્પિટલ પાસે, શાહીબાગ, અમદાવાદ.

ફોન સંપર્ક : (૦૭૭) ૨૨૮૮૪૫૪૭ • સમય : સવારે ૧૦થી ૨ અને સાંજે ૫ થી ૭.

રજનીકાંત પારેખ

કંવીનર - વયસ્ક સમિતિ



## મહિલા ઉક્ષર સમિતિ



સમિતિના ઉપક્રમે તા. ૧૮-૨-૨૦૧૬ ગુરુવારના રોજ અંધજન મંડળ - વખ્તાપુરની મુલાકાતનો કાર્યક્રમ યોજાઈ ગયો.

આ સંસ્થા માત્ર અંધજનો માટે જ નહીં પણ દરેક પ્રકારની વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓને સમાજમાં સમાન હક્ક અપાવવાની કોણિશ કરે છે, પગભર થવાની ટ્રેનિંગ આપે છે. જેથી તેઓ માનભેર જીવન જીવી શકે.

સંસ્થાના પ્રોજેક્ટ ડિરેક્ટર શ્રીમતી વિમલ પાવાડી (મંદભુષિવાળા બાળકો માટે અસાધારણ કામ કરવા બદલ એવોર્ડ જીતનાર)ના માર્ગદર્શન હેઠળ સૌ બહેનોએ સંપૂર્ણ સંકુલની મુલાકાત લીધી હતી. તેઓશ્રીએ સંસ્થામાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ વિશે બહેનોને માહિતગાર કર્યા હતા. ઉપરાંત પ્રજ્ઞાચક્ષુ - વિકલાંગોની સમસ્યાઓની જીણવટભેર છણાવટ કરી હતી. જે હદ્યસ્પર્શી હતી. ફક્ત રૂ. ૧૦૦/- જેટલી નજીવી કિંમતનું દાન કરીને પણ તમે પ્રજ્ઞાચક્ષુ - વિકલાંગને પગભર થવામાં મદદ કરી શકો છો, એ બાબતનો પણ તેમણે ઝ્યાલ આપ્યો હતો. સંસ્થાનું કામકાજ તદ્દન પારદર્શી હોવાથી આપણે આપેલું દાન જરાય વર્થ જતું નથી. આપણા જ હસ્તે લાભાર્થને ભેટરૂપે આપવામાં આવે છે.

એક Special Show – Vision in the Dark એટલે કે પ્રજ્ઞાચક્ષુની જિંદગીનો અહેસાસ કરાવતો શો. ૪૦૦૦ સ્કે. ફૂટના એરિયામાં ઘોર અંધારું ધરાવતો સ્ટુડિયો છે. જેમાં રેસ્ટોરન્ટ, બગ્નિયો, મંદિર, ઓડિટોરિયમ બધું જ છે, માત્ર લાઈટ જ નથી. નવાઈની વાત એ છે કે આ ઘોર અંધારામાં આપણને માર્ગદર્શન આપનાર વ્યક્તિઓ પ્રજ્ઞાચક્ષુ છે. આ શો જોઈને સૌ બહેનો સત્ય થઈ ગયા હતા.

શ્રીમતી વિમલબેનના સમજાવટભર્ય વક્તવ્યથી પ્રભાવિત



થઈને બહેનોએ નાનું મોટું યથાશક્તિ દાન કર્યું હતું, જે નીચે પ્રમાણે છે :

૧. શ્રીમતી રોશની વિજય મહેતા રૂ. ૬,૦૦૦/- (પુત્ર ઋષભના જન્મદિન નિમિત્ત) (સીલાઈ મશીન)
૨. શ્રીમતી ભારતીબેન રજનીકાંત કથીરિયા રૂ. ૬,૦૦૦/- (જૈનેતર) (સીલાઈ મશીન)
૩. કાર્યક્રમમાં હાજર રહેલ સૌ બહેનો વતી રૂ. ૬,૦૦૦/- (દ્રાયસિકલ)

જે એકી ખાસ યોગદાન આપનાર બહેનો આ પ્રમાણે :

|                            |         |
|----------------------------|---------|
| શ્રીમતી વીજા ભરત ગાલા      | ૧,૦૦૦/- |
| શ્રીમતી ફાલ્ગુની તુખાર શાહ | ૧,૦૦૦/- |
| શ્રીમતી ચેતના સંજ્ય મોતા   | ૫૦૦/-   |
| શ્રીમતી જ્યોતિ અનિલ શાહનંદ | ૫૦૦/-   |
| શ્રીમતી હેતલ ધીરેન શાહ     | ૫૦૦/-   |

સૌ બહેનોએ અંધ અને વિકલાંગની દુનિયામાં ડોકિયું કર્યું હતું. આપણી પણ આવા ભાઈ-બહેનોને મદદ કરવાની ફરજ બને છે અને સમાજમાં આની જાગૃતિ ફેલાવવાની પણ જરૂર છે, એવા ઉમદા વિચાર સાથે સૌ છૂટા પડ્યા હતા.

**નમ્ર વિનંતી :** અંધજન મંડળ - વખ્તાપુરની મુલાકાત એકવાર અવશ્ય લેશો.

સુષુપ્ત જલદીય શાલ - કન્વીનર

માણસે ઈથર પર એટલો સંપૂર્ણ વિથાસ મૂકવો જોઈએ કે જેથી તેને દુનિયાની સહાયુભૂતિની જરૂર જ ન રહે.

## શ્રી રતનવીર ગૃહ ઉદ્ઘોગ

શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ સંચાલિત શ્રી નવનીત ભવન - આવાસ યોજના ખાતેના શ્રી રતનવીર ગૃહ ઉદ્ઘોગ ખાતે નીચે મુજબના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

- ★ તા. ૨૦-૧૦-૨૦૧૫ના રોજથી ચાલુ કરવામાં આવેલ બેકરી કોર્સ અંતર્ગત ૨૦ જેટલી બહેનોએ તેમાં ભાગ લીધો હતો. યુનિવર્સિટી તરફથી શ્રી ઈમરાનભાઈએ બેકરીની વિવિધ આઈટમો બનાવવાની રીત શીખવાડી હતી.
- ★ તા. ૨૦-૧૦-૨૦૧૫ના રોજથી ચાલુ કરવામાં આવેલ બ્યુટી કોર્સ અંતર્ગત શ્રીમતી નીતાબેન હેમંતકુમાર શાહ (યુનિવર્સિટી) તરફથી બ્યુટી પાર્લરના વિવિધ વિષયો અંગે તાલીમ આપી હતી. જેમાં ૨૧ જેટલી બહેનોએ ભાગ લીધો હતો.
- ★ તા. ૨૦-૨-૨૦૧૬ના રોજ કેન્સર અવેરનેસ સેમિનાર તથા ઓરિફલેમ કંપનીની આઈટમોનું ડેમોન્સ્ટ્રેશન યોજવામાં આવેલ. જેમાં અંદાજિત ૩૦ જેટલી બહેનોએ ભાગ લીધેલ.
- ★ તા. ૧૫-૩-૨૦૧૬ના રોજ બાગાયતી પાકોની તાલીમનો એક સેમિનાર બાગાયત નિયમકશીના વિભાગમાંથી શ્રી કમલેશભાઈ પટેલના માર્ગદર્શન ડેટણ યોજાયેલ. જેમાં ૪૫ જેટલી બહેનોએ ભાગ લીધો હતો. ■

**શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ સંચાલિત મેડિકલ સેન્ટરમાં બાળ રોગ વિભાગમાં નીચે પ્રમાણે ડોક્ટરો મળે છે**

| દિવસ        | સમય              | ડોક્ટર         |
|-------------|------------------|----------------|
| સોમથી શુક્ર | સવારે ૮ થી ૧૦.૩૦ | ડૉ. અનિલ ચૌહાણ |
| શનિવાર      | સવારે ૮ થી ૧૦.૩૦ | ડૉ. પરેશ શાહ   |
| સોમથી શનિ   | સાંજે ૫ થી ૬.૩૦  | ડૉ. કોશા શેઠ   |

## તબીબી સાધનો વપરાશ માટે આપવાની યોજના

**શ્રી કચ્છી જૈન ભવન - પાલડી પર નીચે મુજબના તબીબી સાધનો એનિક ભાડાના ધોરણે મળી શકશે. જેઓને આ સાધનોની જરૂરિયાત હોય તેઓ શ્રી કચ્છી જૈન ભવન - પાલડી પર ફોન : ૨૬૫૭૮૮૬૨ / ૨૬૫૮૧૫૦૧ પર સંપર્ક સાધી શકશે.**

|                            |          |                   |         |                               |          |
|----------------------------|----------|-------------------|---------|-------------------------------|----------|
| ૧. એર બેડ                  | રૂ. ૧૦/- | ૫. વોકર           | રૂ. ૨/- | ૯. બેડ પાન                    | રૂ. ૨/-  |
| ૨. વીલ યેર                 | રૂ. ૩/-  | ૬. વોકિંગ સ્ટીક   | રૂ. ૧/- | ૧૦. ફાઉલર બેડ                 | રૂ. ૧૦/- |
| ૩. ઓક્સિજન સિલિન્ડર (નાનો) | રૂ. ૫/-  | ૭. ક્રોડ યેર      | રૂ. ૩/- | ૧૧. ટેબલ યોપ (ફાઉલર બેડ માટે) | રૂ. ૨/-  |
| ૪. નેબ્યુલાઈઝર             | રૂ. ૫/-  | ૮. સેલાઈન સ્ટેન્ડ | રૂ. ૨/- | ૧૨. બેક રેસ્ટ                 | રૂ. ૨/-  |

**નોંધ :** (૧) સ્ટોકમાં હશે ત્યાં સુધી આ સાધનો રીપોર્ટ આપીને ભાડેથી મેળવી શકશે. (૨) સાધનો પાલની ભવન પરથી લઈને ત્યાં જ પરત કરવાના રહેશે.

**કે. આર. શાહ - માન્દ મંત્રી, શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ**

## અખરોટ

અખરોટનો આકાર માનવીના મગજ જેવો જ હોય છે તેમ ખાવામાં પણ લોકોને તે બહુ ભાવે છે. તેને લેટિનમાં જગલેન્સ રેજિયા કહેવામાં આવે છે. સંસ્કૃતમાં તેને અક્ષોટ, અક્ષોડ, કર્ષરાલ, શૈલપીલું, રેખાફળ અને મદનાભફળ કહે છે. હિન્દીમાં અખરોટ, મરાઠી અને ગુજરાતીમાં અખરોટ કહેવામાં આવે છે. અંગ્રેજીમાં તેનું નામ વોલનટ છે.

અખરોટનું જાડ મધ્યમ પ્રમાણનું ને સુગંધિત હોય છે. નવી ડાળીઓમાં તેનો બહારનો ભાગ મખમલ જેવો હોય છે. જાડની છાલ ધૂળ જેવા રંગની અને અડધાથી બે ઈચ્છ જાડી હોય છે. તેમાં લાંબા ચીરા હોય છે. તેના થડમાં કાળા ડાખ હોય છે. તેનાં પાન હ થી ૧૨ ઈચ્છ લાંબા અને સંયુક્તપત્ર હોય છે. આવા સંયુક્તપત્રોની પાંચથી અગિયારની જોડ હોય છે અને દરેકની લંબાઈ ત થી ૮ ઈચ્છ અને પહોળાઈ ૨ થી ૪ ઈચ્છ હોય છે. તેનાં ફૂલો ર થી ૫ ઈચ્છ લાંબા અને લીલા રંગનાં હોય છે.

અખરોટનું ફળ ગોળાકાર, રેખાયુક્ત, કઠળ આવરણવાળું અને મીઠોળ જેવા આકારવાળું હોય છે. ખાવામાં એક બીજ હોય છે અને તેના બે ભાગ પડે છે. વસંતમાં ફૂલ અને શરદાતુમાં ફળ આવે છે. તેની મીજ વાંકીસ્યુડી હોય છે અને તેનો જ ઉપયોગ ખાવામાં થાય છે.

અખરોટની ઉત્પત્તિ પાંચથી દસ હજાર ફૂટની ઊંચાઈએ હિમાયલ પ્રદેશમાં થાય છે. તેના ફળમાં ઓક્ઝેલિક એસિડ તથા બેન્યુમ નામનો ક્ષાર મળે છે. તેની મીજમાં ૪૦ થી ૪૫ ટકા તેલ, જગલેઝેસી એસિડ તથા રાખ હોય છે. તે પચવામાં ભારી તથા મુલાયમ હોય છે. સ્વાદમાં મીઠાશ હોય છે અને પ્રકૃતિમાં ગરમ હોય છે.

અખરોટ વાયુનું શમન કરે છે અન કફ પિત વધારે છે. અખરોટની મીજનો લેપ ચામડીના વિકારોમાં, સોજો તથા દુખાવાને દૂર કરે છે. શરીરનો રંગ તથા ચામડીની સુંવાળપ વધારતું હોવાથી તેનો લેપ ચામડી ઉપર કરવામાં આવે છે. અખરોટ પક્ષધાત, ચહેરાની અડધી બાજુનો વા (ફેસિયલ પેરેલિસિસ) વગેરે વાઈના વિકાર અને મગજની નબળાઈમાં સારું કામ આપે છે. પેટના રોગો જેવા કે દુખાવો, ગોળો ચડવો તથા કબજિયાત વગેરેમાં તે ઘણું ઉપયોગી છે. ■

## શ્રી કચ્છી લૈન સેવા સમાજ - અમદાવાદનો માર્શિક અહેવાલ

**ફેબ્રુઆરી / માર્ચ - ૨૦૧૬**

**● તા. ૨૬-૨-૨૦૧૬**

★ આજરોજ સવારે ૭ વાગે શ્રી પ્રતાપ નારાણજી દંડ, શ્રી કે.આર. શાહ, ડૉ. ચંદ્રકાંતભાઈ દેઢિયા તથા શ્રી પીયુષભાઈ પારેખ કચ્છ જવા રવાના થયા હતા. બપોરે ૧૨ વાગે ભુજમાં તેરા ગામના ઠાકોર શ્રી મયુરઘજસિંહજી સાથે તેરાના દરબારગઢમાં આવેલ ૧૫૦ વર્ષ જૂની રામાયણની ચિત્રાવલીની સાચવણી અંગે ચર્ચા વિચારણા કરી હતી તથા બીજા ટિવિસે સવારે તેરામાં એ જ કલાકૃતિ રૂબરૂ જોવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં ફોટોગ્રાફર શ્રી સમીર ભવું પણ હાજર રહ્યા હતા.

★ આજે બપોરે ૨ વાગે ભુજ મધ્યે શ્રી લાલચંદ થાવરદાસ અતિથિગૃહમાં શ્રી પ્રતાપ નારાણજી દંડ, શ્રી કે.આર. શાહ, ડૉ. ચંદ્રકાંતભાઈ દેઢિયા, શ્રી પીયુષ પારેખ તથા શ્રી મહેન્દ્રભાઈ દોશીએ શ્રી મૂકેશભાઈ જવેરી સાથે કચ્છી બોલીના રીસ્ટોરિંગ માટે ચર્ચા કરી હતી તથા તેમાં કચ્છ યુનિવર્સિટી પણ સહયોગ આપે તે બદલ ચર્ચા વિચારણા કરી હતી. ત્યારબાદ શ્રી મૂકેશભાઈ જવેરી સાથે અન્ય ટ્રસ્ટીઓ પણ જોડાયા હતા અને ભુજમાં તેમની સંસ્થામાં મેડિકલ સેન્ટર ચાલુ કરવા માટે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

★ આજે રાત્રીના સમયે તેરા ખાતે શ્રી પ્રતાપ નારાણજી દંડ, શ્રી કે.આર. શાહ, ડૉ. ચંદ્રકાંતભાઈ દેઢિયા, શ્રી પીયુષભાઈ પારેખ તથા શ્રી સમીર ભવું તેરાના ટ્રસ્ટી શ્રી પ્રવીણભાઈ દંડ, ટ્રસ્ટના મહેતાજી શ્રી ગીરીશ મહ્લ સાથે તેરાના ઠાકોરાના વંશજ શ્રી રાજુભાઈ સાથે તેરા દરબારગઢના રીપેરિંગ અંગે

ચર્ચા વિચારણા કરી હતી.

**● તા. ૨૭-૨-૨૦૧૬**

★ આજે સવારના ૧૦ વાગે શ્રી પ્રતાપ નારાણજી દંડ, શ્રી કે.આર. શાહ, ડૉ. ચંદ્રકાંતભાઈ દેઢિયા તથા શ્રી પીયુષભાઈ પારેખ પાંજરાપોળની શાખામાં ત્યાંના મેનેજર શ્રી તથા ટ્રસ્ટના સેકેટરી શ્રી જગદીશસિંહજી જીઝેજા સાથે મિટિંગ કરી હતી. સ્થળ ઉપર જગ્યાનું નિરીક્ષણ કરી ત્યાં કેવી રીતે વૃક્ષારોપણ કરવું તે બાબત પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેઓ પાસે વિશાળ જગ્યા છે પણ ફેન્સિસગ કરેલ નથી. તેથી વહેલી તક ફેન્સિસગ કરાવી લેવા માટે ભલામણ કરવામાં આવી હતી.

★ આજે બપોરે ૨ વાગે શ્રી જનકલ્યાણ મેડિકલ ટ્રસ્ટના નેજા હેઠળ યોજાયેલ સ્વી રોગોના કેમ્પમાં શ્રી પ્રતાપ નારાણજી દંડ, શ્રી કે.આર. શાહ, ડૉ. ચંદ્રકાંતભાઈ દેઢિયા તથા શ્રી પીયુષ પારેખ હાજરી આપી હતી. જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા બધા જ ટ્રસ્ટીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. શ્રી કચ્છી જેન સેવા સમાજ - અમદાવાદ તરફથી શ્રી પ્રતાપ નારાણજી દંડ મજફુર ટ્રસ્ટની વૈદ્યકીય સેવાઓને બિરદાવી હતી. ડૉ. ચંદ્રકાંત દેઢિયાએ આજના કેમ્પનું મહત્વ સમજાવ્યું હતું તથા પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

**● તા. ૨૮-૨-૨૦૧૬**

★ આજે રાતના ૮ વાગે ભુજપુર મધ્યે ભુજપુરના ભૂતપૂર્વ સરંગચ શ્રી મહેન્દ્રભાઈ ગઢવી સાથે ઔપયારિક બેઠક યોજવામાં આવેલ તથા બેતીવાડી ક્ષેત્રે વેલ્યુઅરેડ પ્રવૃત્તિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ

ચર્ચામાં શ્રી પ્રતાપ નારાણજી દંડ, શ્રી કે.આર. શાહ, ડૉ. ચંદ્રકાંત દેઢિયા તથા શ્રી પીયુષ પારેખ હાજર રહ્યા હતા. અન્યમાં શ્રી મહેન્દ્રભાઈ ગઢવીના ભાઈઓએ પણ બેઠકમાં ભાગ લીધો હતો.

**● તા. ૨૯-૨-૨૦૧૬**

★ આજે સવારના ૮.૩૦ વાગે શ્રી પ્રતાપ નારાણજી દંડ તથા ડૉ. હિતેન્દ્રભાઈ શાહ મેડિકલ સેન્ટરના મેડિસીન વિભાગના ડૉ. ડેવાંગ શાહ, ડૉ. જિનેશ શાહ, ડૉ. નીતુ પરીખ તથા ડૉ. શિવા તોશનીવાલ સાથે મિટિંગ કરી હતી અને મેડિકલ સેન્ટરના ડેવલપમેન્ટ માટે તથા અન્ય અગત્યની બાબતો માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

**● તા. ૧-૩-૨૦૧૬**

● આજરોજ સવારે પાલડી ભવન ખાતે હિસાબી સમિતિની એક મિટિંગ મળી હતી. જેમાં શ્રી મગનલાલ સંઘવી, શ્રી હસમુખભાઈ બી. શાહ, શ્રી કે.ડી. શાહ અને શ્રી કિશોરભાઈ ઠક્કર (એકાઉન્ટન્ટ) હાજર રહ્યા હતા. તા. ૩૧-૧૨-૨૦૧૫ સુધીના ઓડિટ થયેલ હિસાબો અંગે ચર્ચા વિચારણા કરી હતી. જાન્યુઆરી / ફેબ્રુઆરી-૨૦૧૬ના હિસાબો પણ ઓડિટ હેઠળ છે. એપ્રિલ-૨૦૧૬ સુધી ૩૧-૩-૨૦૧૬ સુધીના સંસ્થાના હિસાબો તૈયાર થઈ જશે તેવી ધારણા છે તેમ શ્રી કિશોરભાઈએ જણાવેલ.

**● તા. ૨-૩-૨૦૧૬**

● આજે સવારના ૧૦ વાગે શ્રી પ્રતાપ નારાણજી દંડ શ્રી કચ્છી વિશ્રામ ગૃહ - શાહીબાગ ખાતે ડાયાલિસિસ સેન્ટરના દુન્યાજી ટેકનિશિયન શ્રી જાવેદ શેખ તથા મેનેજર શ્રી દીપ દંડ સાથે જરૂરી ચર્ચા કરી હતી. ડાયાલિસિસ સેન્ટરમાં

અત્યારે દર્દીઓ માટે એક જ મશીન ચાલુ છે જે પૂરી કેપેસિટીથી ચાલે છે. તેમાં બીજું એક મશીન વધારવા માટે ટ્રસ્ટ મંડળમાં રજૂઆત કરવી તેમ નક્કી કરવામાં આવ્યું હતું.

● **તા. ૩-૩-૨૦૧૬**

★ આજરોજ સવારના ૧૨ વાગે શ્રી પ્રતાપ નારાણજી દંડ, શ્રી કે.આર. શાહ તથા ડૉ. ચંદ્રકાંત દેઢિયાએ શ્રી વીસા ઓસવાલ જૈન ગુર્જર જ્ઞાતિ સમાજ - ભુજના પ્રમુખ શ્રી મૂકેશભાઈ જીવેરી, સહમંત્રી શ્રી મહુભાઈ જે. શાહ, ટ્રસ્ટી શ્રી સૂર્યકાંતભાઈ જે. શાહ, શ્રી બીરજુભાઈ સી. શાહ, શ્રી અલ્પેશભાઈ આર. શાહ, ટ્રસ્ટના એડવાઇર્ઝર ડૉ. જયંત અંજારિયા તથા આર્કિટેક્ટ શ્રી રીતેશ એસ. શાહ સાથે શ્રી કચ્છી જૈન ભવન - પાલડી સ્થિત મેડિકલ સેન્ટરની મુલાકાત લીધેલ અને તે બાબતની તમામ વિગતો મેળવેલ. ત્યારબાદ ભુજ

સ્થિત શ્રી ડોસાભાઈ લાલચંદ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટના શ્રી ડોસાભાઈ લાલચંદ અતિથિગૃહના ૧૬ા માણે શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદના મેડિકલ સેન્ટર જેવું જ એક મેડિકલ સેન્ટર શરૂ કરવા બાબત વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

● **તા. ૪-૩-૨૦૧૬**

★ આજરોજ શ્રી કે.ડી. શાહ તથા શ્રી રજનીકાંત પારેબે શ્રી કચ્છી વિશ્વામ ગૃહ - શાહીબાગની મુલાકાત લીધી હતી. ભવનની સફાઈ અંગે નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી હતી. સાથે ડાયાલિસિસ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી.

● **તા. ૭-૩-૨૦૧૬**

★ આજરોજ તબીબી સેવા સમિતિની એક મિટિંગ ડૉ. હિતેન્દ્ર એમ. શાહના પ્રમુખ સ્થાને કચ્છી જૈન ભવન -

પાલડી ખાતે મળી હતી. તેમાં શ્રી પ્રતાપ દંડ, શ્રી કે.આર. શાહ, ડૉ. ચંદ્રકાંત દેઢિયા, શ્રી અંધ્રિન સાવલા, શ્રી અશોક મહેતા, શ્રી લક્ષ્મીચંદ વીરા, શ્રી હરસુખભાઈ શાહ, શ્રી નરેન્દ્ર ખોના અને શ્રી અનિલ હરિયા હાજર રહ્યા હતા. જેમાં મુખ્યત: કચ્છી જૈન સેવા સમાજના સભ્યો માટેના ૨૬મી જાન્યુઆરીના રોજના રસીકરણ કેમ્પ અને ૨૧મી જાન્યુઆરીના રોજના બાળરોગ કેમ્પનો અહેવાલ આપવામાં આવ્યો હતો. મેડિકલ સ્ટોરનો કોન્ટ્રાક્ટ પાંચ વર્ષ માટે રિન્યુ કરવાનું નક્કી થયું હતું. વર્ષ ૨૦૦૭ની સાલના Logiq P3 ની જગ્યાએ નવું સોનોગ્રાફી મશીન ખરીદવા વિચારણા કરવામાં આવી હતી. ડોક્ટર્સને ચૂકવાતા ઓનોરેરિય વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ■

## શ્રી અચલગાર્છ જૈન સંદ્ય - અમદાવાદ

**રૂડી આવી ચૈત્ર માસની ઓળી  
ઉપાશ્રેયે આવી કરો તમારા કર્મની હોળી.**

તપસ્વીરતન અચલગાર્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રીગુણોદયસાગરસૂરીશ્વરજી મ.સાહેબના આજ્ઞાવર્તિની પ.પૂ.સા. શ્રી અક્ષયગુણાશ્રીજી મ.સાહેબનાં શિષ્યા પ.પૂ.સાધ્વી શ્રી ઈન્દુકલાશ્રીજી મ.સા., પ.પૂ.સાધ્વીશ્રી હંસમાલાશ્રીજીમ.સા., પ.પૂ.સાધ્વીશ્રી જિનશ્રદ્ધાશ્રીજી મ.સા. આદિ ઠાણા-૩ નવનીત વિવિધલક્ષી ભવન, પ્રભુદાસ ઠક્કર કોલેજ રોડ, પાલડી - ઉપાશ્રેયમાં બિરાજમાન છે.

**ચૈત્ર માસની આયંબીલની ઓળી :** ચૈત્ર સુદ-૭, બુધવાર, તા. ૧૩-૪-૨૦૧૬થી ચૈત્ર માસની આયંબીલની ઓળી શરૂ થાય છે. પ.પૂ. સાધ્વીજી મહારાજ સાહેબ શ્રીપાલ મહારાજાનો રાસ ઓળીમાં દરરોજ ૮ વાગે વાંચશે તેમજ સિધ્યચક્ની આરાધના કરાવશે. લાભ લેવા વિનંતી.

પ.પૂ.સાધ્વીશ્રી હંસમાલાશ્રીજી મ.સાહેબની આયંબીલ તપની ૭૧મી ઓળી ચાલુ છે. જેનું પારણું ચૈત્ર વદ-૧, શુક્રવાર, તા. ૨૨-૪-૨૦૧૬ના રોજ આવે છે. આપણાં શ્રીસંઘના અહોભાગ્યે મહારાજ સાહેબની ૭૧મી ઓળીનાં પારણાનો લાભ આપણાં શ્રીસંઘને મળેલ છે.

**નોંધ :** પ.પૂ.સાધ્વીજી મ.સાહેબ પાસેથી  
આપ જ્ઞાનની ગાથાઓ કંઠસ્થ કરી શકો છો.

**લી. અચલગાર્છ જૈન સંદ્ય - અમદાવાદ**  
**પ્રમુખ :** લક્ષ્મીચંદ શામજી છેડા

## કાર્તી નજરે....

માસ ફેબ્રુઆરી-૨૦૧૬ દરમ્યાન શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદની વિવિધ સેવાઓનો લાભ લેનાર વ્યક્તિઓ

| ક્રમ | સેવાઓ  | લાભ લેનાર વ્યક્તિઓ                    |
|------|--|---------------------------------------|
| ૧.   | <p>(અ) માતુશ્રી સાકરલેન રવજુ મોરારજુ લાલન (કોડાય - સુપ્રીમવાલા)<br/>શ્રી કચ્છી જૈન ભવન, પાલડી, અમદાવાદ .....</p> <p>શ્રી નવનીત મેડિકલ સેન્ટર તથા<br/>શ્રીમતી પ્રભાવતીભણેન કાંતિલાલ વેલજુ સાવલા મેડિકલ ચેક-અપ સેન્ટર, પાલડી, અમદાવાદ.</p> <ul style="list-style-type: none"> <li>● કુલ લાભ લેનાર વ્યક્તિઓ .....</li> <li>● જેમાંથી -</li> <li>● શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદની વ્યક્તિઓ .....</li> <li>● સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબો .....</li> <li>● મોતિયા - આંખનાં ઓપરેશન (સાપ્તાહિક બે દિવસ) .....</li> <li>● સોનોગ્રાઝી .....</li> <li>● ટી.એમ.ટી. (માત્ર ડોક્ટર દ્વારા ભલામણથી) .....</li> <li>● બોડી ચેક-અપ .....</li> <li>● અન્ય .....</li> </ul> | ૧૩,૧૬૪                                |
|      | (બ) માતુશ્રી કંકુલેન કાનજુભાઈ રવજુ (નાની ખાખરવાલા) સેવા ભવન, પાલડી, અમદાવાદ<br>કુલ લાભ લેનાર વ્યક્તિઓ .....  | ૭૫૧                                   |
|      | શ્રી કચ્છી જૈન ભવન - પાલડીની કેન્ટીનમાં કુલ લાભ લેનાર વ્યક્તિઓ .....   | ૨,૮૯૭                                 |
| ૨.   | <p>જી.એમ.ડી.સી. પ્રાયોજિત શ્રી કચ્છી વિશ્રામ ગૃહ - શાહીભાગ, અમદાવાદ<br/>શ્રી કચ્છી વિશ્રામ ગૃહમાં લાભ લેનાર કુલ વ્યક્તિઓ .....</p> <p>કેન્ટીનમાં લાભ લેનાર કુલ વ્યક્તિઓ .....</p> <p>શ્રી જલારામ અન્નકેન્દ્રમાં લાભ લેનાર કુલ વ્યક્તિઓ .....</p> <p>કચ્છ સંસ્કૃતિ ભ્યુઝિયમની મુલાકાત લેનાર કુલ વ્યક્તિઓ .....</p> <p>શ્રી ધીરજલાલ ટોકરશી કાપડિયા ડાયાલિસિસ સેન્ટરમાં લાભ લેનાર કુલ વ્યક્તિઓ .</p>  | ૨,૦૫૩<br>૫,૫૧૭<br>૫૦૮<br>૧,૧૨૬<br>૪૨૪ |
| ૩.   | માતુશ્રી કંકુલેન કાનજુભાઈ રવજુ (નાની ખાખરવાલા) સેવા ભવન,<br>ગીતા મંદિર, અમદાવાદ<br>લાભ લેનાર કુલ વ્યક્તિઓ .....  | ૪૪૭                                   |
|      | માસ ફેબ્રુઆરી - ૨૦૧૬ દરમ્યાન વિવિધ પ્રકારની સેવાઓનો લાભ લેનાર કુલ વ્યક્તિ .....  | ૨૬,૬૧૮                                |

## મેરેજ બ્યુરો

શ્રી કચ્છી જૈન ભવન પર કોઈ પણ ફાલિના ચુવક - ચુવતી માટે મેરેજ બ્યુરો કાર્યરત છે. આપશ્રી આપનું નામ રજિસ્ટર કરાવીને મેચ્યોંગ સંબંધી જરૂરી વિગતો મેળવી શકશો. ઇબે મુલાકાત માટે દર શનિવારે બપોરે ૩.૦૦થી ૬.૦૦નો સમય નક્કી કરવામાં આવેલ છે. જરૂરિયાત અનુસાર આપશ્રી મેરેજ બ્યુરો સમિતિના કન્વીનર શ્રી હીરજુ પાસું શાહનો મોબાઇલ નંબર ૯૮૨૫૩ ૮૦૮૬૬ પર સંપર્ક સાધી શકશો.

હીરજુ પાસું શાહ, કન્વીનર - મેરેજ બ્યુરો સમિતિ  
શ્રી કચ્છી જૈન સેવા સમાજ - અમદાવાદ



## નવું વર્ષ કચ્છ અને બૃહદ્દ કચ્છની જનતાને મંગલમયી બની રહે એ જ અભ્યર્થના....

# જીવદચાપ્રેમીઓ દાનવીર દાતાઓ

**આપના અમૃત્ય દાનની સરવાણીનો મોટો પ્રવાહ પાંજરાપોળો તરફ વાળો**

- ◆ આપનો કે આપના પરિવારજનોનો, બાળકોનો જન્મદિવસ.
- ◆ લગ્નદિવસ, લગ્નનિથીની ઉજવણી, લગ્નના રૂપ કે પ્રોત્સંહની ઉજવણી.
- ◆ આપની જુંદગીના ૫૦/૭૫ વર્ષની ઉજવણી.
- ◆ આપના સ્વજનની પૂણ્યતિથી, દેવ-દેવીના પહેંડી પ્રસાદનો દિવસ વગેરે પ્રસંગોને નિરાધાર-મુંગા જીવો માટે અભ્યર્થાનનો અવસર બનાવો.
- ◆ વર્તમાનકાળે પાંજરાપોળોને મુશ્કેલ પરિસ્થિતિ ઉદ્ભબી છે.
- ◆ વધુ વરસાદના કારણે લીલા દુકાણની પરિસ્થિતિ ઉદ્ભબી છે.
- ◆ ઘાસ-ચારા-દાશખાણના ભાવ વધતા જાય છે. ખૂબ તંગી વર્તાય છે.
- ◆ હલમાં પરિસ્થિતિ વિકટ છે તો ઉનાખામાં શું થશે? પરિસ્થિતિ વધુ બગડશે.
- ◆ વધતા જતા વહિવટી ખર્ચ-મૌંઘવારી અને ઘટતા જતા બ્યાજદરથી બે પાસા ભેગા કરવા મુશ્કેલ બન્યા છે.
- ◆ દરેક પાંજરાપોળોના બજેટખર્ચ દોઢાથી બમણા થઈ જવાની શક્યતા છે.
- ◆ વર્તમાનકાળમાં નવા નવા કંતલખાના ખોલાતા પાંજરાપોળોની જરૂરિયાત વધી છે.
- ◆ ચાંત્રિકરણ, શહેરીકરણ, વાહન વ્યવહાર વધવાથી પશુઓનો વપરાશ ઘટતો જાય છે.
- ◆ ચરિયાણ ગૌચરની જીવીનો ઉધોગોને અપાતા મૌંઘી થતી જાય છે.
- ◆ ખેતીની પેદાશમાં રોકડીયા પાક તરફ ખેડૂતોનું વલણ વધી ગયું છે. ચરિયાણ ગૌચર જીવીનો પર દબાણ થતા જાય છે.
- ◆ ખેડૂતો તરફથી ભેટમાં મળતું ઘાસ ઓછું થવા લાગ્યું છે.
- ◆ આપણો વસવાટ શહેરોમાં થતા પશુઓ પ્રત્યે દયા-ભાવના લાગણી ઘટી છે.
- ◆ માંસાહારનો પ્રચાર વધતા, માંસની નિકાસ વધતા પશુઓની બેફામકતલ વધી છે.
- ◆ પશુ બચશે તો દેશ બચશે, ખેતી બચશે, પર્યાવરણ બચશે, ગરીબી, ભૂખમરો ઘટશે.

કચ્છની કોઈપણ ૮૦ પાંજરાપોળમાં દાન મોકલવા માર્ગદર્શન અને પશુસંખ્યા જાણવા ફોન કરી શકશો,  
લિસ્ટ મંગાવી શકશો અથવા પ્રતિનિધિને રૂલે બોલાવી લેશો.

### શ્રી કચ્છ જિલ્લા પાંજરાપોળ ગોશાળા સંગઠન

માતુશ્રી મેધભાઈ અને પિતાશ્રી ધારશી માલશી ભેદા-મોખા (થાણા)

કાર્યાલય : શ્રી આશાપુરા રોડ, સોનીવાડ, સોનીવાડ કોમ્પ્લેક્સ, પહેંલા માણે, ઓફિસ નં. ૧૨૭/૧૩૦. ભુજ-કચ્છ (ગુજરાત) ૩૬૦ ૦૦૧.

અજ ઓફિસ : ૦૨૮૩૨-૨૨૭૩૦૪. મો. ૦૯૯૦૪૮ ૩૧૫૧૪ (શ્રી ભરતભાઈ સેંઘરવા)

**સૌજન્ય દાતા : દીપક તથા ગીરીશ ધારશી માલશી ભેદા - મોખા (થાણા)**

: મુંબઈ ઓફિસ :

માતુશ્રી મેધભાઈ અને પિતાશ્રી ધારશી માલશી ભેદા-મોખા (થાણા)

૩૦૭/૩૧૧, સરદાર વલ્લભભાઈ પટેલ રોડ, ૧૩ ક્રનજુ મેન્શન, ગોકુલધામ હોટલની બાજુમાં, મુંબઈ-૪૦૦ ૦૦૪.

ટે. નં. ૨૩૮૧૩૭૩૩ / ૬૬૩૮૦૫૦૦. મો. ૮૮૨૦૨ ૮૮૭૨૬ / ૮૮૧૩૮ ૫૩૮૫૬

**Since 1958**

**Leading. Innovating. Growing.**



**ISO 9001 : 2008**

## Our Divisions



Reliable Hard Freight Transport



Timebound Multimodal Express Cargo Service



Warehousing & Inventory Management

## V-Trans offers unmatched service edge to all its customers

- Specialized in swift, safe movement of parcels from a small 10 kg parcel to bulk sundry, Full truck Loads, ODC and Projects at most cost effective rates
- Expertise in multi point door pickup and door delivery
- Next Day Delivery Service on select 25 routes and scheduled dispatches to major locations
- Geographical presence across India at 400 locations in 26 states - further expanding
- Unique V-Trans advantages: Full transit insurance, centralized Customer Service Cell with Toll Free Nos. Specialized Key Accounts Management for multi location servicing, fully computerized operations, all logistic solutions under one roof

### Corporate Office : V-Trans (India) Limited

5-A, Navre Apartments, S. V. Marg, Sion (West), Mumbai - 400 022. Tel: 022 - 2402 0880. Fax: 022-24043144  
Email: [info@vtransgroup.com](mailto:info@vtransgroup.com) Web: [www.vtransgroup.com](http://www.vtransgroup.com)

**V-Trans Toll Free no. : 1800-220-180**

**V-Xpress Toll Free no. : 1800-220-240**

## કચ્છ દર્શન



"Mangal Mandir" - "Regd. under Postal Registration No. GAMC-315/2015-2017 Valid upto 31st December, 2017  
issued by the SSPO's Ahmedabad City Division, permitted to post at Ahmedabad PSO on 5th of Every Month."  
R.N.I. No. of RNP is 33266/1978 • Published on 1st of Every Month

## A World Class Exterior & Interior Acrylic Paints



*You Can't Buy Better Even At Higher Price !*

**INDOCEM (INDIA) PVT. LTD.**  
(An ISO 9001: 2000 Certified Company)

Ahmedabad : 27541226, 27544161, 25743401, Fax : 079-27544199, Bangalore : 080-26758800, 26758028,  
Baroda : 0265-2412446, 2434041, Bhopal : 0755-2556785, Bhuj : 02832-223290, 250959, Goa : 0832-2752582,  
Hubli : 0836-2251415, Hyderabad : 040-24740401, 55598874, Mangalore : 0824-2410320, 4252325,  
Mumbai : 022-26858636, 26858639, Nasik : 0253-2511247, Pune : 020-26110951, Rajkot : 0281-2222766, Surat : 0261-2543332,

મંગલ મંદિર • એપ્રિલ-૨૦૧૬ • ૧૦૦